

गीता

59

2149
13

300

213

206

300



શાસનપ્રેમી આધ્યાત્માણ શોઠ લક્ષ્મીચંદ્ર વેદ.

૩૮ સ્મરણાંજલિ.

સદ્ગત આચાર્યશ્રી હૃરવિજયસૂરિએ જેમ નિર્ભેદ ધર્મ-
 દેશના આપી, રાજ્યસત્તામાં પણ જૈન શાસનની પ્રભા
 પ્રસારી હતી, તેમ વર્ત્માન કાળે જેએ ઈંગલાંડ-
 જર્મની ઇટાલી આદિ આંખ દેશોમાં જૈન
 તત્વને પ્રસારી રહ્યા છે અને દેશના
 સત્તાવાહુક સ્થાનોમાં પણ
 સમયાનુસાર પ્રવૃત્તિથી
 શાસનસેવા કરી
 રહ્યા છે, એવા
આચાર્યશ્રી વિજયધર્મસૂરિના
 અનન્ય લક્ષ્મિ અને તેઓના ઉપદેશથી
 શાસનસેવાનાં અનેક કાર્યો કરનાર
 આચાર્યાણા આત્મધંધુ શેડ લક્ષ્મીચંદળ વેદના
 કરકુમલમાં—હૃરવિજયસૂરિના જીવનસૂત્રની સ્મરણાંજલિ
 અર્પણ કરતાં મને આનંદ થાય છે.

પ્રકાશક.





ઉપોદ્ગાત.

મહાજનો યેન ગતઃ સ પંથા ભડા પુરુષોની આત્મવિભૂતિ ઉચ્ચય જીવનકુમ ધડવામાં ઉપકારક છે. આ ઉપરથી શાખ ધટનામાં પણ કથા વિભાગને આસ સ્થાન આપવામાં આવ્યું છે અને મોટા ભાગે અત્યારના જીનાનથળની કસેટીમાં પૂર્વ પુરુષોનું જીવનદર્શન સો ટચમાંથી પસાર થયેલ જેવાયું છે. એટલે 'નૈન' પત્રની લેટ તરીકે પૂર્વ શાસન ઉપકારક પુરુષોનું જીવન ઝિચિકર શૈલીએ આપવાનું છેલ્ખા તણુ વર્ણથી શરૂ રાખ્યું છે.

આવા આદર્શ જીવનોના અભ્યાસથી મને કહેવાને હિમત થાય છે, કે જૈન સમાજમાં એવા સમર્થ જગતશેડ, વિશાળ ભૂમિના રાજનેતાઓ, કુશળ મંત્રીઓ, દેશસેવકો, 'રાજ્ય' ના ઉપનામને શોલાવનારા ડોઢ્યાધીશો, કળાખાને, કુશળ વ્યાપારીઓ, બહાણુવઠીઓ, રાજક્રારીઓ, ધર્મનેતાઓ અને શાસનશુભેચ્છકો જન્મી ચુક્યા છે કે જેના જીવનપરિચયથી જૈન સમાજ ભગ્નર થઈ શકે અને અલ્યારના મંદ જીવનમાં નવું ચૈતન્ય પ્રકટાવી શકે.

નૈન પ્રજના પોતાના વર્તમાન જીવનમાં જેવાતી મંદતા, નખળાંધ અને નામર્દાંધ એ કંદ્ચ પૂર્વનો પરંપરાગત વારસો નથી; પરંતુ લન્જવનાં આવરણું છે, તેમ આવા જીવનસ્ત્રો સાક્ષી પુરે છે. નીતિ, શૌર્ય, તેજ, સત્તા, આત્મધળ, જલત-દેશ અને ધર્મનું અભિમાન, સેવા, અંધુત્વ એ સર્વ આદર્શ વિભૂતિઓ આવા જીવનોમાં રોમેરોમ ઝળહળી રહેલાં જેવાય છે. જેના અનુભવ પછી જૈન પ્રજન પોતાના પૂર્વના વારસાને હસ્તગત કરવા ઉદ્ઘમવંત થાય તો આ યોજનાથી શ્રમની સાર્થકતા થશે.

આવી નવલકથામાં એંતિહાસીક ધટના ઉપર આડંધરનો એાપ ન ચરી જાય, કે મિથ્યા પ્રશંસાના મોહમાં ન ક્રસાંદ જવાય તે માટે બનતી

કાળજ રાખવામાં આવે છે, અને તેજ હેતુથી મી. રાવળ, જૈન સાહિત્ય-
માં પ્રથમ પ્રવેશ કરતા હોવાથી તેમણે વાંચેલા રાસાઓ કે તેવા કાવ્ય-
પ્રથોના અલંકારોને ઓએ ચટાવાઈ જતો જોઈ નિર્ધાર્ય મારે કેટલેકં
સ્થળે તેવી સહરાગતને છોડી દેવા કરજ પરી છે, અને જેમ બને તેમ
વાસ્તવિક ધતિહાસના આધારે વધારા-વધારા કરવા પડ્યા છે. મુળ
લેખક તેમ કરવામાં મને સહમત થયા તે માટે આ સ્થળે સંતોષની
નોંધ લઈ છું.

આચાર્યાંશ્રી હિરવિજ્યસુરિના જીવનભૂત સાથે કેટલાક અદ્ભુત
ચમત્કારના દાખલા જોડાયેલા સંભળાય છે; પરંતુ એક યોગી પુરુષનો
ચમત્કારમાં રસ હોય તે વાત મને લાક્ષ્ણીકરને અફલે ગ્રેમલાંજિના અલ-
કાર જેવી લાગે છે. એટલું ખ્રિસ્ટ કે એવા સમર્થ ત્યાગી પુરુષોના
યોગથા-ત્પોથળ-જ્ઞાનથળ અને આત્મશક્તિના તેજમાં વચ્ચનસિદ્ધ
સામાન્ય હોય છે, એટલે આવા પ્રસંગે સ્વાભાવિક સિદ્ધજ્ઞન્ય હોવાની
કદ્યના થંડ શકે. આટલા ઉપરથી આદશાહના પ્રથમ સમાગમ સમયે
સુરિજીથી અચ્યાનક આદશાહનું રક્ષણ થવાની ઘટનાને જગતી રાખી છે.
જોકે ધતિહાસરસિકો પાસેથી તેને માટે જોઈતાં પ્રમાણો મળી શક્યાં
નથી છતાં આ એક યોગપ્રભાવનું સ્વાભાવિક ઇળ હોય તે બનવાનોગ છે.
કેમકે સુરિજીના સ્વર્ગવાસ પણી તેમના અભિસંરકારના સ્થાને કંતાતુએ
આખા ઇલ્યાની વાત મુશ્કીભ લેખકાથી તેમજ સામાન્ય હેશના ઐતિ-
હાસિક અંથોમાંથી પણ મળે છે, એટલે એવા સમર્થ યોગી પુરુષની
ચૃણુભિદ્ધ કે વચ્ચનસિદ્ધિના પ્રસંગે આવી ઘટના અની જાય, તે છેક
અસંભવિત કહી શકાય નહિ.

આ નવલકથા ચાર વર્ષ અગાઉ લેટ માટે લખાવી રાખી હતી,
પરંતુ અકખરના પૂર્વજીવનનો પ્રથમ પરિય્ય થાય તે દુરસ્ત ધારી તેના
ગ્રાથમિક જીવનમાં તેણે કરેલાં આકમણો અને તે સામે રાણ્ણા પ્રતાપે
દર્શાવેલ અદ્દગ શૌર્યઃતાચા જગ્ઘકુશાની દેશભક્તિનો ધતિહાસ થયા વર્ણ
આપવા પણી આ અંથને અહાર મુકી શકાયો છે. જોકે આ રીતે સ્વા-
ભાવિક વિલંબ થતાથી તે દરમિયાન ધતિહાસરસિક મુનિ મહારાજશ્રી
વિઘાવિજ્યજી તરફથી સૂરીશ્વર અને સમાટનો અંથ પ્રકટ થતાં.

નોવેલ માટે ઐતિહાસિક પ્રમાણ તપાસવાને હીક તક ભળી છે. કેમદુ
તેમા અમારા લક્ષ્યબિંદુ અનુસાર સહરાગત કરતાં વાસ્તવિક ઘટનાને
અગ્ર સ્થાન અપાયું જણાય છે, તેમ આ અંથમાં અકાશર અને સૂરિજી-
ના માટે જૈન તેમજ જૈનેતર અને દેશી તેમજ લિદેશીને હાથે ગુજરાતી
તેમજ ઉદ્દીપને અંગ્રેજુમાં લખાએલા લગભગ છન્નુ અંગ્રેજનું હોછન
કરાયું છે અને તેને ધતિહાસના પ્રસિદ્ધ અભ્યાસક ઉપાધ્યાયશ્રી ધન્દ-
વિજયજી મહારાજે અવલોકવા પણી પ્રકટ થયેલ છે, એટલે આ સુંદર
સગવડનો લાલ ગ્રામ થવા માટે ઉપરોક્ત અંથના લેખકનો ઉપકાર
માનવાની મારી દૂરજ સમજું છું.

અંથમાં વાચ્યક જૈન ઐતિહાસિક નોવેલોનો પ્રસાર વધારવામાં
સહાયક અનો એજ વાંચના સાથે વિરમું છું.

૬૧૦ શાસનસેવક,

શેઠ દેવચંદ દામજ કુંડલાંકર.



અન્ય રવામિત્વના સર્વ હક્ક પ્રકાશકે સ્વાધીન રાખ્યા છે.

પ્રસ્તાવના.



ખૌદ્ધ ધર્મના ધતિહાસને અનુલક્ષી “ચક્રવર્તી અશોક” મેં પ્રકટ કર્યો ત્યારે ભારા ડેટલાક ભિત્રોની પ્રેરણા તેવી જ એક જૈન ધતિહાસને લગતી નવલક્ષ્ય ભારા હાથે લખાયેલી જેવાની થઈ. નોક અધાપિ પર્યત જૈન સાહિત્યમાં ઉંડા ઉત્તરવાની તક મુને ભળી નહોતી, પરંતુ મારા ભિત્રોના ગ્રોત્સાહક પત્રોએ મુને જૈન સાહિત્યમાં ઉંડા ઉત્તરવા માટે પ્રેર્યો અને સુભાગ્યે તે જ અરસામાં ‘જૈનપત્ર’ ના તંત્રી શ્રીયુત્ દેવચંદ્રભાઈનો પરિચય પણ મુને અનાયાસે ગ્રામ થયો. તેના પરીણામે યતિ હૃરવિજ્યસ્તરિજીનાં સંબંધમાં ડેટલીક અગત્યની માહિતી ભળતાં, અને ‘કૃપારસકોપ’ ‘કાવ્યમહોદ્ધિ’ વગેરે અંથે ગ્રામ થતાં આ વાર્તા લખવાને માઝ અંતઃકરણ પ્રેરાયું.

આ નવલક્ષ્ય લખાઈને તૈયાર થયા પણ ડેટલાક ખાસ ડારણથી તેને ચાર વર્ષ સુધી પ્રસિદ્ધ કરવાનું ન થની શક્યું. સુભાગ્યે તેટલું મોઢું થવાથી ફરીને અંદ્રવાર આખું લખાણ તપાસી જવાનો મુને વખત મળ્યો. આમ થવાથી તે ફરમિયાન મને વધારે અનુભવ મેળવવાની તક ગ્રામ થતાં, મુને જે ગ્રંથકારો અને વિચારકાની મહદ્દ ભળી છે તે સર્વનો આલાર માનવાની આ તક લઇ છું.

બાદશાહ અકબર ઇંતેહિપુર સિકિમાં રહેતો હતો તે સમયનો ધતિહાસ આ નવલક્ષ્યમાં લેવાયો છે. બાદશાહ અકબરના એ શાલુણાએ સિકિમાં જન્મા હેવાથી સિકિ તેને ખાડુ પ્રિય હતું. દ. સ. ૧૫૭૦ માં અકબરે સિકિની નજીકમાં એક નવું શહેર વસાયું અને

તेनुં નામ ઇતેહપુર રાખ્યું. ત્યારથી તે ઇતેહપુર-સિક્કિ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું છે.

અકૃષ્ણના ધર્મજિગ્માસુ સ્વલાવને કાઈને સિક્કિમાં તેણે એક મહાલય ચણાબો હતો, ને ધિયાદતખાના તરીકે પ્રસિદ્ધ હતો. આ ધિયાદતખાનામાં અકૃષ્ણ વિવિધ ધર્મના આચાર્યોને બોલાવીને તેમની સાથે ધાર્મિક ચર્ચા ચલાવતો અને પ્રત્યેક ધર્મનું સત્યાન્વેપણું કરતો. આ પ્રમાણે તેને જૈનાચાર્ય શ્રી હીરવિજયસુરિજી સાથેનો પરિચય અને જૈનધર્મ તેમ જે 'દ્વા' ની લાગણી જન્મવાના પ્રસંગે પણ આ કૃથાનકમાં જોડવામાં આવેલ છે.

નવલકથા લખવામાં મૂળ વસ્તુની સંકલના કરવા અને રસ પોષ-વામાં કાલ્પનિક પાત્રોને પણ મૂકવા પડે છે, એટસું જ નહિ, પરંતુ સમયને અનુલક્ષીને ધરિત કદ્દમનાઓના તારો સાંધવા પડે છે, તે સંતય ગણુશે.

આ નવલકથા મેં લગભગ ચાર વર્ષ પૂર્વે શ્રીમાન દેવચંદ-ભાઈની પ્રેરણાથી તૈયાર કરી તેમને સોંપી હતી. જેને લાંબે અંતરે પણ તેમણે બહાર મુકવાને તક આપી છે તે માટે સંતોષ જાહેર કરતાં મારે એ પણ જણાવી દેવું જોઈએ કે, તેઓ જૈન છતાં જૈન મહિતાના કાલ્પનિક મોહને પસંદ ન કરતાં એતિહાસિક પ્રમાણોને અનુલક્ષીને જ આ નવલકથા પ્રગટ થાય તે માટે તેવી શકમંદ ઘટનાઓ કાઢી નાખવા તથા તેને વધારે રસમય ઘનાવવાને ધણા સુધ્યારા વધારા સુચ્યબા છે તે માટે હું તેમનો આલારી છું અને અંથની મહિતામાં તેમના અમને પણ ઉપકારક સમજું છું—

પ્રાંગંગ.
તા. ૧-૧-૨૧

દલપાઠરામ ભાઈશાંકર રાવાળ.

અનુક્રમણિકા.

પ્રાચીની.	વિષય	પૃષ્ઠ.
૧	આણધારો હુકમ ...	૧
૨	નિમન્ત્રણ ...	૮
૩	અજુની સુલાક્ષણ ...	૧૩
૪	બજુંયાવિરાનો જુલભ ...	૨૨
૫	ખાપીના ખંડામાં ...	૩૫
૬	આમન્ત્રણનો સ્વીકાર ...	૪૧
૭	ધતિ હિસ્વિન્યસુરિ ...	૪૫
૮	પરોપકાર કે આત્મહસ્તાર્થી ...	૫૨
૯	રાજ્યપૂત રમણી ...	૫૫
૧૦	માનવમન ...	૭૨
૧૧	પ્રયત્નશીલ પદ્મા ...	૮૦
૧૨	એકાન્તવાસમાં આપત્તિ દર્શાન	૮૬
૧૩	વેરની વસુલાત ...	૯૪
૧૪	અયણી મદ્દ ...	૯૮
૧૫	અકૃષ્ણરની આકૃત ...	૧૦૪
૧૬	મહાત્માનો મેળાંપ ...	૧૧૩
૧૭	અકૃષ્ણરનું ઈરમાન ...	૧૧૭
૧૮	પૃથ્વીસિંહ કે અકૃષ્ણ ...	૧૨૧
૧૯	પગનાની ભતિયા ...	૧૨૬
૨૦	કાજુનો કાળ ...	૧૨૬
૨૧	કમળાની કસોદી ...	૧૩૩
૨૨	અકૃષ્ણરની અંતરેચા ...	૧૪૦
૨૩	પ્રેમ-ગંધી ...	૧૪૭
૨૪	આકુતિ ...	૧૫૬
૨૫	અકૃષ્ણરની લુલદ્યા ...	૧૬૫
૨૬	સનેહ સંધાન ...	૧૭૧
૨૭	ચંપાની દીક્ષા ...	૧૮૦
૨૮	સ્વરી-સેવા ...	૧૮૬





શાસ્ત્રવિશારદ - જૈનાચાર્ય.
શ્રી વિજયધર્મ સૂર્ય મહારાજ.

આનંદ પ્રેસ-ભાવનગર.

શ્રી

ધર્મ જગ્નાસુ અકબર

અને

આચાર્ય શ્રી હિરસૂરિલ.



પ્રકરણ ૧ લં.

આણુધાર્યો હુક્મ.

પ્રાતઃકાળનો સમય થવા આવ્યો હતો. હિન્દુ હેવ મંદિરામાં ધારનાદનો દ્વાનિ કર્ણ ગોચર થતો હતો, અને તેની સાથે મસ્તિષ્ઠોમાં ‘અદ્વા હો અકબર’ ની આંગ પોકારો રહેલા ફકીરનો સ્વર મળી જતો હતો. પક્ષીઓ વનવિહાર કરવાને કલરવ કરી રહ્યાં હતાં. પતિગતા સાધીઓ પોતાના પતિએ જાગ્રત થતાં પહેલાં ઠેલી ઠેલી ઉડીને ગૃહકાર્ય કરવામાં ગુંથાઈ ગઈ હતી અને કૂલટા નારીએ પથારીમાંથા ઉઠતાં જ છીડા શોધી. સાસુ, નષ્ટુંદ, વગેરે પ્રત્યે ભચાવી રહેલ ધાંધલના કર્કશ અ. વાજ સાથે ધંટીએના લેરવી સુસ્તું મિશ્રથ થતું હતું. આ સમયે ભારતવર્ષનો ચક્રવર્તી બાદશાહ અકબર પોતાના હુતોહ-

પુર સિદ્ધિના રાજમહાત્મયના જરૂરામાં એઠો હતો. અકબર શલુંમાં ખાડુદુર ચોઢો ને રાજ્ય કરવામાં ખાંડાશ અને કાર્ય-દક્ષ હતો; તેમજ તે વિદ્યારાસક પણ હતો. જરૂરામાં એઠો એઠો તે સુધિ દેવીનું નિરીક્ષણ કરી રહ્યો હતો અને અદ્વાની અદ્ભૂત લીલાનું અવલોકન કરતાં મનમાં ને મનમાં તેની સ્તુતિ કરતો હતો. તેનો રાજભક્ત નોકર ટોડરમલ્લ પણ તેની સમિપમાં જ એઠો હતો.

અકબરને વિચાર અસ્ત સ્થિતિમાં ડેટલેા સમય નીકળી ગયો. તે તેને પણ ખખર રહી નહિ, પરંતુ તે તરફના રાજ્યમાર્ગ અધિને વાજતે-ગાજતે એક ટોળું પસાર થતાં તેના અવાજથી સચેત થઈને તે તરફ જોવા લાગ્યો. આ ટોળાની વચ્ચમાં એક પાલખી હૃતી ને તેની ખાન્દૂમાં એક મનુષ્ય ચામર ઢોળતો હતો. અને વચ્ચે વચ્ચે ‘હીરવિજયસૂરિલુ કી જય’ એવો જયવનિ સંભાગાતો હતો.

પ્રાતઃકાળમાં ફરવા નીકળેલી આ મંડળીમાં કોનો સતકાર થાય છે, તે જાણવાની તેની લુણાસા વધી એટલે તેણે તરતજ ટોડરમલ્લ પ્રત્યે દ્રષ્ટિ ફેરવીને પૂછ્યું—“ટોડરમલ્લ ! અત્યારમાં આ મંડળી કૃયાં જાય છે ? અને પાલખીમાં એસારી કોને શામારે માન આપવામાં આવ્યું છે ? ”

“જહાંપનાહુ ? એ મંડળીમાંના સર્વ લોકો જૈન ધર્મીએ છે. તેઓ તેમના દેવ મંદીરેથી ધર તરફ જતા હ્યો. પાલખીનો હેતુ શો છે તે ફરમાન થાય તો તપાસ કરું. ” ટોડરમલ્લે વિવેકુથી જવાબ આપ્યો.

“વારુ ! પણ તેઓ ‘હીરવિજયસૂરિલુ કી જય’ એવી જય ગર્ના કરતા જાય છે; તે હીરવિજયસૂરિલુ કોણ છે ? ” આદશાહે લુણાસાપૂર્ણ સ્વરે નવો પ્રશ્ન કર્યો.

“હીરવિજયસૂરિલુ શ્રાવક લોકોના ધર્મગુરુ છે. ને તેમના શુષ્ણ માટે તેઓ માન રાખે છે. ”

બાદશાહ પુનઃ ઓદ્યો:—“ વારુ, તું એક નોકરને મોક-
લીને તે પાલભીમાં કોણુ એઠેલ છે અને તેનું કારણ શું છે, તે
તપાસ કરાવી લે. ”

ટોડરમલ્લે તુર્ત પુછ—પરછ કરાવી જોતાં તેનાણી શકયો કે,
૭ મહિનાના ઉપવાસ કરનાર એક બાઈને જુન મંદિરે દર્શનાર્થ
લઈ જવામાં આવે છે. ક્ષણુ માત્રમાં આ હકીકત મેળવીને તેણુ
બાદશાહની હળજુરમાં જણાવી, એટલે આ હકીકતથી આશ્ર્ય
પામીને અકણરે કહ્યું—“ શું છ માસના ઉપવાસ ? અને તે
પણ એક બાઈએ કર્યા છે ? ટોડરમલ્લ ! તમે તેને મારા પાસે
ઓદ્યાવો. આ વાતમાં મને બહુ આશ્ર્ય લાગે છે. ”

ટોડરમલ્લ બાદશાહના અણુધાર્યો હુકૂમથી દિગુંદ થઈ
ગયો; પરંતુ તે તેમની પ્રવૃત્તિ સમજતો હતો. એટલે હવે કંઇ
દલીલ કરવી તે નિરર્થક સમજુ બાઈને ઉપર લાવવાનો સંદેશો
મોકલી દીધ્યો.

આટલા સમયમાં જૈન મંડળી રાજ મહાલયથી થાડે
ફર નીકળી ગઈ હતી; છતાં અદ્ય સમયમાંજ નોકરે બાદશા-
હનો સંદેશો તે મંડળીને જણાવી દીધ્યો. મંડળીમાંના લોકો
ગભરાટમાં પડી ગયા; પરંતુ સમસ્ત લારતવર્ષના મોંગલ
શહેનશાહની આજાનું અપમાન કરવાની તેમનામાં હિંમત નહોંતી.
પાલભી ઉપાડનારાએ તરતજ પાછા કૂર્યા અને અદ્ય સમય-
માંજ તેચો રાજ મહાલયના પ્રવેશ દ્વાર પાસે આવીને ઉલ્લા.
બાકીની મંડળી રાજ મહાલયથી થાડે ફરજ ઉલ્લી હતી.

રાજમહાલયના પ્રવેશ દ્વાર પાસે આવી પહોંચ્યા પછી
પાલભી ઉપાડનારાએ તે નીચે મૂકી. એટલે પાલભીમાં
એકદિલી તરણ્ણી ધીમેથી નીચે ઉતરી. બાદશાહના નોકરે તેને
પોતાની પાછળા પાછળા આવવાનો નેત્રસંકેત કર્યો. એક પછી
એક દાદર વરાવ્યા પછી તે તરણ્ણી અને નોકર દિવાનખાનાના
દ્વાર પાસે જઈ પહોંચ્યા. એટલે નોકર તેને બહુર ઉલ્લા રહેવાની

સુચના કરીને પોતે અંદર ગયો અને બાદશાહને કૂર્નિસ બજ-
વીનેણાદ્યો, “ જહાંપનાહ ? પાલભીમાં એડેલ બાઈ હાજર છે.
આજા હોય તો અંદર લાવું .”

શહેનશાહ અકૃત્પદે માથું ધુષ્પાવીને હડકારમાં આજા
આપી. બાદશાહ અને ટોડરમલ ઝડ્ખામાંથી નીકળી દિવાન-
ખાનામાં આવી એક હતા. બાદશાહ એક આરામ ખુરસી પર
પડ્યો હતો ને ટોડરમલ બાદશાહની ખુરસી નજીબ નામ
વદ્દને ઉલ્લો હતો.

બાદશાહની આજા મળી કે તરતજ દિવાનખાના બહુર
ઉલેલી તરણી અંદર આવી, તેણે બાદશાહને નમન કર્યું. બાદ-
શાહે તેનો સ્વીકાર નેત્રથીજ કર્યો અને સામેના એક આસન પર
બેસ્વાને તેને સુચના કરીને ઓદ્યો: “ પુત્રી ! તમે કોણું છો ? ”

તરણીએ પોતાનું અંગ શ્વેત વસ્ત્રોથી ઢાંકી દીધું હતું. તેનું
વદ્દનમંડળ જોતાં તેની ઉમ્મર સત્તરથી ઓગણીશ વર્ષની અંદ-
રની હોવી જોઇએ એમ કલ્પી શકાતું હતું. તેના શરીરનો રંગ
ગૌરવર્ણનો હતો. છ મહીનાના ઉપવાસ થવાથી જોકે તેનું શરીર
કંઈક હુર્ણણ જણ્ણાતું હતું, તો પણ તેના સુકુમાર વદ્દનમંડળ
પર મંદ હાસ્યની છટા હળ્ણએ વિલસી રહી હતી. તેના નેત્ર-
ચુગલમાં થઈ રહેલો ચળકાટ કંઈ ઓરજ હતો. તે નિર્બાધ અને
શ્વાંત વદ્દને બાદશાહે સુચવેલ આસને એડી અને બાદશાહનો
વિવેક પૂર્ણ પ્રેરન સાંભળીને તેણે બાદશાહના સહભૂષ્ણા વિષે
સાંભળેલી વિવિધ વાતોનો સાક્ષાતકાર થતાં તે તેમની મનમાં
જ પ્રસંગા કરવા લાગી. તેના સુકુમાર શુલાણી ગાલપર શર-
મના શેરડા પડ્યા. તેનાથી એક શળ્ણોચ્ચાર સુદ્ધાં થઈ શક્યો
નહિ. લગ્નાવિનીત મુખે તે કંઈ પણ ઓદ્યા વગર નીચું
જોતી એસી રહી.

“ પુત્રી ! સહજ પણ સંકોચ કે લય પામશો નહિ. ”
બાદશાહે પુનઃ નામ સ્વરે ઓદ્યા માંડયું. “ તમને માત્ર થોડી
મણી હુકીકત પૂછવાની જુગાસાથીજ અને ઓદ્યાવવામાં આવેલ

છે. રહ્નારી જ્ઞાસા માત્ર થોડાજ પ્રિનો પૂછીને હું તૃપ્ત કરીશ. ત્યાર પણી તમને પુનઃ તમારા માર્ગે જવાની હું વિના વિલંબે આજા આપીશ. પુત્રી ! તમે કોણું છો તે રહુને જણુવશો ? તમારું નામ શું ? ”

અકભરના વાત્સલ્યપૂર્ણ શાળ્દો પુનઃ સાંભળતાં તર્દણીના હૃદયમાં આનંદની છોણો ઉછળવા લાગી. તેનું હૈથું ભરાઈ આવ્યું; છતાં બની શકે તેટલું બળ લાવીને તે નાચ સ્વરે બોલી. “ બાદશાહ સલામત ! રહ્નારી પાસેથી શી હકીકિત જણુવાની ધ્રુચ્છા રાખો છે ? રહ્નારું નામ ચંપા છે. ”

“ ચંપા ! ” ટોડરમહું તરદ્દ દાખિ કરી બાદશાહ પુનઃ ચંપા સામે જોતાં બોલ્યો. “ ચંપા, તમારું નામ છે તેવાજ તમારામાં સફુણું છે, એ જાણીને રહુને અનહુદ આનંદ થાય છે. તમે છ મહિનાના ઉપવાસ કરવાની વાત રહ્નારા સરદાર ટોડરમહલ દ્વારા હુમણુજ રહ્નારા જણુવામાં આવી. આ હકીકિત સલ્ય છે કે ? ” એટલું બોલીને ચંપા શો ઉત્તર આપે છે તે જણુવાની ધ્રુચ્છાથી બાદશાહ ચંપા પ્રત્યે એકી ટસે તાકી રહ્યો.

નિર્મણ હૃદયા ચંપા નીચું વહન રામીને બોલી; “ બાદશાહ સલામતને હું દેવ સમાન ગણ્ય છું. તેમની પાસે અસત્ય બોલવું એ દેવની સામેજ ઠગાઈ કરવા ખરોખર છે. જહાંપનાડે જે વાત સાંભળી છે, તેમાં અસત્યનો અંશ સુદ્ધાં નથી. ”

બાદશાહ ચંપા પ્રત્યે એકીટસે તાકી રહ્યો હતો. તેનાં દઢતાપૂર્ણ અને નમ્રતાલયી વચન સાંભળીને તે આનંદ પામ્યો; પરંતુ આ સાંભળીને તેના આશ્રીર્યમાં વધારે થયા વગર રહ્યો નહ્નિ. રહેણા જાણી અને કર્તાવ્યનિષ્ઠ ઇકીરા કે સંન્યાસીઓ અજનો લ્યાગ કરીને ઇલાહારથી પોતાનું જીવિત ટકાવી રહે છે; પરંતુ ઇલાહાર અને અજ્ઞ એ અજ્ઞોનો ત્યાગ કરી કેવળ જળ ઉપરજ દેહ ટકાવી રાખવો અને છ મહિનાનો સમય વીતી જયો. છતાં પણ તેની સુખસુદ્રા હજુ પણ પૂર્વના જેવીજ નેજસ્વી હેખાતી હતી, એ જોઇને તેના હૃદયમાં આશાંકા ઉત્પન્ન

થઈ કે આ કંઈ અન્ય લોકોને ઠગવાની ચુક્તિ તો નહિ હોય ? શોડી સમય પૂર્વે આનંદિત અને નભ્રતાપૂર્ણ જણ્ણાતી બાદશાહની મુખમુદ્રા પર એકાએક વિલક્ષણ ફેરફાર દિલ્લીઓચર થવા લાગ્યો. બાદશાહની મુખમુદ્રા પરનો ફેરફાર ટોડરમહૃ કળી ગયો અને આજે કંઈ પણ નવાજૂની થયા છાર રહેનાર નથી એમ તેને લાગ્યું.

આ બાજૂ ચંપા પણ બાદશાહની મુખમુદ્રા ઉપરથી વિસ્તિત થઈ. ઘડીવાર બાદશાહ સહામે તો ઘડીમાં ટોડરમહૃ સહામે દિલ્લી કંઈ તી ઉલ્લી હતી, એટલામાં બાદશાહ ગંભીર વાણીથી ખોલ્યો:

“ ચંપા ! તમે જે કહો છો તે કહાચ સત્યપૂર્ણ હુશે; પરંતુ મણે પ્રથમાં શાંકા થવા લાગી છે કે છ મહિના સુધી જળ ઉપર ફેહ ટકી રહે એ નહિ બનવા જોગ છે. મણે પ્રત્યેક બાખતમાં પ્રત્યક્ષ ખાત્રી કરવાની ટેવ પડી ગઈ છે. તમારા વચ્ચનો પર મહારી શ્રદ્ધા ચોંટતી નથી.”

અદ્ય સમય સુધી બાદશાહ મૈન રહ્યો. દિવાનખાનામાં શાન્તિ પ્રસરી રહી હતી. બાલ રવિના રંગખેરંગી કિરણો ચંપાના નિર્મણ વદનમંડળ પર પોતાની પ્રતીલા ફેંકી રહ્યાં હતાં તેથી લેના સૈન્દર્ધમાં ઓદ્દ વૃદ્ધિ થઈ રહી હતી. ચંપા પ્રત્યે એક વાર દિલ્લી ફેંકીને અકુભરે ટોડરમહૃલ તરફ જોયું અને ખોલ્યો. “ ટોડરમહૃ ! ચંપાએ છ મહિના સુધી કેવળ જળ ઉપરજ ફેહ ટકાવી રાખ્યો હુશે, તો હજુ પણ જીજ એક મહિના સુધી તે તેમ કરી શકશે, એવું મારું માનવું છે.” એટલું ખોલીને અકુભર ચંપાને સંખોધીને ખોલ્યો: “ અને તેથીજ હું તમને આજ્ઞા કરું છું કે, તમારે આજીથી એક મહિના સુધી મહારા રાજમહાલયની સહામેના મહાલયમાં નિવાસ કરવો. કેવળ જળ ઉપરજ તમે તમારું જીવિત ટકાવી શકો છો, એવી મહારી પ્રતીતિ થશે એટલે હું તમને પુતું તમારા નિવાસસ્થાને સન્માન પૂર્વક પહેંચડાવી દઈશ.”

બાદશાહ અકબરની આજા સાંલળને ચંપા સ્તરધંજ અની ગઈ. કોઈપણ જાતના અપરાધ સિવાય બાદશાહ અકબરે આવી કઠોર શિક્ષા પોતાને શામારે ઝરમાવી હતી, તે તેનાથી જમજાયું નહિ; પરંતુ ચંપાનું હૃદય ધૈર્યપૂર્ણ હતું, તેને પોતાના શુરૂના ચરણોમાં શ્રદ્ધા હતી. તેણે એક દીર્ઘ નિઃધાસ મૂક્યો. અને કરયુગલ જોડીને ઓલીઃ “હે શુરૂ ! સ્વામી હીરવિજય સૂરીણ ! આમ કરવામાં તમારો કોઈ અદ્રષ્ટ શુભ હેતુજ હોવો જોઈયો, એવી મહારી દદ પ્રતીતિ છે.”

હીરવિજયસૂરિનું નામ સાંલળતાની સાથેજ અકબર ચમક્યો. ને ઓલ્યોઃ “ ચંપા તમને એક વાત પૂછવાનું તો હું ભૂલીજ ગયો ! વાર્દ, એ હીરવિજય સૂરીણ કોણું છે ? તમારી મંડળી હમણું એમનોજ જ્યધ્વનિ કરતી હતી કે શું ? ”

“ હા, જહાંપનાહ ” ચંપા નમ્રસ્વરે ઓલી. “ તેણા અમારા ધર્મશુરૂ છે.”

બાદશાહ—“ તે કયાં છે ? ”

ચંપા—“ શુજરાતમાં .”

“ ઢીક છે. હાલ તરત તમારે મહારી આજા પ્રમાણે વર્તવાનું છે. ” એટલું ઓલીને બાદશાહ ટોડરમદલને ઉદેશીને ઓલ્યો: “ ટોડરમદલ ! ચંપાને કોઈ પણ જાતની અડયણ ન આવે તેની તમામ જોખમદારી હું તમારા શિર પર સુકું છું. તમે અત્યારે રાજ મહાલય પાસે ઉલેલી જૈન મંડળીને જણાવી હો કે ચંપાની પરિક્ષા કરવાના ઉદેશથીજ બાદશાહ આજથી એક માસ સુધી તેને પોતાની દેખરેખ નીચે રાખવા દઈછે છે. ત્યાર પછી તેને સન્માન પૂર્વક સુકૃત કરી દેવામાં આવશે.”

આટલા શાખદો ઓલીને બાદશાહ ત્યાંથી ઉડી ચાલ્યો ગયો. ટોડરમદલ ચંપાને લઈને ત્યાંથી જવા લાગ્યો. રાજમહાલય પાસે ઉલેલ જૈન મંડળીમાં સર્વે બાદશાહ અકબરનો આવંદો

અથુધાર્યો હુકમ સાંભળીને દિલગીર થઈ નિરાશ વદને પોત-પોતાના સ્થાન તરફ પાછા વહ્યા.

અદ્ય સમયમાંજ ટોડરમદલ ચંપાને લઇને એક રાજ-મહાલય પાસે આવી પહોંચ્યો. અને તેને ઝૂતમા નામની એક બાંધીને સ્વાધીન કરી. ચંપાને બીલકુલ અજ્ઞ ખાવા ન ભણે તે બાયતનો પછો બંદોબસ્ત રાખવાની સૂચના ઝૂતમાને કરીને ટોડરમદલ ચાલ્યો ગયો.

ઝૂતમા ચંપાને લઇને રાજમહાલયના ઉપરના ભાગમાં જવા લાગી. દાદર પર ચડતાં ચડતાં ચંપા વિચારવા લાગી કે, જગત ગમે તેમ માને, પરંતુ બાદશાહ અકૃષ્ણ સફુલુણી, વિવેકી અને તત્ત્વરસિક છે એ હું દઢતાપૂર્વક જોઈ શકી છું. મુારી પરીક્ષા લેવામાં તેનો શો ઉદેશ સમાયલે. હશે ! બાદશાહની પ્રીતિ હિન્દુ ધર્મ પ્રત્યે દિન પ્રતિદિન વધતી બાય છે, તો આમાં તેનાજ હુાથે નૈન ધર્મનો વિજયદંજ ઝરકવાનો હૈવી સંકેત તો નહિ હોય !



મુકુરણુ ૨ જું.

નિમન્નાશ.

જનાનખાનામાં ગયા પછી બાદશાહે અદ્ય સમયમાંજ પોતાનું નિત્યનું કામ આજે અટપટ આટોપી લીધું, અને કંપાં પહેરીને તે પુનઃ દિવાનખાનામાં આવ્યો. દરરોજ સહવારના નવ વાગ્યા પછી અકૃષ્ણને બહાર જવાનો નિયમ હતો; છતાં આજે તેણે તેમ કર્યું નહિ. સહવારમાં પોતે કરેલ હુકમમાં કંધું સાહસ થયું હોય તેમ તેના જુહ્યમાં થતું હતું, ને તેથી તેનું ચિત્ત ઉદ્ધિન હતું.

દિવાનખાનામાં આવ્યા પછી બાદશાહે એક વિરામાસનપર

પડ્યો અને તે વિચારવા લાગ્યો. આજે મહેં આ શું કહ્યું ? મહારા આ કૃત્યથી હિન્દુ પ્રજામાં અસંતોષ ફેલાયા વગર રહેણે કે ? મહારી ન્યાયપ્રિયતા મહારા આ આચરણથી કલાંકિત નહિ થાય કે ? ધારો કે આ તરણીની હુકીકત સત્ય ન હોય, તો પણ તેને કોઈ પણ જાતના અપરાધ સિવાય એકાન્ત બાસની શિક્ષા કરવાનો મહને શો અધિકાર છે ? હું એક રાજીકું મહારી સત્તાનો આવો, કે આથી પણ વિશેષ લયં કર રીતે હુરુપયોગ કરી શકું તેવી સ્થિતિમાં હું મૂક્યોદો છું; પરંતુ તેમ કરવામાં શું હું વ્યાજળી છું ? ખરેખર મહારા ઉતાવળીયા સ્વભાવને લીધે વધું અનર્થ મહારાથી થઈ જાય છે; પરંતુ ચંપાની હુકીકત સાંશળીને હવે મહારા મનમાં એક નવીન ઘોટાળો ઉપસ્થિત થયો છે અને તેનો તોડ મહારે સત્વર આણવાની જરૂર છે. અત્યાર સુધીમાં મહેં અનેક ધર્મનું રહુસ્ય જાણ્યું છે. વિવિધ ધર્મના ધર્માચારોં સાથે મહેં ધર્માચાર્ય ચલાવી છે અને તેમની યોગ્ય કદર કરી છે. પણ આવા અસાધ્ય વ્રતની વાત કોઈથી જાણી નથી. જૈનધર્મનું રહુસ્ય જાણવાથી આ વાત માટે વધારે સમજશો. તેમના શુરુ હુરવિજયસૂરિલુની સર્વત્ર આટલી બધી પ્રશંસા થાય છે તો તેમનો મેળાપ મહારે એક વખત અવશ્ય કરવોજ જોઈએ. વાર્ષિક પણ ઈતિમાદખાન કેટલાએક સમય સુધી ગુજરાતના સુખા તરીકે હતો. તેને હુરવિજયસૂરિલુની સંખ્યે અવશ્ય કરેંદ્ર માહિતી હોવી જ જોઈએ. તેમજ થાનસિંહ પણ શ્રાવક છે. એ પણ પોતાના આચાર્ય સંખ્યે સંતોષકારક હુકીકત મહને અવશ્ય આપી શકશો. આ પ્રમાણે વિચાર કરીને બાદશાહે બાંધીને જુમ આરી “ બાંધી ? બોા બાંધી ? ”

“ જી, હજૂર ” બાંધીએ દિવાનખાનામાં પ્રવેશ કરતાં ઉત્તર આપ્યો.

“ જી, ચાકૂખને જઈને કહે કે ઈતિમાદખાન તથા થાનસિંહને બોલાવી લાવ. ”

“ જો હુકૂમ ” કહીને બાંધી ત્યાંથી ચાલી ગઈ.

અદ્ય સમયમાં જ ઈતિમાદખાન અને થાનસિંહ ત્યાં આવી પહોંચ્યા. બન્ને જણ્ણાએ બાદશાહને વિનયપૂર્વક નમન કર્યું. બાદશાહ પોતાની સામેના આસનપર ઘેસ્યવાનો નેત્ર-સંકેત કર્યો. એટલે તેઓ બન્ને પોતપોતાની જગ્ગાએ ઘેડા.

“ ઈતિમાદખાન ! ગુજરાતમાં હીરવિજયસૂરિ કરીને કોઈ જૈનાચાર્ય છે કે ? ” અકૃષ્ણને શરૂઆત કરી.

“ હાજુ, તે એક જૈનધર્મના આદર્થ યતિ છે. ગુજરાતની હિંદુ પ્રભાગ તેમના પ્રત્યે મોટું માન ધરાવે છે અને તેમના વચનમાં ધિષ્ટ સિદ્ધિ સમજે છે. ” ઈતિમાનખાએ જગ્ગાંયું.

“ જૈનધર્મના સુખય લક્ષ્યણો શા શા છે, તેનો તમે કંઈ ખ્યાલ રહુને આપી શકશો કે ? ” બાદશાહ થાનસિંહ તરફું દિલ્લિ ફેરવી પૂછ્યું.

“ જહાંપનાહ ! ” થાનસિંહ ખુલાસો કરતાં કહ્યું. “ ધર્મના તત્વો માટે તો ધર્મગુરુ ઠીક સમજલવી શકે; પરંતુ અમારો સુખય આચાર કોઈપણ પ્રાણુને હુઃખ ન આપવું-હિસાન કરવી, તે છે.

“ અને જૈનો ચાર-છ માસ સુધી કેવળ જળપાન કરીને જ ઉપવાસ કરે છે, એ વાત સત્ય છે કે ? ” બાદશાહ સિમિત કરતાં આગળ ચલાંયું.

“ હા હજુર ” થાનસિંહે ખુલાસો કરી આગળ ચલાંયું. અમારા ધર્મના આચાર્યો છ છ માસ સુધી પણ આવા ઉપવાસ કરી શકે છે. ”

“ ત્યારે આજે ચાંપા નામની એક તરણું બાળોને તેની છમાસની ઉપવાસની વાતમાં શાંકા થતાં મેં પરીક્ષા માટે રોક્કી રાખી છે, તેમાં શું રહારી ભૂલ થઈ છે ? બાદશાહને પોતાના જિતાવળા હુકમ માટે હુઃખ થતું હોય તેમ જેવાતું હતું.

આ પ્રશ્નનો ઉત્તર આપવો તે, ઠીક ન સમજીને થાનસિંહ નીચું જોઈ રહ્યો.

બાદશાહ અદ્વય સમય સુધી મૈન રહો અને ત્યારપણી થાનસિંહ પ્રત્યે સિમત પૂર્ણ દાખિ કેંકતો એલ્યો: ” મહારા અનમાં એક નવીન કદમ્પના ઉદ્ભાવી છે.

” ૩ હજૂર. ” થાનસિંહે ઉત્સુકતાપૂર્ણ સ્વરે કહ્યું.

” એજ કે જૈનાચાર્ય હીરવિજયસૂરિજીને અહિં આવશા માટે નિમંત્રણ કરવું. ” અકૃષ્ણ એલ્યો.

” આપના એ વિચાર પ્રત્યે અમારી ઉલ્લયની સંભત્તિ છે. ” ઈતિમાદખાન એલ્યો.

” વારુ, ત્યારે નિમન્ત્રણ લઈને અહિંથી કેને મોકલવા? ” અકૃષ્ણ પ્રશ્ન કર્યો.

” કુમાલ અને મૈંદીને મોકલીએ તો તે વધારે ઢીક થઈ પડ્યો. ” થાનસિંહે અકૃષ્ણને સૂચના કરી.

તરત ૪ કુમાલ અને મૈંદીને ત્યાં એલાવવામાં આવ્યા. અકૃષ્ણ રે તરત ૫ એક રૂક્કો લખી કાઢ્યો અને ઈતિમાદખાનને તેના પર મહોર કરવાની આજા આપી. ઈતિમાદખાને તે રૂક્કા પર મહોર કરી એટલે બાદશાહે તે રૂક્કો થાનસિંહને આપ્યો. અને તે વાંચવા કર્માવ્યું. થાનસિંહે તે વાંચવા માંયો. તેમાં આ પ્રમાણે લખેલું હતું.

ગુજરાત પ્રાન્તના સૂઆ શાહુદુદ્દિન અહુમદખાન જેગ—

વિશેષમાં જલાખવાનું કે, આ રૂક્કો લાવનાર મૈંદી અને કુમાલ જૈનાચાર્યશ્રી હીરવિજયસૂરિજીને તેડવા માટે તમારા તરફ આવેલા છે અને તેથી તમારે તેમને હાથી, ઘોડા, પાલખી અને બીજી રાજ્યસામની સાથે સંભાળ અને ધામધૂમપૂર્વક સંત્વર અમારા તરફ રવાના કરવા. એજ

લિ. સુદીતાન જલાખુદ્દિન મહુમદ અકૃષ્ણ.

” કુમ થાનસિંહ, આમાં કંઈ સુધારે વધારે કરવાની

જરૂર છે કે ? ” થાનસિંહ રૂક્ષો વાંચી રહ્યો, એટલે બાદશાહે પુછ્યું.

“ ના; જહાંપનાહ ” થાનસિંહે ઉત્તર આપ્યો.

“ મહારે જહાંપનાહને એક નાગ વિનંતી કરવાની છે ? ” ઈતિમાહખાન ઓલ્યો.

“ શી ? ” અકખરે લક્ષ્માપૂર્ણ સ્વરે કહ્યું.

“ એજ કે ચાંપાને એકાન્તવાસમાંથી વેળાસર મુક્તા કરવાની આજા જહાંપનાહે આપવાની જરૂર છે. ”

“ આનસ્થાહે ! તમારી સ્વરૂપના તરફ હું સંપૂર્ણ લક્ષ્ય આપીશ. મેં નેટલી સુધૃત સુધી તેને એકાન્તવાસમાં ચાખવાનો નિશ્ચય કર્યો હતો, તેમાં ઘરાડો કરવાનું મેં મહારા મેનમાં કયારનુંયે નક્કી કરી હીધું છે. ”

“ પરંતુ આચાર્યશ્રી અતે આવે ત્યાર પહેલાં તો તેને મુક્તિ મળી જશેને ? ” થાનસિંહે નાગતાપૂર્ણ સ્વરે કહ્યું.

“ હા; તે ખદલ તમો તદ્દન નિશ્ચિંત રહો. ”

“ જહાંપનાહની આજા અમને શિરસાવંધ છે. ” ઈતિમાહખાન અને થાનસિંહ સાથેજ ઓલ્યો ઉક્યા.

ત્યાર પછી શહેનશાહ અકખરે ગુજરાતના સુખાપર લખેલો રૂક્ષો કુમાલ અને મૈંદીને સ્વાધીન કરતાં કહ્યું :— “ જૂંએ, જૈનાચાર્ય હીરવિજયસ્સુરિણને માર્ગમાં કોઈ પણ જાતની અડચણ્યુ પડવા દેશો નહિ. તેમને સન્માનપૂર્વક તેડી લાવીને ઝત્વર પાછા આવનો. ”

કુમાલ અને મૈંદીએ બાદશાહને કુર્નિસ ખલાવી અને ત્યાથી ચાલતા થયા. થાનસિંહ અને ઈતિમાહખાન પણ બાદશાહને નમન કરીને પોતપોતાના નિવાસસ્થાન તરફ વલ્યા.



પ્રકૃતાણ તે જું.

કાળની મુલાકાત.

“ સુધિ ઈશ્વર નિર્મિત છે. સૂર્ય ચન્દ્રનું તેજ, નસો મંડળમાં સ્વેચ્છાનુસાર વિહાર કરનારી વિદુદ્વિતાતું ચાંચલ્ય અને ચોમાસાના દિવસમાં કાન ફેંકી નાખે તેવી ગર્જના કરનારો મેઘ, એ બધું કોણે ઉત્પન્ન કર્યું ? વૃક્ષરૂપ વલ્લભને કોટિ કરતી હોય તેમ વિંટળાં રહેલી આ લતાઓમાં મોહુકતા કોણે મૂકી ? મહાન પર્વતોના શિખર પરથી રાત્રિ દિવસ અખંડ રીતે ખળ ખળ કરતું જળ કોણી આજાથી વહ્યા કરે છે ? જોવામાં મનોહર, સુંધવામાં સુરલિમય; પરંતુ ચ્યાંટવા જતાં હાથની આંગળીમાં કંટક લોંકાય એવા છોડમાં સુરમ્ય ગુલાખનાં પુણ્યો કોણી આજાથી ખીલે છે ? એ બધી સર્વ શક્તિમાન અદ્વાનીજ અગાધ, અગમ્ય અને અનંત લીલા છે. સ્વર્ગ અને મર્યાદાકનો ઉત્પાદક અદ્વાજ છે. અખીલ સુધિ અદ્વાનીજ છે. અર્થાત્ સુધિ અદ્વામય-ઈશ્વરમય છે; પરંતુ મતુષ્ય ! ઈશ્વર નિર્મિત સુધિપર પોતાનો અધિકાર ચલાવનારો અને પોતાની બુદ્ધિમત્તાનો આડંખર ધારણું કરનારો મતુષ્ય ! અરે ખુદા ! મતુષ્યની ઉત્પત્તિમાં ઈશ્વરની લીલા દૃષ્ટિમાન થતી નથી ! શયતાનના સાગ્રાન્યમાં ધાતુ અને રસનું મિશ્રણ થવાથી મતુષ્યની ઉત્પત્તિ થઈ હશે ! એક નહાતું સરખું મતુષ્યપ્રાણી વિશ્વનિયંતા ઈશ્વર બદ્લ નાસ્તિક મતનું પ્રતિપાદન કરવા મંડી જાય છે. દીપક દ્વિતીયે પડતાની સાથેજ તેનો પ્રકાશ પ્રાણી કરવાનો અક્ષમ્ય અને હુસ્યાસ્પદ પ્રયત્ન કરનારા પતંગીઆની પેઠે આ સુધિમાં જન્મ પામ્યા પણી મૃત્યુ થતાં સુધી ઈશ્વરી સંકેતના કપોલ કલ્પિત રીતે બળતાજ અર્થ ઉપજાવી કાઢનારા મતુષ્ય પ્રાણી ! કાચના શીશાને પાદાધાત થતાંની સાથેજ તેના સહૃદશાઃ દુકડા થઈ જાય છે, તેવીજ રીતે અદ્ય સ્નમયમાંજ હતો. ન

હતો થઈ જાય તેવો આ ક્ષણુ ભંગુર હેહ તું તહારી માતિકીને ભાને છે કે ? તહારી આશા, તહારું સામર્થ્ય, તહારી કૃચ્છા એ સંઘળાં આજની રાત્રિ પણ ટકી રહેશે કે કેમ, તે માટે તહારી સંપૂર્ણ ખાત્રી છે કે ? તું જણે છે કે તહારો આ દ્વિપવાન હેહ અદ્ય સમયમાંજ બણીને ખાકસાર થઈ જનાર છે ? અથવા તો તે કથમાં દટાઈ જવાનો છે ? જ્યારે જ્યારે તું દૃશ્યરેચછા વિરુદ્ધ અસુક કાર્ય કરવા માટે તત્પર થાય છે, ત્યારે ત્યારે તે તું નથી કથમાં દટાઈ જવાનો હેતુ નથી. ક્ષણે ક્ષણે તે તું નથી પોતાની સત્તાનું ભાન કરાવીને તહારો ગર્વ તોડી પાડે છે; પરંતુ એ અદ્ય દૃશ્યરી સંકેત તહારા પોતાના શુભ માટે જ છે, એ તું સહમતે છે કે ? તું એવું જ્યારે માનવા વાગીશ, ત્યારે તહારો કીર્તિધ્વજ અભિલિખિતમાં ફૂરકવા લાગશે એમ તું નથી લાગતું કે ? અહો, હું મહારું રાજ્ય, મહારો ધર્મ એ બધું કેવી રીતે ચલાયું છું. ઉદાહરણો આપનાર પોતેજ તદ્દનુસાર ન વર્તો તો તે કેવી રીતે યશસ્વી નિવડે ! મહારું રાજ્ય, મહારો ધર્મ અને મહારું સર્વસ્વ હું દૃશ્યરનેજ ચરણ ધરી દઉં તો ? તે હ્યાણું છે, સર્વ શક્તિમાન છે, તેજ મહને સત્ય માર્ગ બતાવશે. “ અહ્યા હો અકૃષણ ”

બાદશાહ અકૃષણ આ પ્રમાણે વિચાર તર્ફીન થયેલો રાજ મહાલયની સમીપમાં આવી રહેલા ઉધાનમાંની એક પથરની છેઠકપર છેઠો હતો. એવામાં તેની નજર સહામેની પુણ્યતા તરફ ગઈ. એક માળી વિવિધ પ્રકારનાં પુણ્યો તોડી તોડીને પોતાના ખલા પરની ઓળીમાં નાંખતો હતો. તેણે એટલાં બધાં પુણ્યો ચુંટી લીધાં હતાં કે તેની ઓળી મહોં સુધી પુણ્યોથી ભરાઈ ગઈ હતી; પરંતુ પુણ્યો તોડતાં તોડતાં સંગીતની ધૂનમાં ચડેલા માળીને તેનું ભાન નહોનું. અંતે જ્યારે પુણ્યો ઓળીમાંથી ઉલ્લાસ જવાં લાગ્યાં અને તેના ચરણ પર પછિદાઈને નીચે પડવાં લાગ્યાં, ત્યારે જ તે સંગીતની ધૂનમાંથી ચમક્યો. હુમણું જ અભિલ

સંદેશ પર અંધકારનું સામ્રાજ્ય વિસ્તૃત થઈ જશે, એમ લાગવાથી માળી ઉતાવળે પગલે ઉદ્ઘાનમાંથી જવા લાગ્યો.

અકુભરે માળીને ઉતાવળે પગલે જતો જેચો. અત્યાર સુધી તે તેના પ્રત્યે એકી ટસે તાકી રહ્યો હતો. કેણું જણે બાદશાહના મનમાં શું એ વિચાર ઉદ્ભાવયેા કે તેણે માળીને અવાજ કરીને પોતાની પાસે ખોલાયો.

બાદશાહ અકુભરને જેતાંની સાથેજ માળી ચમક્યો. ને બાદશાહ પાસે આવી ધુંટડીએ પડીને તેને સલામ કરી. એટલે અકુભરે પૂછ્યું: “ કેમ ! આ પુણ્યો તું કેના માટે લઈ જાય છે ? ”

“ એગમ સાહેખા માટે. ” માળીએ નમ્રતાથી ઉત્તર આપ્યો.

અકુભર મૈન રહ્યો. માળી પણ નીચું જોઇને ઉલો હતો. અંતે એક નિઃખાસ નાખીને અકુભર ખોલ્યો: “ તું આ બધા પુણ્યો પડ્યાના અંતઃપુરમાં લઈ જ. ”

“ લુ હજૂર જેવી આજા. ” એટલું ખોલીને માળી બાદશાહને સલામ કરીને ત્યાંથી ચાહ્યો ગયો.

અકુભર વિચાર તન્દ્રાને અધીન થયો. માળી ઉલો રહ્યો કે ચાહ્યો ગયો હતો, તેનું તેને ભાન રહ્યું નહિ. અકુભર પહેલાં વિચાર મજન જણ્યાતો હતો, ત્યારે તેની સુખમુદ્રા પર ગાંલીયા અને સમાધાન વૃત્તિની છાયા દર્શિંગોચર થતી હતી; પરંતુ અત્યારે તેની સુખમુદ્રા પર અસરોથની છાયા સ્પષ્ટ રીતે જણ્યાછ આવતી હતી. તેના કપાળમાં કરચલીએ પડી. અત્યાર સુધી નિશ્ચલ રીતે ખોળામાં પડી રહેલો હસ્ત ઉંચો થયો. અકુભર ટફાર થયો. આણસ મરડી નિઃખાસ નાંખતાં તે ખોલ્યો: “ પદ્મા ! ઓ ! હઠીલી પદ્મા ! ”

પુનઃ બાદશાહે અદ્ય સમય સુધી મૈન ધારણ કર્યું. પ્રભુયની વચિત્રતા બદલ તે વિચાર કરવા લાગ્યો. કપાળ પર

હાથ ફેરવતો ફેરવતો તે બોલ્યો. “ હું હું એ સંબંધી વિચાર જ કરીશ નહિ. પ્રષ્ટુયના ગ્રાસહાયક વિચારને આધીન હું નહિ જ થાઉં ! પ્રષ્ટુયની બ્રોલુપ્તાને વિવશ થવા કરતાં રાત્રિ દિવસ અદ્દાનું ચિન્ત્વન કર્યો કરવું એ કંઈ ઓછું શ્રેયસ્કર નથી. ”

“ અત્યારે એવી શું ગંભીર ખટપટમાં પડયા છો, જહાં-પનાહ ! ” બાદશાહની બેઠકની પછવાઢેથી અવાજ આવ્યો.

બાદશાહે પાછું કરીને જેચું તો પોતાનો પ્રિય મિત્ર ધીર-ભલ શિર જુકાવીને ઉલો હુતો. ધીરભલને જેવાથી બાદશાહની વિચાર તંદ્રા ઉડી ગઈ. તેણે સિમત કરતાં ધીરભલને પૂછ્યું. “ કંઈ નવા જુની છે કે શું ? ”

“ હાણ, કાળ આપને મળવા છુંચે છે. ”

“ કાળ, શાખ સાંસણતાં જ આકુભરની મુખમુદ્રા પર નાખુશીની છાયા ફરી વળી. કંઈ પણ બોલ્યા સિવાય આકુભર ધીરભલ પ્રત્યે થોડી વાર સુધી એકી ટસે તાકી રસ્તોઅને પછી ગંભીર સ્વરે બોલ્યો: “ ધીરભલ, આ કાળ મુને શામાટે મળવા છુંચે છે તે તું બાણે છે કે ? ”

“ ના જહાંપનાહ. ” બાદશાહની અદ્દાતી મુખચર્ચાનું નિરીક્ષણ કરતો ધીરભલ બોલ્યો.

“ તેની સાથે તહારો મેળાપ કેવી રીતે થયો ? ”

“ હું આપને રાજમહાલયમાં મળવા માટે ગયો, ત્યારે તે રાજમહાલયની ઢેવડી પાસે બેઠો હતો. આપ રાજમહાલય-માં નથી; પરંતુ ઉધાનમાં છો એવી ભાતમી મુને ઢેવડી પરના પહેરેગીરે આપી એટલે હું આ તરફ આવવા નીકળ્યો. કાળ પણ મુહારી પાછળ આવવા લાગ્યો. અને આપની મુલાકાત કરાવી આપવાની તેણે મુને વિનંતી કરી છે. હું તેને અહાર ઉછો રાખીને આપની આજા માગવા આવ્યો છું. ”

“ હી....ક ” આકુભર ઉદ્ધિમ સ્વરે બોલ્યો.

“ બીરખલ, જ્યારે જ્યારે આવી ગડમથલ ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે મુહારી કોધજનાળા ભયંકર સ્વરૂપ ધારણુ કરે છે. આ કાળ મુહારા રાજકાર્યસાર વિષે ભગતી જ ચર્ચાઓ ઉપસ્થિત કરવાનો ધર્ઘો લઈ એઠો હોય એમ મને લાગે છે. ”

“ શા ઉપરથી આપ એમ કહેં છો ? ” બીરખલે આશ્વર્યથી પૂછ્યું.

“ હું ખુલાસો કરું છું. ” એમ કહી અકખરે બોલવું શરૂ કર્યું. “ ઇતોહૃપુર સિકિના દક્ષિણ તરફના સીમાઓ કેટલાક ગરીબ રાજપૂતોનાં ધર આવી રહેલાં છે અને ત્યાંથી થાડે ફૂર સરકારી જમીનનો એક વિશાળ દુકડો છે. આ જમીનનો દુકડો મેળવવા માટે કાળું મહુને વારંવાર અરજ ગુજરી છે. એક વખત મું તે જમીનનો તે શું ઉપરોગ કરવા માગે છે તે બાબતમાં પૂછ્યું; પરંતુ તે બાબતમાં તેનો ખુલાસો મને છિં જણ્યાયો નહોતો. ”

“ એ જમીન મેળવવામાં તેનો ઉદેશ હળવુસ્ને શું શકમંદ જણ્યાય છે ? ”

“ શકમંદ ! તેનો આંતરિક ઉદેશ અતિ હુંષ છે. તે જમીન તેને હું આપવા ધર્યું નથી. તેણે મહુને એવું જણ્યાંથું છે કે તે ત્યાં એક મસજુદ બાંધવા ધર્યે છે; પરંતુ આ એક પ્રકારનું અસત્ય ખાનું છે. રાજપૂતોના નિવાસસ્થાનની નજીકમાં મસજુદ બાંધાવીને તેઓને ગુમ રીતે તે કનંગત કરવા ધર્યે છે, એ વાત હું ક્યારનોયે કળી ચૂક્યો છું. મહુને આ વર્તન પ્રત્યે ખરેખર કોધ ઉપજે છે. બીરખલ, આવી વ્યક્તિઓ અમારા ઈસ્લામી ધર્મને ખદનામ કરે છે. જા, તું તેને કહી હું કે બાદશાહ અત્યારે તમારી ખુલાકાત લઈ શકે તેમ નથી. ”

“ પરંતુ.... ” બીરખલ બોલતાં બોલતાં અટકી ગયો.

“ કેમ, વળી પરંતુ શું ? ” અકખર બોલ્યો.

“ મુને લાગે છે કે ખાદશાહ જીલામતે અત્યારે કાળુની જીલાકાત લીધી હોત તો ઠીક.”

“ પણ તેનું કંઈ કારણ ? ”

“ કારણ એજ કે જ્યારે તે આપને મળવાજ ઈચ્છે છે, ત્યારે આપ તેને અત્યારે ના પાડશો; તોપણું તે પુનઃ આવ્યા વગર રહેશો નહિ. જો તેને તે જમીન આપવી જ નથી, તોપરી તેને સ્વપ્ન ઉત્તર અત્યારે જ આપી દેવામાં શી અડચણું છે ? ”

“ ભીરખલ, તું હિંદુ હોવા હતાં પણ એક ઈસ્લામી ઝૂકીરની તરફદારી શામાટે કરે છે ? ” સિમત કરતાં ખાદશાહ બોલ્યો.

“ જહંપનાહ ” ભીરખલે ખોલવું શરૂ કર્યું. “ ખાદશાહ આકબર ન્યાયી-ઉદ્દાર અને ક્ષમાવન્ત છે; તેમજ તે કોઈ પણ ધાર્મિક અગડાઓમાં નહિ પડતાં સર્વ ધર્મને સમાન ગણે છે, એ વાત સુશિક્ષિત જનસમાજ સારી રીતે જણે છે. ઈસ્લામી ધર્મ, હિન્દુધર્મ અને ખીજન પણ જૂદા જૂદા ધર્મો અત્યારે આપના જેવા ન્યાયી શહેનશાહુના ઉદ્દાર આશ્રય નીચે સુરક્ષિત રહેવા પામ્યા છે. આપ સર્વ જનતાને સમાન ગણેલું છો. ક્ષમા આપવામાં ઉદ્દાર છો, તેવાજ અપરાધિઓને શાસન કરવામાં ફૂર છો. આપની પાસે રોક અને રાયને શુદ્ધ ન્યાય મળી શકે છે. હું કાળુની તરફદારી કરતો નથી; પરંતુ તેને આશામાં ને આશામાં ધક્કા ખવડાવવા કરતાં ચોકખો ઉત્તર આપી દેવામાં આવે તો વધારે સારું.

“ ઠીક; જો ત્યારે તેને અહિ ખોલવી લાવ ”

ભીરખલ કુર્નિસ ખજનવીને ખોલતો થયો. ખાદશાહે તેના પ્રત્યે એક પ્રેમભરી દાખિ ઝેંકી અને સ્વગત ખોલવા લાગ્યો: “ પોતાનું તેટલું સારું અને ખીજનું તેટલું ખોટું એવું સૌ કોઈ માને છે; પરંતુ તેમ માનવું એ ભૂલ છે. હું આખા કારતવર્ષનો શહેનશાહ હું. સામાન્ય જનસમાજ

કરતાં હું મહદ્દુ પછ પામેલો છું. અભિલ ભારતવર્ષની પ્રજાને શુદ્ધ ન્યાય આપીને તેમનું સંરક્ષણ કરવું એજ મહારાજાં પરમ કર્તાવ્ય છે. ઈસ્લામીઓ અને હિન્દુઓ ખન્ને પ્રત્યે સમાન દર્શિ રાખવી એ મહારી કરજ છે. મહારી શીતળ છાયા નીચે નિવાસ કરતી સિક્કિની ગરીબ રાજ્યપૂત પ્રજાને મહારા ધર્મનો શુરૂ ત્રાસ આપે એ મહારાથી કદિ પણું સહુન થઈ શકશે નહિ. તેનો ઉદેશ હું કદિ પણું સક્રણ થવા હેનાર નથી. ”

આકબર આ પ્રમાણે વિચાર કરતો એઠો હતો, એટલામાં બીરબ્લ કાળને લઈને લાં આવી પહોંચ્યો. કાળ બાદશાહને કુર્નિસ બજાવીને પોતાના ગળામાંની માળા હાથમાં લઈને તેના મણુંક ફેરવતો બાદશાહ સામું જોતો ઉલો રહ્યો. બીરબ્લ બાદશાહ એઠો હતો તે એઠકથી એ કદમ ફૂર બાદશાહ અને કાળ પ્રત્યે દર્શિ ફેંકતો ઉલો.

“ કાળ ! ” પોતાની સામેની પુણ્યલતા પ્રત્યે દર્શિ ફેંકતો આકબર ભવાં ચઢાવીને એ પરવાહુથી બોલ્યો. “તમે અત્યારે મહારી પાસે શામાટે આવ્યા છો તે હું સહુનજી ચૂક્યો છું. સિક્કિમાં સરકારી જમીનનો ટૂકડો મેળવવા નાટે તમે મહુને અરજ શુનારી છે અને તે બદલ મહારા છેલ્લો નિર્ણય જાણુવા માટેજ તમે આવ્યા છોને ? ”

કાળનું વધ આશરે પચાસ વર્ષનું હતું, તેનું શરીર રૂષપુષ્ટ અને શ્યામવર્ણ હતું, તેની દાઢીના વૈત થઈ ગયેલા કેશ વચ્ચે વચ્ચે પવનની લહારીઓને લીધે ફર ફર ઉડી રહ્યા હતા; તેનાં ચક્ષુ બારિક હતાં; પરંતુ તેમાં હજી ચંચળતા હતી અને કંઠમાં તેણે ચાર પાંચ માળાઓ ધાલેલી હતી.

બાદશાહનાં અવગણુના અને કોધમિશ્રિત ઉપર્યુક્ત શબ્દો સાંભળીને કાળએ પોતાના એષ દખાવ્યા અને બાદશાહ પ્રત્યે એક કોધપૂર્ણ દર્શિપાત ફેંકી પુનઃ માળા ફેરવતાં ફેરવતાં તે નામ સ્વરે બોલ્યો. “ હાં, જહાંપનાહ, મણે તે જમીન ભાખત આપ નામવરને એ ત્રણું વખત અરજ શુનારી હતી; પરંતુ હજી

સુધી મુને તે ખાખતનો ખુલાસો મળ્યો નથી અને તેથી આજે બાદશાહુ સલામતને તસ્થી આપવી પડી છે.”

“કાળ ! ઈસ્લામી ધર્મ માટે તમારા હૃદયમાં લાગણી હોય એ સ્વભાવિક છે; પરંતુ તેજ સ્થળે મસ્જિદ બાંધવામાં તમારો શો ઉદેશ છે તે હું જણવા પ્રચ્છું છું.” કાળ પ્રત્યે તીક્ષ્ણ દસ્તિ ફેંકતો બાદશાહુ બોલ્યો.

“જહાંપનાહુ” હવે પોતાના હેતુને બાદશાહુ તરફથી અનુમતિ મળશે એમ લાગવાથી મનમાં ને મનમાં આનંદ પામતો કાળ નામ સ્વરે બોલ્યો: “જે જમીનની આસપાસ તેટલાક અદ્દલાના ઉપાસકો રહેતા હોવાથી તેમની નિમાજ પઢવાની સગવડ સચવાય એ હેતુથીજ —”

“એટદે ? અકૃષણ ઈસ્લામી ધર્મની ઉજ્ઞતિ કરવામાં એદુરકાર રહે છે એમ તમારું માનવું છે ? ”

“નહિ, નહિ;” કાળ વિસ્તીર્ણ થયો હોય એમ ચમકી ને બોલ્યો. “મુહારી માન્યતા એવી છેજ નહિ; પરંતુ જહાંપનાહુ, આપ જનસમાજનું ગમે તેટલું શ્રેય કરવાનો શ્રમ હ્યો, તોપણું તે ઔહિક કલ્યાણ જ ગણી શકાય. અને તે ઔહિક કલ્યાણ કરતાં વધારે શ્રેષ્ઠ સામાજિક કલ્યાણ કરવાની જવાખદારી અદ્દલાએ અમારા શિર પર મૂકી છે. અદ્દલાના ઉપદેશથી જ જનતાનું કલ્યાણ થાય તે વધારે સારું ગણી શકાય.”

હવે અકૃષણના કોધનો પાર રહ્યો નહિ. તોપણું તે પોતાનો કોધ શમાવી દઈને મૂકું સ્વરે બોલ્યો. “જનસમાજના કલ્યાણાર્થે હું જે જે પ્રયત્નો કરુંછું, તે અદ્દલાની ઈચ્છાથી નથી કરતો, એ તમે શી રીતે જાણી શકાય ?

મહુમદ પયગમ્બરના પ્રત્યેક અનુયાયી માટે હું પૂજ્ય ઝુદ્ધ ધરાવું છું; પરંતુ કંઈ કાર્ય કરતી વખતે મહારે મુહારી સમસ્ત પ્રજાના કલ્યાણના પણ વિચાર કરવો જોઈએ. ઈસ્લામીએ આને રજૂપુતો, એ બન્ને પ્રજાની વચ્ચે કોઈપણ જાતનો ક્ષુદ્ર લોહ ભાવ રાખવાની મુને કંઈ પણ આવશ્યકતા જણ્યાતી નથી.”

થાડીવાર અકુભર મૈન રહ્યો. તેણે કાળ પ્રત્યે તીક્ષ્ણ દૃષ્ટિ હેંકી. પોતાના ઉપરેશની અસર કાળની સુખસુદ્રાપર થઈ નથી એમ લાગવાથી અકુભર પુનઃ બોલ્યો: “ કાળ, તમે જે જમીનની માગણી કરો છો તે તમને નહિ આપવા માટે હિન્દુ પ્રજા તરફથી મુને સેંકડો અરળુઓ મળી છે. તે ઉપરથી આ જમીન આપવાનું પરિણ્યામ મારા બેઠ અંગો વચ્ચે કુલેશ વધારનારું મને જણ્યાય છે, નેથી હું તમને તે જગ્યા આપી શકતો નથી. ”

“ ડીક, પરંતુ તે જમીનની નજીબીકમાં બીજા કેટલાક હિસ્થામીઓ રહે છે તેઓ પોતાની જમીન મુને વેચાતી આપવા— ”

“ તેમને પોતાની જમીન વેચવી હશે તો શાનશાહુ તે ખરીદવાને શક્તિવાન છે.” અકુભર વચ્ચેજ બોલી ઉક્યો: “ તે સ્થળની નલુકમાં તમને એક તસુ જેટલી પણ જમીન મળે નહિ એવી મુારી દુષ્ટા છે. ”

એટલું બોલીને બાદશાહ મૈન રહ્યો. બીરખલે એક દીર્ઘ નિઃશ્વાસ મૂક્યો. તે કાળ પ્રત્યે સાથંક દૃષ્ટિ હેંકવા લાગ્યો; પરંતુ કાળની સુખસુદ્રા પર કોધ, આંખ્યાર્ કિંવા નિરાશાની છાયા સરખી પણ તે જોઇ શક્યો નહિ.

અસ્પ સમય પછી કંઈ યાદ આવ્યું હોય તેમ કાળ બોલ્યો: “ પોતાના રાજ્યમાં દુષ્ટાનુસાર અધિકાર ચલાવવાનો જહાંપનાહુને હું છે; પરંતુ મર્યાદોકના રાજ્યો પર પોતાનો અધિકાર ચલાવવાર આપને તેમજસર્વ નૃપતિઓને અલ્લાના સિંહાસન પાસે પોતાના શિર— ”

“ સખુર ! ” અકુભર ધૂરકી ઉક્યો: “ તમે અહો ઉપરેશ સંભળાવવા માટે આવ્યા નથી ! તમને જે ખુલાસો જોઈતો હતો તે મળી ગયો છે. જાઓ ! ”

“ અલ્લા જહાંપનાહુનું રક્ષણ કરો. ” એટલા અસ્પ

શખ્ફોં બોલીને કાળ ત્યાંથી ચાલતો થયો. બીરખલ પણ તેને ઉદાનની બહાર મૂકી આવવા માટે તેની પાછળ જવા લાગ્યો. બાદથાહે માત્ર કાળ પ્રત્યે તિરસ્કાર સૂચક દાખિ હેંકી.

અદ્ય સમયમાંજ બીરખલ પાછા આવ્યો. એટલે સ્વિમત કરતાં અકૃપા બોલ્યો. “ બીરખલ ! મહારા હૃદયમાંના ઉભરા કાઠવાથી હુલે મહારો કોધ કંધક શાંત થયો છે. ”

“ પરંતુ હિંદુ પ્રજાના કલ્યાણનો વિચાર કરીને આપે આજે ઉદાર પગલું ભર્યું છે, તેનું કંધ ભલતુંજ પરિષ્વામ ન આવે તો સારું ! ” બીરખલ ચિન્તાતુર મુખમુદ્રા કરીને ધીમેથી બોલ્યો.

“ એટલે ? તે મહારા પ્રાણું તો હરવાનો પ્રયત્ન નહિ કરેને ? ” બાદથાહે અહંપત હુસી પડ્યો.

“ કહાચ તેમ પણ બને. આ બાધતમાં આપણે ખાસ સાવધાનતા રાખવાની જરૂર છે. ” બીરખલ ગંભીર સ્વરે બોલ્યો.

“ ફીક છે. પ્રસંગ આવ્યે સૌંધ થઈ રહેશે. ”



પ્રકૃતણુ ગુથુ.



જીજાવેરાનો જુલામ.

આજે આપો દિવસ વૃદ્ધિ થયા કરી હતી. અત્યારે પણ વરસાદ અરમર અરમર વરસી રહ્યો હતો. અજવાળી રાત્રિ ડોવા છતાં આકાશ વાદળાંથી એવું છવાઈ રહ્યું હતું કે ચન્દ દર્શન થઈ શકતાં નહોતાં. અર્થાત સર્વત્ર અંધકાર વ્યાપી રહ્યો હતો. વચ્ચે વચ્ચે વિજળીના ચમકારા થતા હતા. વળી મેઘ ગજીના ખણું કાન ફોડી નાખે તેવી જ વારંવાર થયા કરતી હતી.

કૃતેહપુરસિદ્ધિની દક્ષિણ્ય ભાજુના સીમાડાપરના કુંગાલ ઝુંપરાઓમાં ગરીબ રાજ્યપુતો રહેતા હતા. મહેનત મળુરી કરીને તેઓ પોતાનો ઉદ્દર નિર્વહિ ચલાવતા હતા. ભાજુના જંગલમાંથી મેળવેલા વાંસના કકડાને ઝાડનાં પાઢાંના આચ્છાદનવાળા ઝુંપડાનો આશરો તે રજ્યપુતો ઉભા કરતા, તેથી વરસાદે આજે બિચારા ગરીબ લોકેના ઝુંપડામાં પાણી પાણી કરી મૂક્યું !

એક ઝુંપડાની તો એવી હુર્દશા થઈ હતી કે કહેવાની વાત જ નહિ. ઝુંપડીની એક ભાજૂની એથ વિખાઈ પડી હોવાથી, અંદર એક તસુ જેટલી જમીન પણ કોરી રહી નહોંતી. ઝુંપડીમાં દીપક તો હોયજ કર્યાંથી ? વચ્ચે વચ્ચે વિજળીના ચમકારા થતા, તેના પ્રકાશવડે એટલું જોઈ શકતું હતું કે તે ઝુંપડીના મધ્ય લાગમાં એક સ્વી અસ્તાવ્યસ્ત સ્થિતિમાં પડી હતી. તે સતી મરણ પામેલી હોવી જોઈએ, કારણ કે તેના એશિકા પાસે એકલો તે ભૂત સ્વીનો પતિ હુઃખના નિઃખાસ સુકતો હતો. તેણે ધણીવાર સુધી છાતું છાતું રડયા કર્યું; પરંતુ લાંઘો સમય સુધી તેનાથી તેમ થઈ શક્યું નહિ. આખરે તે પોતાની ભૂત પત્નીને કોટિ કરીને મોટેથી રૂદ્ધન કરવા લાગ્યો. બહાર ભયંકર મેઘ ગર્જના થવા લાગ્યો. વિજળીએ માત્ર અર્ધકણ આ હેખાવ જોઈ લીધો અને તે પુનઃ અદૃશ્ય થઈ ગઈ. અને ઝુંપડીમાં પુનઃ અંધકાર વ્યાપી ગયો. પેલો પુરુષ હુલુ રૂદ્ધન કરતો હતો; તેવામાં તેને કંઈક યાદ આવ્યું. તે રડતો બંધ થયો. પોતાની પત્નીના વક્ષઃસ્થળપર મૂકેલું પોતાનું શિર તેણે ઉચ્ચક્યું અને એક દિર્ઘ નિઃખાસ નાખીને અટ દઈને તે ઉલો થઈ ગયો.

અત્યાર સુધી તેને પોતાના ન્હાના અને ન્હાલા પુત્રની સમૃતિ નહોંતી. હુલે તે તેને યાદ આવ્યો, તરતજ તે ઝુંપડીના એક ગુણ્યામાં ગયો અને એકદ્વારેલી ગોદીમાં વિટાએલું ભાળક તેણે ઉચ્ચક્યું. તે ભાળકને એક સપ્રેમ ચુંખનું કરીને તેને છાતી મરસું ચાંપતો તે પુરુષ અશુષ્પૂર્ણ નથેને બોલ્યો. “ એટા ! ત્હારી

માતા તહારો ત્યાગ કરીને ચાલી ગઈ છે. ” એટલું બોલતાં બોલતાં તેનાથી મોટેથી રહી જવાયું.

પ્રિયપાઠક ! બિચારું અજ્ઞાન બાળક પિતાના ઝૃદનનો અર્થ શું સમજવાનું હતું ? નિદ્રામાંથી જાથ્રત થવાથી તેણે રડવા માંડયું. બાળકના ઝૃદનથી તેના પિતાનું હૈયું વધારે ભરાઈ આવ્યું. તેણે તે બાળકને પોતાની મૃત પત્નીની છાતી પર સૂવાડયું અને પત્ની તથા બાળક ઘનને સ્નેહાદિંગન દઈને તે છાતીક્રાટ ઝૃદન કરવા લાગ્યો.

આ સ્થિતિમાં તે ધષ્ણી વાર સુધી પહ્યો રહ્યો. ત્યારપણી જાથ્રત થઈને તેણે જેયું તો આકાશમાં વાડળાં વિખરાઈ જવાથી ચંદ્ર અમૃતધારા વર્ષાની રહ્યો હતો. મૃત ઢેહને બાળવાની કંઈપણ વ્યવસ્થા કરવાનો વિચાર કરીને તે ત્યાંથી ઉલ્લો થયો. અને પોતાના આડાશી-પાડાશીઓને બોલાવવા લાગ્યો; પરંતુ કોઈએ પ્રત્યુત્તર આપ્યો નહિ. નજીકના કોઈપણ શુંપડામાંથી બિલકુલ અવાજ આવતો નહોતો. સર્વત્ર શાંતિ જણ્ણાતી હતી. શું બધાં ક્યાંથી નાન્ની ગયાં હશે કે ઉંઘતા હશે ? એમ વિચારતો તે પોતાની શુંપડીમાં પાછો આવ્યો. અને પોતાની પત્નીની છાતી પર મસ્તક મુકીને રડવા લાગ્યો.

અદ્ય સમયમાં જ તેણે ઘોડાના ડાખલાનો અવાજ સાંભળ્યો. તેણે કાન માંખ્યા. ઘોડા નજીકમાં જ આવી પહેંચ્યા હાવા જેઈએ એવી તેની પ્રતીતિ થઈ. પોતાને કદાચિત્ અનાયાસે મદદ મળી આવશે, એવી આશાથી તે શુંપડીના દ્વારપાસે આવીને ઉલ્લો. ચન્દ્રના ઉજજવલ પ્રકાશમાં તેણે બારણુંમાં આવીને જેયું તો ચાર ઘોડેસ્વારોને પોતાની શુંપડી સમીપ આવી પહેંચેલા જેયા. તે ઘોડેસ્વારોમાંનો એક હોલ્યો : “ અરે, એ શરૂતાન, જરા અહિં આવી જ જેઈએ ? ”

આ હુકૂમનો અનાદર કરીને શુંપડીમાં પાછું ચાચ્યા જરૂર એ અશ્વકુચ હતું. રાઘોળ (જે તેનું નામ હતું) મૂજતા શરીર

આગળ ચાહ્યો. મહા મુશિબને હગલા લસતા રાધાલ પ્રત્યે ડેણા ધૂરકાવતો પેદો ઘોડેસ્વાર બોલ્યો: “ તાકીદ કર, બહુમાશ ! ”

હવે રાધાલની ખાત્રી થઈ કે કેઠ નહુનો સૂનો અધિકારી પોતાનો નિત્યનો અત્યાચાર કરવા સારુ નીકલ્યો છે; કારણું પોતાની પ્રજા સુખી રહી શકે એવા કાયદાઓ ધડવાનું કામ જોકે શહેનશાહ અકુભરના હાથમાં હતું; પરંતુ તે કાનૂનોની અભિવાણી કરનારા તો આવા નહુના સુના અધિકારીએ જ હતા. આથી જ અકુભરને અભર પણ નહેઠતી કે ગુમ રીતે પોતાની પ્રજા પર કેવો જૂલમ થયા કરતો હતો. જીજુઆ વેરાના બહુના હેઠળ તેના તેટલાક અમલદારો ગરીબ અને અશિક્ષિત લોકોને રંબઢીને તેમની પાસેથી પૈસા એકવતા અને પોતાના બિસ્સા નાણુથી તર કરતા હતા. આ કારણુથી જ ગરીબ લોકો અધિકારીનું નામ સાંભળતાં કંપી ઉડતા. રાધાલ ઘોડેસ્વારને જેઠને છુલુ ઉડ્યો હતો તેનું પણ એજ કારણ હતું; પરંતુ કાળના મહેંમા બળ રૂપે પડ્યા જિવાય છુટકેજ નથી એમ ધારીને રાધાલ તે અધિકારી પાસે જઈને ઉલો.

“ શયતાન ! જીજુઆ વેરો જલદી લાવ. ” પેદો મુસલમાન ઘોડેસ્વાર બોલ્યો.

રાધાલ મૈન ઉલો રહ્યો. પોતાના શા હવાલ થાય છે તેની તે ઘૈર્યથી રાહુ જોવા લાગ્યો.

“ કાન કૂટી ગયા છે કે ? ” પેદો મુસલમાન સ્વાર હવે રાતો પીણો થઈ ગયો. અને બોલ્યો. “ પૈસા લાવ. જીજુઆ વેરો સત્વર આપી હે. ”

“ મહારી પાસે પૈસા નથી જેથી જીજુઆ વેરો આપવાની મહારી શક્તિ નથી. ” રાધાલ નામ સ્વરે બોલ્યો.

“ અરે પાગલ, પૈસા આપે છે કે તેદ કરું ? ” એદો ઘોડેસ્વાર ઘોડા પરથી નીચે ઉત્તરીને રાધોળ પાસે આવ્યો અને તેના અન્ને હુથ પંકડીને એલ્યો.

ગરીબ મનુષ્યો મોટા ભાણુસેનાં કે અધિકારીઓનાં અ-પમાન કારક વચ્ચેનો સાંલળવા માટે ટેવાયલાં હોય છે. ગરીબાધ્યે કુદરતી રીતે તેમના સ્વભાવમાં નમૃતા મૂકી હોય છે; પરંતુ જ્યારે સહન શીકતાની પરાક્રાણ થાય છે ત્યારે તે નમૃતા પણ ઉચ્ચતાનું સ્વરૂપ ધારણું કર્યા વગર રહી શકતી નથી. અત્યાર સુધી શાંત રહેલા રાધોળનો પિત્તો હું હુથથી ગયો. આજે પોતાની પ્રિય પત્નીનું મૃત્યુ થયું હોવાથી તેનું ચિત્ત ઉદ્દિગ્ન હતું. વળી અતિ વૃદ્ધિને લીધે તેની કંગાલ જુંપડીનો આશ્રય પણ ચુંથાઈ ગયો હતો. મૃત પત્નીના શખની અંતઙ્ગીયા કરવા માટે આડોશી-પાડોશીને બોલાવતાં તેમાં પણ તેને નિરાશા જ પ્રાપ્ત થઈ હતી. આ પ્રમાણે તેના હુદ્દ્યમાં અજિનની જવાગા લડલડ ખળી રહી હતી, તેવામાં આ ઘોડેસ્વારેની મદદ મળવાને અદલે મુસલમાન સ્વારે રાધોળના હુથ પકડ્યા. એટલે રાધોળનો મિલજ હુથથી ગયો. તેના હુદ્દ્યમાં સગળી રહેલા અજિનમાં ધી હોમાયું, તેણે જેસથી મુસલમાન સ્વારના હુથમાંથી પોતાનો હુથ છોડાવી દીધો. અને તેના પેટમાં એક જેસથી પાદુ લગાવી દઈને તે ઘોડેસ્વારને ધૂળ ચાટતો કરી દીધો.

પોતાને સંતાપનારને થોળ્ય શાસન આપીને રાધોળ પોતાની જુંપડીમાં ચાહ્યો ગયો. અને ગલરાટમાં રડતા ભાળકને ખાથમાં લઈ છાનું રાખવા લાગ્યો; પરંતુ જુંપડીનો આશ્રય લેવાથી શું ફ્રાયદો થવાનો હતો? તે કંઈ થોડો એકાદ મજબૂત ડિલ્લો હતો! એદો ઘોડેસ્વાર તરતજ ઉલો થયો. અને પોતાના હુથમાં ખુલ્લી સમશેર પકડીને જુંપડીમાં દાખલ થયો. રાધોળએ તરતજ પોતાના આડોશી-પાડોશીને મદહે બોલાવવા માટે બુમો પાડી પણ તે મુસલમાન સ્વાર તેથી સહજ પણ ભય પામ્યો. નહિ. મૃતપત્નીના શુણ પાસે એઠેલા રાધોળની બાથમાં

તેનું પ્રિય ખાળક હતું. પેદો મુસલમાન સ્વાર રાધોળના અંગપર ધર્યો એટલે તેને તેની સાથે કંક્ષુદ્ધમાં ઉત્તરખું પડ્યું. લઢતાં લઢતાં રાધોળના હુથમાંથી ખાળક જમીન પર પડ્યું અને તે ગતપ્રાણુ થઈ ગયું. પોતાનું એકનું એક ખાળક ગતપ્રાણુ થએલું જોઈને રાધોળને કંપારી આવી અને તે મૂળ્યાંગત થઈને ધરણી પર ફળી પડ્યો.

આ અનાવ અન્યા પછી પેદા મુસલમાન ઘોડેસ્વારને જણ્ણાયું કે અહિંથી કંઈ પૈસા પાકે તેવો સંસાર નથી—આવી કંગળ જુંપડીમાંથી કશું મળવાનું નથી, એમ વિચારીને તેઓ સંબળા ત્યાંથી ચાલ્યા જવાની તૈયારી કરતા હતા. એવામાં તે ઘોડેસ્વારેમાંના એકની દૃષ્ટિ રાધોળની પતની તરફ ગઈ. શાન્ત નિદ્રા લેતી તે તરણી પર દૃષ્ટિ પડતાંની સાથે તેનું અપ્રતિમ લાવણ્ય જોઈને તે ઘોડેસ્વાર મોહિત થયો.

પ્રિય વાંચનાર ! મનોવિકારને વિવશ થઈને મનુષ્ય કેવો મૂઠ અની જાય છે તે જ્ઞાયો ! આ જગતના પ્રારંભ કાળથી તે અધ્યાપિ પર્યાત સૌનંદર્યની કદમ્પનાયોયો પણ કેટલાયે મનુષ્યોને હેવા નચાવ્યા છે ? જે જે વસ્તુ પર મનુષ્ય અંતઃકરણ-માંની સૌનંદર્યકદમ્પના પોતાનું ખાં અજમાવે છે, તે જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય ગાંડાની પેઠે હોડાહોડ કરી મુકે છે. લલે પછી તે વસ્તુ ગમેતેવી ક્ષણુભંગુર હોય, ગમે તેવી ભાષક હોય કે ગમે તેવી અસત્ય હોય ! શકુંતલાની પ્રતિમા કાઢીને અશ્રુ ઢાળનારો અને મૈત્રેયી પાસે શકુંતલાના સૌનંદર્યરસનું પૂર્ણ રીતે વર્ણન કરનારો રાજ હુષ્યન્ત પણ એક વખત આવી જ સૌનંદર્ય કદમ્પનાને આધીન થયો હતો, તો પછી સાધારણ મનુષ્યની તો બાતજ શી ? હું કામાં સૌનંદર્ય દેવ કે હાનવને પણ હીવાના અનાવે છે, તો પછી એક ઘોડેસ્વાર રાધોળની સ્કીનું અનુપમ લાવણ્ય જોઈને તેના પ્રતિ આકર્ષિય તેમાં શું નવાઈ ? સારા-સારનો વિચાર હુદયમાં ન લાવતાં તરતજ તે મૂત સીના

શબ્દ પાસે જઈને ઉલો, તે પાપાત્મા આ પવિત્ર રાજ-
ભૂતાખીના શરીરનો સ્પર્શ કરવા જય છે એજ ક્ષણે
ઝુંપડીની બહાર કંઈ કોલાહલ સંભળાયો. પુષ્પળ દોકો
ઝુંપડી પાસે એકત્ર થઈ ગયા હોય એવી તે સ્વારેની ખાત્રી
થઈ. પેદો નરાધમ પાંચ સાત ડગલાં પાછો હતી ગયો અને
પોતાના સોખતી સાથે ઝુંપડીના દ્વાર તરફ પાછો વહ્યો;
પરંતુ ઝુંપડીના દ્વારમાં લગભગ પચીશોક રાજપૂતો પોતાના
હાથમાં મોટી લાકડીઓ લઈને ઉલા હતા. ઘોડેસ્વારો સહમજ
ગયા કે પોતાનાં સો વર્ષ આજે પૂર્ણ થવા આવ્યા છે.

એક ધટિકા પૂર્વે રાધોળાએ પોતાના પાડોસીઓને બુમ
પાડી ત્યારે કોઈ જાયત થયું નહોતું; પરંતુ થોડા સમય પૂર્વે
રાધોળાએ જે કિંદિયારી પાડી હતી, તેથી ધણાખરા પાડોશીઓ
જાયત થઈ ગયા હતા. અને તેઓ પોતાની નજીકની ઝુંપડીમાં
રહેનારાઓને જાયત કરવા લાગ્યા. અદ્ય સમયમાંજ સૈા રાધો-
ળની ઝુંપડી પાસે આવી પહોંચ્યા ને રાધોળ તેની પત્ની અને
ખાળકને અસ્તાભ્યસ્ત સ્થિતિમાં જમીનપર પડેલાં જોયાં એટલે
ત્યાં રહેલા મુસલમાન ઘોડેસ્વારોએજ રાધોળ, તેની પત્ની
અને તેના ખાળકના પ્રાણું હર્યા હોવા જોઈએ, એવી કદ્દના
થતાં તેમની કોધ જ્વાળા ભલૂકી ઉઠી અને ‘મારો હરામખોરાને
તેમને ઢાર કરો ! ’ એવા ઉદ્ગારો ચોતરફથી સંભળાવા લાગ્યા.
“ સખુર કરો, સખુર કરો. અમરસિંહજ આવે છે. ” એક-
જણ વચ્ચેજ ઘોલી ઉઠ્યો.

આ સાંભળીને સર્વને વિજળીનો આંચકો વાગ્યા જેવું
થયું. તે મુસલમાનને મારવા માટે ઉગામેલી લાકડીઓ સૌના
હાથમાં એમની એમ રહી ગઈ. મુસલમાનના અંગપર ધર્સા
જવા માટે તૈયાર થઈ રહેલા મનુષ્યોના પગ ત્યાં જમીન સાથે
જ ચોંટી ગયા. ને અમરસિંહતું નામ સાંભળીને સૈા પાછા કરી
ને જોવા લાગ્યા. ખરેખર, અમરસિંહ પોતાની નિત્યની ગંભીર
ગતિથી ઝુંપડી તરફ આવતો હતો. અમરસિંહને જોતાંની

સાથેજ સૌચો તેના નામનો જય ગર્જના કરી; કારણુ કે તે તેમનો વિશ્વાસુ નાયક હતો—દોક સેવક હતો. અમરસિંહની મૂર્ત્તિ પ્રત્યે તેઓ સર્વ એકાથચિતે જેવામાં એટલા બધા લીન થઈ ગયા કે તેમના આ હુર્દક્ષયપણુનો લાલ લઈને પેલા ચારે મુસ-લમાન ઘોડેટ્વારો જુંપડીની બીજુ બાળુઓથી પલાયન કરી ગયા તેની સુખાં કોઈને અખર પડી નહિ.

જુંપડીની નજુકમાં અમરસિંહ આવી પહોંચ્યો એટલે જૌચો તેને નમન કર્યું. અમરસિંહ પ્રત્યે તેઓ નિઃસીમ પ્રેમ ધરાવતા હતા. અમરસિંહ સિક્કિના એક વિલાગમાં રહેતો હતો. જો કે તે કોણુ છે, તે બાખતની કોઇને માહિતી નહોંતી; પરંતુ તે પોતાનો કલ્યાણુકર્તા હતો, એમ આ સર્વ ગરીબ રાજ્યપૂતોની ખાત્રીપૂર્વેક માન્યતા હતી. રાજ્યપૂતોના કલ્યાણાંશેજ અમરસિંહ પોતાનો સર્વ સમય વ્યતીત કરતો હતો. અકખર પોતે અત્યંત દ્યાળુ અને કાર્યદક્ષ નૃપતિ હતો; પરંતુ તેના રાજ્યદરખારમાંના કેટલાક લુચ્યા અધિકારીઓ—ખુદ શહેનશાહ પાસે પહોંચ્યીને દાદ ન મેળવી શકે એવા ગરીબ-પ્રભાજનાને રંબાડતા હતા. અકખરને આ અત્યાચારની રજ માત્ર પણ અખર મળતી નહિ. આ અત્યાચારના પ્રકાર અનેક હતા અને તેમાંના એકનું વર્ણન અમે ઉપર આપી ગયા છીએ. બીજે પ્રકાર દોકને લાંચ આપીને ધર્માંતર કરાવવાનો હતો. આથી પરિણ્યામ ધાણુંજ ખરાણ આંધું. અકખર બહારથી રાજ્યપૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે; પરંતુ ધર્માંતરની બાખતમાં અંદર-આનેથી તેનો હુથ હોવો જોઈએ, એવી તે સમયના પુષ્કળ રાજ્યપૂતોની માન્યતા હતી અર્થાતું તેમનામાં એવી ગેરસમજ ફેલાવા પામી હતી. અમરસિંહના મનમાં પણ આવીજ ગેર-સમજ ઉફલવી હતી અને તેથી તેણે ગરીબ રાજ્યપૂતોનાં હુંખનું નિવારણ કરવાનું અને ગરીબ રાજ્યપૂતોની ફરિયાદ ઠેઠ રાજના ડાન સુધી પહોંચાડીને ધર્માંતરની બાખતમાં અકખરની સહાનુભૂતિ છે કે કેમ તે બાખતનો નિર્ણય કરવાનું બીજું અડાયું

હતું. કાળું મસળુદ ખાંધવા માટે માગેલી જમીન તેને નહિ આપવાની અરજ અમરસિંહને કરી હતી અને અકૃબરે તે માન્ય પણ રાખી હતી, એ વાચકો ગત પ્રકરણમાં વાંચી ગયા છે. બાદશાહ અકૃબરશાહ હવે સમરસિહના નામથી પરિચીત થઈ ગયો હતો.

અમરસિંહને નમન કર્યા પછી સર્વ રાજપુતોએ અનેલો અનાવ તેને કહી સંભળાવ્યો કે ઉપરથી અમરસિંહ તે મુસલમાન સ્વારોને કંઈ પણ ઈન કર્યો સિવાય પકડી લાવવાની આજા આપી. એટલે સૌની દષ્ટી ઝુંપડી તરફ વળી; પરંતુ ત્યાંથી તો તે સ્વારો કયારનાએ પલાયન કરી ગયા હતા.

શિકાર હાથમાંથી છટકી ગયેલો જોઈને સર્વ રાજપુતો નિરાશ થયા; પરંતુ થોડા થોડા માણુસોની ચાર ટોળીઓ કરીને અમરસિંહ તેમને જુદી જુદી દિશામાં જવાની સ્ફુર્યના કરી. અમરસિંહનો આ વિચાર સર્વને પસંદ પહ્યો અને તેઓ તેને અમલમાં મૂકવાની તૈયારીમાં હતા. એવામાં તે મુસલમાન સ્વારોને કેદ કરીને ત્રણ રાજપુતો ઘોડેસ્વારોને ઝુંપડી તરફ આવતા જોઈને સર્વને આશ્રીય થયું ને તે રાજપુત ઘોડેસ્વારો ઝુંપડીની સમીપમાં આવી પહોંચ્યા ત્યાંસુધી સર્વ તેમના ગ્રત્યે એકિટસે જોતા ઉલાજ રહ્યા.

ઝુંપડીની નજીકમાં આવી પહોંચ્યા પછી પેલા ત્રણ રાજપુત ઘોડેસ્વારોમાંનો એક સહુજ આગળ આવ્યો અને સર્વને ઉદેશીને ખોલ્યો: “ અમે રહ્યે થઈને જતા હતા એટલામાં અતે કોઈની કિકિઆરી સાંલળી. આથી અમે આ ખાનુ તરફ અમારા થોડા વાખ્યા; પરંતુ માર્ગમાંજ આ ચાર ઘોડેસ્વારોની સાથે અમારો મેળાપ થયો અને તેમના ગલરાચેલ વર્તન પરથી અમે તેમને પકડ્યા છે. તેમણે શું અહો કંઈ અયોધ્ય કૃત્ય કર્યું છે ? ”

તે રાજપૂત સ્વારના ગ્રતાપ પૂર્વ અને સહાતુભૂતિ દર્શક સ્વરે ઉચ્ચારેલા ગ્રેનથી સર્વના અંતરમાં તેના માટે માન

ઉપજયું. તેઓ બધા એકી અવાજે એલી ઉક્યા: “ આથી વધારે લયંકર હૃત્ય કર્યું ? તેમણે ત્રણ મનુષ્યોના પ્રાણ હુર્યો છે ! તેમને કાપી નાખો ! તેમનું રૂધિર પાન કર્યા સિવાય આમારા મન શાન્ત થશે નહિ. ”

એ ત્રણ રાજ્યપૂત સ્વારેને જોતાંની સાથેજ અમરસિંહના હૃદયમાં તેમના માટે આદર ઉપજયો હતો. તેમના ઘોડા અને તેઓ પોતે વરસાદથી ભીજાઈ ગયા હતા. તે યવન સરહારોને પકડવાથી તેઓ પરાકરી હતા એ તો સ્પષ્ટ રીતે જણ્ણાઈ આવતું હતું. તેમજ તે ત્રણે સ્વારે પૈકી આગળ આવીને એલાનાર સ્વારનું ગાંભીર્ય, સરળપણ્ણાની સાક્ષી આપનારા તેના લાગણી ભર્યા શાફ્ટો, હાવસાવ આ સર્વ જોઈને અમરસિંહ મોહિત થયો. તે રાજ્યપૂત સ્વારના છેવડના પ્રેરને લીધે ઉપજ થયેલો કોલાહલ શાંત કરીને તેણે તે રાજ્યપૂત સ્વારને સર્વ હુકીકત સંક્ષિપ્તમાં કહી સંભળાવી અને “ હુવે શું કરવું ? ” એવો પ્રેરન તેને પૂછ્યો.

“ ઈન્સાહેની અદાલતમાં તેમના માટે કુરીયાદ કરવાથી આપને દાદ મળી શકશે. કાપાકાપી કરવાથી શો વિશેષ ઝ્યાદો થવાનો છે ? ” તે રાજ્યપૂત સ્વારે પોતાનો અલિપ્રાય દર્શાવ્યો.

અમરસિંહને આ સલાહ પસંદ પડી અને તે યવન સરહારોના નામ ઠામ નોંધી લઈને તેમને મુક્ત કરવામાં આવ્યા; પરંતુ તેટલા સમયમાં તેમના શરીર પર લાતો અને પાટુઓના અનેક પ્રહુાર થયા વગર રહ્યા નહોતા.

હુવે માત્ર અમરસિંહ અને તે ત્રણ રાજ્યપૂત ઘોડેસ્વારો ત્યાં રહ્યા. તેમણે બધાયે જુંપડીમાં પ્રવેશ કર્યો. જુંપડીમાંનો હેખાવ ખરેખર હૃદય લેદ્ધક હતો. અમરસિંહ રાઘોળને ઓળખતો હતો. માતા, પિતા અને બાળક એ ત્રણને સાથે મૃત્યુ ચામેલાં જોઈને સર્વના અંત:કરણું હુઃખિત થયાં.

“ અરે ! અરે !! આવા અત્યાચારો થયા કરે ત્યાં સુધી પણ

આ જગતમાં ઈશ્વર છે—ઈન્સાક્ર છે એમ માની અમારે એસી રહેલું ? હું જે રાજ હોત તો આવા અત્યાચારો કહિ પણ જોઈ શકત નહિ ? ” અમરસિંહે હુઃઓઝગાર કાઢ્યા.

એટલામાં રાધોળને શુદ્ધિ આવવાથી તેણે સહજ હાલવા માંડ્યું. અત્યાર સુધી રાધોળને પણ મૃત્યુ પામેલોજ સર્વ સ્વહમજતા હતા તેને જીવતો જોઈને સર્વ આનંદ પામ્યા અને તેઓ તેની પાસે ગયા.

તેમને પોતાની તરફ આવતાં જોઈને રાધોળના કોધનો પાર રહ્યો નહિ. તેમને યવન સરદારો સ્વહમજને તે તેમના અંગ પર ધર્યો; પરંતુ જેવો તે અમરસિંહજ પાસે પહોંચ્યો કે તરતજ તેણે એણાખી લીધ્યો અને તે તેમને લેટી પડ્યો. તેનું હૃદય ભરાઈ આવ્યું ને ગળગળા સાહે ઓદ્યો: “ અમરસિંહજ ! આ તે કેવો અત્યાચાર ! ” એટલું ઓલીને તેણે અમરસિંહની છાતી પર પોતાનું શિર મૂકી દીધું.

અહ્વપ સમય પછી રાધોળ પોતાનું મહાં ઉચ્ચ કરીને ઓદ્યો: “ અમરસિંહજ ! અંતે અજ્ઞ વિના તરક્કીએ આઇને મહારી સ્વીએ આજે સાયંકાલે પોતાના પ્રાણુ ત્યજયા છે. હુશે, બિચારીને હુઃખમાંથી મુક્તિ મળી ! પરંતુ મહારું નસીબ કેવું ફૂટેલું ! મહારી સ્વી મરણ પામી અને હું હુઃખ લોગવવા માટે અહિ રહ્યો ! અમરસિંહજ ! આ શું પડ્યું છે તે જોયું કે ? અરેરે ! બિચારું નહાતું બાળક ! અમરસિંહજ—અમરસિંહજ તમે બધી હડીકત જાણી કે ? મહારા બાળકનો અકાળે પ્રાણ લેનારા રાક્ષસો ગયા ક્યાં ? ” હુવે રાધોળના નેત્રોમાં કોધનો અભિ લસકવા લાગ્યો. તેણે આવેશમાં જ આગળ ચલાવ્યું ! “ હું તેમની પાછળ જ-હને—” એટલું ઓલીને રાધોળ અમરસિંહજની લેટમાંથી મુક્તા થઈને તેની પાછળ જવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. અમરસિંહે તેનો હુથ મજબૂત રીતે પકડી રાખ્યો. એટલે રાધોળ

કેદ્ય પૂર્ણ દૃષ્ટિ કેંકતો બોલ્યો ? “ અમરસિંહજી ! છેડો, રહુને જવાદો ! ”

“ રાધોજી ! આમ ગાંડાઈન કર ! શાન્ત થા ! ” ૨૧-
ઘાણનો હૃથ પકડીને અમરસિંહજી બોલ્યો.

“ અમરસિંહ ! આ પ્રમાણે તમે ક્યાં સુધી શાન્તિ પ-
કૃશો ? અમારા ગ્રાણુ હરવામાં આવે અને અમારાપર અસહ્ય
અને નિઃચીમ જુલભ ગુણરવામાં આવે; છતાં પણ તે અત્યાચા-
રની લેશ માત્ર પણ માહિતી ને બાદશાહ મેળવી શકતો નથી
તે બાદશાહ શાનો ? અમરસિંહ ! અકખરને જરૂરને કહો કે
રાજમહાલયમાં ટાઢા છાંચે બેડા બેડા ન્યાય અને તત્વજ્ઞાનની
વાતો કરવા કરતાં અહિં ચાલી રહેલા અત્યાચારો અત્રે આવીને
નજરોનજર જુઓ ! ” એટલામાં અમરસિંહ સાથે જુંપડીમાં
આવેલા ત્રણુ રાજપૂત સ્વારો પ્રત્યે દૃષ્ટિ જતાં રાધોજી સહજ
અચક્યો. તેણે અમરસિંહને પૂછ્યું ! “ અમરસિંહજી ! આ
ગુહ્યસ્થો કોણુ છે ? ”

“ તેઓ આપણુ મિત્રો છે. ” અમરસિંહ પોતાના મ-
નમાં કંઈક વિચાર કરતાં બોલ્યો.

“ રાધોજી ન્યારે અકખરને ઉદેશીને બોલતો હતો
ત્યારે પેલા ત્રણુ ઘોડેસ્વારોની સુખસુદ્રા પર એક પ્રકારની ચળ-
વિચળ થઈ રહેકી હતી તે ચાલાક અમરસિંહ કળી ગયો હતો.
અમરસિંહ તે ચળવિચળનું કારણુ શોધતો હતો. થોડીવાર ર-
હીને અમરસિંહ બોલ્યો ! “ રાધોજી આમ રડીને ઐસી રહે-
વાથી શું વળવાનું છે ? આપણે પહેલાં તો આ મૃત હેઠની
અંત્યેણિ કિયા કરવામાં રોકાવું જોઈએ.

એક દીર્ઘ નિઃવાસ મૂકીને રાધોજી બોલ્યો : “ એ ખર્દં,
પરંતુ પૈસા— ” થોડીવાર વિચાર કરીને રાધોજી પુનઃ બોલ્યો.
“ અત્યારે મહારી પાસે એક કેડી સુદ્ધાં નથી; પરંતુ પ્રાતઃ-
કાળે હું ગમે તેમ કરીને થોડા ધણુ પૈસા અવશ્ય લાવી શકીશ. ”

એટલામાં પેલા ત્રણુ રાજ્યપુત ઘોડેસ્વારોમાંનો વચ્ચેનો સ્વાર સહજ આગળ આવીને ઓદ્યો: “ મહારા દ્રવ્યનો ઉપયોગ આવા સત્કાર્યમાં થશે તો મહુને બહુ આનંદ થશે. હું આપનો પરિચિત મનુષ્ય નહિ હોવાથી આપ મહારી સહાયતાનો અનાદર કરશો નહિ. સંકટના સમયે આપણે સર્વ રાજ્યપૂતોએ સગા ભાઈની પેઠેજ વર્તાવું જોઈએ. ”

ધડીએ ધડીએ શૈર્ય, ધુર્તપણું અને ઔદ્ધાર્ય વ્યક્ત કરનારી આ વ્યક્તિ વળી કોણુ છે ? એમ વિચારતો અમરસિંહ તે રાજ્યપુત સ્વાર પ્રત્યે એકી ટસે તાકી રહ્યો. રાધોળ અને અમરસિંહ તે રાજ્યપુતની વિનંતી સ્વીકારી અને રાધોળને ધૈર્ય આપીને તે પેલા ત્રણુ રાજ્યપુત સ્વારેની સાથે ઝુંપડી બહાર નીકળી પડ્યો. પેલા ઉદાર રાજ્યપુત સ્વારના ખલા પર હાથ મૂકીને અમરસિંહ ધીમે સ્વરે ઓદ્યો: “ આપ જરા એક ખાનું આવશો ? ”

કંઈ પણ ન ઓદતાં તે રાજ્યપુત સ્વાર અમરસિંહની સાથે થોડે હુર ગયો અને અમરસિંહની પ્રત્યે સહેતુક દિશિપાત કરતાં ઓદ્યો: “ કેમ શું છે ? ”

“ આપનું નામ શું ? ” અમરસિંહે પુછ્યું.

“ પૃથ્વીસિંહ, ચિતોડના યુદ્ધમાં હું અને મહારા પિતાશ્રી મહારાજ ઉદ્યસિંહના સૈન્યમાં હતા; પરંતુ મહારાજ ઉદ્યસિંહનો પરલોકવાસ થયા પણી આ રાજ્યમાં આવવાની ઈચ્છા થતાં આ તરફ વસ્યો છું. આપણા સ્વર્ગાતી બંધુનું મહારાથી કદ્યાણ થઈ શકે તો મહુને બહુ આનંદ થશે. ”

“ આપના જેવા પર્યાપ્તારી પુરુષ જગતમાં બહુ હુર્દાં છે. મહારાજ નામ અમરસિંહ ! ” અમરસિંહે વિવેક દર્શાવિતાં કહ્યું.

“ તે હું જણું છું : ” પૃથ્વીસિંહ ઓદ્યો: “ સિક્કિના ગર્ભીભ રાજ્યપૂતોની જીર્ણ ધાનાર અમરસિંહનું નામ મેં

મેવાડમાંજ સાંલજથું હતું. ઈશ્વર આપના જેવા વીરપુરુષને દીર્ઘાયુષી કરો ! ”

“ આપની સાથે મૈત્રી કરવાની મહેને ૬૬ ઈચ્છા છે. ”
પૃથ્વીસિંહ પ્રત્યે એકી ટસે જેતાં અમરસિંહ ઓદ્યો.

“ વાહ, ઈશ્વરે કેવો સુધોગ મેળવી આપ્યો ! ” પૃથ્વીસિંહ ઓદ્યો.

“ ઈશ્વરનીજ એવી ઈચ્છા છે કે આપણે ઉલયને પરસ્પર મિત્રતા બાંધવી. વારુ, પણ તમારા વસ્ત્રો લીનિયલા છે. મહારી જુંપડીમાં ચાલો. આ મિત્રોને પણ આપણી સાથેજ લઈ દો, તેઓ આવશો ખરાને ? ”

“ હા, જ્યાં હું જાઉ ત્યાં તેઓ આવવાનાજ ! તેઓ મહારા પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. ” એટલું બોલીને પૃથ્વીસિંહ પોતાના બન્ને મિત્રો પાસે ગયો. અને તેણું તેમના કાનમાં કંઈ ધીમે રહીને કંઈ એટલે તેઓ બન્નેએ અમરસિંહ પ્રત્યે એક વડુ કટાક્ષ ફેંક્યો.

અદ્ય સમયમાંજ અમરસિંહ, પૃથ્વીસિંહ અને તેના એ મિત્રો અમરસિંહની જુંપડી તરફ જવા લાભ્યા. પૃથ્વીસિંહે પોતાના બન્ને મિત્રોના કાનમાં કંઈ, ત્યારથી તે ઉલયની સુખ-સુદ્રા સહજ લયલીત જણ્ણાતી હતી. પૃથ્વીસિંહે એવું તે તેમના કાનમાં શું કંઈ હશે ?

પ્રકરણ ૫ મું.

પાપીના પંચામાં.

આજે રાત્રિએ અકખર પોતાના મહાલયમાં રહેનાર છે એવી ભાતમી મજ્યા પછી પદ્માનું મન એટલું બધું અસ્વસ્થ થઈ ગયું કે તે ડાઇપણ રીતે શાન્ત થયુંજ નહિ. વાસ્તવિક રીતે જેવા જતાં તો બાદશાહ પોતાના અંત:પુરમાં

આવનાર છે એ હકીકત સાંભળીને તેની પ્રત્યેક રાણીને આનંદ થવોજ જોઈએ; પરંતુ પડ્માએ અકૃષર માટે પોતાના મનમાં એટલો તો હલકો અભિપ્રાય બાંધી લીધો હતો કે તે અકૃષરને પોતાના હુદ્દેવને લીધેજ મળેલો પતિ સ્હુમજતી હતી. જ્યારે અકૃષરની સાથે તેનું લઘું થયું, ત્યારે પણ તેની સાથે લઘું કરવાની ઈચ્છા પડ્માના મનમાં નહોંતી; પરંતુ તે સમયે તેના પિતાના નહાના સરખા રાજ્યને અકૃષરની સહાય લીધા વગર ચાલે તેમ નહોંતું અને કેવળ પિતાના કદ્યાણુંજ તે અકૃષર સાથે લઘું અંથિથી જોડાવા માટે તૈયાર થઈ હતી; પરંતુ તેના આ આત્મયજનો જાઓ ઉપયોગ થયો નહિ; કારણું કે તેનું લઘું થયા પછી અદ્ય સમયમાંજ તેનો પિતા મરણ પામ્યો. તે આત્મવિહીન થઈ ગઇ. પડ્માના હુદ્દ્યમાં અકૃષર માટે ઓમનો અંશ સુન્દર નહોંતો એટલુંજ નહિ; પરંતુ અકૃષર પ્રત્યે તેના મનમાં દ્રેષ ભાવ હતો એમ કહેવામાં કંઈજ હરકત નથી.

આ દ્રેષ ઉત્પત્તિ થવાનું કંઈ ખાસ કારણ નહોંતું; તો પણ અકૃષરની ધાર્મિક વલણુનો લળતોજ અર્થ કરવાથી પડ્માનું મન અકૃષર પરથી ઉડી ગયું હતું. “ અકૃષરની હિન્દુ ધર્મ પ્રત્યેની લાગણી કેવળ બાધ્ય છે અને તે ઈસ્લામી ધર્મનોજ પ્રચાર કરવા ઈચ્છે છે. રાજ્યપૂત તરફાયીએને સુસલમાનો સાથે પરણાવવાથી અને ચાવની સ્વીએને રાજ્યપૂતો સાથે પરણાવવાથી કંઈ હિન્દુ ધર્મનો પ્રચાર થતો નથી; પરંતુ ઉલ્કાં અહૃતથી ધાંધલ નહિ મચાવી મૂકતા છુપીરિતે ઈસ્લામી ધર્મનો પ્રચાર કરવાની અકૃષરની આ એક શુસ ચુક્તિ છે. ” એવા એવા વિચારેને લીધે ધણુા ખરા હિન્દુએ અકૃષરને અંતઃકરણ ચૂર્ણક ધિક્કારતા હતા. પડ્માની પણ તેવીજ સ્થિતિ હતી. પોતાના જેવી રાજ્યપૂત સ્વીએની સાથે લઘું અંથિથી જોડાવામાં હિન્દુધર્મ નામાવશોષ કરવાનોજ અકૃષરનો આંતરિક હેતુ છે, એવી તેની પછી ખાત્રી થઈ ચુકી હતી અને તેથીજ અકૃષર સાથે તેને બનતું નહોંતું. અકૃષર પણ તેના આ ખધા વિચારે

કુળી ગયો હતો; અને ધીમે ધીમે પદ્માના મનમાંથી આ વિચારાં ફૂર કરી તેની પાસેથી ચોખ્ય ગ્રેમ પ્રાસ કરવાનો તેણે પોતાના મનમાં દઢ નિશ્ચય કર્યો હતો. પોતાની બધી એગમો કરીણાં આકબર પ્રદ્રનિને વધારે રહ્યો હતો. કારણું કે પદ્મા અતિ લાવણ્યમય હતી. અને જનાનભાનામાં પ્રવેશ કર્યા પછી અદ્ય સમયમાંજ પદ્માએ પોતાના અનેક સહશુણ્યાથી આકબરનું મન પોતાની તરફ આકર્ષી લીધું હતું. પરંતુ પદ્માનું હૃદય પીગળતું નહોતું.

આકબરની સાથે ગમે તેમ કરીને પણ મેળાપ ન થવા હેવો એવો પદ્માએ પોતાના મનમાં નિશ્ચય કર્યો હતો. તેણે પ્રથમ બીમારીનો ઢાંગ કરવાનો વિચાર કર્યો, પરંતુ તેથી આદશાહ જનાનભાનામાં આવ્યા વગર રહેશે નહિ, એમ વિચારને તેણે આજે રાત્રિએ રાજમહાલયની બહાર નીકળી જવાનો વિચાર કર્યો અને તે ચુક્લિ પાર પાડવા માટે તેણે આજે રાત્રિએ જળ વિહાર કરવાનું નક્કી કર્યું. તેણે નોકાતૈયાર કરવવાની આજા એક દાસીને આપી હીધી અને દાસી તે આજાનો અમલ કરવા માટે નીકળી પણ પડી. દાસી જેવી રાજમહાલયની બહાર નીકળવા જતી હતી તેવામાં કાળને તેણે લાં જોયો. કાળની અને તેની દાઢિ એક થઈ. દાસીએ પોતાનો માર્ગ બદલ્યો, પરંતુ કાળએ તેને પકડી પાડી એટલે દાસી એકવાર ચોમેર દાઢિપાત કરીને બોલી: “ મુને જવા દો અત્યારે આમ તોક્કાન ન કરો ! જવા દો મુને કોઈ જોશો ! ”

“ કોઈ જોવાનું નથી. ” કાળ નિહરપણે બોલ્યો: “ અને કહાચ કોઈ જુદે તોપણ શું ? વારુ પણ જુદેખા, તું આટલી બધી આજે લયભીત કેમ જણ્યાય છે ? અહિ ઝેણું આવવાનું હતું ? તે દિવસે છટકી ગઈ ત્યારપછી મોં ચુદ્ધાં બતાવ્યું નહિ ને ? ”

“ માત્ર મ્હોં બતાવ્યાથીજ તમને કયાં સંતોષ થાય છે ?

મહને છેતરવા માટેજ તમારો જન્મ થયો છે. વાર્ડ, અસ્થારે મને જવા ધો. મહને બહુ ઉતાવળ છે. ” જુલેખા કંટાળતી હોથ તેમ બોલી.

જુલેખાનાં ઉતાવળા પણ હાસ્યચુક્કા જવાખથી કાશું મંદ હાસ્ય કર્યું. તે બોલ્યો: “ જુલેખા આટલી બધી ઉતાવળ શી ? ”

“ અમારા એગમ સાહેખ આજે જળ વિહુરાથે જવાના હોવાથી નૌકા — ”

કેણું જાણે આ સાંભળીને કાળુને શું થયું કે તેના મહેંમાંથી “ઓહ ! ” એવા ઉદ્ગાર નીકળી પડ્યા. તેનાં આરિક ચક્કુ વિસ્તૃત થાઈ ગકાં. તેના બન્ને એછ પહોળા થયા અને નિત્યનિયમાનુસાર તેણે ગળામાંની માળા પોતાના જમણા હાથમાં લીધી.

“ શું કહે છે ? ” જુલેખાનો હોથ પકડીને કાળ બોલ્યા. “ તહારી એગમ અહુમા આજે રાગિએ રાજમહાલયની અહુર નીકળનાર છે ? ” એટદું બોલીને કાળ જુલેખા પ્રત્યે તાકી રહ્યો.

જુલેખાએ માની લીધું કે પોતાનો હોથ પકડીને પેટ ભરાય ત્યાં સુધી પોતાના સોન્હર્યનું પાન કરવાના હેતુથી જ કાળ પોતાની પ્રત્યે તાકી રહ્યો હતો; પરંતુ વખત ન હોવાથી તેણે તરતજ છલ્યકે કરીને પોતાનો હોથ કાળના હાથમાંથી છોડાવી લીધો. અને ત્યાંથી ચાલતી થઈ.

સિંહણુની માર્ક પોતાના હાથમાંથી છટકી ગયેલી જુલેખા પ્રત્યે દાખિ હૈંકતો. કાળ ક્ષણવાર સ્તંભિન થાઈ ગયો. અને જુલેખા દાખિથી ફૂર થાઈ ત્યાં સુધી તેની તરફ જોઈ રહ્યો. ત્યારપણી તે સ્વાગત બોલ્યો. “યાઅદલા ! આટલી લાંખી મુદતે પણ તેં મહારી પ્રાર્થના સાંભળી ખરી ! આજના જેવી સોનેરી તક કુરી કુરીને પ્રાપ્ત થવાની નથી. તહારી મહારા પ્રત્યે સંપૂર્ણ મહેરબાની જણ્યાય છે ! ”

ચાંદની શાંત અને પુરખહારમાં ખીલી હતી. સર્વાંગાની પ્રસરી જતાં યમુનાનો પ્રવાહુ પણ અતિ ગંભિર જથુતો હતો. વાયુ મંદ ગતિએ વાઈ રહ્યો હતો. આ સમયે યમુના નહીંમાં ‘ સરસર ’ કરતી એક નોકા જળમાર્ણ કાપતી આગળ ચંધતી હતી. આ નોકામાં એઠેલી પદ્મમા ચન્દ્રકા પ્રત્યે એકી-દર્શે જેઠ રહી હતી. અમુક દિશા તરફ નોકા લઈ જવાનો નિર્ણય તેણે અગાઉથી કરી રાજ્યો હોય એમ જથુતું નહોતું. કારણું ઘડીમાં તે અમુક આજ્ઞાએ નોકા હુંકારતી હતી તો બીજી જ ક્ષણે વળી પોતાની નોકાને જીવાજ માર્ગ હુંકારતી હતી. ગમે તેમ કરીને પોતાની નોકા જળતરંગ થર રામવાની જ પદ્મમાની ઈચ્છા હતી. પોતે કંઈ ખાનુ નોકાને લઈ જાય છે, રાજમહાલયથી પોતે કેટલી ફૂર આવી પહોંચી છે, વગેરે બાધત તરફ તેનું લક્ષ્ય જ નહોતું. થોડીવાર થયાં તેની નોકાથી થાડે ફૂર એક બીજી નોકા પાછળ પાછળ આવતી હતી, તેની પણ તેને ખખર પડી નહિ. ચન્દ્રકાનું સૌનંદર્ય જોવામાં પદ્મમા પોતાના દેહનું ભાન પણ વિસરી ગઈ હતી. પાછળની નોકા પોતાની નોકા પાસે આવી પહોંચી તો પણ તેનું ધ્યાન તે તરફ એંચાયું નહિ.

એકાએક પદ્મમાની નોકામાં કોઈ કુદી પડયું. પદ્મમા ચમકી; પરંતુ તે બૂમ પાડવા જાય તે પહેલાં જ પેલી વ્યક્તિએ તેના મહોંમાં હુચ્ચા દઈ એક પુણ્યની પેઢ તેણે પદ્મમાને ઉંચકી લીધી અને પોતાની નોકામાં લઈ જઈને તેને સૂવાડી હોરડાં વતી પદ્મમાનું શરીર બાંધી લઈને તે વ્યક્તિએ પોતાની નોકા જપાટાખંધ હુંકારાવી.

‘ આ શું થયું ? ’ એટલો પણ વિચાર પદ્મમા કરો શકે તેટલો સમય તેને મહ્યો નહોતો. માર્ગ બાંધી ક્ષણું પૂર્વે ચન્દ્રકાનું માધુર્ય જોવામાં લીન થયેલી પદ્મમા અત્યારે અન્યાની નોકામાં કેદ થયેલી પડી પડી હું પોછાર કાઢતી હતી અને પોતાને કેદ કરનાર કેણું છે, તેમ ભયભીત દૃષ્ટિ જોતી હતી.

ચન્દ્રિકાના પ્રકાશમાં પદમા પોતાને પકડનાર વ્યકૃતિને એવાળી શકી નહોતી. પરંતુ તેના મ્હેંપરની દાહી તેમજ તેના શરીરના બાંધા વગેરેતું જેમ જેમ પદમા બારિક રીતે નિરીક્ષણ કરતી ગઈ તેમ તેમ તે વ્યક્તિટ કાળ હોવાની તેની શંકા દ્વારા થતી ગઈ.

પદમાને કે નૈકામાં કેદ કરવામાં આવી હતી તે નૈકા ચ્યાવનાર વ્યક્તિ પોતાનું કાર્ય કરવામાં એટલી બધી લીન થઈ ગઈ હતી કે પદમા પોતાની ભારીક તપાસ ચ્યાવે છે કે કેમ, તેની તપાસ રાખવામાં તેને અવકાશ નહુંતો. નૈકા અપાઠાણંધ જળમાર્ગ કાપતી આગળ વધતી હતી.

પદમાએ આકાશ તરફ દ્વારા ફેંકી તો ચન્દ્ર હુવે અસ્ત્ર થવાની તૈયારીમાં હતો એમ જણાયું. અકબરને છેતરવા જતાં તેનું કેવું પરિણામ આંધું તે વિચારથી હુદ્ધય ભીજી થઈ ગયું. પોતે અદ્રશ્ય થવાથી ખાદ્યાહુને કેવું હુંઘ થશે, જનાનભાનાની છંતર એગમો પોતાને માટે કેવી અક્રવા ફેલાવશે, લોકો પોતાને માટે કેવી વાત કરશે, પોતાની હુવે કેવી હુર્દશા થશે, પોતાને આમ કેદ કરનાર મનુષ્ય કાળ જ હશે કે શું! અને જે તે કાળ હોય તો આવું નિંદ્ય કૃત્ય તેણે શા માટે કર્યું હશે, વગેરે વિચારે પદમાના અંતઃકરણમાં વીજળીની ઝડપે પસાર થવા લાગ્યા.

પદમાની વિચારમાળાના મણુકા આ પ્રમાણે ક્ર્યો કરતા હતા એવામાં નૈકા ઉભી રહી. તરતજ ચાર મનુષ્યોએ આવી તેને ઉંચકી લીધી ને પાલખીમાં એસાડવામાં આવી.

પદમાની પાલખી ઉંચકીને જનારાઓએ લગભગ અર્ધા પોણા, કલાક સુધી ચાલ્યા કર્યું. ‘હું સંભાળીને ચાલો; ધીમે ચાલો’ એવી એવી સૂચનાએ તેઓ એક ભીજને આપ્યા કરતા હતા. પાલખો ઘડી ઘડી ઉંચી નીચી થાતી હતી તે ઉપરથી પોતાને કોઈ અન્નાયા અને અવધદ માર્ગ લઈ જવામાં આવતી હતી એવી પદમાની ખાત્રી થઈ. એટલામાં પાલખી ઉચકનારાંએ ઉલા રદ્ધા અને પાલખીને નીચે મૂકવામાં આવી.

પદ્મમાને પાલખી બહાર કાઢવામાં આવી અને તરતજ તેની આંખોપર પાટો બાંધવામાં આવ્યો. ત્યારપણી તેને એક મનુષ્યે પોતાની ભાંધપર ઉંચકી લીધી અને તે ત્યાંથી ચાલતો થયો. પોતાને કયાં લઈ જવામાં આવતી હતી તે પદ્મમાથી સમજુ શકાયું નહિ.



પ્રકૃતાણુ દ હુ.

આમન્ત્રણનો સ્વીકાર.

ગાંધાર *બંદરના જૈન ઉપાશ્રયમાં જૈનચાર્ય હીરવિજય સૂરીજુ 'અહિસા' એ વિષય પર વ્યાખ્યાન આપી રહ્યા હતા. સવારનો વખત હોવાથી અને આચાર્યશ્રીની મધુરવાણી અને અપરિમિત જ્ઞાનથી મુખ્ય થઈને ખી પુરુષની મોટી ઠંડ જામી હતી છતાં વ્યાખ્યાનના રસમાં સૈં એકતાન થઈ જવાથી સર્વો ચુપકીદી પથરાઈ ગઈ હતી. અહું ગરીબ ધનવાળનો લોફ ન હોવાથી પાછળથી આવનારને આગળ આવવાનો વિવેક કરવાનો લોકાચાર આ ધર્મભંદિરમાં નહોતો. કોઈ પ્રકારનો કોલાહલ કે કૂતુહલને સ્થાને શાંતિનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આ પ્રસંગે બહાર ગામના પંદરક શ્રીમાનો આવીને સમુદ્દરની પાછળ આચાર્યશ્રીને વંદન કરીને ગોઢવાય ગયા. ઝાંખળનારાચો વ્યાખ્યાનશ્રવણમાં એટલા તદ્વિન થઈ ગયા હતા કે તેમને પાછળ કોણું આંદ્રે કે ગયું, તે જાણવાની કાળજી રહેતી નહોતી. જો કે આચાર્યશ્રીએ તે આવનારાચોને વંદન કરતાં જોયા હતા અને અમદાવાદના આગેવાનો તરીકે ઓળખ્યા હતા, પરંતુ તેમને દણિથી મિઠો ધર્મલાલ આપવા સિવાય તેઓ શ્રી પણ પોતાની ઉપહેશધારા અસ્પલીત ચલાવી રહ્યા. વ્યાખ્યાન

* આ બંદર ખંભાતના અખાત ઉપર ખંભાત નજીક છે. અત્યારે શહેરના સ્થાને ખંડીયરો ને અરણ્ય છે.

સમય પૂર્ણ થતાં શ્રોતાઓ આચાર્ય શ્રીને નમન કરી વીભરાઈ જવા ઉક્ખા અને તેમનું ધ્યાન અમદાવાદના આગેવાનો તરફ એંચાયું એટલે લાંના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું અને સૌ આચાર્ય શ્રી પાસે આવી સુખ શાતા પુછવા પછી તેમાંથી એક આગેવાને નમ્રતાથી શહેનશાહ અકખરનું કુરમાન સલા વચ્ચે વાંચી સંભળાયું અને વિશેપમાં જખુાયું કે શહેનશાહ અકખર આચાર્ય શ્રીનાં દર્શન કરવા માટે આતુર છે અને તેમની દુષ્ટ પૂર્ણ કરવાની આપને વિનંતી કરવા સાર્દ અમદાવાદના સુખા શાહબુદ્દિને અમને આપની તરફ મોકલ્યા છે. બાદશાહે પોતાના તરફથી કમાલ અને ગૌંઠી નામના મોકલેવા ફૂતો હાલ અમદાવાદમાં છે. તો તેમને શું ઉત્તર આપવો તે કુરમાવશો.

આ નવીન પ્રકરણ સંભળાને શ્રોતાજનો માંહેમાંહે તે સંખ્યાંથી તર્કવિતર્ક કરવા મંડી ગયા. આચાર્ય શ્રી સલાના ગૃહસ્થોનો અભિગ્રાય જાણુવાની ખાતર સલાજનો પ્રત્યે સહેતુક દાખિપાત કરી રહ્યા હતા. અદ્ય સમયમાંજ સલાજનોમાંનો એક ગૃહસ્થ ઉલો થયો અને ઐદ્યો: “નામદાર શહેનશાહ અકખર તરફથી આચાર્ય શ્રીને નિમન્ત્રણ કરવામાં આવ્યું છે એ વાત ખરી છે, પરંતુ તેમ કરવામાં તેનો શો હેતુ હશે; તે આપણે કણી શકતા નથી. બાધ્ય દાખિથી જેતાં અકખરશાહ હિન્દુ ધર્મનો પક્ષપાત કરતાં હોય એનો આપણને સામાન્ય લાસ થાય છે, પરંતુ વસ્તુતા: જોવા જતાં શહેનશાહ અકખર હિન્દુ ધર્મપ્રત્યેની પ્રીતિ તે હિન્દુ ધર્મના પાયાની ખીલી ઢીલી કરવા માટેજ છે એ વાત આપણે હિન્દુઓએ લૂલી જવાની નથી. આપણી હિન્દુ પ્રભામાં આપણો જૈન ધર્મ સર્વોત્કૃષ્ટ ગણી શકાય તેમ છે અને કદાચ શહેનશાહ અકખરની દાખિ તેને આધાત પહોંચાડવાની હોય એમ મુને જખ્યાય છે. તો મુહારા નમ્ર મત ગ્રાસાએ આદશાહનું નિમન્ત્રણ સ્વીકારીને આચાર્ય શ્રીને કુતેહુપુર સુધી જવાની કંદુજ આવશ્યકતા નથી.”

“ ભરાખર, સાચું બોલ્યા ! ” સભામાંથી પ્રતિધ્વનિ થયો.

“ પરંતુ આ બાબતમાં આચાર્યશ્રીનો પોતાનો અભિપ્રાય વધારે ઉપયોગી નિવહણો એવી મુહારી માન્યતા છે. ” એજા એક ગૃહસ્થે જણ્ણાંયું.

“ કોઈપણ રીતે એકપદ્ધિ દાખિથી જોવું એ સર્વથા હાનિકારક છે. ” અત્યાર સુધી મૌન રહેલા આચાર્યના પદ્ધશિષ્ય વિમલહર્ષે પોતાનો અભિપ્રાય વ્યકૃત કર્યો.

પોતાનો અભિપ્રાય જાણવા માટે સભા આતુર હતી એ જોઈને આચાર્યથી હીરવિજયસૂરીજીએ આમન્ત્રણ સ્વીકારવું કે તેમ તે સંબંધી પોતાના વિચારો જહેર કરવાનો નિશ્ચય પોતાના મનમાં કર્યો. તેમણે એકવાર આખી સભા પ્રત્યે દાખિ કરીને શાંતિથી બોલ્યા: “ દેવાનુભિય લાઇઓ ! શહેનશાહ અકખરનું આમન્ત્રણ સ્વીકારવું કે તેમ તે માટે શ્રીસંઘની એકમતીથી હું નિર્ણય કરીશ, પરંતુ આ વાતને ઉતાવળે ધકેલી નાંખવા જરૂર નથી. પ્રત્યેક બસ્તુને એ બાળુ હોય છે. માત્ર એકજ બાળુનું અવલોકન કોઈ પણ રીતે ઇષ્ટ નથી. કારણ કે તેમ કરવાથી કેટલીક વખત સાચાને પણ અન્યાય અપાય જાય છે. જેમ ઉજ્ઞતિ, અવનતિ, લરતી એટ, સુખ હુઃખ, ન્યાય અન્યાય વગેરેના યુદ્ધ છે તેમ શુણું અને અવગુણુનું પણ યુદ્ધ છે. માત્ર લોકવાયકા ઉપરથી અમુક માણુસના ચારિત્ર સંબંધી સંપૂર્ણ મત બાંધી લેવો અને તેના શુણવગુણુની પરીક્ષા કરવી નહિ; એથી તો તે અકિતને અન્યાય આપવા જેવું થાય. શહેનશાહ અકખર સંબંધી આપણે અનેક અદ્વાચો. અત્યારસુધીમાં સાંભળી છે. હિન્દુ ધર્મ પ્રત્યેની તેની મમતા હિન્દુ ધર્મનો નાશ કરવા માટેજ છે એવું પણ આપણે ધાર્ણી વાર સાંભળીએ છીએ, પરંતુ માર્દ માનવું એવું છે કે અકખર ધર્મજીજાસુ છે. પ્રત્યેક ધર્મની ચિકિત્સા કરવાની તેને ટેવ છે તેમ મને લાગે છે. તેમકે મુહારા સાંભળવા પ્રમાણે ખુદ ઈસ્લામી ધર્મ ઉપર પણ તે અંધશ્રદ્ધ રાખતો નથી. પ્રત્યેક ધર્મતત્વોમાં છુપાય રહેલું

સત્ય શોધી કાઢવાની અકખરને ટેવ હોવાનું ખુદ દીસ્લામીએ। પણ કહે છે. તે જેતાં શાનશાહ જત્યનો પિપાસુ હોય તો આપણા ધર્મની ચિકિત્સા કરવાની તેની પ્રવૃત્તિથી આપણું ગભરાવાનું કારણ નથી. મહારી માન્યતા એવી છે કે આવા સમયે અકખર પ્રત્યે દ્રેષ લાવના નહી કરતાં પ્રત્યેક ધર્મના ધર્મગુરુઓએ અકખરને પોતાના ધર્મતત્વો સમજવવાનો યત્ન કરવાની જરૂર છે અને તેમ થવાથી તે પ્રત્યેક ધર્મનું સત્ય સ્વરૂપ રહુમજતાં શીખશે. આ પ્રમાણે જ્યારે તેણે પોતેજ મહુને મળવાનું આમંત્રણ કર્યું છે, ત્યારે હુવે તેનો મેળાપ કરીને જૈન ધર્મનાં તત્ત્વોનું રહુસ્ય તેને સમજવવું તે મને હીક લાગે છે. ગમે તેમ તોપણું અકખર ભારત વર્ષનો શહેનશાહ છે. વળી તે કુચ્છંદી, અવિચારી કે બ્યાલિચારી નથી, પરંતુ દીર્ઘ દિનિ-વાળો, શાણો. અને ઉદ્ધાર છે. જૈન ધર્મનાં તત્ત્વોનું રહુસ્ય તેને સમજવવાથી આપણા ધર્મપ્રચારને અવસ્થય કંદ્ધ પૃષ્ઠ તેના તરફથી મળશે તેમ મને લાસ થાય છે. ”

આચાર્યશ્રીના આ વિચારથી હાજર રહેલ સંધ સમુદ્દર આશ્રમાં ગરકાવ થઈ ગયો. કેટલાક ગૃહસ્થો એક પીળના કાન ઐતરવા લાગ્યા. આચાર્યશ્રી નિમન્ત્રણું સ્વીકારવાની તરફેણુંમાં પોતાનો મત દર્શાવશે એવી તેમને કર્યાપના સુદ્ધાં નહોતી. આચાર્યશ્રી સભાજનો પ્રત્યે નિરીક્ષણું કરવા એડા હતા. પ્રથમ જે થોડા ધણું સભાજનો અકખરનું નિમન્ત્રણું સ્વીકારવાની વિરુદ્ધમાં હતા તેમના હૃદય પર પણ આચાર્યશ્રીના શફ્ફોની સર્વોચ્ચ અસર થઈ હોય તેમ તેમણે જોઈ લીધું, એટલે પછી આગળ ચલાવ્યું. “ જો મારું કહેલું સકળ શંધને હીક લાગતું હોય તો અમદાવાદથી આવેલા શંધના આગેવાનેને આપણે જણાવવું જોઈએ કે તેમણે અમદાવાદના સુખાને જઈને કહેવું કે યતિ હીરવિજયે અકખરશાહનું નિમન્ત્રણું સ્વીકાર્યું છે અને અદ્ય સમયમાંજ અત્રેથી ઝૂતેહપુર જગ્યા માટે વિહાર કરશે ત્યારે તમને અમદાવાદ મુકામે ખણ્ણો. ”

સભાજનોએ વગર ફ્લીલે આ વાતને જીલી લીધી અને

અમહાવાહના આગેવાનો આ નિર્ણયથી આનંદ દર્શાવતા સૌ વિદ્યાય થયા.



પ્રકરણ ૭ મું.

ધતિ હૃતિવિજયસૂરિ.

મારવાડમાં શ્રીમાલનગર એવું ધનાઢ્ય અને આખાદ શહેર હતું કે જ્યાં કોડસમૃદ્ધિ ધરાવનારજ નિવાસ કરી શકતો. પ્રત્યેક કેટિથેવજ પોતાના ગૃહમંહિર પર એક ધ્વજ રાખતો હતો. આ નગરમાં કેટલાક સમય પૂર્વે એહાહડ અને રોહડ નામના એ લાઈઓ રહેતા હતા. બજે કેટિથેવજ હતા; પરંતુ સમય જતાં એહાહડ પાસે નવાળુલાખ ડ્રાપિયા રહ્યા. હવે તેના મનમાં ચિન્તા થવા લાગી કે નગર છોડીને બહાર રહેવા જવું પડશે અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચશે. આથી તેણે પોતાના મનમાં એવો નિશ્ચય કર્યો કે પોતાના ખાઈ રોહડ પાસેથી એક લાખ ડ્રાપિયા ઉઠીના તરીકે લઈ આવીને પણ પોતાની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવું. આ ઉપરથી એહાહડ પોતાના લાઈ રોહડ પાસે ગયો અને તેને જણુણું કે જે તે તેને એક લાખ ડ્રાપિયા ઉઠીના આપે તો પોતાની પ્રતિષ્ઠા સચ્યવાય અને તેની સાથે નગરમાં પણ રહી શકાય. પરંતુ રોહડે એહાહડની માગણીનો અન્વીકાર કર્યો અને તેને જણુણું કે જે તે નગરમાં નહિ રહે તો શ્રીમાલનગર કંઈ પડી ભાંગવાનું નહોતું. પોતાના બંધુનાં આવા અપમાનકારક અને તિરસ્કારસૂચક શાદો સાંભળીને એહાહડને બહુ માહું લાગ્યું. તે નિરાશ વહને પોતાની હુકાને પાછો કર્યો અને હતાશ હુદયે પોતાની વર્તમાન સ્થિતિ બદલ ચિન્તા કરવા લાગ્યો.

વાત એમ અની કે જ્યારે એહાહડની આવી સ્થિતિ થઈ તેજ ક્ષણે શ્રીમાલનગરમાં પણ એક જણુવાળોગ અનાવ બની

રહ્યો હતો. તે નગરના રાજકુમારે પોતાના પિતા તરફથી દર મહિને ભળતી રકમ એછી પડવાથી પોતાને વધારે જમીન આપાવવા બદલ મંત્રી માર્ક્ઝિત પોતાના પિતાને વિનંતી કરી. મંત્રીએ રાજકુમારની માગણી પૂર્ણ કરવા માટે રાજને ધાણ ધાણ સમબાળયો, પરંતુ રાજ એકનો એ થયો નહિ. તેણે પ્રધાનને કહ્યું કે, ‘જે પુત્ર પોતાના પિતાની કમાઈમાંથીજ પોતાનો ઉદર નિર્વાહ ચલાવે છે તે સર્વદા ટાકું આનારો અર્થાત् નિર્ભળ ગણ્યાય છે.’ પિતાનાં આવાં વચ્ચેનો સાંભળીને રાજકુમારને ચાનક ચડી ને તેણે પોતાનાં પિતાના રાજ્યની હુદનો ત્યાગ કરીને ભૂજ બળથી ભાગ્ય પરીક્ષા કરવાને પોતાના મનમાં દુદ નિશ્ચય કર્યો. તુર્તજ તેણે પોતાનાં અંગપરનાં કપડાં બદલી નાંખ્યા અને શ્યામલણ્ણ પોષાક પહેરીને રાજમહાલય છોડીને ચાહ્યો જવા લાગ્યો.

આ રાજકુમાર અને એઓહડની વચ્ચે મૈત્રીનો સંબંધ હતો. તેણે જતાં જતાં પોતાના ભિત્ર એઓહડને ભળવાનો નિશ્ચય કર્યો તરતજ તે એઓહડની હુકાન તરફ વધ્યો. આ પ્રસંગે ઉપર જણ્ણાંયું તેમ એઓહડ પણ ચિન્તામન સ્થિતિમાં હુકાનમાં એઠો હતો. રાજકુમારને આમ અચાનક પોતાની હુકાને આવતા જોઈને એઓહડને આક્ર્યુ થયું તેમાં પણ તેના અંગપરનાં શ્યામ વસ્તો જોઈની તેણે ઉઠીને આવકાર અપતાં પૂર્ણ ! — “આજે આવાં શ્યામ વસ્તુ પહેરીને કયાં જવા નિકળ્યા છે ? ” “ભૂજબળથી ભાગ્ય પરીક્ષા કરીને હુવે આપ કમાઈ ગાતાં શીખવું છે. પિતાના રાજ્યની હુદ આજથી સહાને માટે તજ જવાનો મહેં દુદ નિશ્ચય કર્યો છે.” રાજકુમારે કહ્યું.

દુખીઆને દુખીઆ ભળતાં હુઃખ એઓછું થતું નથી, પરંતુ દિલાસો તો મળે છેજ. એઓહડની છચ્છા પણ હુવે શ્રીમાલનગરમાં રહેવાની નહોંતી, તેણે રાજકુમારની સાથે શ્રીમાલનગરનો ત્યાગ કરી જવાનો નિશ્ચય કર્યો. અને રાજકુમારને પોતાની છચ્છા જણ્ણાવી. રાજકુમારે તેના વિચાર મર્યે સંમતિ

દર્શાવી. એટલે બન્ને જણા તરતજ ચોઅય વ્યવસ્થા કરીને ત્યાંથી નીકળી પડ્યા.

રાજકુમાર અને ઓહડ શ્રીમાલનગરથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું ને છુટતાં છુટતાં આહલાદ ભૂમિ જોઈ ત્યાં ‘ઉઅસ’ નામનું નગર વસાયું અને સાજકુમારે પોતાનું ઉદ્યસિંહ નામ ધારણ કર્યું. ઓહડ ઉદ્યસિંહના મંત્રી તરીકે કામ કરવા લાગ્યો.

સુખ, હુઃખ, ભરતી ઓટ, રાત્રિ દિવસ, ઉભતિ અવનતિ એ બધાં કંઈ ચિરસ્થાધ નથી. ચક્રવત્ત પરિવર્તનને સુખાનિ ચ દુઃખાનિ ચ ॥ ચક્ની પેડે તેઓ બધાં ક્ર્યા કરે છે. નિરાશાની હંડી ખીણુમાં પડેલો મનુષ્ય એક વખત આકાશના સર્વોચ્ચ શિખરે ચઢવાને લાગ્યશાળી થાય છે, અને તેજ મનુષ્ય પુનઃ પાછો તેજ ખીણુમાં પટકાઈ પડે છે. એવું વિધિનું વ્યપક રહુસ્ય છે. અદ્યપણુંદી મનુષ્ય તે રહુસ્ય કળી શકવા માટે સર્વથા અશક્ત છે.

ઉદ્યસિંહ અને ઓહડ પોતાનો કાળ આનંદમાં વ્યતીત કરતા હતા. ઓહડને ઘેર એક ગાય હતી. તે ગાયને દોહલાથી ફૂધ નીકળતું નહોતું; અને તે જ્યારે જંગલમાં ચારે ચરવા જતી ત્યારે તેના આંચળમાંથી ફૂધ જરી જતું. આ અખર સાંલળી એક દિવસ ઉધાકળે ઓહડ ત્યાં ગાય પાછળ જઈ આ આશ્ર્યકારક ઘટના જોઈને જ્યાં ફૂધ અરી જતું હતું તે જગ્યા ઓહાવી નાંખી. તો ત્યાંથી શ્રી જિન પાર્વિનાથજીના પ્રતિ-માળ મળી આંદ્રાં. તે જોઈ તેના આશ્ર્યનો અવધિ થયો.

તેણે તુર્ટ મહારાજ ઉદ્યસિંહની સંમતિ લઈને ત્યાંજ એક જિનપ્રાસાદ બંધાવી તેમાં સ્થાપના કરી અને તે સ્થળે નવું શહેર વસાયું. અને ઉધાકળની શુલ પ્રાપ્તિના સમરણમાં ઓશ વંશની સ્થાપના કરી. ઓહડ પોતે આરડકમણું ઓશવાળ તરીકે પ્રક્ષિદ્ધિમાં આવ્યો, તેમજ ત્યાં ઉધાદેવીની સ્થાપના કરી શહેરનું નામ ઓશીયા પાડ્યું. આ ઓશવાળ

વશના પ્રથમ રાજની બેંતાલીશામી પેઢીએ શ્રી હીરવિજય સૂરિનો જન્મ થયો.

હીરના પિતાનું નામ કુંઅરો હતું અને તેની માતાનું નામ નાથી હતું. તેઓ પાટણુપૂરમાં વસતા હતા. તેમને અનુકૂમે ત્રણુ પુત્ર અને ત્રણુ પુત્રીએ પછી સંવત ૧૫૮૮ ના આગશ્રિષ્ટ સુહિ દને સોમવારે તેણે એક પુત્રને જન્મ આપ્યો. કે જે આપણી નવલકથાના આદર્શ થતિ હીરવિજય સૂરિલુ તરીકે પ્રસિદ્ધ થયા.

બાળ્યાવસ્થાથીજ હીરમાં જુદાજ પ્રકારનું ચૈતન્ય હતું. પાંચ વર્ષની વયે હીરના માતપિતાએ તેને વિદ્યાખ્યાસ કરાવવા માંડ્યો. નિશાળેથી લણીને ઉક્ખા પછી હીરને ઉચ્ચ શિક્ષણ આપવાના ઉહેશથી, તેના માતપિતાએ તેને એક મુનિ પાસે મૂક્યો. ફૂધ અને તેમાં વળી સાકર લણી. હીર મુદ્દિશાળી તો હતોજ અને તેમાં વળી તેને મુનિ સત્તસંગનો લાલ મળવા લાગ્યો. મુનિ સાથે રહીને, હીર, પોનાની બાર વર્ષની ઉમરમાં નવતર્તવ, જીવવિચાર, ઉપદેશ માગા, મંધ્યણી, ચોણ્ય શાસ્ત્ર, આરાધના દરશનસીતેરી એ સર્વ શીખ્યા. અને ત્યારથી હીરનું વલણ વૈરાગ્ય તરફ બેંચાવા લાગ્યું.

સમયના વહુનની સાથે હીરના માતપિતાં પરલોકવાની થઈ ગયાં. આ અખર પાટણુમાં મગતાં વિમળા અને રાણી નામની હીરની બન્ને બણેનો પાટણુપર આવી અને હીરને પાટણ તેડી ગઈ.

પાટણ ગયા પછી હીરને એક મહાન લાલ થયો. ત્યાં જૈનાચાર્ય વીજયદાન સૂરિ સાથે તેનો સમાગમ થયો અને તેમની દ્વારા તેણે ઉચ્ચ શિક્ષણ સંપાદન કર્યું.

વીજયદાનસૂરિના મુમાગમથી હીરની વૈરાગ્યવૃત્તિ વધારે ૬૬ થવા લાગી. અંતે તેણે દિક્ષા લેવાનો વિચાર કરી ચોતાની બણેનોને આ વાત જણાવી, ત્યારે તેના નેત્ર મુગલમાંથી અશ્વાગુણ બણેવા માંડ્યો. તેણે કહ્યું: “ આઈ હીક્ષા લેવી જે

કંઈ નહાની સુની વૃત્તનથી. કેશ લોચન કરવવા, અણુવાણું પગે ચાલવું, ચોમાસામાં એકજ સ્થળે રહેવું, માયા ત્વાજ દેવી, કામ, કોધ, મહ, મોહ, લોકાદિ પંચશત્રુઓ પર વિજય મેળવવો, ઘેર ઘેર લિક્ષા માળીને આવું, એ બધું તહારાથી કેમ થશે ? ” ત્યારે હીરે કહ્યું કે:—“ આ અસાર સંસારમાં સંયમ જેવું કંઈજ સુખ નથી. મહાન તપનું ક્રૂણ મનુષ્યાવતાર છે અને તે ક્રારાજ મોક્ષની સાક્ષ્યતા થઈ શકે છે, તેમજ પ્રાણી માત્રનું ક્રદ્યાણું કરવાની સોનેરી તક પણું મનુષ્યાવતારમાં મળી શકે છે તો તે હુથ આવેલી તકનો સહુપથોગ કરવાની રહારી દદ ધિચા છે.”

ત્યારપણી લાઇ ભગિની વચ્ચે ધણો વાદવિવાદ ચાલ્યો. અને હીરે પોતાની ભગિનીના મનતું સમાધાન કર્યું; ત્યારે તેણે તેને દીક્ષા દેવાની રાજુ ખુશીથી રજા આપી. હીરે સંવત् ૧૫૮૬ ના કાર્તિક વદ ૨ ને સોમવારે પાટણુમાં જ દીક્ષા દીધી.

ત્યારપણી હીરે પોતાના ગુરુ વિજયદાનસૂરિ સાથે પ્રવાસ આહેરો. જેમ જેમ તેનો પરિચય ગુરુ સાથે વધતો ગયો, તેમ તેમ ગુરુની ખાત્રી થતી ગાઈ કે હીરને જે પૂરું શિક્ષણ મળે તો તે લવિષ્યમાં શાસન હીપાવશે, તેથી તેમણે હીરને દક્ષિણુમાં ન્યાયશાસ્નનો અભ્યાસ કરવા સારુ જવાની આજા આપી. શ્રી ધૂર્મસાગરજી અને શ્રી રાજમલ એ બન્નેને સાથે લઈને ગુરુ આજા પ્રમાણે હીર *હેવગિરિમાં ગયા અને ચિત્તામણી વગેરે ન્યાયશાસ્નમાં અતિ કઠિન બંધેનો અભ્યાસ કર્યો. આ વખતે હેવગિરિનો હાકેમ નિબલમશાહુ હુતો. ઉપ-

* વર્તમાન સમયમાં ‘ન્યાયશાસ્ન’ માટે જેમ બંગાલ કેન્દ્રસ્થાન છે અને ‘વાકરણુ’ માટે કાશી ગણ્યાય છે તેમ તે વખતે નૈયાયિકાની પ્રધાનતા દક્ષિણ દેશમાં વધારે પ્રમાણુમાં હતી, હીરવિજયસૂરિજીને હેવગિરિમાં, ન્યાયશાસ્નનો અભ્યાસ કરવા માટે તેમના ગુરુઓ મોકલ્યા તેનું કારણું પણ તેજ હતું.

લેખક.

યુક્તા ગણે મુનિઓને વિધાલ્યાસ માટે જે કંઈ ખર્ચ થતું તો ત્યાંના રહીશ દેવશી શાહ અને તેની ખી જસમાઇએ પુરું પાડ્યું હતું.

હીર વિધાલ્યાસ કરી આવ્યા પછી જેમ જેમ તેની ચોભતા બધવા લાગી તેમ વિજ્યદાન સૂરિલુએ તેમને 'પંડિત પદ' 'ઉપાધ્યાય પદ' વગેરે પહોંચોથી વિભૂષિત કર્યા હતા. ત્યારપછી સં. ૧૯૧૦ ના પોષ શુદ્ધ પના દિવસે શીરોહીમાં તેમને સૂરિપદ (આચાર્યપદ) આપ્યું હતું અને ત્યારથી તેઓ હીરવિજ્યસૂરિલુ કહેવાયા.

ઉપર અમે જણ્ણાવી ગયા તે પ્રમાણે આચાર્યપદ પ્રાપ્ત થયા પછી બાર વર્ષે એટલે સં. ૧૯૨૨ ના વૈશાખ સુદ્ધિ ૧૨ ના દિવસે હીરવિજ્યસૂરિના શુરૂ શ્રીવિજ્યદાનસૂરિનો વડા-વલી મુકામે સ્વર્ગવાસ થયો એટલે સંઘનો સંઘળો બાર સૂરિ-જીના શિર પર આવી પડ્યો.

વિક્રમની સોણમી શતાધિનો સમય આખા ભારતમાં અને આસ કરીને ગુજરાતમાં તો લગભગ અરાજકતા જેવોજ હતો. પરિષુમે પ્રાન્ત સૂખાએ પ્રબન્ન રંભડવા કે હેરાન કરવામાં કંઈજ કચાશ રાખતા નહોતા. ગુનેહુગાર કે જિન ગુનેહુગારની તપાસ કર્યા વગર કોઈ જઈને કાન ભંસેરતું તો અટ વોરંટો કાઢતા અને તેમને પછી તે સાધુ હોય કે ગૃહસ્થ તો પણ કષ આપવું એજ પોતાની હક્કમતતું ચિહ્નન સમજતા હતા. આથી સારા સારા સાધુએને પણ કોઈ કોઈ વખતે આપત્તિએમાંથી પસાર થવું પડતું હતું.

આપણી નવલકથાના નાયક આચાર્ય હીરવિજ્યસૂરિલુને પણ તે સમયની નાહિરશાહીને લીધે કેટલુંક સહન કરવું પડ્યું હતું. આ સંબંધમાં તેમના પ્રાથમિક જીવનનો વધારે નહી તો એકાદ પ્રસંગ પણ આ સ્થળે આપવાનું અમે ઉચિત ધારીએ છીએ.

વિ. સં. ૧૬૩૦ (ઈ. સ. ૧૫૭૪) માં જ્યારે સૂરિલુ

ગ્રારસદમાં હતા, ત્યારે કુર્ણાઋબિના ચેતા જગમાલઋબિને
તેમની પાસે એવી ઝરીઆદ કરી કે ‘ મહારા શુરૂ મહને પોથી
આપતા નથી તો તે અપાવો. ’ સૂરિલુણે કહ્યું. “ ત્હારામાં
લાયકાત નહિ હોય તેથી તે ત્હને પોથી નહિ આપતા હોય. તે
માટે તકરાર કરવાથી શો ક્રાયહો ? ” આ પ્રમાણે સહમન્જવવા
છતાં પણ જ્યારે તે નજ સમજ્યો ત્યારે તેને ગંધ બહાન
કરવામાં આવ્યો. જગમાલ પોતાના શિષ્ય લહુઆઋબિને
લઈને પેટલાદના હાકેમ પાસે ગયો. અને ત્યાં જઈને કેટલીક
ભનાવઠી વાતો કહી. હાકેમ ચિડાયો. અને તેને સૂરિલુણે પકડી
લાવવા માટે કેટલાક સિપાઠિઓ. જગમાલની સાથે મોકલ્યા.
જેમને લઈને તે ઓરસદ આવ્યો. પરંતુ કાર્યસિદ્ધ નજ થધ.
અર્થાતું સૂરિલુણે તો ત્યાં હતાજ નહિ. પરંતુ જ્યારે ત્યાંના
શ્રાવકોને આ બાખતની ખખર પડી ત્યારે તેમણે તે સિપાઠ-
ઓને દામ નીતિથી સમજાવ્યા એટલે તેઓ ઝરી એઠા ને જગ-
માલને મનમૂકીને તેમણે સહાય આપી નહિ. પોતાના સહાયકો
ખૂટવાંથી જગમાલનું કંઈ ચાલ્યું નહિ. તેને નિરાશા મળી.
સૂરિલુણ ત્યારપણી ખંભાત ગયા અને ત્યાં પ્રગટપણે વિહાર
કરવા લાગ્યા.

આવા આવા અનેક ઉપદ્રવો આચાર્યશ્રી હીરવિજયસૂરિ-
લુણે અનુભવ્યા હતા. છતાં પણ તે કશાની લેશમાત્ર પણ પરવા
નહિ કરતાં તેઓ પોતાનું ઉપદેશ આપવાનું કર્તાબ્ય અગાઉં કરતા
નહેતા. તેઓ સર્વત્ર ઉપદેશ આપતા અટન કરતા હતા. સં.
૧૬૩૭ માં સૂરિલુણ ખંભાતમાં આવ્યા હતા અને ત્યાં ચોમાસું
રહ્યા હતા. અહિંના સંધવી ઉદ્ઘાટણે સં. ૧૬૩૮ માં શ્રી
અંદ્રપ્રલુણી પ્રતિષ્ઠા પણ સૂરિલુણા હાથેજ કરાવી હતી. અ-
હિથી સૂરિલુણ ગંધાર ગયા હતા, જ્યાંથી તેમનો પ્રવાસ ઝોડ-
પુરનો નિશ્ચિત થયો હતો તે અગાઉ જોવાઈ ગયું છે.



મ્રકુરણુ ચ મું.

પરોપકાર કે આત્મસ્વાર્થ ?

અમરસિંહ અને ગ્રણુ રાજપુત સ્વારે અમરસિંહના ઘેર આવી પહોંચ્યા ત્યાંસુધી ગુપચુપ ચાલ્યા કર્યું; પૃથ્વીસિંહના ભિત્રો માત્ર માર્ગમાં આપસ આપસમાં ધીમે સ્વરે વાતચીત કરતા હતા. માર્ગમાં ચાલતાં ચાલતાં પૃથ્વીસિંહ અમરસિંહને પોતાના ભિત્રોના નામ માનસિંહ અને ધીરખલ હતાં એમ જણાવ્યું હતું.

અમરસિંહનું ધર એક જીના પડી ગયેલા ખંડીઓરમાં હતું. પોતાના ગૃહના દ્વાર પાસે આવી પહોંચ્યા પછી અમરસિંહજી પૃથ્વીસિંહને ઉદેશીને બોલ્યો: “ પૃથ્વીસિંહ ! મુારા ગૃહની અંદર પ્રવેશ કરતાં પહેલાં હજી એકવાર વિચાર કરો. અમરસિંહ અકળની વિરુદ્ધ ચળવણ કરનારે રાજપૂત હોવાથી તેના ગૃહમાં પ્રવેશ કરવો એ કંઈ રમત નથી. જો કે હું અંતકરણથી રાજદ્રોહી નથી, પરંતુ રાજપૂતોના કલ્યાણાર્થી મુારા તરફથી થતા પ્રયત્નોને રાજદ્રોહનું સ્વરૂપ અપાય એવો સંભવ છે. અને તેથી મુને સહાય કરતાં પૂર્વે તમારે અને તમારા ભિત્રોને માટે હજી પણ એક વખત વિચાર કરી લેવાની જરૂર છે. જ્યાંસુધી મુારા ગૃહમાં તમે પ્રવેશ કર્યો નથી, ત્યાંસુધી અહીંથી પલાયન કરી જવાનો રહ્યો તમારા માટે ખુલ્લો છે. એકવાર મુારી મદદે આંદ્યા પછી ઊંઢગીલર મુને એક સરખી રીતે તમારે મદદ કરવાના સોણન લેવા પડ્યો. પાછળથી પશ્ચાત્તાપ કરીને હતાશ હુદયે મુને સહાય કરવા કરતાં અત્યારે મુારાથી ફર રહેશો તે હું વધારે પસંદ કરીશ.”

“ પરંતુ અમારા નિશ્ચય માટે શાંકા લાવવાનું કંઈ પ્રયોજન નથી. તમારા જેવા પરોપકારી પુરુષના નિવાસ સ્થાનમાં

ग्रवेश करीने पावन थवा अमो उत्सुक छीये.” एटलुं घोलीने पूर्वीसिंहे हास्य कर्णे. अमरसिंहनी शंका फूर थतां ते त्रणे राजपूत स्वारोने लडने पोताना गृहमां दाखल थये.

ऐक जुना पडी गयेला धर पासे पहेंच्या पछी अमरसिंह दादर चढवा लाग्ये. दादर अब्जाण्ये. अने उंच्या डोवाथी त्रणे राजपूत स्वारो धीरेथी उपर चढता हुता. दादरमां केटलाये पगथीआं चढवा छतां हुलु पगथीआंनो अंत आवतो नहि डोवाथी भीरखल अमरसिंह प्रत्ये मनमां क्यवातो हुतो. एटलामां ऐक पगथीयुं युकी जवाथी पूर्वीसिंहनो पग भरडाये. एटले ते पणु अस्वस्थ थये. ने अमरसिंह तरळ कोध करतां पुनः उपर चढवा लाग्ये. अळप सभयमांज तेओ खधा उपर गया. त्यां ऐक ओरडी तेमना जेवामां आवी. ओरडीमांना दीपकनो प्रकाश मंद हुतो. सर्व ते ओरडीमां दाखल थया.

आ ओरडीमां लगाभग दश पंदर राजपूतो घेठा हुता अने तेओानी आसपास ऐ त्रणु हुकडा पडया हुता. अमरसिंहने आवी पहेंचेलो जेईने तेओअे तेने प्रणाम कर्यां; आ उपरथी तेओ आगली भोडी रात्रि सुधी अमरसिंहनी राहु जेतां घेठा हुशो, ऐवुं अनुमान पूर्वीसिंहे पोताना मनमां कर्णे. ते ओरडाना पाढणना लागमांनी बारी पासे ऐक स्त्री घेठी हुती. ते भात्र पोतानी जग्याअे स्वस्थ घेसी रही. तेणु पोतानुं भें बारी भाषी रागेकुं डोवाथी ते तळणु हुती के वृद्ध हुती, वा सुंदर हुती के कुडपा हुती, ते कंध कणी शकाय तेम नहेतुं. तेनां अंग इरतुं ऐक वस्त्र विंटागेलुं डोवाथी तेना शरीरनां अवयव सुद्धां जेई शकातां नहेतां, भात्र तेनी डोकनो तेमज कोण्ठीनो विलाग जेई शकातो हुतो.

लोलथी लालने भाटे ज्ञवने जे ज्ञतो करे, द्रव्य लोगववानी ते आशा शी रीतथी करे.

પૂઢીસિંહ આ ખીને જોઈને ચમક્યો. તેણે ચોતાના ભિત્ર બીરખલના કાનમાં ધીમે સ્વરે કહ્યું: “ આ તો ખી લાગે છે જોઈએ છીએ શું નાટક ભજવાય છે ! ”

બીરખલનું મન અહિં આવવાથી ઉદ્વિગ્ન થયું હતું. તેણે પૂઢીસિંહને કંધપણું પ્રત્યુત્તર નહિ આપતાં એકવાર ચ્યામેર દિશિપાત કર્યો અને ઓરડીમાં કોણું કોણું બોઠા હતા, તે જોઈ લેવાનો યત્ન કર્યો. અમરસિંહનું લક્ષ્ય તેના તરફ મુદ્દલ નહોતું. તે પોતાના સંઘળા ભિત્રોને ઉદેશીને બોલ્યો: “ ભિત્રો ! પુશ્ચર કૃપાથી આજે આપણું ત્રણ નવા સહાયકો મળ્યા છે. પાપ-પુષ્યનો ચોઅય બદલો પુશ્ચર તેમને આપશો, એમ માનીને આજે આપણે તેમને આપણી મંડળીમાં શામિલ કરીએ ! ”

એક વૃદ્ધ, પરંતુ ભવ્ય આકૃતિવાળો પ્રતાપી રાજપૂત બોલ્યો: “ આપણું મદ્દ કરનાર પ્રત્યેક રાજપૂત આપણુંને પ્રિય છે; પરંતુ અમરસિંહજી ! આ ત્રણ નવા ભિત્રો કોણું છે તેની સવિસ્તર હુકીકત અમારે પ્રથમ બાણુવીજ જોઈએ. ”

“ બરોબર છે. ” અમરસિંહ બોલ્યો: “ કાકા, તમે તમની બારીક તપાસ કરો. ”

“ શું અમારી તપાસ ! ” બીરખલના મહોંગાંથી ઉદ્વાર નીકળી પડ્યા.

“ કેમ શું થયુ ? ” અમરસિંહ બીરખલ તરફ વળીને બોલ્યો: “ તમે ભય કેમ પામો છો ? ”

“ છટ, છટ, લીતિ શાની ? ” બીરખલ બોલવા લાગ્યો; “ પરંતુ ભિત્રો ! અમને પૂછવાથી તમને શી માહિતી મળવાની છે ? અમે વન વન લાટકનારા છીએ. અમે તમને શું કહી શકવાના હતા ? ”

“ એકાન્તવાસમાં રહેનારા મનુષ્યો તો ધણી વાર ઉત્તમ ગોધ આપી શકે છે. ” પેદો વૃદ્ધ રાજપૂત વર્ચ્યે બોલ્યો.

“ એ વાત પણ અર્દી. ” બીરખલ ગંભીર સ્વરે બોલવા લાગ્યો: “ વનમાં રખડી રખડીને મુહારા માથાના વાળ ધોળા

થઈ ગયા છે; પરંતુ જે પ્રમાણે કાચબો પોતાનાં બધાં અંગો સંકેલી લે છે, તે પ્રમાણે મુહારા ચિત્રવિચિત્ર અનુભવો લોકોને જે કે બિજી લિન્ન રંગના લાસે છે; તો પણ મુહારી આંખોથી મુને તે બધા એકજ રંગના લાસે છે. મુહારા અનુભવો રાય અને રંકની પાસે એક સરખાજ દર્શિત થાય છે. પરંતુ રાણ પાસે ખાસ કરીને જે ટલું બધારે જુહું બોલાય તે ટલું ફૂયદા કારક છે. સાચું બોલનારને આ જગતમાં જૂતિઆનો માર મળે છે. જોટા હિંદુ થઈને રાણ પાસે હિંદુત્વની બડાઈ હુંકી એટલે તમે અકબરના દરખારના બીરખલ થઈ ચુક્યા. ” એ ટલું બોલીને બીરખલ સર્વ પ્રત્યે જેવા લાગ્યો. તેનું બોલવું બધાને પસંદ પડ્યું. પેલી જીવે પણ જરા ઝરીને પૃથ્વીસિંહ પ્રત્યે દિલ્લિપાત કર્યો. પૃથ્વીસિંહે સહજ સ્વિમત કર્યું અને જોંખારો આપ્યો. બીરખલે પણ સહજ સ્વિમત કર્યું.

“ હું, પણ તમારું નામ શું ? ” પેલા વૃદ્ધ રાજપૂતે પૃથ્વીસિંહને પુનઃ પ્રશ્ન કર્યો.

“ પૃથ્વીસિંહ, માનસિંહ અને બીરખલ. ” પૃથ્વીસિંહે ઉત્તર આપ્યો.

“ સભુર કરો ! કાકા ! ” અમરસિંહ વચ્ચે જ બોલી ઉઠ્યો. “ આ આપણા નવા મિત્રોને આપણા નિલ્યના પ્રેરનો પૂછવાની આવશ્યકતા નથી. અદ્ય સમયમાં જ પૃથ્વીસિંહે અમારા ઉપર અનહૃદ ઉપકારો કરી દીધા છે. તેના ઉદાર હૃદય બદલ મુહારા મનમાં કદિ પણ આશાંકા ઉદ્દલવશેજ નહિ. આપણા આ મિત્રોને આપણે પ્રેરનો પૂછી લીધા, હવે તેમની પાસે શપથ લેવડાવોએ એટલે તેઓ આપણા સાચા મિત્રો થઈ ચુક્યા; પરંતુ તેમની પાસે શપથ લેવડાવતાં પહેલાં આપણા કાર્યની શ્રાડી ધણી કદ્દમના તેમને આપી દઈએ તો ઢીક. ”

“ પરંતુ અમરસિંહજ ! ” પૃથ્વીસિંહ વચ્ચે બોલી ઉઠ્યો. “ ધારો કે તમારા કાર્યસંબંધી માહિતી મેળવા પછી

આને તમારી મંદળીમાં શામિલ થવાનો અમારો નિશ્ચય ફેરફીએ તો—”

પૃથ્વીસિંહનું આવું બોલવું સાંભળીને સર્વનાં વહન નિસ્તોજ થઈ ગયાં, તેઓ એક ભીજા પ્રત્યે જોવા લાગ્યા. થોડી વાર ઓરડીમાં શાન્તિ પ્રસરી રહી. અદ્ય સમય પછી અમરસિંહ ધીમે સ્વરે પરંતુ સ્પષ્ટતાથી બોલવા લાગ્યો “તો—તો પણ શું ? તેથી અમને કંઈજ નુકશાન થનાર નથી. આને તમે અહિં ને કંઈ જોયું છે, તે સંબંધી એક અક્ષર પણ કોઈને નહિ કહેવાના તમારી પાસે સોગન લેવડાવીને તમને અહિથી મુક્ત કરવામાં આવશે. અને તમે તે સોગનનું યથાર્થ પાલન કરો છો કે કેમ, તે માટે સખ્ત દેખરેખ રાખવામાં આવશે.”

“ત્યારે તો સહેજ સંકટ ખરું” અત્યાર સુધી ચુપ રહેલો માનસિંહ ધીમે રહીને બોલ્યો.

“સંકટ શાનું ? ” માનસિંહ પ્રત્યે વળીને પૃથ્વીસિંહ શાન્ત સ્વરે બોલ્યો.

“એમાં સંકટ શાનું ? મૃત્યુનું કે ? વચનલંગ થનારને મૃત્યુની શિક્ષા થવીજ જોઈએ. જો તમને મૃત્યુનો ભય લાગતો હોય તો હજી પણ તમે બન્ને મહુને ત્યજીને ચાહ્યા જાઓ ! હું તો સોગન પૂર્વક કહું છું કે અમરસિંહ માટે હું મહારા ગ્રાણ અપીશ.”

આ સાંભળીને સર્વ સંતુષ્ટ થયા. પૃથ્વીસિંહની પ્રશંસા થવા લાગી. માનસિંહ અને ધીરખલ પૃથ્વીસિંહ પ્રત્યે તીક્ષ્ણ દિલિથી જોવા લાગ્યા. પૃથ્વીસિંહની મુખમુદ્રા શાન્ત અને ગંભીર હતી.

“અમારો પણ એજ નિશ્ચય છે.” ધીરખલ નિર્દ્દેશ બોલ્યો. માનસિંહ કંઈ પણ ન બોલતાં ડોકું ધૂળાવીને સંમતિ દર્શાવી.

“હું તો તમારો નિશ્ચય દઠ થયો છે કે ? ” અમરસિંહ ધીરખલ અને માનસિંહ પ્રત્યે લેદક દિલે કેંકતાં મૂછયું.

“ હા; ” બન્ને જણા સાથે જ એલી ઉઠ્યા.

અમરસિંહ આથી સંતુષ્ટ થયો. તે સહજ આગળ આવીને એદ્યો. “ મિત્રો ! જાણી બુલ્ણે કિંવા છુપીરીતે થતો અકખરનો અન્યાય અટકાવવાનો જ અમારો ઉદેશ છે. અકખરની શાસન પદ્ધતિમાં અનેક પ્રકારના હોષ છે અને તેથી ગરીબ રાજ્યપૂતોને ધારું સહન કરવું પડે છે. આવા અત્યાચારો પ્રત્યે ગુમ રીતે અકખરની સંમતિ હેઠી જોઇએ, એવી અમારી માન્યતા છે. અકખર એવા અત્યાચારો પ્રત્યે સંમતિ દર્શાવતો હોય કે નહિ અથવા ગમે તેમ હોય, પરંતુ વારંવાર એવા અત્યાચારો થયા કરે છે એ વાત સાચી છે. આ અત્યાચારો અટકાવવાની અમેાંએ પ્રતિજ્ઞા કરી છે. અમે એકવાર અકખરની અંતર્ગત રાજ્યનીતિ તપાસવાનો નિશ્ચય કર્યો છે. જો અકખર રાજ્યપૂતો પ્રત્યે ખરેખર સંમતિ દર્શાવતો હુશે તો આપણી સ્થિતિમાં સત્વર સુધારો થશો, અને જો તે માત્ર ખાદ્ય રીતે રાજ્યપૂતો પ્રત્યે સંમતિ દર્શાવતો હુશો. અને તેનો આંતરિક ઉદેશ રાજ્યપૂતો પ્રત્યે છણકપટ કરવાનો જ છે એવી અમારી પ્રતીતિ થશો, તો અકખરનું રાજ્ય નામાવશેષ કરવા માટે અમે સર્વ એક પગે તૈયાર છીએ. હું ધારું છું કે હું તમે અમારો ઉદેશ સંપૂર્ણ રીતે સમજુ શક્યા હુશો જ. અમે સર્વ અહિં પ્રત્યેક માસની વહી ચતુર્થીને દિવસે લેગા થઈએ છીએ અને આગળ શું કરવું તે સંબંધી વિચાર કરીએ છીએ. તમે અમારી મંડળીમાં શામિલ થવા માટે તૈયાર છીને ? ” એટલું એલીને અમરસિંહે પોતાના નણે નવા મિત્રો પ્રત્યે એકવાર દાખિયાત કર્યો.

“ અદ્યાત્મ. ” પૃથ્વીસિંહ નીડરતાપૂર્ણ સ્વરે એદ્યો ઝુારા બન્ને મિત્રો પણ ઝુારા જેવા દ્રદ નિશ્ચયી છે. ”

ખીરથલે અને માનસિંહ શિર ધુણાવીને પોતાની સંમતિ દર્શાવી એટલે અમરસિંહ સહજ મોટા સ્વરે એલ્યો. “ કુમળાહેવી ! ”

અત્યાર સુધી પીઠ ફેરવીને એઠેલી સ્વી તરત જ જલ્દી થધ. તેણે પોતાનું મહેં ફેરવીને સર્વ પ્રત્યે દાખિ ફેંકી. તેણે

પોતાના અસ્તી વસ્ત થયેલાં વખ્તો સમાર્યા; પરંતુ ટેટલામાં તેણું કંઠ સ્થાન અને તેનો વૃક્ષ: પ્રદેશ દિશિગોચર થયા વગર રહ્યાં નહિ. તેનો કાળો ભમર જેવો કેશકલાપ છુટો વિખરાયલો હતો; પરંતુ તે સમારવાનું તેને સૂજયું નહિં. તેણે પોતાનો કેશકલાપ કદી પણ એળાંયો હોય એમ જણ્ણાતું નહોતું; કારણું કે તેમાં તેલની ગંધ સુદ્ધાં જણ્ણાતી નહોતી. આમ છતાં પણ તે કેશકલાપ સુંદર જણ્ણાતો હતો, તેની મુખ મુદ્રાપર ક્રિકાશ હતી, તે બહુ સુંદર નહોતી; પરંતુ તેની નાસિકા, નયનયુગલ, દંત-પંક્તિ વળેરે એવાં નમણ્યાં હતાં કે તે જેનારને સૈંદર્ય-મધ્યીજ જણ્ણાતી હતી. જે કે તે સુંદર, રમણીય કિંવા મોહક જણ્ણાતી નહોતી; પરંતુ તેનાં સ્વરૂપ-માંથી સૈંદર્ય અસ્પષ્ટ રીતે પણ દેખાઈ આવતું હતું. કેટલાંક પુણ્યો એવાં હોય છે કે જેને આપણે સુંધરવા માટે નાસિકા આગળ ધરીએ છીએ, ત્યારે તેમાંથી બિલકુલ સુગંધિ આવતી નથી; પરંતુ જ્યારે આપણે નિરાશ થઈને તેમને આપણી સામે મૂડીએ છીએ, ત્યારે અદ્ય સમયમાં જ તેની સુ-ગંધિ છેઢેકી રહે છે. કુમળાનું સ્વરૂપ પણ આવાજ પ્રકારનું હતું. કુમળાની મુખમુદ્રા જેવા પહેલાં પૃથ્વીસિંહ અને તેના ઘનને મિત્રો નિરાશ થયા હતા; કારણું જ્યાંસુધી તેઓએ કુમળાનું મ્હેં જેચું નહોતું ત્યાંસુધી પોતાની તરફ પીઠ ક્રેરવીને ઘેઠેલી ખીના જોરવ સંબંધે અને તેની હાજરી સંબંધી તેઓ કશો ખ્યાલ કરી શકતા નહોતા, પરંતુ જેમ જેમ પૃથ્વી-સિંહ કુમળા પ્રત્યે તાકી તાકીને જેવા લાગ્યો તેમ તેમ કુમળાની ઉચ્ચ અને ગંભીર મુખમુદ્રા જોઇને તેના મનમાં કુમળા વિષે પૂજ્ય બુદ્ધિ ઉદ્ભવી. તેની દિશિ નિર્મણ અને પવિત્ર બની ગઈ.

કુમળાદેવી પૂતળાની પેઢ શાન્ત, ગંભીર અને નિર્વિકાર મુખમુદ્રા ધારણ કરીને જિલ્લી હતી. તેના નેત્રોની પાંપણ સુદ્ધાં હાવતી ચાહતી નહોતી. તે કેના પ્રત્યે તાકી રહી હતી તે સ-મજુ શક્ય તેમ નહોતું; પરંતુ તે પોતાની પ્રત્યે આડકતરી

રીતે જેથા કરતી હતી આવી પૃથ્વીસિંહની અદ્ય સમયમાં જ પ્રતીતિ થઈ.

અંતે પોતાના નવા ભિત્રોને કુમળાહેવીની પાસે આવવાનો અમરસિંહ ઈસારો કર્યો. પૃથ્વીસિંહ પોતાની પાસે આવી પહેંચતાંની સાથે જ કુમળાએ પોતાની કમરમાંથી એક કટાર એંચી કાઢી. શૂરહૂદયી પૃથ્વીસિંહ આથી ચમક્યો. પૃથ્વીસિંહના ખન્ને ભિત્રોએ પોતપોતાની સમશેરની મુઠ પડી. કુમળાહેવી આ ખંડું જેઇ શક્યા વગર રહી નહિ. તે માત્ર ઉંચી નજર કરીને પૃથ્વીસિંહ ગ્રત્યે તાકી રહી. પૃથ્વીસિંહના કપાળમાં કરચલીએ પડી.

“ કટારી જેઇને ભયભીત થવાનું કંઈ જ ગ્રયોજન નથી.” અમરસિંહ પૃથ્વીસિંહને ઉદેશીને બોલ્યો. “ કુમળાના હાથમાંના શસ્ત્રનો સ્પર્શ કરીને સોગન લેવાની અમારી પદ્ધતિ છે. પૃથ્વીસિંહ આ કટારીની ધાર પર ખન્ને હાથ મૂકીને સોગન દ્વો ”

પૃથ્વીસિંહે કુમળાના હાથમાંના શસ્ત્રપર પોતાના ખન્ને હાથ મૂક્યા અને તે બોલ્યો ! “ આજથી હું અમરસિંહજીના કાર્યને મનસા વાચા અને કર્મણા સહાય આપવાની પ્રતિસા કરું છું. દૈવ દુર્વિષાક્થી કદાચ હું વિશ્વાસધાતી નિવડું તો આ શસ્ત્રથી ઝૂંચા પ્રાણ નષ્ટ થનો ! ”

પૃથ્વીસિંહના ખન્ને ભિત્રોએ પણ તેજ ગ્રમાણે સોગન લીધા પછી કુમળાહેવીએ એકવાર પૃથ્વીસિંહ ગ્રત્યે દશ્ટિપાત કર્યો. ત્યારછી પોતાના હાથમાંની કટારી ઉંચી કરીને તે બોલી ! પવિત્ર સોગન લીધા પછી શસ્ત્રને પવિત્ર કુંકુંમથી વધાવવું જેઇએ, એટલું બોલીને તેણે ઉંચી કરેલી કટારીથી પોતાના બાહુ પર સહજ સ્પર્શ કર્યો. તરતજ લાલ હીરા જેવું રંધીર જિન્હું તેની બાહુ લતાપર આવીને ઉલું રણું.

કુમળાએ તરત જ પોતાના જમણા હાથના અંગુઠા વડે

તે ઇધિરનું તિલક પૃથ્વીસિંહને કર્યું. પૃથ્વીસિંહે રોમાંચ અનુભવ્યો. કુમળાદેવીને તેણે જ્યારથી જોઈ હતી, ત્યારથી જ તેની લેઢક દિશાએ પૃથ્વીસિંહનું છૂદ્ય લેઢી નાણયું હતું જ. તે સહજ અસ્વસ્થ થયો હતો. તેમાં યે વળી તેની આવી વિચિત્ર કૃતિથી પૃથ્વીસિંહ સહજ ગભરાયો; પરન્તુ પોતાના અંતઃકરણની વિષમતા વ્યક્તા ન થઈ જાય, એ હેતુથી અમરસિંહ અને કુમળાને સંબોધીને ઓદ્યો. “આવું પવિત્ર તિલક મહારા કપાળમાં થવાથી હું મહને લાગ્યશાળી સહમણું છું.

ત્યારપણી ભીરખલ અને માનસિંહને રક્ત તિલક કર્યો પછી કુમળા ઓલીઃ “ મહારા સત્ત્વમય ઇધિરનો ભાર તમોએ તમારા કપાળ પર લીધો છે. પ્રતિજ્ઞા પૂર્ણ થયા સિવાય એ ભાર હુલકો થનાર નથી કેમ પૃથ્વીસિંહ ? ”

“ અલખત ” પૃથ્વીસિંહ ઓદ્યોઃ “ ઇવે રક્ત-અંધનથી આપણા અંતઃકરણ સંકળાઈ ચુક્યાં છે. પરંતુ આપણા કાર્યની શરૂઆત કરતાં પહેલાં મહને એક પ્રેરન પૂછવાની અગત્ય જણ્યાય છે. અકખર બાદશાહ રાજપૂતો પ્રત્યે છળકપટ કરવા ધ્યાયે છે, એવું તમે શા ઉપરથી માનો છો ? રાજ્યમાં બનતા બધા બનાવો પ્રત્યે ઝુદ બાદશાહ કેવી રીતે ધ્યાન આપી શકે ? કદાચ રાજપૂતો ઉપર થતા અત્યાચારો સંબંધી અકખર કંઈ જાણુંનો પણ ન હોય ! આથીજ અકખર પ્રત્યે દ્રેષ્ટાવના રાખવી એ સર્વથા અનુચિત ગણ્યાય ! વળી તમે મહારી મુખમુદ્રા પ્રત્યે ખારિકીથી જુઓ ! મહારી અને અકખરની મુખમુદ્રામાં સામ્ય એટલું બધું છે કે તમે કવચિત મહને રાજપૂત શરૂ અકખરજ સહમજશો. ! ”

આટલું ઓલીને પૃથ્વીસિંહશાન્ત રહ્યો. સર્વત્ર શાન્તિ પ્રસરી રહી. અમરસિંહ પૃથ્વીસિંહ પાસે ગયો. અને તેની મુખમુદ્રા પ્રત્યે ખારિકીથી જોવા લાગ્યો. કુમળાદેવી પણ પૃથ્વીસિંહ પ્રત્યે તાકી રહી. તેને પણ તે અકખર જેવોજ

લાગ્યો: તેણું એકવાર ચોમેર દણ્ઠિ ફેરવ્યો: તેના કપાળ પર કરંચંદીઓ પડી.

કુમળાહેવીની અસ્વસ્થા પૃથ્વીસિંહ કળી ગયો. તે આગળ બોલવા લાગ્યો: “ પરંતુ આ સાંય્ય મહારા કર્તાયની આડે આવનાર નથી એ વાત તમે નક્કી માનજો. મહારા ભાલ પ્રદેશ પરનું રક્ત તિલક મહુને સ્વસ્થ બેસી રહેવા દેશે નહિ. પરંતુ આપણું કાર્ય શરૂ કરતાં પહેલાં હું આકબરની ખરી મન: સ્થિતિ તપાસી લઈશ. મહારા કાર્યધૈત્રની તમને કવપના સુદ્ધાં આવી શકશે નહિ. જો કે હું ચિયતોડમાં જન્મ્યો છું: તોપણું સિક્કિ પ્રાંતમાં કાર્ય કરવા માટે હું કેદીપણું રીતે અશક્ત નથી. તમારા કાર્યની પૂર્ણાહુતિ મહારાજ હાથથી થશે, એવી મહારી ખાત્રી છે. આવતી ચતુર્થીએ આપણે અહીં પુન: મળશું, તે વખતે એકાદ હિતશત્રુનો અંત લીધા સિવાય અહીં નહિ આવવા બદલ હું પ્રતિજ્ઞા કરું છું. પરંતુ તમે એટલું નક્કી માનજો કે આકબર બીરખલ અને માનસિંહ તમારા હિતશત્રુ નથીજ.” એટલું બોલી પૃથ્વીસિંહે પોતાના બન્ને મિત્રો તરફ દણ્ઠિ ફેરવી. તેમની ઉલયની સુખમુદ્રા અસ્વસ્થ જણ્ણાતી હતી. પૃથ્વીસિંહના છેલ્લા શબ્દો તેમને રૂચ્યા ન હોય એમ તેમની સુખમુદ્રા પરથી સ્પષ્ટ રીતે જણ્ણાઈ આવતું હતું.

આ સાંભળીને પેલો વૃદ્ધ રાજપૂત બોલી ઉદ્ઘ્યો: “ પૃથ્વીસિંહ, તમે ધારો છો તેટલું આ કાર્ય સહેલું નથી. અમારા જેવા ગરીબ રાજપૂતોના હુઃખની તમને માહિતી નથી, તેથીજ આકબર માટે તમારા હૃદયમાં પૂજય ખુદ્દિ છે. થાડાં અઠવાડિયા થયાં સિક્કિના રાજપૂતો પ્રત્યે જે અત્યાચારો થાય છે, તે સંબંધી આકબરને સહજ પણ માહિતી ન હોય એ કેમ સંભવે? અરેરે, બિચારા રાધોળને અજ સુદ્ધાં ખાવા મળતું નથી, તેના ઉપર એ સુસલભમાન સ્વારોએ કેવો જુલ્દમ ગુજર્યો? ”

“ ખરેખર, પૃથ્વીસિંહજી, ” કુમળાહેવી વર્ચેજ બોલી ઉઠી. “ દુષ્પિર અમારા ઉપર રૂક્ષ્યો છે. તું સિકિની દીનાવસ્થા! અજ વિના ટળવળીને રાજપૂતો પોતાના પ્રાણું ત્યાગે છે. ક્યાં ત્યાં ભૂખ્યાં માણુસોની કાન ફોડી નાંખે એવી કિકિઆરીએ. સંભળાય છે. સંતાપ, શોક અને આંકંદ સિવાય સિકિમાં હુંવે કંઈજ રહ્યું નથી. આ કરતાં પ્રલય કાળથી સર્વ સાથેજ મૃત્યુ પામીએ તે કેવું સારું ! ” આટલું બોલતાં બોલતાં કુમળાનાં નેત્રમાંથી અશ્વ ભરાઈ આવ્યાં. તેણે પોતાની ઓદણીના છેડાથી અશ્વ લુંછી નાંખ્યાં. તેના નેત્રોમાં વિલક્ષણ પ્રકારનું તેજ દેખાવા લાગ્યું. તેની, સુખમુદ્રા માહુક જણ્ણાવા લાગી. તેણે પોતાના ઓષ્ઠ પીસ્યા. પૃથ્વીસિંહે આ દૃશ્ય સ્તબ્ધ થઈને જોયાંજ કર્યું.

અહ્વ્ય સંમયમાં સભા બરખાસ્ત થવાની તૈયારી થવા લાગી. પ્રત્યેક રાજપૂત અમરસિંહને પ્રણામ કરીને ત્યાંથી જવા લાગ્યા. સૌની ખાંધળ પૃથ્વીસિંહ અને તેના બે ભિત્રો ચાલતા હતા. પૃથ્વીસિંહે અમરસિંહને પ્રણામ કર્યા. કુમળાહેવી તે ત્રણે ભિત્રોને સુક્વા સારું દાઢર ઉત્તરીને નીચે આવી અને પૃથ્વીસિંહને ઉદેશીને બોલી: “ પૃથ્વીસિંહ ! પ્રતિજ્ઞાનું નિરંતર સમરણ કર્યા કરનો હો કે ? ”

“ જ્યાંસુધી આ દેહમાં પ્રાણું છે, ત્યાંસુધી તેનું કદિ પણ વિસ્મરણ થવાનું નથી ! ” કુમળાહેવી પ્રત્યે એકી ટસે તાકી રહેલો પૃથ્વીસિંહ બોલ્યો.

કુમળાહેવી સહજ આગળ આવી અને પૃથ્વીસિંહના કર્ષ્ણ પાસે મ્હેં રાખીને ધીમે સ્વરે બોલી: “ અમરસિંહમાં ચોઘ્યતા છે. તેનામાં અનેક સંદુગુણ છે; પરંતુ તેના જ્ઞાનથ૰ની વિકાસ થાય તેમ નથી. આપ તેને મહા કરશો તો હું આપનો અત્યંત ઉપકાર માનીશ. ”

“ તે તમારા શું જીગા થાય છે ? ” પૃથ્વીસિંહે આ-
ક્ર્યાર્થ પામતાં પ્રશ્ન કર્યો.

“ તેઓ મૃદુરા કંધીજ જગા થતા નથી. ” કુમળા બોલી: “ મૃદુરા માતા પિતા કોણ છે તેની પણ મૃદુને ખરાર નથી. અમરસિંહે બાળ્યાવસ્થાથીજ મૃદું લાલન પાલન કર્યું છે એટલી વાત હું જાણું છું. મૃદુરા પર અનંત ઉપકાર છે. ઢીક, ત્યારે હું રણ લઈ છું. ” એટલું બોલીને કુમળા ત્યાંથી વિદ્યુત વેગે ચાલી ગઈ.

કુમળા પ્રત્યે દશિ ફેંકતો પૃથ્વીસિંહ વિચારમુંઘ બની સ્થિર ચિત્તે ઉલ્લો રહ્યો. અંતે “ કેમ હવે અહીંથી નીકળવાનો વિચાર છે કે નહિ ? ” એ પ્રશ્ન તેના ભિત્રો લર્ડથી પૂછાયો, ત્યારેજ તેણે સચિત થઈ કલ્યું. નહિ, નહિ; ચાલો, આપણે જધુંએ છીએ ને ? હું, પણ રાત્રિ ધ્યાણી વીતિ ગઈ છે. અરે ! પ્રાતઃકાળ થવા આવેલ છે ને શું ? ” એમ કહીને ત્રણે જણ્ણા ચાલતા થયા.

પૃથ્વીસિંહ, બીરખલ અને માનસિંહના ગયા પછી અમરસિંહ સાદ્દી પર પડયો. પડયો વિચારતન્દ્રાને આધીન થયો. અદ્ય સમયમાંજ કુમળા પાછી આવી. અમરસિંહનુંને વિચારમણ થયેલો જોઈને તે બોલી “ અમરસિંહનું કાર્ય કંઈ થતું નથી અને સમય વ્યતીત થતો જાય છે. ”

“ ખરેખર ” અમરસિંહ બોલ્યો. “ હું પણ એજ વિચાર કરું છું. પણ કુમળા મૃદુંમાથી એક શાખ નીકળતાંની સાથેજ શૂરવીર રાજપૂતો આપણી મદ્દે આવ્યા વગર રહે તેમ નથી હો ? ”

“ પરંતુ એમ બંડ કરવાથી શો ઝાયદો ? ” કુમળા બોલી: “ રક્તાપાનની નહીંએ વહેશે અને અનાથ ડી બાળકાની સંખ્યામાં વધારો થશે. ઉત્તાવળ કરવામાં ઝાયદો નથી. અમરસિંહનું ! ”

“ એમ કેમ ? ” અમરસિંહે બલાં ચઢાવ્યાં અને બોલ્યો, એક વખત અકાશનો નાશ થયો કે— ”

“ તો તેની જગ્યાએ તરતજ થીલે અકૃષ્ણ આવશે, સહમન્યા ? ” અમરસિંહ પ્રત્યે એકી ટસે જેઠ રહેલી કુમળા બોલીઃ “ વળી અકૃષ્ણ આવા અત્યાચારો પ્રત્યે ગુસ રીતે સંમતિ દર્શાવતો હોય એવું પણ શી રીતે માની શકાય ? મુને લાગે છે કે તમે ઉતાવળ કરો છો. ” “ તું ભૂલે છે કુમળા ! મુહારી ઉતાવળથી મુહારા હાથમાં એવા પ્રકારની સત્તા આવશે કે જેથી સર્વ અત્યાચારોનો હું ક્ષણ માત્રમાં અંત લાવી શકીશ એટલું જ નહિ; પરંતુ મુહારી કુમળાને હું રાખી પદ— ”

“ ખસ કરો, ખસ કરો ? ” કુમળા કોધપૂર્ણ સ્વરે બોલી: “ અમરસિંહજ, મહેં તમને અનેક વખત કહ્યું છે અને હજ પણ કહું છું કે કુમળા એક દીન સ્વી છે. સંપત્તિ, સૌનંદર્ય વા એક્ષર્યાની મુને બીલકુલ આવશ્યકતા નથી. પ્રલુબુ મુને સદ્ગ્રાદાર અને સદાચાર આપો, એજ એક ઇચ્છા મુહારા મનમાં નિરંતર રહ્યા કરે છે. ”

“ નહિ, કુમળા એવું ન એલ ! ” કુમળાને એલતી અટકાવી અમરસિંહ વચ્ચેજ એલી ઉડ્યો ! “ તહારી ચોણ્યતા, તહારી સહૃદયતા અને તહારા સહશુશ્રોનો હું જેમ જેમ વિચાર કરું છું, તેમ તેમ તહારા પ્રત્યેનો મુહારો પ્રેમ દફ થતો જથ્ય છે. કુમળા, ? મહેં તહારું લાલન પાલન કર્યું; પરંતુ તું હજ મુહારી થઈ નથી ! ” એટલું એલતીને અમરસિંહ આશાપૂર્ણ નેત્રે કુમળા પ્રત્યે તાકી રહ્યો. અમરસિંહનું એલવું પોતાને પસંદ નહોતું, તો પણ તેને હુઃખ્યિત નહિ કરવાના વિચારથી કુમળા ગદગદ કરું છે. એલતી: “ મુહારા જેવી એક પામર સ્વી પ્રાસ કરવાના વિચારથી તમારું હૃદય હુખ્યિત ન કરો ! ”

“ તું આ પ્રમાણેજ એલ્યા કરીશ કે ? ” અમરસિંહ કરુણાજનક સ્વરે એલ્યો: “ નહિ, નહિ; ” કુમળા એલતી: “ હું એવી દુષ્ટ નથી. તમે મુહાર પર અનેક ઉપકાર કર્યા છે. તે ઉપકાર વિસરી જાઉં એવી હું કૃતદ્ધન નથી, તમે મુહારા પ્રતિપાલક છો. હું તમારા પ્રત્યે પૂજય બુદ્ધિ ધરાવું છું. અને

આત્યાર સુધીના તમારા ઉપકારનું નિરંતર સ્મરણ રાખીને આજસુધી હું તમારી આજસનુસાર વતી છું; પરંતુ મહારી પાસે આવા પ્રકારનો બદલો ન માગો ! ” એટલું ઓલીને કુમળા ત્યાથી ચાલી ગઈ.

“ કુમળા ! ” અમરસિંહે કુમળાને ધીમેથી ઘૂમ પાડી; પરંતુ કુમળા લાં નહોતી. અમરસિંહે એક નિઃશ્વાસ સુક્ષ્મો. તે હીપક યુઝવી નાંખવા સારુ ઉલો થયો. હીપક પાસે જતાં જતાં તે ઓલ્યો : “ હુનરો વર્ષે એકજ કુમળાનો જન્મ થાય છે, તેની પ્રાસિ માટે યુદ્ધ બાદશાહનું રાજસિંહસન જમીનહોસ્ત કરવા માટે કોણ તૈયાર ન થાય ? ” એટલું ઓલીને તેણે હીપક હોલવી નાંખ્યો. ઓરડીમાં અંધકાર પ્રસરી રહ્યો. કુમળા જે જગ્યાએ એઠી હતી, તે જગ્યા પાસે જઈને અમરસિંહ પ્રકાશી રહેલા ચંદ્ર પ્રત્યે દણિ ઝેક્ટો અખડવા લાગ્યો. “ કુમળા આ બધી ગડમથલ હું કેવળ તહારા માટેજ કરું છું. યવનોનો નાશ કરીને રાજપૂતોને સુખી કરવા રાજસત્તા પ્રાપ્ત કરવી, એ અધું કેવળ તારાજ માટે ! મોટાં મોટાં રાજ્યોની પાયમાલી કરવામાં પણ સ્વીએ નિમિત્ત માત્ર ગણાઈ છે ! ત્યારે હું મહારી કુમળા માટે આટલું કરું તેમાં શું આશ્વર્ય ? ” વળી વિચારનું નાવ તરંગે ચઢ્યું હોય તેમ આગળ ચલાવ્યું : “ આ પૃથ્વીસિંહ કોણ હશે ? તેનું સ્વરૂપ અકખ-રના જેવું જ કેમ લાગે છે ? તેણે પોતાના રહેઠાણું સંખ્યી તો કંઈજ માહીતી આપી નહિ ! ” આ પ્રમાણે વિચારની ધૂન-માં જ અમરસિંહને પ્રાતઃકાળ થઈ ગયો.



પ્રકરણ દ મું.

રાજ્યપૂત રમણી.

પદ્મા કે જીજાકિડા કરવા જતાં લોયરામાં પુરાધ હતી તે જ્યારે સ્વર્ણ થઈ લ્યારે તે એક સુંદર ગાલીચા ઉપર પડી હતી.

અને તેના સામે એક વ્યક્તિ છોડી હતી. આ વ્યક્તિ કોણું હતી, તે તેનાથી સ્હુમજાયું નહિ; કારણું તેની એ આંખો સિવાય આખું શરીર વક્તાન્ધાહિત કરેલું હતું. પેતે કૃયાં હતી તે પુદ્ગાથી સ્હુમજ શકાયું નહિ. અરણું કે પુદ્ગા જ્યાં હતી લાં અંધકાર વિશેષ હતો. વળી તે જગ્યામાંના ઢીપકનો પ્રકાશ એટલો તો મંદ હતો કે લાં ઢીપક હતો નહિ, એમ કહેવામાં કંઈજ અડગણું નથી. ચારે ભાગુની દિવાલો પરથી છો ઉખડી ગયેલી હતી અને તેમાંથી કેટલાક પથરો અહાર ઉપરી આવેલા જણુતા હતા.

પોતાની સામે એઠેલી વ્યક્તિ કંઈ પણ એલયા સિવાય એસી રહી હતી એ જેઠને પદ્મમા કંપી ઉડી. ચોતે કોઈ ભૂતની સમીપમાં એટી હોય એમ તેને લાગ્યું. પદ્મમા ભયલીત થઈને ડિકિઆરી પાડવાની તૈયારી કરતી હતી, એટલામાં તેની સામે એઠેલી વ્યક્તિ એલવા લાગી. “ એગમ સાહેબ ! આપના પ્રત્યે નિઝુર વર્તાન ચલાવીને હું આપને અહિં ઉપાડી લાંયો છું એ કંઈ મહારો નહાનો સુનો અપરાધ નથી. કદાચ આપને એમ લાગ્યું હુશે કે આપને અહિં એક બંધિવાનની પેઠે પકડી લાવવામાં આવ્યાં છે, પરંતુ આપનો માન-મરતણો સચવાય તેવી રીતે વર્તાવાની રહેં સંપૂર્ણ કાળજ રાખી છે અને લાચારીથી આપ નામવરને અહિં આણુવા માટે અમારા તરફથી આપને જે કંઈ ત્રાસ પડ્યો હોય, તે બદલ માર્ગી ચાહું છું. જગ્નાનભાનાની સધળી એગમો કરતાં આપ નામવર વિશેષ દ્વાળું અને ક્ષમારીલ છો, એવી અમારી ભાત્રી હોલાથીજ અમે આપની પાસે વિનંતી કરવાનું ડરાંયું છે. પરંતુ તે વિનંતી રણું કરવા માટે બીજું સ્થળ, તેમજ બીજે સમય, યોગ્ય નહિ હોવાથી આપને આ રીતે અત્યારે અહિં લાવવા કરજ પડો છે; કારણું કે કામ અત્યંત ગુમ છે. ”

આટલું એલીને તે વ્યક્તિ શાન્ત રહી. તે પુદ્ગાના પ્રત્યે લાકી સાકીને જેવા લાગી. પુદ્ગા કંઈજ બોલીએહિ. થોડીબાર

શુદ્ધી શાન્તિ પ્રસરી રહી. ત્રણું ચાર વખત પદ્માચે દીર્ઘ નિ:-
ખાસ મૂક્યા. તેનું છુદ્દય ધળકવા લાગ્યું. આ વ્યક્તિના કોણું
હત્તી, તે માત્ર તેના નેત્રો ઉપરથી એપણાખી શકાય તેમ નહોનું.
આત્ર તેના અવાજ ઉપરથી તે કાળ હાવો જોઈએ એવી
પદ્માના અંતરમાં શાંકા ઉલ્લબ્ધી.

અદ્ય સમય પછી તે વ્યક્તિ પુનઃ બોલવા લાગી. “કાર્ય
આતિ શુદ્ધ રીતે થવું જોઈએ. જો સહજ પણ વાત ખાડાર જવા
પામી તો તેથી પ્રાણું તુકશાન થવાનો સંભવ છે. ધર્મજ
સાવધાનતા રાખવાની છે.”

“ પરંતુ શું કાર્ય છે તે કહો તો ખરા ! ” પદ્મા સહજ
કંટાળીને બોલી.

“ કહું છું. એટલા માટે તો આપ નામવરને અહિં
લાવવા પડ્યાં છે. ” તે વ્યક્તિએ નામ સ્વરે આગળ ચલાયું.
પરંતુ મુને અલય વચન મળે તોજ હું આપને તે હુક્કીકત
સાંબંધિત કહી સંભળાવું ! મહારં કાર્ય કરવાનું મુને આપના
તરફથી વચન મળવું જોઈએ.”

“ વાત કર્યી પહેલાં તે બદલ વચન માગવું એ શું વચન
પળાવવાની રીતિ છે ? ” પદ્મા તિરસ્કાર સૂચક સ્વરે બોલી.

“ માતા પાસે માગવામાં બાળકને રીતિને વિચાર કરવાનો
રહેતો નથી. પ્રભાજન રાજમાતાના બાળક સમાન છે અને
અલારે તેજ દશ્ચિથી હું આપના ચરણે મહારં શિર ઝુકાવું
છું. ” એટલું બોલીને તે વ્યક્તિએ પોતાનું શિર પદ્માના
ચરણેમાં મૂક્યું; પરંતુ પોતાનું શિર ઉંચુ કરતાં પદ્માના
અંગુઠાનો સ્પર્શ થવાથી તે વ્યક્તિના મહેંપરતું વસ્તુ ખર્સી
ગયું. પદ્મા ચ્યામકી ઉઠી. તે અય પામતી બોલી:-કોણ કાળું ? ”

કાળ છેકજ ગભરાઇ ગયો. પદ્મા અને કાળ એટલીક-
વાર સુધી એક ધીજ પ્રત્યે તાકી રહ્યાં. અદ્ય સમય પછી કાળ
નામ સ્વરે બોલવા લાગ્યોઃ “ હું માતાને શરણ આંધો છું,
અહે પછી તે મહુમે મારે કિંબા ઉગારે ? ”

“ પરંતુ મને આહી લાવવાનું શું પ્રયોજન છે, તે મુહા રાથી સમજુ શકતું નથી.”

“ મને અલાય વચન ભખ્યા સિવાય હું તે જણ્ણાવી શકતો નથી.”

“ એમ અલાય વચન આપી શકાયજ નહિ. ”

“ પરંતુ— ”

“ પરંતુ કંઈ નહિ. હું એટલું વચન આપી શકીશ કે તમારું ઠાર્ય મુહારાથી થઇ શકે તેવું નહિ હોય તો હું તેનો સ્ક્રેટ કોઈની પાસે નહિ કરું. ”

આ સાંભળીને કાળુની અર્ધ ચિંતા ઓછી થઇ ગઈ. પરંતુ પોતાની વાત પડ્ઘાને રૂચશે કે કેમ, તે બાખત તેના મનમાં શાંકા ઉદ્ભાવી. થોડીવાર વિચાર કર્યા પછી તેણે બોલવાની શરૂઆત કરી. “ હેવિ ! આપના વચન પર મુને સંપૂર્ણ શ્રદ્ધા છે અને તેથીજ હું મુહારી હડીકત આપને નિવેદન કરું છું કે શહેનશાહ અકખરનું રાજ્ય અત્યંત સુખદાયક અને કલ્યાણકારક છે એવું ધણ્ણાખરાનું માનવું છે, પરંતુ આ માન્યતામાં મને બહુ વહેમ આવે છે. રાજપૂત પ્રણ માને છે કે અકખર તેમનો છે, તેમના ધર્મ માટે લાગણી રાખી રહ્યો છે ને તેની આ પ્રપંચબાની સધળા રાજપૂતો ઇસાઈ પડ્યા છે. એ ખરું છે કે રાજપૂતોમાં સ્વરાજ્યની મહત્વાકંક્ષા હવે રહી નથી; તેમનામાં સ્વધર્મનું અલિમાન રહ્યું નથી. પરંતુ:—”

“ બોલો, બોલો; કાળ ! અત્યારે તમારી સામે બેઠેલી સ્વી અકખર બાદશાહની એગમ નથી, પરંતુ એક રાજપૂત કંન્યા છે. તો વાતને ન અચકાવતા હિમતથી આગળ બોલો. ” પડ્ઘાએ કહ્યું. “ હું જે બોલવાનો છું તે પ્રત્યેક રાજપૂતોના હૃદયમાં રમી રહ્યું છે. સત્ય પ્રયતાના જ્હાના હેઠલ પોતાની જ્હેન-પુત્રી-ઓ સાચે લગ્ન કરવાના લાલચુઓને-પણ લદે તે બાદશાહ ઢાય-પણ દેહાંત ફંડની શક્ષા થવી જોઈએ, એમ ફરેક બાલ્યા-ગિમાની રાજપૂતને લાગવું જ જોઈએ. પોતાના પૂર્વબેનું

રાજ્ય પડાવી લેનાર અને પોતાના માન-પ્રતિકાને હણી લેનાર અકખર રાજ્યપૂતોની દશિમાં કલંક રૂપ થઈ પડવો જોઈએ, એમ ખુદ દેવીને પણ નથી લાગતું કે? ” કાળુએ પદ્માને રૂચેલી વાતને વધારે રસહાર કરી.

છેવટનું વાક્ય ઉચ્ચારતાં કાળુએ પોતાના ઘોલવાની પદ્માના હૃદય પર શી અસર થાય છે તે જેવા સારુ પદ્માના તરફ તાકીને જેયું; તેને એમ ખાત્રી પૂર્વિક લાગ્યું કે પદ્માને તેના શાખ્યો રૂચ્યા હતા; પરંતુ કાળુએ તેવું માનવામાં ભૂલથાપ ખાંધી હતી. કાળુના પ્રથમના સંલાષણુથી અકખરના નાશની કદ્વપના પદ્માના વદનમંડળ પર તરવરી રહી હોય એવો સહજ શાંસ થતો હતો. પરંતુ તેના મનમાં તરતજ એવી કદ્વપના ઉદ્દસી કે રાજ્યપૂત ધર્મ નામાવશેષ કરવા ઉદ્યુક્ત થયેલા અકખર પ્રત્યે તો ઈસ્લામ ધર્મી કાળુને પ્રેમ ઉત્પત્ત થવો જોઈએ પરંતુ તેમ કરતાં કાળ અકખર પ્રત્યે આટલો બધો દ્રેષ્ટાવ રાખે છે તેમાં કંઈ રહુસ્ય હોવું જોઈએ, તેની કદ્વપના આટલેથીજ અટકી પડી નહિ. ઈસ્લામી ધર્મના હુરાથણી લોકોના મન હુખ્યાય એવું અકખરે કંઈ પણ કૃત્ય કર્યું હોવું જોઈએ, અર્થાતું રાજ્યપૂત ધર્મ પ્રત્યે ઉદ્દારતા દર્શાવનારું એકાદ પગલું અકખરે લાર્યું હોવું જોઈએ. પદ્માએ પોતાના મનમાં એવી પણ કદ્વપના કરી લીધી.

આ કદ્વપના સાથેજ અકખર પ્રત્યેનો પદ્માનો દ્રેષ્ટાવ એગળીને પાણી જેવો થઈ ગયો. અનેક વર્ષના જળ સિંચનથી વૃદ્ધિ ગત થએલું વિશાળ વૃક્ષ વીજળીના એક આધાતું માત્રથી જેમ ખળીને લસ્ય થઈ જાય છે, તે પ્રમાણે પદ્માના દ્રેષ્ટનું પણ થયું. રાજ્યપૂતો પ્રત્યે અકખર છળ કરે છે અને ઈસ્લામી ધર્મનો પ્રચાર કરવા માટેજ તે સતત પ્રયત્ન કરી રહ્યો છે, એવી આજીવીન સુધી પદ્માની માન્યતા હતી, પરંતુ આજે તેને જુદાજ પ્રકારનો અતુલવ મળ્યો. ખુદ ઈસ્લામીએ પણ અકખરથી અસંતુષ્ટ છે એવી આજે પદ્માની ખાત્રી થઈ અને તેનું કારણ અકખર.

હિન્દુ ધર્મના ઉચ્ચ તત્વો માન્ય કરે છે, રાજ્યપૂર્તા પ્રબાને પ્રેમ સંપાદન કરવાને પ્રયત્ન કરે છે, એજ છે એવી પદ્ધાની પ્રતીતિ થઈ. તરતજ અકથર માટે પદ્ધાના મનમાં પ્રેમ લાવના ઉત્પન્ન થઈ. તે વિચારવાંલાગી: “કાળની છાચા વિરુદ્ધ કોઈપણ કાર્ય અકથરે કર્યું હોય બોઇએ અને તેથીજ તે કંઈ કારસ્થાન રચતો હોવો જોઇએ. વિવિધ પ્રકારના ધર્મની ચર્ચા કરવાનું કાર્ય અકથરે શરૂ કર્યું છે. તે કાળને પસંદ ન હોય બોઇએ અથવા રાજ્યપૂર્તોને ત્રાસ આપનારી કાળની કોઈ વાત માટે અકથરે વિરુદ્ધતા દર્શાવી હોવી જોઇએ.” આ પ્રમાણે અનેક કદમ્પનાએ પદ્ધાના મનમાં ઉદ્ભાવી અને લથ પામી; પરંતુ તેણે તરતજ પોતાના મનમાં વિચાર કર્યો કે ગમે તેમ હોય, પરંતુ આ સમયે કાળને ભૂતથાપ ખવડાવીને આપણે અહિંથી નહાસી છુટવું. તેણે તરતજ પોતાની દાખિ કાળ તરફ ફેરવી. કાળ હુલ પણ પદ્ધા પ્રત્યે તાકી રહ્યો હતો. પદ્ધાએ તેના જાસું જોયું કે તરતજ તે ઉત્સુકતાથી એલી ઉછ્યો: “હેવી ! આપનો વિચાર હું જાણી શક્યો. નહિ ? ”

પદ્ધાએ એક હીર્દિ નિઃશ્વાસ મૂક્યો અને એલી: “હં, પણ તેનો ઉપયોગ શો ? હું જહંપનાહની ઘેગમ છું. ઝૂઠાથી તે કાર્ય શી રીતે થઈ શકે ? ”

“પરંતુ આપ નામવરની સહાનુભૂતિ હુશે તો ખસ છે.” આનંદ પામતો કાળ એલ્યો: “કાર્ય કરવાની જવાખાહારી તો હું ઝૂસ શિર પર—”

પદ્ધાને કંઈક યાદ આવ્યું, તે એલી ઉઠી: “પરંતુ કાળ સાહેબ હિંદુ ધર્મનો નામશૈષ કરનારા જાદચાહના આણ લેવાની છાચા તમને શાથી આય છે ? ”

કાળ સહજ ચમક્યો; પરંતુ તો તરતજ પોતાની દાઢી પર હાથ ફેરવતો એલ્યો: “આજની શંકા બસેબર છે. જાદચાહું ચાલપૂરો પ્રથેતો હુક્કા મનથીજ દ્વેષ કરે છે; પરંતુ છસ્વા-

ઝી પ્રત્યેનો તેનો દેખ તો તેના કાર્યો દ્વારા પ્રતીત પણ થાય છે. હિંદુ મળ પ્રત્યેજ જે વે દેખ કરતો હોત તો તેથી અમને સંતોષ થાત. અમારા ધર્મનો પ્રચાર દિનપ્રતિદિન વૃદ્ધિગત થાત. અહ્વા પણ તેથી આનંદ પામત; પરંતુ તેને તો હિંદુ કે હિસ્લામી એકે ધર્મની જરૂર નથી. તેણે પોતાનો એક નવીન ધર્મ સ્થાપવાનો યત્ન કર્યો છે. જુદા જુદા ધર્મના વડા શુરૂઆ ઓલાવીને ઈખાદતખાનામાં તે ચર્ચા કરવે છે અને પ્રત્યેક ધર્મમાંથી પોતાને મન ગમતું સ્વીકારી લઈને બાકીનું તે તણ હે છે. ગંધ કાલે વળી તેમણે વાણીઆની કન્યાને તેના રોજની પરિક્ષા કરવા રોકી છે ને તેના ધર્મશુરીને ઓલાવવા શુજરાતમાં રૂક્ષો મોકદ્યો છે. હેવી ! ધર્મસ્થાપના કરવાનું કાર્ય અહ્વાનું છે; પરંતુ અહ્વાની અવગણુના કરીને અકખરે ધર્મ સ્થાપવાનું કાર્ય પોતાના હાથમાં લીધું છે. નિંકિના સીમાડા પરની એક વિશાળ જગ્યામાં મસજુદ બાંધવાની રૂહને સ્વમામાં અહ્વાએ આજા કરી હતી. તે ઉપરથી રૂહને ત્યાં જગ્યા આપવાની રહેતી તેની પાસે માગણી કરી હતી; પરંતુ તેણે રહારી તે માગણીને તુચ્છકારી કાઢી છે. તેનું કારણ તે એમ જણાવે છે કે તે જગ્યાએ રહેનારા રાજ્યપૂતો તેથી નારાજ થાય તેમ છે. જ્યારે ને ત્યારે કોઈ પણ ધર્મ પ્રત્યે છળ કરવો હોય ત્યારે તેના વિરાધી ધર્મના માણુસોની ફરિઆદનો ગ્રશ્મ રણુ કરવાની પ્રપંચનાળ તો એકલો અકખરજ જાણે છે. ”

“ હું, પણ તમે જે વણિક કન્યાની વાત કહી તેને કૃયાં રાખવામાં આવી છે તે તમી જાણો છો કે ? ” પદ્માએ પૂછ્યું.

“ ખુદ આદશાહ નામવરના રાજમહાલયની સામેના ગૃહમાં. ”

“ હીક. ” એટલું બોલીને પદ્મા ચોડીવાર શાન્ત રહી. તે કાશ અત્યે એકી ટસે જોઇ રહી હતી.

“ દ્યારે હું આ આખરી બાહ્યાહુના બાધુ છલવા કે નહિ ? જાય અમાર જિતાર અત્યે જ્ઞાનતિ હશાની એંકે નહિ ? ” કાશનો પુનઃ જીતાંપાણી.

કાળને કોઈ પણ સીતે ક્રસાવ્યા સિવાય મુક્તિ મેળવવાનો માર્ગ પદ્મા માટે હતો જ નહિ. તે સિંહત કરી એલીઃ “કાળ! સર્વ ધર્મની છળ કરનાર અકુભરને હવે પરલોકમાં પહોંચાડી હેવો જ જોઈએ. તમારા વિચાર પ્રત્યે મહારી સમતિ જ છે એટલું જ નહિ; પરંતુ હું તમને તમારા કાર્યમાં યથાશક્તિ સહાય પણ આપીશ. બાહશાહને મારી ગેરહુાજરી જાણવામાં ન આવે તેમ મારે મહેલમાં પહોંચી જવું જોઈએ.”

“પુનઃ આપણને મળવાનું કયારે અને કયાં થશે.”

“આજ સથણે.”

“આજથી ચોથા દિવસે પધારશો ?”

“હા;”

“બહુ સારું, ત્યારે હવે પધારો ! આપને અહોથી જવાની વ્યવસ્થા તૈયાર છે.” કાળ નમ્ર સ્વરે એલ્યો.

અહૃપ સમયમાં પદ્મા કાળએ તૈયાર રાખેલા મીયાનામાં જઈ એડી અને જતાં જતાં તે દાંત કચકચાવી સ્વગત એલીઃ “નરાધમ ! તું રાજપૂતાણીને ઠગવા ધર્છે છે કે ?”



મુકુરાણુ ૧૦ મું

માનવમન.

લગભગ છેલ્હા ત્રણું ચાર દિવસ થયાં બાહશાહ રાત્રીએ પોતાના ખાનગી દિવાનખાનામાં રહેતો નહોતો. આથી જો કોઈ પણ વિશેષ કંદાળયું છોય તો તે પદ્માજ હતી. પદ્મા કાળને ક્રસાવીને નહાસી છુટી હતી. પાછી આવ્યા પછી અકુભર માટે તેનું હૃદય વિશુદ્ધ થઈ ગયું હતું. ને અકુભર પ્રત્યે તેના અન્નમાં દ્વેષ જાવના હતી, તે અકુભર માટે પુનઃ પદ્માના હૃદયમાં ગ્રેમબાવના જાગ્રત થિએ. અકુભરની ક્ષમા માગવા સારું

આજે પદ્મા અંગીરો થઈ ગઈ હતી. કાળુના કારસ્તાનની હકી-
કું અકુભરને કહી સંલાલવવા માટે આજે તેનું મન તલપાપડ
થઈ રહ્યું હતું. છેલ્લા એ દિવસો થયાંતે પોતાની દાસી જીલેખાં
સાથે બાદશાહને ઓલાલવવાનો સંદેશો મોકલતી હતી; પરંતુ
અકુભરનેના દિવાનખાનામાં તેમજ અન્ય કોઈ એગમના અંતઃ-
પુરમાં એ રાત્રિએ થયાં હુતોજ નહિ એવી ભાતમી મળતાં
ચદ્માના આશ્ર્યનો પાર રહ્યો નહિ. બાદશાહ રાત્રિના સમયે
કૃયાં જાય છે ? અને તે શા કામ માટે જાય છે, તેનો વિચાર
પદ્મા કરવા લાગી. કંઈ પણ રાજકીય ખટપટ ચાલી રહી હોય
તો વિચારભુવનમાં તે શા માટે ન જાય ? વારૂ, રાજકીય કારણ
ન હોય તો પોતાની એગમના સહવાસસુખનો ત્યાગ કરીને
અકુભર રાત્રિના સમયે શા માટે બહાર જાય ? અકુભરના
રાજ્યમાં શાન્તિ હોવાથી ચુદ્ધ થાય તેવો તો સંલવ નહોતો,
ત્યારે ધર્મ સંબંધી તો કંઈ ખટપટ નહિ હોય ને ? અને જો
તેમ હોય તો હિંદુધર્મની વિરુદ્ધમાં તો કોઈ ખટપટ નહિ
હોયને ?

પરંતુ છેલ્લા શબ્દો પદ્માના અંતરમાં ભાત્ર એક ક્ષણુ
પર્યાંતજ ટકી રહ્યા. અકુભર માટે હવે તેના હૃદયમાં સહજ પણ
આશાંકા રહી નહોતી; પરંતુ બાદશાહ સાથે એ ત્રણ દિવસ
થયા મેળાપ નહિ થતો હોવાથી તે ઉદ્ઘિન થઈને બપોરના
સમયે બાદશાહ રાજકારણાર સંબંધી ખટપટમાં ગુંથાયલો
રહે છે, એમ જણુવા છતાં પણ તેણે આજે જીલેખાને સંદેશો
લઈને મોકલી.

જીલેખા પદ્માનો સંદેશો લઈને ગઈ ખરી; પરંતુ તેના
સંદેશો અકુભરને પહોંચવાને હળુ સમય ન પાકયો. હોય તેમ
જેવી જીલેખા જનાનખાનામાંથી બહાર પડીને ખાસ દિવાનખા-
ના તરફ જવાના માર્ગ વળી કે તરતજ કાળ તેના જેવામાં
આવ્યો. જીલેખાને હવે કાળ પ્રત્યે તિરસ્કાર આવ્યો હુતો
અને અત્યારે તે અતિ મહુત્વના કામ માટે નીકળી હોવાથી

જુલેખા કાળ પ્રત્યે દિશિપાત નહીં કરતાં તે પોતાના માગે વળી. પણ કાળ કંઈ જુલેખાથી ગાંજ્યો. જથું તેવો નહોતો. તેણે તરતજ જુલેખાનો હાથ પકડ્યો. જુલેખા આ વખતે ગુસ્સે થયા વગર રહી નહીં. તેણે છણુકો કરીને કાળના હાથમાંથી પોતાનો હાથ છોડાવી દીધો. અને કોધપૂર્ણ સ્વરે બોલીઃ—હું કહું છું કે રાજમહાલયમાં પગ મૂકવાનું તમને પ્રયોજન શું છે? મસીદમાં બેઠાં બેઠાં માળાનો જાપ જપવાનું મૂકીને રહારા જેવી તરણીયોની પાછળ શા માટે જમો છો? અરે! એટલું જ નહીં; પરંતુ રાજકીય કારણોમાં માથું મારવા માટે બોંયરા અને—”

“ અરર, જુલેખા ભૂમાણુમા ન કર! ” જુલેખાના મેંઠાં પર હાથ મૂકતાં કાળ બોલ્યો; પરંતુ જુલેખા કાળને ગાંડે તેવી નહોતી. તેણે કાળનો હાથ પોતાના મેંઠાં પરથી ખસેડી દીધો. અને પૂર્વના જેવા ત્રાખદાર સ્વરે બોલવા લાગી “ કેમ રહારા કેડા મૂકવો છે કે નહીં? હું તમારી બધી ખટપટ જહાંપનાહુને—”

“ લે, જવા દઉં છું. પરંતુ કુપા કરીને ભૂમાણુમ બંધ કર! ” એટલું કહીને કાળએ જુલેખાને જવા દીધી. જુલેખાએ જતાં જતાં કાળ પ્રત્યે તિરસ્કારસૂચક દિશિ ફેંકી.

પરંતુ જુલેખા એ ચાર ડગલાં ભાગ્યેજ ગાંધ હુશે, એટલામાં ત્યાં છુપાએલી ચાર વ્યક્તિઓએ જુલેખાને મુશકેટાટ બાંધી દીધી અને તરતજ જુલેખાને લઈને તેઓ ત્યાંથી અદરશ થયા.

કાળ આ જનાવથી સંતુષ્ટ થયો. તેણે પોતાનું ડાકું ધુખ્યાંયું અને કંઠમાંથી માળા કાઢીને તે ફેરવતો ફેરવતો ત્યાંથી ચાંદયો. ગયો.

આ સર્વ બનાવ માત્ર અદ્ધી ક્ષણમાં અને તે એવી તો ચુપકીથી બનવા પામ્યો હતો કે બાળુના અંથસંઅહાલયમાં વાતચીત કરી રહેલી વ્યક્તિઓ તત્સંબંધી કંઈ પણ જાણી શકી

નહિ. અંથસંશ્રહાલયના દ્વાર પણ ખુલ્લાંજ હતાં; પરંતુ અંથસંશ્રહાલયમાં બેઠેલા અણુલક્ષ્યલ અને સલીમને તે સંબંધી કંઈજ ખખર પડી નહિ.

અણુલક્ષ્યલ પોતાના નિત્યના આસન પર બેઠો હતો. તેની સામે પુસ્તકેનો ટગ પડ્યો હતો. શાહજાહો અંથસંશ્રહાલયમાં આવી પહોંચતાં તેને બેસવાની જગ્યા કરી આપવા માટે અણુલક્ષ્યલે થોડાંક પુસ્તકો એકખીન પર ગોઢવી દીધાં હતાં. શાહજાહો પુસ્તકેના ટગલા પાસે બેઠો બેઠો એક પુસ્તકનાં પાનાં ફેરવતો હતો. સલીમ પુસ્તકનાં પાનાં એવા તો એદરકારીથી ફેરવતો હતો કે પ્રત્યેક ક્ષણે ‘ ફટ ફટ, ધ્વનિ થયા વગર રહેતો નહિં અને તે સાથે અણુલક્ષ્યલનું હૃદય ધાણુંજ કચવાતું હતું. પરંતુ સલીમને કંઈ કહી શકાય તેમ પણ નહોતું. તે તહૂન અસ્વસ્થ થઈને બેઠો હતો. અંતે શાહજાહાએ જેવી એદરકારીથી તે પુસ્તક જેયું હતું, તેથી વિશેષ એદરકારીથી તે પુસ્તકને જમીન પર પટકીને બોલ્યો: “ કેમ, હવે ઉત્તર આપો છો કે નહિ ? ”

સલીમે શું પ્રેરન પૂછ્યો હતો, તેતું કઝલને સમરણ રહ્યું નહોતું. તેણે પૂછ્યું:—“ આપે મહને શું પૂછ્યું ? ”

“ આવું કાર્ય કરવા માટે કુરાનનો આધાર મળી શકે નહિ ? ” સલીમે સિમત કરતાં પૂછ્યું.

“ કેવું કાર્ય ? ” કઝલે પુનઃ પૂછ્યું.

“ આનો અર્થ એવોજ કે મહારે તમને બધી હકીકિત ઝરીથી કહી સંભળાવવી પડશો. ” પોતાના મહેં પર હાથ ફેરવતાં સલીમ બોલવા લાગ્યો: “ ધારો કે એકાદ પુરુષના હૃદયમાં અસુક સ્વી માટે પ્રેમભાવના જાથેત થઈ છે. તેઓ બન્ને જુદી જુદી જાતના છે. પુરુષ મહાન શ્રીમાન અને સત્તાધિષ્ઠિત છે. સ્વી એક વણ્ણિક કન્યા છે. ” એટલું બોલીને સલીમ કઝલ પ્રત્યે તાકી તાકીને જોવા લાગ્યો.

“ અને એકાદ પુત્રને અદ્વિતીય “ શાહુજાહા સલીમ ” એ શબ્દો મૂકીએ તો ? ” ઝાજથે સિમત કરતાં પૂછ્યું.

આ શબ્દો સાંલળતાની સાથેજ શાહુજાહાની મુખમુદ્રા રક્તવર્ણ થઈ ગઈ. પોતાની પ્રેમકહુણી વડીલો જાણે છે, ત્યારે પ્રત્યેક તરણું કિંચા તરણપીઓના મુખમંડળ પર લંજળ, રક્તાતા ચમકવા લાગે છે. એટલું જ નહિ; પરંતુ તત્કાળ તેમનાં હૃદય ધમકવા લાગે છે. શાહુજાહા સંપૂર્ણ રીતે ગભરાઈ ગયો. ઝજલ પોતાનો મર્મ કણી જશે એવું તેણે સ્વાને પણ ધાર્યું નહેતું. પરંતુ ભાણ્ય દસ્તિ અરસિક અને શુદ્ધ જણુતાં ઝજલે પોતાની રસિકતા વ્યક્ત કરી, તેથી શાહુજાહાની સ્થિતિ ધણી વિચિત્ર થઈ પડી. અંતે ઝજલે બોલવાનું શરૂ કર્યું. “ રાજકીય કારણોમાં વિક્ષેપદૃપ થઈ પડે તેવું કાર્ય આપના હાથથી ન થવા પામે તો ધણું સારું ! શાહુજાહા આપ નામવરની કુરાન પ્રત્યે સારી શ્રદ્ધા જણ્યાય છે. પ્રત્યેક ધર્મમાંથી સત્યાન્વેષણ કરીને પ્રત્યેક વિચારોની કસોટી કરીને તેની પરિક્ષા દેવાની જે ધર્યા જહાંપનાહને અહુનિષ થયા કરે છે તે—”

“ એટલે ? પિતાશ્રી કુરાનની આજા પ્રત્યે શ્રદ્ધા નથી ધરાવતા કે શું ? ” આક્ષર્ય પામતા સલીમે પૂછ્યું.

સલીમે આ પ્રેન ઝજલને સહજ મોટેથી પૂછ્યે. હતો. તેના તે પ્રશ્નનું શું પરિણામ આવશે તેની જે તેને માહિતી હોત તો તે ઝજલને આ પ્રશ્ન પૂજતજ નહિ.

* * * *

વાંચનાર ! ચાલો આપણે આ બાળુ પદ્માની સ્થિતિનું અવદોકન કરીએ. જીલેખાં હમણા આવશે, ધડી પણી આવશે, એમ માર્ગ પ્રતીક્ષા કરતાં કરતાં લગભગ અદ્ધી ઘરિકા વીતી ગઈ, મન અને પાંચ ઈંદ્રિયોનો સંબંધ એવો નિકટ છે કે મનમાં જે પ્રકારનો અને જે પ્રમાણોનો વિકાર થાય તે પ્રમાણોની અને તેવાજ પ્રકારની વિકૃતિ પાંચે ઇન્દ્રિયો અનુભવવા માંડે છે.

જીલેખાને પાછી આવતાં વિલંબ લાગવાથી જયારે

પદ્માનું મન અસ્વસ્થ થયું, ત્યારે તેની માનસિક અસ્વસ્થતા તેના શરીર વ્યાપારમાં તત્કાળ પ્રતિભિમિષત થઈ. તે અનેક વખત પોતાના આસન પરથી ઉલ્લી થઈ. અનેક વખત, તે બારીમાં જઈને ઉલ્લી રહી. જુલેખાને વિલંખ શાથી થયો, એજ વિચાર તેના મનમાં એક સરખી રીતે ધુમવા લાગ્યો. અંતે તે કંટાળીને પોતાના પલંગ પર જઈ પડી.

પરંતુ શાખાનો સ્પર્શ થતાંની સાથેજ તેના મનમાં એક કંદપના ઉદ્ભાવી. તે તરતજ ચમકીને છેડી થઈ. અને વિચારવા લાગી કે બાદશાહ કદાચ કંઈ જરૂરી કામમાં ગુંથાયા હુશે, જેથી દિવાનખાનાના પહેરેગીરે જુલેખાને અંદર જવા દીધીજ નહિ હોય! કદાચ તે દિવાનખાનાના દ્વાર પાસે રાહ જોઈને પણ એસી રહી કાં ન હોય! હવે તેણું પોતેજ બાદશાહ પાસે જવાનો પોતાના મનમાં દઢ નિશ્ચય કર્યો.

અધીર મનુષ્યના મનમાં કંઈ કંદપના ઉદ્ભબતાની સાથે જ તે તેનો અમલ કરે છે. તે પ્રમાણે બાદશાહને જાતેજ જઈને મળવાનો વિચાર ઉદ્ભબતાંની સાથેજ પદ્મા પોતાના વખ્ટો બદલીને બહાર નીકળી પડી.

પદ્મા ઉતાવળે પગે જનાનખાનાની બહાર નીકળી પડી. તેનું મન અત્યારે બાદશાહમાંજ મળ થઈ ગયું હતું; પરંતુ પદ્મા અંથસંઅહાલયની પાછળ થઈને ખાસ દિવાનખાના તરફ જતી હતી, એટલામાં તેના કર્જું પર ધ્વનિ આવ્યો કે— “ એટલે ? પિતાશ્રી કુરાનની આજા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા નથી કે શું ? ”

આ વાક્ય સાંભળતાંની સાથેજ પદ્માની ખાત્રી થઈ કે શાહજાહાં સલીમ અંથસંઅહાલયમાં કોઈની સાથે વાતચિત કરતો એઠો છે. અકખરનું વલણું કયા ધર્મ પ્રત્યે વિશેષ છે, ઈન્હું ધર્મ પ્રત્યેની લાગણી તેની કેટલા અંશે સાચી છે, વગેરે પ્રશ્નો પદ્માના અંતમાં નિરંતર એક સરખી રીતે ગોળાતા હોવાથી “ એટલે ? પિતાશ્રી કુરાનની આજા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા નથી

કેશું ? ” એ વાક્યથી પદ્માની જિજાસા વધી. આ સંવાદ કેવા અકારનો છે. તે સાંભળવાની તેને હચ્છા થઈ. તે દિવાલની એવે ઉલ્લી રહી અને કાન માંડીને સાંભળવા લાગી.

* * * *

“ નહિં, નહિં. જહાંપનાહ કુરાન પ્રત્યે બિલકુલ શ્રદ્ધા ધરાવતા નથી એમ તો નજ કહી શકાય ” આ વાક્ય બોલેનાર અખુલકુલનો સ્વર પજાએ તરતજ ઓળખી કાઢ્યો. કુલત આગળ બોલવા લાગ્યો: “ પરંતુ કુરાનમાં અમુક આજા લખી છે તદ્દનુસાર અંધશ્રદ્ધાથી વર્તવું જ જોઈએ, એવો વિચાર જહાંપનાહને બિલકુલ પસંદ નથી. પ્રત્યેક બાખ્તમાં મનુષ્યે સ્વવિચાર શક્તિનો ઉપયોગ કરીને-ત્યાજય બાખ્તનો ચોચ્ય વિચાર કરીને પોતાને વાસ્તવિક લાગે એવો અમુક માર્ગ અહુણુ કરવો જોઈએ, અને કુરાનપ્રશ્નીત ધર્મ આપણો હોવાથી તેને સર્વોત્કૃષ્ટ ગણુવો જ જોઈએ, એ કેવળ મૂર્ખાઈ છે એવું જહાંપનાહનું માનવું છે.”

“ ત્યારે પિતાશ્રી હિન્હુધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે કે ? ”

“ કેટલાક લોકોની એવી પણ માન્યતાછે; પરંતુ વસ્તુતઃ અમુક ધર્મ પ્રત્યે બાદશાહ નામવરણી ખાસ પ્રીતી છે એમ કહી શકાય તેમ છે જ નહિં. કે મનુષ્ય પ્રત્યેક બાખ્તની મીમાંસા કરવાની હચ્છા ધરાવે છે, તે અમુક ધર્મ પ્રત્યે ખાસ વલણ ધરાવી શકે જ નહિં. કારણુ કે પ્રત્યેક ધર્મમાં કાલ પરિવર્તનની સાથે આપણુને અનેક હોષો મળી આવે છે. નિરનિરાવા ધર્મ, વિધિ અને શાસ્કકમ તે તે ધર્મના પ્રાથમિક તત્વો નથી; પરંતુ કાલપવાહની સાથે ચાંટેલી શેવાલની જણથી ખરડાઈ રહ્યા છે. માટે સારાસારના વિચાર તૃપી પ્રખર જ્યોતિ પ્રગટાવીને મનુષ્ય એક વખત સત્યશોધન શરૂ કરતાંની સાથે જ તે પ્રત્યેક ધર્મમાંથી અનેક દોષ શોધી શકે છે. આથી જ જહાંપનાહને કુરાનપ્રશ્નીત ધર્મ માન્ય નથી. તેમજ હિન્હુધર્મને પણ તે સંપૂર્ણરીતે અંગીકાર કરતા નથી. તેમની માન્યતા એવી છે કે પ્રત્યેક મુરા મનુષ્યે પોતાના મનપર વિશ્વાસ રાખીને પોતાના મનમાં

કહેલો તત્વોને એક ધર્મ તરીકે ગણુંબો. ઈસ્લામી ધર્મને છુંદી નાખુંબો યાતો હિન્હદુર્ધર્મના ગુણુગાન કરવાં એવો તો તેમનો ઉદેશ જ નથી. સ્વપ્રાણીત ધર્મની સ્થાપના કરવાની તેમની છુંછા છે.”

“ યાતો હિન્હદુર્ધર્મના ગુણુગાન કરવાં એવો તેમનો ઉદેશ જ નથી ” આ શબ્દો સાંલળતાંની સાથે પદ્ધાના મનમાં જે ભાદ્યશાહુને મળવાની ઉમ્રીઓ ઉછળી રહી હતી, તે એકાએક શાંત થઈ ગઇ. કેટલાંક મનુષ્યોની પ્રકૃતિજ એવી હોય છે, કે તેમનાં મનપર અમુકપ્રકારની છાપ સત્ત્વર પાડી શકાય છે. એવાં મનુષ્યોને “ લતાવૃત્તિવાગ્માં ” ગણી શકાય. જેમ એક લતાને અમુક વૃક્ષપર પર ચઢાવી એટલે તે વૃક્ષપર વિટળાઈ ગયા સિવાય તેને અન્ય માર્ગ જડો જ નથી, તેમજ આવા માણુસાની મનઃસ્થિતિનું હોય છે. અમુક અનુભવ થતાંની સાથે જ આવા મનુષ્યનું મન તેવું બની જાય છે અને તેનાં મતની પુષ્ટિ માટે તેજ વિચારનો પ્રવાહ વહેવા લાગે છે. પરંતુ પુનઃ બીજા પ્રકારનો વિચાર તેના સામે મુકાતાં જ વળી તેનું મન તેવું બની જાય છે. આજે તે એક મનુષ્યને ધિક્કારે છે, તો આવતી કાલે તેજ મનુષ્યનાં ચરણોમાં ત પોતાનું શિર જુડાવે છે.

પદ્ધાના હૃદયમાં અકખર પ્રત્યેનો દ્રેષ્ટાવ કાળ સાથેના સંભાષણુથી નથી થયો હતો. અને તે સમયે તેને પોતાના વર્તન અદ્દલ પશ્ચાત્તાપ થયો હતો. એટલું જ નહિ પણ તે માટે ક્ષમા લીક્ષા માગવા અત્યારે તે અકખર પાસે જતી હતી; પરંતુ કુજલના સંભાષણુથી તેની વિચાર માગાનો મેરુ ચલાયમાન થયો હતો. તેના મનમાં પુનઃ વિવિધ પ્રકારની આશાંકાઓ ઉફ્ફસવવા લાગી. તે વખતે કાળએ પણ કણું હતું કે અકખરને ઈસ્લામી ધર્મ પણ જેઈતો નથી, તેમજ તેને હિંહુ ધર્મની પણ જરૂર નથી; પરંતુ તેણે પોતાની જ કીર્તિ વધારવી છે. અને આજે કુઝલે પણ એવું જ કણું આનો. અર્થ શું? અન્ને વિરોધી ધર્મના લોકોને આપસ આપસમાં લડાવી મારીને અકખર તે અન્નેનો નાશ કરવા ઈંદ્રે છે કે શું?”

આ શંકા પદ્માના મનમાં ઉદ્દેશવતાંજ તેના પૂર્વના વિચારોને શોખી લીધા. જેમ એકાદ પાણ્ણીના વાસણુમાં થોડો ધંણો રંગ નાંખવાથી તે પાણ્ણીનો રંગ બહલાદ જય છે, તે પ્રમાણે પદ્માના સર્વ વિચારો ક્ષણુમાત્રમાં બહલાદ ગયા. તે વિચારવા લાગી હે—”

“ મહેં અત્યારે જઈને બાદશાહની ક્ષમા માગી હોત તો અહારા હુથે ડેવી કયંકર ભુલ થવા પામત ! ”

આ પ્રમાણે વિચાર કરતી પદ્મા દિવાલ પાસે ઉલ્લિ હુટી. અદ્યપ સમયમાંજ તેણે એક વ્યક્તિને પોતાની તરફ આવતી જોઈ. તેણે ઉંચું મહેં કરીને જેણું તો બાદશાહ અકૃષ્ણ !

પદ્મા તરતજ ત્યાંથી ચાલતી થઈ. પોતાનો કેશકલાપ સમારતી તે ત્યાંથી હરિણ્ણની માઝુક હોડી ગઈ.

બાદશાહ અકૃષ્ણ આશ્રીય પામતો થોડીવાર ત્યાંજ છિલો રહ્યો. પદ્માના વર્તનથી તે સહુજ પણ આશ્રીય પામયો નહું. તેની મુખમુદ્રા પર સંતાપની છાયા વિલહી રહી. તેના મહેંમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા: “ હુઠીલી લી ! ઈશ્વરના નિયમ ખરેખર વિચિત્ર છે ! પ્રેમહાન અને તેનો સ્વીકાર આ જગતમાં એકજ સ્થળે કેમ દિણોચર થતાં નહીં હોય ? ”

પ્રકુરણ ની મું.

પ્રયત્નશીલ પદ્મા.

કુષ્ણુપક્ષની અંધારી રાત્રી અને તેમાં વરસ્તતા વરસાદને દીધે દોકો પોતાના ઘરમાં શાંતિથી બેઠાં હતાં. તે વખતે શહેનશાહ અકૃષ્ણના રાજમહાલયની સામેના ગૃહ પાસે એક અંધાર પડદામાં છુપાયેલ વ્યક્તિ આવી પહોંચી. ને તે મહાલયના દ્વાર ઉપર તેણે પોતાના હુથની આંગળીઓ વડે પ્રથમ એક,

પછી છે, અને પછી ત્રણ, એમ ત્રણ વખત દીચકીએ વગાડી. અદ્વિતીયમાં જ તે ગૃહનું ક્ષાર ઉઘણું. પેલી વ્યક્તિએ તે ગૃહમાં પ્રવેશ કર્યો કે તરતજ ગૃહનું પ્રવેશક્ષાર બંધ થયું.

“ ઝૂતમા ? તે અત્યારે જાયત તો હશેને ? ” પેલી આવનાર વ્યક્તિએ ગૃહની અંદરના દાદરપર ચઢતાં ચઢતાં પૂછ્યું.

“ હા; એગમસાહેખા, મહેં તેને આપનો સંદેશો પહેંચાડ્યો હોવાથી તે અત્યારે આપની રાહ જોતીજ એઠી હશે.” ઝૂતમાએ ખુલાસો કર્યો.

“ વાર્દ ; ” એટલું કહીને તે વ્યક્તિ શાન્ત રહી.

ઝૂતમા આવનાર વ્યક્તિને સાથે લઈને દાદર ચઢવા લાગી. અદ્વિતીયમાં ઝૂતમા અને તે વ્યક્તિ એક એકાન્ત ઓરડા પાસે આવી પહેંચ્યા એટલે ઝૂતમા એલી : “ એગમ સાહેખ ! કોઈપણ વ્યક્તિ સાથે ચંપાનો મેળાપ નહિ થવા દેવાનો જહાંપનાહે સખત હુકમ કર્યો છે. આપ અહિં આવ્યા છો એ વાતનો તે નામવરને સહજ પણ શક જશો તો મહારા પ્રાણ જોખમમાં આવી પડશો.”

“ તું તદ્દન નિશ્ચિંત રહે ! મહારે ચંપાની સાથે થોડી વાતચિત કરવાની છે. રહુડાં કાર્ય પૂર્ણ થશે કે તરતજ હું કોઈને પણ ખખર ન પડે, તેવી રીતે અહિંથી શુપચુપ ચાલી જઈશ.”

“ વાર્દ, ત્યારે હું હવે જાઉં છું. આપ પાછા ફરો ત્યારે દાદરની નળુકના ઓરડા પાસે આવીને આપ મહને ધીમે સ્વરે ભૂમ પાડજો.” એટલું કહીને ઝૂતમા ત્યાંથી ચાલી ગઈ.

પેલી વ્યક્તિએ તરતજ ચંપાના ઓરડામાં પ્રવેશ કર્યો. આ ઓરડા કંઈ એટલો બધો સુસનિયત નહોતો. ઓરડામાંની જમીનપર એક ગાલીચા ભીછાવેલો હતો. મધ્ય ભાગમાં એક ગોળ મેજ પડેલું હતું અને તેની આસપાસ ત્રણ ચાર ખુરસીએ પડેલી હતી. એક ખુણ્ણામાં પાણીનો ધડો જણ્ણાતો હતો.

“ એગમસાહેભાને હું નમન કરું છું. ” આવનાર વ્યક્તિને પ્રણામ કરતાં ચાંપાંશે ઉલા થઈને વિનયપૂર્ણ સ્વરે કહ્યું.

“ નહિ, નહિ, તમે મહુને પ્રણામ કરવા લાયક નથી. મહુને નમન કરીને આપ મહુને ફૂષિત ન કરો. ” આવનાર વ્યક્તિએ પોતાના મહેંપરને ખુરખો ફર કરતાં કહ્યું.

ચાંપાંશે એગમને ખુરસીપર ઐસવાનો નેત્રસંકેત કર્યો એટલે તે એક ખુરસીપર બેઠી. બીજુ એક ખુરસી સહજ ફર ખસેડીને તે પર ચાંપા બેઠી અને તે બોલીઃ— “ હેવિ ! આપના દશાંનથી મહુને આજે અનહૃદ આનંદ થાય છે. ”

ખેણ ! એગમે બોલવાનું શરૂ કર્યું. આપને અહિં લગભગ એક મહિના સુધી એકાન્તવાસમાં રહેવાની નામવર જહાંપનાહે કુરજ પાડી છે તે બાખતની અધર મહુને પ્રણ ચાર દિવસ પૂર્વેજ મળી છે; નહિંતર હું તમને વહેલી મળવા આવત. વારૂ, પણ તમારું ધ્યાન જાણવાની મને આકંશા છે તે તૃપ્ત કરશો કે ?

“ ધણી ખુશીથી ” ચાંપાંશે નીચી નજરે જોતાં કહ્યું.

“ તમે કંઈ જ્ઞાતિમાં જન્મ પામ્યા છો ? ”

“ વણીક ”

“ બાદશાહ નામવરનો એવો તો શો અપરાધ તમે કર્યો છે કે તેમણે તમને આમ નજરકેદની પેઠે રામ્યા છે. ”

“ બાદશાહ નામવરનો મહેં કંઈજ અપરાધ કર્યો નથી અને હું તેવું કરવાની ધર્યા પણ ધરાવતી નથી. ”

“ ત્યારે તમને નજરકેદ કરવાનું કંઈ કારણ ? ”

“ કારણ એજ કે મહારા બ્રત બદલ નામવર જહાંપનાહના હૃદયમાં શંકા ઉદ્ભવી છે, જળપાનપર છ છ માસ સુધી રહી શકાય એ વાત સાચી છે કિંબા જુદી છે, તેની પ્રતિતી કરવા સારુ તેમણે મહુને આ એકાન્તવાસ આપ્યો છે; પરંતુ જાણ્યે કે અજાણ્યે જે કંઈ ધનવા પામ્યું છે, તે સૌ સારાનેજ માટે છે. ”

“ તમને નજરકેદ કરવાથી બાદશાહ નામવરનું શું
સારું થઈ રવાનું હતું ? ”

“ હું નજરકેદ થવાથી બાદશાહ નામવરનું એકલાનું જ
કર્યાણું થવાનું નથી; પરંતુ તેથી જગતના મોટા લાગનું
કર્યાણું થવાનું છે એવી મહારી દદ પ્રતીતિ છે. ”

“ એટલે ” એગમે આશ્ર્ય પામતાં પૂછ્યું.

“ એટલે એજ કે બાદશાહ નામવર સત્યના પરિક્ષક છે.
મહારી કસોટી કરવાની તેમની ઇચ્છા પૂર્ણ થવાથી બાદશાહ
અકભરના હાથે એવાં સુકૃતિપૂર્ણ કૃત્યો થવાનાં છે કે જેથી
તેમનું નામ ભારતવર્ષના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કેઠારાઇ
રહેશે. ” ચાંપા બોલી.

“ તમને બાદશાહ નામવરના સ્વભાવનો કંઈ પરિચય
છે કે ? ”

“ ના; ”

“ ત્યારે તમે શા ઉપરથી માનો છો કે બાદશાહ નામવ-
રના હાથે અમુક સુકૃત્યો થવાનાં છે ? ”

“ કારણું એજ છે કે બાદશાહની હુલમાં ધાર્મિક સત્ય
શોધવાની તૃષ્ણા વધતી જાય છે. પ્રત્યેક ધર્મના ધર્મગુરુઓને
સિક્કિમાં બોલાવીને તેઓની પાસે અકખર હંબાદતખાનામાં
ધાર્મિક ચર્ચા ચલાવે છે. અકખરશાહનો સ્વભાવ એવો છે કે
તે સ્વખુદ્ધિનો ઉપયોગ કર્યો સિવાય કોઈપણ ધર્મજ્ઞાનું
અન્ધશ્રદ્ધાથી પાલન કરતાજ નથી. જુદા જુદા ધર્મના તરવો
જાણુવાનો તેમને બહુ શોખ છે. અત્યારસુધીમાં બાદશાહે
વિવિધ ધર્મો સંબંધી જ્ઞાન મેળંયા પછી હવે તેમણે અમારા
ધર્મનાં તરવો જાણુવાની પ્રવૃત્તિ આદરી છે. ”

“ તમારો ધર્મ કયો ? ” એગમે સિમત કરતાં પૂછ્યું.

“ અમારો ધર્મ જૈન છે. ”

“તમારા ધર્મના સુખ્ય લતવેનું મુને થોડું ધાણ
શાન આપશો ? ”

“અમારા ધર્મમાં ઈદ્વિયેને જીતવાનું સુખ્ય કુરમાન
હેવાથી અમારા માટે ‘જૈન’ શાખ વપરાયો છે. બાકી
કેંદ્ર પણ જીવ પ્રત્યે દ્વા પ્રેમ રાખવો. ગ્રાણુનો પણ સત્ય
ઓલાવું, પરાઈ વસ્તુ ન લેવી, પરપુરુષને ભાઈ, આપ
ગણુવા ને બને તેટલો મમત્વભાવ ઓછો કરવો એ જરૂ-
રનાં કુરમાનો છે. અમારા ધર્મગુરુ શ્રી હૃરવિજયસૂરિજી
અતે થોડા વખતમાં બાદશાહના ઓલાવવાથી આવવા સંભવ
છે. તેમનાથી વધારે આપ જાણી શકશો. ચંપાએ ખુલાસો કર્યો.

“બહેન ! ” એગમે ચંપા પ્રત્યે તાકી રહેતાં પૂછ્યું:
“જહાંપનાહનો હિંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ તમને સાચો જણ્યાય
છે કે ? ”

“એટલે ? આશ્ર્ય પામતાં ચંપા ઓલી. એગમ
સાહેણા ! આપ નામદાર ખુદ જહાંપનાહના પત્ની હેવા છતાં
આપ હુલ સુધી તેમનું હૃદય ઓળખી શક્યાં નથી કે શું ? ”

“ના, ના; એમ તો છેક નથી; પરંતુ મહારા સાંભળવા
પ્રમાણે બાદશાહને તો હિંદુ ધર્મ પણ જોઈતો નથી અને
તેમને ઈસ્લામી ધર્મ પણ જોઈતો નથી. ”

“એટલે બન્ને ધર્મમાં પરસ્પર જગડા ઉપસ્થિત કરીને
બાદશાહ બન્ને ધર્મનો નાશ કરવા ઈચ્છે છે એવું તમે માનો
છો ? ”

“મુને એવું લાગે છે ખરૂં.

“ત્યારે એ આપનો સર્વથા ભાસ છે. ધર્મ ચિકિત્સક
મનુષ્ય બહુધા અપ્રિય થઈ પડે છે; કારણ કે તે પ્રત્યેક ધર્મ-
માંના દોષો શોધી કાઢીને તેનો નાશ કરવા ઈચ્છે છે.
તે ધર્મની જૂની માન્યતાઓને બણગી રહેનારાઓને બિલ-
કુલ પસંદ પડતું નથી. આગળના ખાંદશાહેના સમયમાં હિંદુ-

એને તેમની દુઃખ વિરુદ્ધ વર્તલાવીને સુસલમાન ધર્મની દીક્ષા આપવામાં આવતી બાહશાહુ અકખર એવું તો કંઈ કરતા નથી ને ? તેઓ ખુદ પોતાના ધર્મના દોષો પ્રત્યે પણ તિરસ્કારની દિદિથી જૂએ છે. સમયાનુસાર ધાર્મિક પરિવર્તન થવાની પણ જરૂર આપને નથી લાગતી કે ? પ્રત્યેક ધર્મના તત્ત્વો દેશ, કાળ અને સ્થિતિને અનુસરતા હોવા જોઈએ. અક બરે હજુસુધી દીસ્તલામી ધર્મ, હિન્દુ ધર્મ કે અન્ય કોઈપણ ધર્મને રાષ્ટ્રીય સ્વરૂપ આપવાનો પ્રયત્ન થોડો જ કર્યો છે ? અલભતા, તેમનો ધર્મચિકિત્સક સ્વભાવ કેટલાકને નહિ રૂચતો હોય, પરંતુ તેના શાસનકાળમાં શાન્તિ, સમભાવ અને ધાર્મિક છુટ પડાવી લેવાના પ્રયત્ન થતા નથી એટલું નષ્ટી છે. ”

ચંપાની વક્તવ્યકળાથી બેગમ તો દિંગ્મૂઠ જ થઈ ગઈ. અકખર પ્રત્યેનો તેનો સહભાવ જોઈને તે આનંદ પામી. તે ચંપા પ્રત્યે તાકી તાકીને જોવા લાગી. ચંપાની સુખમુદ્રાપર આનંદની છાયા વિલસી રહી હતી. નજરકેદ થવાથી તેના મનને સહજ પણ હુઃઅ થયું હોય એવું તેની સુખ મુદ્રાપરથી જણાતું નહોતું. ઉલટું આજે તેનું વહનમંડળ પ્રકૃતિત જણાતું હતું. અદ્ય સમય સુધી શાન્ત રહ્યા પછી બેગમ બોલીઃ “ ચંપા જેણ ! આપના ભંભાષણથી આજે ઝૂહારી કેટલીક આશાંકાઓ ફૂર થઈ ગઈ છે. આપનો સહૃદાત્મક અને ધર્મશરીલ સ્વભાવ જોઈને હું અતિ પ્રસન્ન થઈ છું. તમે કહો તો હું જ્ઞાંપનાહુને કહીને અહિંથી તમારો સત્ત્વર છુટકારો કરાવી શકું તેમ છું ? ”

“ નહિ, બેગમ સાહેખા ! એમ ઉતાવળ કરવાની કંઈ જ જરૂર નથી. યોગ્ય સમય પ્રાપ્ત થતાં સૌ સાંઝે થશે. ઝૂને અહિં કોઈ પણ પ્રકારનું હુઃઅ નથી. ”

“ ઢીક, ત્યારે હું હુવે રણ લઇશ. રાત્રિ ધણ્ણી વીતી જવા આવી છે. ” એટલું કહીને બેગમ ઉભી થઈ અને યુરઘો પહેરી વેતાં ઓરડાના દ્વાર પાસે જઈ પુનઃ બેગમને કંઈ સાંભર્યુ હોય તેમ પાછા વળી ધીમેથી બોલી “ ચંપા જેણ ! હું પણ એક

રાજપૂતાણી છું અને ભાગ્યવશાતું ખાદ્યાહુ અકૃષ્ણના જનાન-
ખાનામાંની એગમ અનવા પામી છું. મહારા જેવું કંઈ પણ
કામ. હોય તો ઝૂતમાને કહેશો એટલે તે મહુને સત્તવર સંદેશો
પહેંચાડશો. ”

“ બહુ સારું, પધારને. ” ચંપાએ વિવેક દર્શાવ્યો.

અદ્વિતીયમાં જ એગમ આવી હતી તે રસ્તે થફુને
અપાટાખંધ ચાલી ગઈ. દાદર પાસે પહેંચતાની સાથે જ એગમે
ધીમે સ્વરે ખૂબ પાડી. “ ઝૂતમા ! ઓ ઝૂતમા ! ”

“ જ હજૂર ” કરતી ઝૂતમા અદ્વિતીયમાં જ બહાર
આવી.

એગમ અને ઝૂતમા અટઅટ દાદર ઉત્તરતાં પ્રવેશ
ક્રાર પાસે આવી પહેંચ્યા પછી એગમે ઝૂતમાના હુથમાં દસ
સોનામોહરે મૂકતાં કલ્યું કે “જે, તે વણિક કન્યા હિન્દુ ધર્મી
છે. તેના જેવી પવિત્ર સાધ્વીના શિર ઉપર અહીં કોઈ પણ
પ્રકારનું સંકટ આવી ન પડે તેની ખાસ સંલાળ રાખને. ”
એટલું કહુને એગમ પ્રવેશકારની બહાર નીકળી પડી. પ્રવેશ
ક્રાર બંધ થયું.

પ્રકુરણુ ૧૨ મું.

એકાન્તવાસમાં આપત્તિ દર્શાન.

મબાન્તિ નમ્રાસ્તરવઃ ફલોદ્રમૈનવામ્બુમિર્ભૂરિ વિલમ્બિનો ઘનાઃ।
અનુદ્રતાઃ સત્પુરુષાઃ સમૃદ્ધિમિઃ સ્વભાવ એવૈष પરોપકારિણામ्॥

મર્તૃહરિઃ ॥

ભાવાર્થ:—કુળ આવવાથી વૃદ્ધો નભી જથ છે, નવાં
જળથી મેધ નભી જથ છે, તેમ સમૃદ્ધિથી સત્પુરુષો પણ નાગ
બને છે. કારણું પરોપકારીઓનો એ સ્વભાવજ છે.

પદ્માના ગથા પછી ચંપા રહુમેની ખારી પાસે ખુરસી
પર એકી એકી કંઈક કિયાર કરવા લાગી.

પોતે ધર્મચરણ કરવા છતાં પણ માત્ર ખાદશાહની આજ્ઞાથી એક બંદીવાન જેવી થઈ પડી હતી એમ વિચારતાં ચંપાના નેત્રો-નયનોમાં અશુલરાઈ આવ્યાં. તેનું હૃદય હુંખીત થયું. જમીન પ્રત્યે દષ્ટિ ફેંકતી તે એક પણ હૃદયોદગાર કાઢ્યા સિવાય એમને એમ બેસી રહી.

ચંપા આ પ્રમાણે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠી હતી એવામાં તેના ઓરડાના દ્વાર પાસે તેને કોઈ મનુષ્યનો પગરવ સંભળાયો. તે એકદમ ચમકીને ઉભી થઈ. ચંપાએ દ્વારલખી દષ્ટિ ફેંકી તો એક કાળા વખ્તમાં છુપાએવ વ્યક્તિને પોતાના ઓરડામાં પ્રવેશ કરતી તેણે જોઈ. ચંપા ગલરાયલા સ્વરે બોલી ઉઠી: “આપ કોણું છો ? અત્યારે અહિં આવવામાં આપનો શો ઉદેશ છે ? ”

“ સુંદરી ! સહજ પણ લય પામશો નહિં. મહારા આગમનનો ઉદેશ તમારા કલ્યાણ માટે જ છે. ” આવનાર વ્યક્તિ ધીમે સ્વરે બોલી.

“ મહારા કલ્યાણ માટે ? ” ચંપા તે વ્યક્તિ પ્રત્યે આશ્ર્યથી જોતાં બોલી.

“ હા; કેવળ તમારા જ કલ્યાણ માટે ? ”

“ તમે મહારાં શું કલ્યાણ કરવા ઈંચોં છો ? ”

“ જો તમે મહારાં કહું માનીને મહારી છચ્છાને આધીન થશો તો મહારા હાથે તમારાં કલ્યાણ થશો અને આ કારાગૃહ-માંથી તમને તુર્ત મુક્તિ પણ મળશો.

“ હા; ” ચંપા અવાક્ર રહી.

“ કેમ, શું વિચારમાં પડ્યા ? ”

“ કંઈ નહિં; તમે કોણું છો તે મહુને પ્રથમ જણુવશો કે ? ”

“ હું કોણું છું, તે હું હમણાં જણુવી શકીશ નહિં. માત્ર હું પૂછું તેટલા પ્રેનોનો ઉત્તર મહુને આપશો કે ? ”

“ તમે મહુને શા શા પ્રેનો પૂછવાની છચ્છા રાખો છો ? ”

“ તમે ખુલાસો આપી શક્યો તેવા સાદા અને સરલ પ્રેનો પૂછોને જ હું સંતોષ પામીશ. ”

થોડીવાર વિચાર કર્યો પછી ચંપા બોલી; “તમારા પ્રેરનોના ઉત્તર આપી શકાય તેવા હશે તો હું અવસ્થ્ય પ્રત્યુત્તર આપીશ.”

“જ્ઞાનો,” તે વ્યક્તિ એકવાર ચેમેર દાખિયાત કરીને ધીમે સ્વરે બોલવા લાગી. કોઈપણ જાતના અપરાધ સિવાય ભાદશાહ અકૃષ્ણ રે તમને અહિં નજરકેદ કરેલાં છે. ભાદશાહનું આ કૃત્ય તમને વ્યાજખી લાગે છે કે ? ”

“હા;” ચંપા બોલી.

“હું ! આ તમે શું બોલો છો ? ” તે વ્યક્તિ વિસ્તય પામતી બોલીઃ ” નજરકેદી તરીકે રહેવામાં પણ તમને સુખ લાગે છે ? ”

“આ પ્રશ્નનો વિશેષ ઝુલાસો હું આપી શકતી નથી.” ચંપા સહજ કંટાળીને બોલી.

ચંપાના આ એદરકારીભર્યો જવાખ્યો ઉપરનો પ્રશ્ન તેને રૂચ્યો નહોટો એ વાત આવનાર વ્યક્તિ સહજમાં કળી ગઈ. થોડીવાર મૈન રહ્યા પછી પુનઃ તે બોલીઃ—“વાર્ષ, કદાચ કંઈ અવિનય જેવું, જથ્યાય તો ક્ષમા કરશો. તમે આવી સુકુમાર અવસ્થામાં આવું દેહદમન. કરીને યોગિની જેવું જીવન શામાટે ગાળો છો ? ” એટલું બોલીને તે વ્યક્તિ ચંપા પ્રત્યે સહેતુક દાખિયાત કરતી તાકી રહી.

“આ જન્મના તેમજ પૂર્વ જન્મના પાપસંચયને બાળીને-ભાસ્મ કરીને નિર્વાણુ પ્રાપ્તિ કરવા માટે જ. ”

“હુનિયામાં જન્મ પામીને સંસાર સુખનો લેશ માત્ર પણ આસ્વાદ લેવાની તમને વૃત્તિ થતી નથી ? ”

“ના; બિલકુલ નહિં” ચંપા આવનાર વ્યક્તિના આવા વિચિત્ર પ્રેરનો સાંભળીને વિસ્તિત થઈ. ને તેના પ્રત્યે હોધપૂર્વ દાખિ ફેંકતાં બોલી.

“વાર્ષ, તમે જૈનધર્મી છો ને ? ”

“હા,”

“ત્યારે કોઈ પણ પ્રાણીના હૃદયને હુઃખ ન થાય એવું જીવન ગાળવું એ જ તમારા ધર્મનો સાર છે ને ? ”

“ અલાણત. ”

“ત્યારે તમારા લીધે કોઈપણ મનુષ્ય-પ્રાણી હુઃખિત થતું હોય તો તમારે તેનું હુઃખ ટાળવું તે તમારે ધર્મ ખરો કે ? ”

“ મારા લીધે ? —હું કોઈને હુઃખ આપવામાં કારણુભૂત હોડું તો તે માટે મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. ”

“ ત્યારે તમારા લીધેજ હુઃખ પામતી વ્યક્તિતું હુઃખ ફૂર કરવાને વચન આપો તોં તે વાત હું તમોને જણાવી દઉં. ”

“ પરંતુ કોઈપણ વાતનો મર્મ જાણ્યા સિવાય હું વચન કેમ આપી શકું ? તમે સ્પષ્ટ રીતે જે કહેવાનું હોય તે કહેા એટલે હું મહારાથી બનતું કરીશ. ”

“ હું ; ” પેટી વ્યક્તિ થોડીવાર કંઈપણ ખોટયા સિવાય ઉલ્લી રહી. અને સ્વગત વિચારવા લાગી. “આ આમ સહેલાઈથી માની જાય તેમ લાગતું નથી. ઠીક છે, અને લાંસુધી તો સમનવીને કામ લઈશ. નહિતર પછી—” એટલું વિચારતાં વિચારતાં તેની સુખમુદ્રા રક્તવર્ણ થઈ ગાં.

ચાંપા શાન્ત ચિંતે ઉલ્લી ઉલ્લી તે વ્યક્તિની ચર્ચા જોઈ રહી હતી. પોતાની સામે ઉલ્લેલી વ્યક્તિના સંખાંધમાં તેના મનમાં વિવિધ પ્રકારના લર્ક—વિતર્ક થતા હતા. ઘડીમાં તે તેના સામે જોતી હતી તો વગી ઘડીમાં તે નીચું જોતી હતી. પરંતુ એટલામાં પોતાની સામે ઉલ્લેલી વ્યક્તિએ પોતાના અંગ પરનો શ્યામવર્ણ અલલો કાઢી નાંખ્યો. તેને જોતાની સાથેજ ચાંપા ગલદાએલા સ્વરે ખોલી: “ કોણ, શાહજાદા સલીમ ? અત્યારે આમ એકાન્તમાં મહારી મુલાકાત લેવાનું કંઈ પ્રયોજન ? ”

“ પ્રયોજન એજ કે તહીર જેવી એક સૌન્દર્યમયી રમણીને આ હુઃખદાયક કારાગૃહવાસમાંથી મુક્ત કરીને તેને રાજમહાલય નિવાસીની બનાવવા ચાહું છું. ”

ચંપા સલીમના ઉદ્ગારો સાંલળીને લય પામી. સલીમના હુરાચારી વર્તનની તેને થોડી ઘણી માહિતી પણ હતી. ખુદ બાદશાહ પણ પોતાના હુરાચારી પુત્રથી અંસંતુષ્ટ રહેતો હતો એ વાત અકબરની પ્રજામાં ફેલાવા પામી હતી. અકબરે પોતાના માટે આવું સુરક્ષિત ગૃહ પસંદ કર્યું હતું; છતાં પણ સલીમ અહીં કેવી રીતે આવી શક્યો, એ ચંપાથી સહમબલયું નહિ. પાપાત્સાની પાપેચા હવે તે કળી ગઈ. સલીમ પ્રત્યે તિરસ્કારસ્થૂયક દાખિ ફેંકતી તે બોલી: “ શાહજહા ! મુને રાજમહાલય નિવાસિની બનાવવાના પ્રયત્નમાં તમે ફૂવી શકનાર નથી. ”

“ ચંપા હું તહારા પર કોઈપણ પ્રકારનો જુલમ શુલ-રવાની બિલકુલ ઈચ્છા રાખતોજ નથી. જો, મહારાજ કહેવું સાંલળી કે. તહારા જેવી એક સૈનદ્યંમયી તરફણીએ આવા ઉથ તપાચરણ કરીને શામાટે આ સુકુમાર દેહકળીને સુકાવી દેલી જોઇએ ? ”

“ કુમાર ! મુને સંસાર સુખની લેશ માત્ર પણ સ્પૃહ નથી. તમે હિંદના ભાવિ શહેનશાહ છો. પોતાની પ્રજાને પુત્ર-પુત્રીવત્ત ગણુવાં જોઇએ એ પ્રત્યેક રાજકર્તાનો ધર્મ છે. ”

“ હું તહારી પાસે ઉપદેશ સાંલળવા આવ્યો નથી. જોાલ, મહારી સાથે પ્રણયથંથિથી જોડાઈને તું મહારાજ લુધન ધન્ય કરી શકે નહિ ? ”

“ સલીમ ! તમે એક શાહજહા તરીકે તમારા ધર્મને ભૂકોએ છો. હું હજુ પણ વિનિવું છું કે આ મિથ્યા ભામને ફર કરી દધ અત્રેથી ચાલ્યા જાઓ, તેમાં તમારા હિત છે. ”

“ એમ ! ” સલીમ ડેળા ધુરકાવતો બોલ્યો: “ ચંપા ! વિચાર કર; હિંદના ભાવિ શહેનશાહની ઈચ્છાનો અનાદર કરવાથી કેવાં માઠાં પરિણામ આવે છે તેનો વિચાર કર. હજુ પણ વખત વહી ગયો નથી. સલીમશાહના અનાનાયાનામાં રહેવાથી કેવાં સુખે ગ્રામ થાય છે તેને કિચાર શું તું નહિ કરે ? ”

“ બસ કર, પાપાત્મા ! બસકર. ” ચંપાની કોધજવાળા હુલે ઝાટી નીકળી અને તે કંપતી કંપતી ઓલીઃ “ અત્યારસુધી મહેં એક રાજકુમાર તરીકે તહાં અપમાન કરવાનું ઉચિત ધાર્થી નહોંતું ; પરંતુ તહારા જેવા નરાધમે મહારી એ સુજનતાની કંઈ જ. કિંમત કરી નથી.. વિષયાંધ મનુષ્ય ! તહારી ઈચ્છા સ્વાને પણ ઝણિભૂત થનાર નથી તેનથી જ. ”

પોતાનું અપમાન થવાથી સલીમ કોધે ભરાયો, તેની સુખમુદ્રા પર રતાશ ચઢી આવી.. તે ચંપા પ્રત્યે કોધ ભરી દિલ્લિ કંકાની ઓલ્યો : “ હુડીલી સ્ત્રી ! તું તહારી હુઠ છોડી હો અને હુજુ પણ વિચાર કર. તું કોનું અપમાન કરે છે, તેનું તહેને કંઈ ભાન છે કે ? ”

“ મહારી પાસે ઉલ્લેખો નરાધમ મહારાજ જીવન કલુંબિત કરવાનો ઉદ્દેશ રાખે છે એ હું સુહમજુ ચુકી છું. એવા પાપાત્માનું અપમાન કરવામાં હું સહજ પણ ભય નોતી નથી. ”

“ ત્યારે તું મહારી ઈચ્છાને આધિન નહિ જ થાય કે ? ”

“ નહિ, નહિ, સ્વાનાંતરે પણ નહિ. ”

“ અને ધાર કે હું અત્યારે તહારા પર બળાત્કાર કર્દું તો રહારાજ અહીં કોણું છે ? ”

“ મહારાજ કોણું છે ? મહારો આત્મસંયમ તારા જેવા પામરનો પરાન્ય કરવાને હું મેશાં સમર્થજ છે. ”

“ ઢીક છે, જેઓ છું કે તહારો આત્મસંયમ તહેને કેવી સહાય કરેછે. ” એટલું ઓલીને ચંપા પર આકમણું કરવા માટે સલીમ હોડ્યો. નિરાધાર ચંપાએ એક ભયંકર કિકિઅારી પાડી. આખો ઓરડો કિકિઅારીથી ગાજ ઉક્ખ્યો.

પાઠક ! જ્યારે જ્યારે મનુષ્યના શિરપર આકૃત આવી પડે છે, ત્યારે જે તે સહૃત્તનરીલ અને પવિત્ર હોય તો તેને કોઈપણ રીતે અણુધારી મદદ આવી મળે છે જ. એવાં એવાં આપણે અનેક ઉહાહરણો સાંલઘણ્યાં છે, ત્યારે શું પવિત્ર હેવી ચંપાનું શિયળરક્ષણું તેની આત્મસંયમ શક્તિ નહિ કરે ! ..

આ રકજક ચાલતી હતી, ત્યારે ચંપાના ઓરડાના દ્વારની બાળુએ બહારના ભાગમાં એક વ્યક્તિ લંખાઈને ઉલેલી હતી. સલીમની સ્વચ્છંદતા જોઈ તેણે પોતાની સમશેર પર હાથ મૂક્યો અને જેવો સલીમ ચંપા તરફ ધર્યો એટલામાં તેણે એકદમ અંદર ધર્સી આવી સલીમના શરીર પર જોસ પૂર્વક એક ઠોંસો લગાવી દીધો કે તરતજ તે જમીન પર પટકાઈ પડ્યો. ચંપા પણ કાયને લીધે ગંસરાઈને ધરણી પર જી પડી અને એશુદ્ધ થઈ ગઈ.

સલીમ પણ અહ્ય સમયમાં જ એડો થઈ ગયો. અને ઉછો થઈને જુએ છે તો તેણે પોતાની સામે પોતાના પિતાને ઉલેલો જેવો. “ યા અદ્લા, ઝુદ બાદશાહ ” એટલું ધીમે સ્વરે બોલીને તે શરમથી નીચું જોઈ રહ્યો.

“ કુલાંગાર ! ” અકૃષ્ણ ગાળુ ઉછ્યો: “ જા, તહારું કાળું કર ! હેવી સમાન પવિત્ર સ્ત્રી પ્રત્યે કુદાણ કરતાં ત્યાંને સહજ પણ શરમ ન આવી. નીચ, અહીંથી સત્વર ચાલ્યો જા ! ”

સલીમ ત્યાંથી કંપતો કંપતો ચાલ્યો ગયો. અકૃષ્ણ વિચારમજ્ઞાવસ્થામાં ઉલો હતો, એટલામાં તેને કંધક યાહ આપ્યું. તે ઓરડાના દ્વાર પાસે આવ્યો અને ઝુમ પાડી ઉછ્યો: “ ઝૂતમા ! ઝૂતમા ! ”

“ લુ, હુંબૂરે આલિ ” કરતી ઝૂતમા દોડી આવી અને બાદશાહને ધુંટડીએ પડીને કુર્નિસ બજાવી.

“ ઝૂતમા ” અકૃષ્ણ તેના પ્રત્યે ધગધગતા અવાજે જોલ્યો. “ મહારી આજાનું ઉદ્દલંઘન કરનાર ચાતો તે પ્રત્યે એદરકારી બતાવનારનો હું વિના વિલંબે શિરઅછેદ કરું છું એ વાત તું જણે છે કે ? ”

“ હુલુ જહાંપનાહ ! ” ઝૂતમા નીચું જોઈ રહી.

“ ત્યારે સલીમે અહિં શી રીતે પ્રવેશ કર્યો ? ”

“ હું અદ્લાના કસમ ખાઈને કહું છું કે આ બાણતમાં મુને કંધ જ ખણર નથી. ”

“ વારુ, સલીમ આવ્યો તે પહેલાં બીજુ કોઈ પણ વ્યક્તિ અહીં આવી હતી કે ? ”

“ હા જહાં પ ” કૃતમા થર થર મુજવા લાગી.

“ એલ, તે વ્યક્તિ કોણું હતી ? અને અહીં આવવામાં તેનો શો ઉદેશ હતો ? ” અકખર ડેળા ધુરકાવતો એલયો.

“ બાદશાહ નામવરના માનીતા બેગમ.....” કૃતમા એલતાં એલતાં અટકી ગઈ.

“ કોણું પદ્ધા હતી કે ? ”

“ હા, હુઝુર ”

“ હીક છે, ” એટલું એલીને અકખર વિચારતન્દ્વામાં પહ્યો, એટલામાં એશુદ્ધ થઈને પડેલી ચંપા પ્રત્યે અકખરની દાદી ગઈ. તેનું શરીર હુવે ધીમે ધીમે હાલવા ચાલવા લાગ્યું હતું. અકખર ચંપાની પાસે ગયો અને દ્વાપૂર્વું સ્વરે એલયો. “ માતા ! ભગિની ! જગૃત થાયો. આપને મુહારા ફુષ પુત્રે ને ત્રાસ આપ્યો છે તે બદલ મુને ક્ષમા કરો ! ”

ચંપાના ઊર્ણુમાં અકખરનો સ્વર ગયો કે તરતજ તે ચમકીને એઠી થઈ ગઈ. પોતાનાં વખ્તો સમારતી તે અકખરથી થાડાં ડગલાં ફૂર ખસીને ઉલ્લી રહી.

“ દેવિ ! ” અકખર માયાળું સ્વરે એલયો. “ આપની પવિત્રતાની બહુ પ્રતીતિ હુવે મુને જોઇતી નથી. આપના જેવાં પવિત્ર માતાથીજ આ જગતું અસ્તિત્વ છે. મુને ક્ષમા કરો ! ”

પુત્રના અપરાધ માટે પિતાને ક્ષમા માગતો જોઇ ચંપા એલીઃ “ કૃપાવંત ! આપે મુહારી ક્ષમા માગવી જોઇતી નથી. આપ સર્વથા નિર્દોષ છો. ”

“ માતા ! મ્હેં આપને આવી એકાન્તવાસની શિક્ષા કરી તેથીજ આપને આવો ત્રાસ અનુભવવો પહ્યો છે. હુંજ અપરાધી છું. દેવિ ! પ્રાતઃકાળેજ હું આપને અહિંથી માન સાથે ઝુક્તા કરવાની વ્યવસ્થા કરું છું. ”

“ બાદશાહ નામવરનો મહારા પ્રત્યે મહદુપકાર થયો છે.”
ચંપાએ વિવેક દર્શાવ્યો.

ત્યારપણી બાદશાહ રાત્રિ ધાણી વીતી ગઈ હેવાથી ત્યાં વધારે ન રૈકાતાં સત્ત્વર ચાલતો થયો.

પાઠક ! ગત પ્રકરણમાં ચંપાની સુલાકાત લીધા પછી પદ્ધાને પોતાના આવાસ તરફ જતી અકખરે જેઠ હતી ત્યારથીજ તેણે તે બાખતની ચોકસાઈ કરવાનો પોતાના મનમાં નિશ્ચય કર્યો હતો અને તેથીજ રાત્રિના સમયે બીજાં કેટલાંક મહુત્વનાં કામ પડતાં મૂકીને પણ તે ચંપાના મકાને રાત્રિએ આવ્યો હતો. બાદશાહ જયારે ત્યાં આવી પહોંચ્યો. ત્યારે તેણે ઝીતમાને ઓલાવીને તે મકાનનાં દ્વાર ઉધડાવવાનો પોતાના મનમાં નિશ્ચય કર્યો હતો; પરંતુ જેવો તે મકાનના દ્વારને અડકર્યો કે તરતજ ઉધડી ગયાં. અકખર આથી વિસ્મય પામ્યો અને ગુપ્યુપ ઉપર ચાહ્યો ગયો. ચંપાના ઓરડા પાસે પહોંચતાં સલીમ અને ચંપા વચ્ચે ચાલી રહેલો સંવાદ તેના સાંભળવામાં આવ્યો. અને તેથી ચંપાનો અચાલ થઈ શકર્યો હતો. બીજે દિવસે ગ્રાતઃ કાળેજ બાદશાહે ચંપાને એક બહુમૂલ્ય સુવર્ણ કંકણની જોડ લેટ આપી તેને સુક્તા કરી હતી.



પ્રકરણ ૧૩ મું.

વેરની વસુલાત.

સલીમ ચંપાને આવાસેથી મ્લાનવદ્ધને નીકળી પોતાના મહાલયમાં પાછો આવ્યો; પંચતુ કોધને લીધે તેની મનઃસ્થિતિ એની અસ્વસ્થ થઈ હતી કે તેને બીલકુલ ચેન પડતું નહોતું. કેચિને ભાર્યા સિવાય, વા કેચિને જાતિપ્રદાન કર્યા સિવાય આજે તેનો કોધ શાન્ત થાય તેમ નહોતું. મહાલયમાં પ્રવેશ કરતાંની સાતેજ તેણે પોતાનાં કપડાં-લત્તાં આડાઅવળાં ફેંકી દીધાં. સુવર્ણના સુરાપાત્રને હાથમાં લઈ પાછું ખૂલ્લામાં ફેંકી દીધું.

રોશમાં ને રોશમાં તેણું પોતાનાં એક એ કપડાં છાડી પણ
નાંખ્યાં અને પછી પોતાની શાખાપર જઈને પડ્યો અને પોતાની
આ હિલચાલની માહિતી અકબરને શી રીતે મળી અને ખુદ
બાદશાહ આજે ચંપાના એકાન્તવાસમાં શી રીતે આવી ચઢ્યો
તેનો વિચાર તેના મનમાં ઘોળાવા લાગ્યો. રાજકુમારનો રંગદેંા
સ્વભાવ અકબર સારી રીતે જાણુતો હોવાથી, તે કોઈપણ સ્વીના
મોહમાં પડે નહિ તે માટે અકબર બહુજ સાવધાનતા રાખતો
હતો, એ વાત સલીમ સારી રીતે જાણુતો હતો. એરલુંજ
નહિ; પરંતુ સલીમના ફુરાચરણની માહિતી મળતાંજ અકબર
તેને ચોણ્ય શાસન કર્યા વગર રહે તેવો નહોતો, એવી પણ સલી-
મની પછી ખાત્રી હતી. રાજકુટુંખમાંની પ્રત્યેક વ્યક્તિએ પોત-
પોતાની મર્યાદા સંભાળીને વર્તાંબું જોઈએજ એવો. અકબરનો
સખ્ય હુકમ હતો. સલીમ પણ પોતાના આચરણની અકબરને
માહિતી ન મળે તે માટે યાહુ ચોકસાઈ રાખતો હતો; છતાં આ
ખબર તેને કેમ પડી હશે તે સમજ શક્યો નહિ.

ચંપાને જે સ્થળે રાખવામાં આવી હતી ત્યાં આજે પોતે
જવાનો હતો એવી અકબરને અગાઉથીજ ખબર હોવી જોઈએ
એમ સલીમ ખાત્રીથી માનવા લાગ્યો. દરરોજ રાત્રિએ બાદશાહ
પોતાના રાજકીય કારણોને લીધે બહાર જતો હતો. ત્યારે
આજેજ રાત્રિએ તે પોતાનું કામ પડતું મૂકીને પોતાની પાછળા
કેવી રીતે આવી ચઢ્યો ! નક્કી, કોઈએ તેની પાસે પોતાની આ
સંકેત સંબંધી ચાડી કરીજ હોવી જોઈએ એવું સલીમ ખાત્રી-
પૂર્વક માનવા લાગ્યો.

“ કોઈએ અવશ્ય ચાડી કરીજ હોવી જોઈએ ” એમ
વિચારતો સલીમ ઉંચું મ્હેં કરીને છત સામું જોઈ રહ્યો. એક
પછી એક અનેક વ્યક્તિએ તેની દૃષ્ટિ સંમુખ ખડી થઈ અને
અદરય થઈહોય એવું સલીમની સુખમુદ્રાપરના ઘડી ઘડી
અદ્ભુતા ચુહેરા પરથી જણ્ણાતું હતું.

અંતે ચાડીવાર પછી તેની સુખમુદ્રા વધારે સંતમ જણ્ણાઈ.

તેણે દાંત પીસ્યા. કોઈપણ વ્યક્તિ બદલ તેનો સંશય દૃઢ થયો. હોય એવું તેની મુખમુદ્રા ઉપરથી પ્રતીત થવા લાગ્યું. પરતુ પોતાની મુખમુદ્રા પરનો ભાવ બદલીને તે તરતજ ખોલવા લાગ્યો! છુટ, છુટ, અખુલકુજલ જેવો પુરુષ અકૃબરને એવી વાત કરે ખરો કે? એ સનજન કવિ મહારો વિશ્વાસધાત કરે ખરો કે? એ રસિક-દ્વારા કવિ આવી રાજકીય બાબતોમાં માથું મારે ખરો કે? ના, પણ-એવું પણ શી રીતે માની શકાય? પરંતુ મેં મહારી ગુપ્તેચછા કોઈની પાસે જણાવી હોય તો તે કુજલનીજ પાસે! લારે તેના સિવાય ભીજું કોણું અકૃબરને તે સંબંધી માહિતી આપી શકે? ખસ! એ તો એજ. આ કામ એતુંજ. તેના આ કુત્ય બદલ હું તેને યોગ્ય શાસન કર્યા વગર રહીશ નહીં.

આ પ્રમાણે વિચાર કરીને સલીમ એકદમ ઉલો થયો. તેણે પોતાનાં કષ્પણાં પહેરી લીધાં અને પોતાના મહાલયની બહાર નીકળી પડ્યો.

ગરીબ બિચારો અખુલકુજલ ! તે અત્યારે પોતાના અધ્યયનના કામમાં તહીન થઈ ગયો હુતો. રાજમહાલયમાં સર્વત્ર શાન્તિનો વિસ્તાર થયો હુતો. પોતાના શિરપર અદ્ય સમય પણી કેવી આપત્તિ આવી પડ્યો તેની તેને લેશ માત્ર પણ કુદ્યાના નહોઠતી.

આગામી કાળનું જ્ઞાન નહિ હોવાથીજ મનુષ્યને વર્તમાનકાળ સુંદર જણાય છે. જે આ અજ્ઞાન કુદરતે ન રાખ્યું હોત તો સર્વ સુધિનું ચક એકદમ બંધજ પડી જાય.

ધીમે ધીમે મધ્ય રાત્રિ થવા આવી એટલે કુજલ પોતાની આંખો ચોળવા લાગ્યો. તેણે પુસ્તક બંધ કર્યું અને તે એકખાનું મુક્કું અને સામેની ભારી પાસે જઈને ત્યાં ઉલો ઉલો નલોમંડળમાં પ્રકાશી રહેલા તારકો પ્રત્યે તાકી રહ્યો. એટલામાં સુધામેના ઉપવનમાં તેની દ્રષ્ટિ ગઈ તો ત્યાં કેચ્છ કુપાઠને ઉભું હોય તેમ તેને લાગ્યું; પરંતુ અત્યારે તેના બેત્રો-

માં નિદ્રા ભરાઈ આવી હોવાથી તે ખ્રમ છે તેમ માની વધુ તપાસ ન કરાવતાં તે પોતાની શાખામાં એડાં એડાં થાડીવાર તેણે ખુદાની બંદગી કરી અને ત્યારપણી દીપક હોલવીને અદ્ધાના નામનું સ્મરણ કરતો શાખામાં સૂતો.

કુજલ પથારીમાં સૂતો તો ખરો; પરંતુ તે અસ્પ સમયમાં જ ચમકીને એડો થયો. તેને અસ્પષ્ટ ચિંતા થવા લાગી છતાં થાડીવાર રહીને તે પુનઃ પથારીમાં સૂતો.

સલીમની સ્થિતિ પણ અત્યારે વ્યથ થઈ પડી હતી. વૈર વાળવાની દુઃખી, અને તે લયંકર વિચારથી પરાવૃત્ત કરનારી તેના હૃદયમાંની સારાસાર વિચાર શક્તિ, એ એ વિરોધી પ્રવાહમાં તેનું મન તણુંતું હોવાથી અત્યારે તેની સ્થિતિ વિચિત્ર થઈ ગયું હતી.


ખગીયામાં ઉભાં ઉભાં સલીમે કુજલને જોઈ લીધો. હતો. તેને જોતાની સાથે જ “ રહારી શાંકા ખરોખર છે કે ? આ સનજીન કવિ એવી ચુગલી કરે ખરો. કે અને ધારો કે તેણે તેમ કર્યું હોય તો પણ તેના પ્રાણું હરવાથી હુવે થયું ન થયું બનવાનું છે કે ? આ માર્ગ ધર્મસંગત છે કે ? ” એવા એવા અનેક વિચારો સલીમના મનમાં ઉદ્ભવવા લાગ્યા; પરંતુ તેણે એક ક્ષણું માત્રમાં જ પોતાની બધી શાંકાએ અટકાવી દીધી અને એક ખોંખારો મારી વૈર વાળવા માટે તૈયાર થયો.

તે મકાનમાં દાખલ થઈ વાંચનાલય તરફ વજ્યો. થોડે ફૂર ગયા પછી તે એકાએક ઉલો રહ્યો; પરંતુ પુનઃ હિંમત એકઠી કરી વાંચનાલય પાસે આગ્યો અને વાંચનાલયની એક આરી કુજલે ઉધાડી રાખી હતી, તે દ્વારા કુજલની શાખા પાસે જઈને ઉલો રહ્યો.

સલીમે છુપાવેલું ખંજર બહાર કહાડ્યું અને કુજલપર થાં કરવા માટે તે ઉગાખ્યું. આવા અંધકારમાં પણ ખંજર ચમકવા લાગ્યું. મન કઠણું કરી દાંત પીસીને સલીમે પોતાના

હાથમાંનું ખંજર શાખામાં સૂતેલા મનુષ્યની છાતીમાં વોંચી દીધું. શાખામાં સૂતેલી વ્યક્તિએ “અહલા” એવી ભયંકર ચીસ પાડી.

આ ભયંકર કિકિઆરી સાંભળતાંની સાથે જ સલીમનું સર્વાંગ કંપી ઉઠ્યું. તેની આંખે અંધારાં આંથ્યાં અને ખૂન ! ખૂન ! અહલાછે અકૃષણ ! એટલું બોલતાં બોલતાં મૂર્ચાંગત થઈને ધરણી પર હળી પહ્યો.



પ્રકુરણ ન્યું.

ગયધી મહદ.

લગભગ અધ્યારી કલાક પછી સલીમની મૂર્ચાંગ વળી એટલે સલીમ ધીમે પગલે લંપાતો—છૂપાતો ત્યાંથી ચાલતો થયો. રસ્તે આવતાં આવતાં તે વિચાર કરવા લાગ્યો “ અરે ! અરે ! મહેં આ શું કયું ? ફ્રાજલ જેવા વિદ્ધાન મનુષ્યની મહેં હત્યા કરી ? સવારે ફ્રાજલના ખૂનની ભાતમી સાંભળતાંની સાથેજ શહેરમાં કેવી લોકવાયકા ફેલાશે ! પિતાશ્રી તે બદલ કેટલા બધા દિલગીર થશે ! આ પ્રમાણે. વિચાર કરતો સલીમ પોતાના મહાલયમાં આવી ખિન્જ હુદ્દ્યે પોતાની શાખામાં જઈને સૂતો. શાખામાં પડ્યાં પડ્યાં તેણે ધણીવારસુધી તરફડીઓં માર્યા પરંતુ તેને નિદ્રા આવીજ નહિ.

વાંચનાર ! મનુષ્યનું મન એવું તો ચલિત છે કે તે ક્યારે અને શું કરશે તેની કદ્દના સુદ્ધાં પણ થઈ શકતી નથી. આજે આપણે કોઈ વ્યક્તિએને પરસ્પર નિકટ પરિચયી તરીકે જોઇશું તો વળી અમુક કાળ પછી તેજ વ્યક્તિએને આપણે શત્રુ તરીકે જોઇ શકશું. આ શું ! કાળનો એવો સ્વભાવજ છે કે તેને કોઈપણ વસ્તુને એક સ્થિતિમાં રહેવા હેવી ગમતીજ નથી. સમયના વહુન સાથે તેને અમુક ફેરફાર જોઇએ છીએ. તે

કેટલીક વખત તો એવા પ્રસંગો લાવીને ઉપસ્થિત કરે છે કે પોતે કઈ દિશા તરફ જય છે તેનું પોતાને પણ લાન હોતું નથી. બિચારા ઝાજલે સલીમનું શું અનિષ્ટ કર્યું હતું ? કંઈજ નહિ. સલીમ તેમજ આખું રાજકુદુંખ અને ખુદ બાહ્યશાહી પણ ઝાજલ પ્રત્યે આદરખુદી ધરાવતાં હતાં; આમ છતાંથે ઝાજલ જેવા એક નિસ્પૃહી મનુષ્ય સલીમની કોધજવાળાનો લોગ થઈ પડ્યો. સલીમને પોતાના વૈરની પૂર્ણાઙ્ગતિ થવાથી હવે નિરાંત વળી હતી.

ત્યારે શું ખરેખર ઝાજલનું ખુન થયું જ ! ઝાજલ જેવા બિનગુનેહુગાર મનુષ્યનો વધ ઈશ્વરે જાણી જોઈને જ થવા દીધો ? ના; પાડક ! સલીમને પોતાના મનમાં આનંદ પામવા ઘો અથવા તો પોતાના હુણ્ણુંથ બદલ તેને પશ્ચાત્તાપ કરવા ઘો. ચાલો, આપણે ઝાજલ કર્યાં છે તેની શોધ કરીએ.

પોતાના અધ્યયનનું કામ આરોપીને ઝાજલ પોતાની પથારીમાં સૂતો અને ત્યારપછી તે એકાએક ચમકીને છેડા થઈ ગયો હતો, એ વાત આપણે ગત પ્રકરણુમાં વાંચી ગયા છીએ. શાયામાંથી છેડા થયા પછી ઝાજલના મનમાં એકાએક કંઈ નવીજ કદ્દપના ઉદ્ભવી. તે વાંચનાલયના દ્વાર પાસે આવીને ઉલો અને આમ તેમ દ્વારિએ ઝેંકવા લાગ્યો. પરંતુ ઝાજલ ત્યાં પાંચેક મિનિટ પણ ભાગ્યેજ ઉલો હશે એટલામાં એ ત્રણું હુથિઆરખંધ માણસો ત્યાં આવી પહોંચ્યા. તેમણે ઝાજલની આંખો ઝરતા પાઠા બાંધીને તેને મુર્કેટાટ બાંધી લીધો. અને તેને ઉચ્ચકી લઇને તેઓ લાંથી ચાલતા થયા.

થોડા સમય પછી પોતાને ઉંચકી જનારા બદમાસો કોઈ ઉંચી નીચી જમીનપર ચાલતા હોય એવી ઝાજલની ખાત્રી થઈ. પોતાની ભાવિ સ્થિતિની કદ્દપના કરતાં ઝાજલ જેવા અહગ અને ધૈર્યશીલ કવિનું ચિત્ત પણ ડગમળી ગયું.

અહ્વય સમયમાંજ ખધા બદમાસો ઝાજલને એક લોંઘ-રામાં મૂકીને લાંથી ચાલ્યા ગયા. ઝાજલની આંખોપરના પાઠા હવે છોડી નાંખવામાં આવ્યા હતા.

ક્રાજલ વિચારમન્ય અવસ્થામાં બોંયરામાં બોઠો હતો એટલામાં એક નકારપોશ વ્યક્તિ તે બોંયરામાં પ્રવેશ કરતાંની સાથેજ બોલી ઉઠી: “ક્રાજલ! હવે મરવા માટે તૈયાર થઈ જા!”

ક્રાજલ કંઈપણું બોલ્યા વગર આવનાર વ્યક્તિપ્રત્યે તાકી રહ્યો. પેલી વ્યક્તિ આગળ બોલવા લાગી. “ત્થેંજ અત્યાર સુધી અકૃષ્ણ બાદશાહુને ભંભેર્યો છે અને હિંદુધર્મની તરફદારી કરી છે. ઈસ્લામી ધર્મની અવગણુના કરનારને મૃત્યુનીજ શિક્ષા થવી જોઈએ.”

“મહે ઈસ્લામીધર્મની શ્રી અવગણુના કરી છે ? ”
ક્રાજલ બોલ્યો.

“બે, આજથી થોડા દિવસ પૂર્વે ત્રણું ચાર મુસલમાન ઘોડેસ્વારોને બાદશાહુની આજાથી કેદ કરવામાં આવ્યા છે. ને આવતી કાલે સહુંજે તે સ્વારોને પ્રણાજન સમક્ષ ક્રટકા મારવાનો હુકમ ખાડુાર પાડવાનો છે તેમ સાંલખ્યું છે. તો તું પોતે એક ઈસ્લામી હોવા છતાં પોતાના જાતિલાઇએ. ઉપર બાદશાહ આવો જૂદ્ધ શુંજે અને તું તેને સહજ પણ ઉપદેશ ન આપે એ કંઈ તહુરો નહુનોસુનો અપરાધ ગણ્યાયકે ? ”

ક્રાજલ વિસ્મય પામ્યો. પોતાના શિરપર આવી પડેલા સંકટ અને ઘોડેસ્વારોની શિક્ષા સાથે કંઈપણ સંબંધ હશે એવી તેને કદ્વપના સુદ્ધાં નહોતી. ચાર મુસલમાન ઘોડેસ્વારોએ સિંહિના સીમાડાપર રહેતા ક્રટલાક ગરીબ રાજપૂતોપર જૂદ્ધ શુંજોર્યો હતો અને તેમના તે અપરાધ બદલ તેમને પ્રણસમક્ષ શિક્ષા કરવાની હતી એટલીજ માહિતી ક્રાજલને મળી હતી. પોતાની સામે ઉલેલી વ્યક્તિના ભાષણપરથી ક્રાજલ એટલું કળી શક્યો કે તે ઘોડેસ્વારો તેમજ આ ગુમસ્થાનમાં નિવાસ કરતા કારસ્થાનીએનો કંઈપણ સંબંધ હોવોજ જોઈએ. તેમને શિક્ષા ન મળે એટલાજ માટે આજે તેમણે પોતાને પકડી લાવવાનું જે સાહસ કર્યું હતું તે ઉપરથી તેઓ અવશ્ય આ ઘોડેસ્વારોના સાથીદારોજ હોવા જોઈએ, એમ ધારીને તેને ઓળ-

ખવાને તે પોતાની સામે ઉભેલી વ્યક્તિ પ્રત્યે એકીટસે જોઈ રહ્યો. પોતાને પૂછેલા પ્રશ્નનું પણ ફાજલને ભાન ન રહ્યું.

પોતાના પ્રશ્નનો ઉત્તર નહિ મળવાથી પેલી વ્યક્તિ કોધ-પૂર્ણ સ્વરે બોલવા લાગી “ કેમ, મહારી સરત કણુલ છે કે ? સૂર્યોદય થતાં પૂર્વે અકુભરને સહમજલવીને તે સ્વારોને સુકૃત કરવવાનું વચ્ચન આપે તો હું હમણાંજ તહેને છોડી મૂકીશ. જે તું વચ્ચન ન આપે તો તહેને અહિં કેદ કરવામાં આવશે અને અકુભરને તું અહિં છે એવી ભાતમી મળતાંની સાથેજ તહારે નાશ કરવામાં આવશે. ”

“ બાદશાહુની ઈચ્છાનુસાર વર્તવા માટે હું મહારા પ્રાણુની પણ પરવાહ કરું તેવો નથી. બલે, મહારા અંત આવે ! હું તહારી શરત માન્ય કરી શકતો નથી. ” ફાજલ કોધપૂર્ણ સ્વરે બોલ્યો.

ફાજલનો આ ન ધારેલ ઉત્તર સાંભળીને પેલી વ્યક્તિ સુચ્છતા દર્શિક હુસ્ય કરતાં બોલી “ ફાજલ ! તહારો મિજાજ હુવે અહિં ચાલી શકે તેમનથી. તહારા પ્રાણ લેવા માટે પ્રત્યક્ષ ચંડાલ શંક લઈને તહારી સામે ઉલો રહેશો ત્યારેજ તહેને પોતાના પ્રાણુની કિંમત સહમજશો. ”

“ ચુપ રહે ! ” ફાજલ ખુમ પાડી ઉઠ્યો. “ બદમાસ, તહારો બડાંડાટ બંધ કર ! જા, તહારા ચંડાલને સત્વર મોકલ, મૃત્યુનો મહુને સહજ પણ લય નથી. ”

“ પરંતુ તે સ્વારોને સુકૃત કરવાજ જોઈએ એવી અદ્વાની ઈચ્છા છે એ વાત તું ભૂલી જાય છે. અદ્વાની આજાનું ઉદ્ઘાંધન કરનાર ખરે ઈસ્લામી ગણ્યાયજ નહિ. ” પેલી વ્યક્તિએ કહ્યું.

“ અદ્વા કદાપિ એવી આજા કરેજ નહિ એવી મહારી ચોઝ્સ ખાત્રી છે અને જો કદાચ ખુદ અદ્વા એવી આજા કરે તો હું તેને સપ્લાપણે કહીશ કે તેનું દેવત્વ નાશ પામ્યું છે. ” “ પરંતુ નરાધમ ! અદ્વાનું નામ લઈને ચાવા ઘોર કૃત્યો કરનાર તું કોણું છે ? ” એટલું બોલીને ફાજલ તે વ્યક્તિના મણેં

આડેનો પડહો ઐંચવા તેના અંગપર ધર્યો; પરંતુ તે વ્યક્તિ સત્ત્વર સાવધ અછ ગઈ. તેણે ઝાજલનો હાથ પકડી રાખ્યો. પણ આ ઐંચતાછુમાં પેઢી વ્યક્તિના મ્હેં પરનું વખ્ત સહજ ખસી ગયું અને વિસ્તિત થતો ઝાજલ એલી ઉઠ્યો. “ કેણુ કા....જ ? ”

પરંતુ ઝાજલના આશ્રીર્યેહૃગાર સાંભળવા સાર્થક તે વ્યક્તિ લાં આશીવાર ઉલ્લી રહી નહિ. તે ત્યાંથી વિનાવિલંબે પદાચન કરી ગઈ. ઝાજલ લેંચરામાં એકલો પડ્યો. અહૃપસમયમાં પોતાના પ્રાણું હરી લેવામાં આવશે, એવો વિચાર આવતાં તે જમીનપર ઘેસી ગયો. અને વિચારમજન થાઈ ગયો.

આજદિન સુધી અનેક ધર્મસલાઘોમાં જે ઝાજલે મૃત્યુ સંબંધી અનેક વિદ્વત્તાપૂર્ણ વિવેચનો કર્યાં હતાં, પુનર્જન્મ સંબંધી જેણે વાદ-વિવાદ કર્યો હતો, સ્વર્ગ અને નરક એ વિષયપર જેણે વ્યાખ્યાનો આપ્યાં હતાં, તેજ ઝાજલની માનસિક સમતા પ્રત્યક્ષ મૃત્યુ સમીપ આવતાંની સાથેજ ચલિત થાઈ ગઈ. “ મૃત્યુ એટલે શું ? મૃત્યુ જાવના રહિત હુશે કે ? દેવ હુશે ? સ્વર્ગ હુશે કે ? ” એવા અનેક વિચારો ઝાજલના મનમાં ઉદ્ભવવા લાગ્યા. મૃત્યુકાળ સમીપ આવવાથી પોતાના ગત આચુષ્ટનું ચિત્ર ઝાજલની દષ્ટિ સન્મુખ તરવા લાગ્યું. ‘ અકૃતર, થીરખલ, માનસિંહ વગેરે પોતાની નિત્યની પરિચયની વ્યક્તિઓનો ત્યાગ સદાને માટે કરવો પડશે કે ? ’ એવો વિચાર મનમાં ઉદ્ભવતાંની સાથેજ તે એક નહીના બાળકની પેઠે રડવા લાગ્યો.

પરંતુ ગમે તેમ તો ઝાજલ તત્ત્વજ્ઞ હતો. તેણે આવા નિર્ણય વિચારો પોતાના હૃદયમાંથી હૂર કર્યા. મૃત્યુ માટે તૈયારી કરવા સાર્થક તે પોતાના મનને શાંત અને નિશ્ચિલ બનાવવાના પ્રયાસ કરવા લાગ્યો. જગતની નશ્વરતાનો અને મૃત્યુ પછી આ અનંત અધ્યાંડમાં કિંવા ખુદાના દરખારમાં મિશ્રીત થાઈ જવાનો વિચાર તે કરવા લાગ્યો. અમૂર્તા, પવિત્ર અને

અમર્યાદ આનંદનો વિચાર કરતાં કરતાં તેણે પોતાના મનને તેજેમય અને ઉત્સાહિત કર્યે.

લગભગ એક ધીકા પર્યાત ફ્રાજલ આ પ્રમાણે વિચાર-મભાવસ્થામાં એસી રહ્યો. લારપછી એકાએક કોઈ વ્યક્તિને તેણે લોંઘરામાં પ્રવેશ કરતી જોઈ. ચાંડાળ પોતાના પ્રાણુ હરવા માટે આંદોલાની હુશે એમ ધારીને ફ્રાજલ મરવા માટે તૈયાર થઇ ગયો; પરંતુ આખનાર વ્યક્તિ ચાંડાળ નહોંતી. તે વ્યક્તિ એવી તો ધીમે પગલે અને લંપાતી-છુપાતી આવતી હતી કે તે અહિં શુભ રીતે આવતી હોય એવું ફ્રાજલ તરતજ સહમળ શક્યો.

અદ્ય સમયમાં જ તે વ્યક્તિ ફ્રાજલ પાસે આવી પહોંચી અને તેના કર્ણ પાસે પોતાનું મહોં રાખીને ધીમે સ્વરે બોલી, “ ફ્રાજલ સરકાર ! પ્રાણુ ભચાવવા હોય તો ઢીલ ન કરતાં સત્ત્વર મહારી પાછળ ચાલો ! ”

“ પણ તું કોણું છે ? ” ફ્રાજલે પૂછ્યું.

“ હું કોણું છું તે પછીથી કહીશ ; પણ આપ સત્ત્વર કરો ! ”

“ ના ; ” ફ્રાજલ બોલ્યો : “ મહોને ભચાવવાની લાલચ આપીને તું મહોને મૃત્યુસ્થળે તો નહિ લઈ જયને ? ”

“ વાહ ! વાહ ! ફ્રાજલ સરકાર ! મહારા માટે પણ આવીજ શાંકા કે ? હું કોણું છું તે કહું કે ? ”


“ હા, બોલ ! ”

“ હું જુલેખાં ! પદ્મા ઐગમની દારી ! ”

“ હે ? જુલેખાં ! તું અહિં કયાંથી અને કેવીરીસે આવી શકી ? ”

“ એ બધું પછીથી કહીશ. હુમણું તો સત્ત્વર મહારી સાથે ચાલો અને પ્રાણુ ભચાવો. ”

ફ્રાજલ એક પણ શરીરોચ્ચાર કર્યો સિવાય જુલેખાંની દુચ્છાને આધીન થયો. અદ્ય સમયમાં ફ્રાજલ અને જુલેખાં લોંઘરાની બહુર નીકળી પડ્યાં.



પ્રકરણ ન્યૂં મું.

અકૃષ્ણની આકૃત.

ગત પ્રકરણોમાં વાંચી ગયા તે પ્રમાણે થોડાંક અઠવાડિઓં થયાં રાજકુટુંખમાં અનેક પ્રકારની ગડમથલ ચાલી રહી હતી; પરંતુ પ્રભાજનનો વ્યવહાર તો સુયન્ત્રિત રીતે જ ચાલ્યો જતો હતો. રાજ, મંત્રી અને રાજકુટુંખ એ બધાં ગમે તે પ્રકારની ચિન્તા અનુભવતાં હોય તો પણ તે ચિન્તાનું પરિણામ પ્રભાજનોની જાણુમાં આવતાં ખાહુ વાર લાગે છે. આધુનિક સમયમાં - વિસમી સહીમાં મહાન લોકોના પ્રત્યેક શરીરો અને તેમના કુલોની ભાતમી દેશના ખુણે ખોચરે આવેલાં પ્રત્યેક ગામડા-ઓમાં પણ વાયુવેગે પ્રસરી જાય છે. કેટલીક વાર એવું પણ ખને છે કે એકાદ રાજ્યના નાયકનું માથું ફુઃખતું હોય તો તે ભાતમી વાયુવેગે આખા દેશમાં ફેલાઈ જાય છે; પરંતુ જે કાળની આ વાત છે તે સમયે તેમ નહોંનું. તે સમયે રાજકુટુંખમાં ગમે તેવી ખટપટ ચાલી રહી હોય; પરંતુ તે ખટપટની ગંધ સુદ્ધાં પ્રભાજનોને મળી શકતી નહિ. આથીજ જે રાત્રિએ વાચ-નાલયમાં, ચંપાના એકાન્ત ગૃહમાં અને કાળના લેંયરામાં જે ઘનાવો ઘનવા પાંચા હુતા તેની પ્રભાજનને દેશ માત્ર પણ ખબર પડી નહિ. સૂર્યોદય થતાંની સાથે જ પ્રભાજનો નિષ્ય નિયમ પ્રમાણે પોતપોતાને કામે વળયા. શાહુળાદો સહીમ અત્યારે પોતાની શય્યામાં બેઠો બેઠો વિવિધ પ્રકારના વિચારમાં તહીન થયો હતો. એટલામાં તેના કુર્ણાપર ધ્વનિ આવ્યો કે: “સિ-હુના સીમાડા પર રહેતા કેટલાક ગરીબ રાજ્યોતો પર જુદમ ગુણરવા બદલના અપરાધ માટે પકડવામાં આવેલા ચાર મુસલમાન ઘોડેસ્વારોને આજે સંદ્યા સમયે મેદાનમાં કુટકા મારવામાં આવનાર હોવાથી સર્વ પ્રભાયે ત્યાં હુાજર રહેવું. ખુદ બાદશાહ સલામત પણ તે પોતાના અધિકારીઓ સહિત ત્યાં હુાજરી આપશે.”

સહીમ આ દેઢેરો સાંભળીને ચમક્યો. હુમણું જ અખુલજીલના ખુનની વાત જાહેર થશે એ વિચાર યાદ આવતાંની સાથે જ તેનું પાતકી હૃદય કંપી ઉઠ્યું. પોતે ઝાજલનો ખુની છે, એ બાતમી અકખરને મળતાં તે પોતાને કેવી સજ કરશે, એવા વિચારો તેના હૃદયમાં ઉદ્ભવવા લાગ્યા; પરંતુ એટલામાં પોતાના દિવાનખાનાની બહાર બે નોકરોને આપસ આપસમાં વાતચિત કરતાં તેણે સાંભળ્યાં.

“ કેમરે નજુમીઆં ! ઝાજલ સરકારની શાખામાંથી આજે એક મનુષ્યનો મૃતહેઠ મળી આવ્યો તે વાત તેંસાંભળી કે ? ” અહુમદખાને પોતાના દોસ્ત નજુમીઆંને પૂછ્યું.

“ હાં, હાં દોસ્ત ! બડી આશ્ર્યકી બાત ! મુને પણ દોલતખાને એવું જ કંઈક કણું હતું. યા અદ્દા, ઝાજલ સરકાર જે રાત્રિએ ત્યાં ઢોત તો તેમના શા હુલ થાત ? ” નજુમીઆં ઓદ્યો.

“ અરે દોસ્ત, હું રહને શું વાત કહું ? હુમણું હુમણું તો ખુદ શહેનશાહના મહાલયમાં એવા એવા વિચિત્ર ઘનાવો બને છે કે કંઈક કહેવાની વાત જ નહિ. ”

“ હું ? ”

“ હું શું ? આજથી એ ત્રણ દિવસ પહેલાં એક રાત્રિએ હું પહેરા પર હતો. રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના અરસામાં મહેં એક મનુષ્યને મહાલયની આસપાસ ઝરતો જેયો હતો. જઈને હું જોઉં છું તો યા અદ્દાહુ, ખુદ ખાદશાહ અકખર ”

“ એમ ? ”

“ હા, એમ ! રહને ખખર નથી દોસ્ત ! બાદશાહ નામબરની સવારી દરરેજ રાત્રિના સમયે બહાર ઝરતીજ રહે છે. ”

બન્ને નોકરો વચ્ચે આ પ્રમાણે થતી વાતચિત સાંભળીને સહીમના આશ્ર્યમાં વધારો થયો. રાત્રિએ પોતે ઝાજલનું ખુન કરવા ગયો હતો ત્યારે કોઈ ખીલજ મનુષ્યનો બધ થઈ

ગયો કે શું ? એ વિચાર તેના મનમાં ઘોળાવા લાગ્યો. તે એકદમ બહાર ધસી આવ્યો અને ઓદ્યો : “ અરે ! નનુમીઆં ? તમે શી વાતચિત કરી રહ્યા છો ? ”

ખુદ શાહુજાદાને પોતાની સામે આવીને ઉલેલો જોતાંની સાથેજ નનુમીઆં અને અહુમહભિઆંના પગ થરથર ધૂજવા લાગ્યા. તેમની વાતચિત એટલેથીજ અટકી પડી.

“ ફાજલ સરકારની શાય્યામાંથી કેનો મૃત દેહ મળી આવ્યો છે ? ” સલીમે નનુમીઆં પ્રત્યે દષ્ટિ ઝેંકતા કહ્યું.

“ હુંઝૂરે આલિ, તે મનુષ્યને ઓળામી શકાયો નથી. ” નનુમીઆં ધૂજતો ધૂજતો ઓદ્યો.

“ જહાંપનાહુને તે આખતની ખખર પડી છે કે ? ”

“ હા, હુંઝૂર ! ”

“ તેમણે ત્યાં આવીને શું કહ્યું હતું ! ”

“ ત્યાં આવીને બાદશાહ નામવરે તે મનુષ્યને ફૂંકન કરવાનો હુકમ આપ્યો હતો. ફાજલ સરકાર પણ તે વખતે તેમની સાથેજ હતા ! ”

“ હં, ઠીક છે. ” એટલું ઓદ્યોને સલીમ પોતાના શયનાદ્વયમાં ચાલ્યો ગયો. તે પોતાની શાય્યામાં જઈને બેઠો અને વિચારવા લાગ્યો. “ ત્યારે તે મનુષ્ય કોણું હશે ? ”

એટલામાં સલીમનો માનીતો નોંકર જમાલ ત્યાં આવી પહોંચ્યો. તેણે શાહુજાદાને ધૂરીએ : પડીને ત્રણ વખત કુર્નિસ બજાવી અને ઓદ્યો : “ કેમ હુંઝૂર, સિંહ કે શિયાળ ? ”

“ અરે ! શું સિંહ કે શિયાળ ? બધી ભાજી બગડી ગઈ ? ”

“ કેમ ? ”

“ કેમ શું ! ખુદ જહાંપનાંહ રાત્રિએ ત્યાં આવી પહોંચ્યા હતા અને મહુને નહાસતાં લોંય પણ ભારે થઈ પડી હતી ! ”

“ બાદશાહ નામવર ત્યાં અચાનક શી રીતે આવી ચલ્યા ? ”

“ તે હું શું જાણું ? ” એટલું ઓદ્યોને સલીમ શાન્ત

રહ્યો. તે મનમાં વિચારવા લાગ્યો: “ ખરેખર, ઝાજલના પ્રાણું
ખચવા પામ્યા લેમાં અંત્રાનોજ કંઈપણું ઉદેશ હોવો જોઈએ,
પણ પેલા છે નોકરો વાતચિત કરતા હતા તે ઉપરથી રહુને
લાગે છે કે તે આકૃતિમક રીતે પણ આવી ચન્દ્રા હોય ! પિતાશ્રી
કયારે કયાં હુશે તેનો કંઈ નિયમજ કયાં છે ? વાર્ષ, જે થયું તે
ઠીકજ થયું ! ” આ પ્રમાણે વિચાર કર્યા પછી સલીમ જમા-
લને ઉદેશીને ઓદ્યો. “ કેમ હોસ્ત, લાવ શિરાજી લાવ. ડંડી
બહુ પડે છે. ”

આ જમાલ સલીમનો માનીતો નોકર હતો. સલીમ
તેના સિવાય બીજા કોઈના હુથનો શિરાજી લેતો જ નહોતો.
ગમે તેવાં ભયંકર કાર્યો ખાર પાડવામાં પણ જમાલ કોઈથી
ગાંઝ્યો. જાય તેવો નહોતો.

અદ્ય સમયમાંજ જમાલ શિરાજી લઈ આવ્યો અને
એક ઘ્યાલી શાહુભાડાના હુથમાં આપી. શાહુભાડાએ
શિરાજીને પેટમાં પધરાવી દીધી. ત્યારપછી તેણે પોતાના
હુથથી એક ઘ્યાલી જમાલને આપી. અન્ને જણ્યાએ ઘ્યાલીની
હુણું સામસામી લીધી. અદ્ય સમયમાં જ તેમની આંખો
લાલ થઈ ગઈ.

શિરાજીનો નિશો બરાખર આવ્યો એટલે સલીમ ઓદ્યો,
“ જમાલ ! બીજી શી નવા જૂની છે ? ”

“ નવાજૂની એ કે બાદશાહ નામવરે પેલી ચંપાને
એકાન્તવાસની સજ્જમાંથી મુક્ત કરીને આજે તેને બક્ષીસથી પણ
નવાળું છે. પણ એ શિકારને હું છટકી જવા હેનાર નથી. ”

“ હોસ્ત ! ” શાહુભાડો પુનઃ શિરાજીની એક ઘ્યાલો
ગટગટાવતાં ઓદ્યો, “ સિંહ શિકાર પકડવા માટે એક જ ત-
રાય મારે છે. હુથમાંથી છટકેલા શિકારની પાછળ પડવાનું
ખરો સિંહ કદી પણ પસંદ કરતો નથો. ”

“ એટલે ? ” જમાલ આક્ષર્ય પામતો ઓદ્યો.

“ એટલે એજ કે તહેં તહાર્દ કર્યાય બનાવ્યું છે; પરંતુ

હું હવેથી તેવી આખતમાં પડવા ઈચ્છિતો નથી. મહને તે ક્રી કોઈ પવિત્ર દેવી સમાન લાગે છે.” સલીમ એટલું બોલીને મૈન-રહ્યો.

જગતમાં કેટલાંક મનુષ્યો એવાં હોય છે કે જેઓ કેવળ પોતાનો સ્વાર્થ સાધવાની ખાતર અનેક નિર્દેખ વ્યક્તિત્વોના ગળા રેંસવામાં પણ પાછી પાની કરતાં નથી. એવા નોચ મનુષ્યોની દશ્ટિ પોતાના જ સ્વાર્થ તરફ વળે છે. મોટા માણુસોની ઝુશામત કરીને પોતાનો સ્વાર્થ સાધી લેવા માટે તેઓ નિરતર તૈયાર જ રહે છે. ગમે તેવાં ભયંકર પાતકેથી પણ તેવાં મનુષ્યો સહજ પણ આંગઢો ખાતાં નથી. જમાલ એક નીચ મનુષ્ય હતો. ખર્દું કહીએ તો શાહુજલદા સલીમને દુરાચારી બનાવવામાં તેનો જ મુખ્ય હુથ હતો. શાહુજલદા સલીમ શોળા સ્વભાવનો તેમ જ પાપલીદ્ર હતો. અને તેથી જ જમાલ ઝાંયો હતો. પરંતુ સલીમનો સ્વભાવ હઠીલો—જખી હતો, એ વાત જમાલ સારી રીતે જાણુતો હતો. જ્યારે અમુક કાર્ય નહિ કરવાની તે હુઠ પકડતો ત્યારે જમાલ તે વાત એટલેથી જ દુંડી કરી નાખતો હતો. કારણું શાહુજલદાની આજ્ઞા વિરુદ્ધ વર્ત્તવાની તેનામાં શક્તિ નહોંતી.

ત્યારપછી સલીમ કપડાં પહેરીને તૈયાર થયો. અને રાજમહાલયની બહાર ચાલ્યો ગયો.

* * * *

ધીમે ધીમે સહંજના ચાર વાગ્યાનો સમય થયો. જે મેદાનમાં મુસલમાન ઘોડેસ્વારોને શિક્ષા કરવાની હતી, ત્યાં માણુસોની મેદની ભરાવા લાગી. મેદાનની વચ્ચોવચ્ચ્ય એક સુંદર ગાલીએ ખીંચાવવામાં આવ્યો હતો. તેમજ ત્યાં ખુરસીએ હારથંધ ગોઠવી દેવામાં આવી હતી. મધ્યભાગમાં બાંદશાહ અકૃપા માટે એક સિંહાસન ગોઠવી દેવામાં આવ્યું હતું અને સિંહાસનની જમણી બાળુથાં શાહુજલદા સલીમ માટે તથા ડાણી બાળું અનીરખલની ખુરસી રાખી હતી. ને તે પછી રાજ ભાનસિંહ વળેરેની ખુરસીએ ગોઠવવામાં આવી હતી.

બેત જોતામાં માણુસોની મેદની એટલી તો મોટી થઈ ગઈ કે એ ગંગવર મેદનીમાંથી કોઈપણ વ્યક્તિને શોધી કાઢવાનું કાર્ય અધરૂં થઈ પડે તેવું હતું. મેદાનની નજીક આવેલા એક મોટા આડ નીચે અમરસિંહ, કુમળા, લુણુસિંહ વગેરે રાજપુત હિતચિંતકટોળી પણ આવી એડી હતી. પોતાની આખી મંડળી અહીં એકઠી થવાની કુમળાને ખાત્રી હતી પરંતુ પૂઢ્યીસિંહ વગેરે નવા સભાસહેના ન આવી પણેંચવાથી અંતે કુમળા એલી ઉઠી: “ હું કંઈ પૂઢ્યીસિંહ અહીં આવે તેમ જણાતું નથી; પરંતુ તે અહીં આવ્યા વગર રહે તો નહિં ! વારુ, તે કેમ નહીં આવ્યા હોય ? ”

“ ન ચે આવે ! તે બદલ આટલી અધી કાળજી કરવાની શી જરૂર છે ? ” લુણુસિંહ એલ્યો.

“ અમુક મનુષ્ય આવવાનો હોય અને તે ન આવે તો ચિન્તા ન થાય કે ? ” કુમળા એલી: “ ગઈ કાલે રાત્રિએ તે અમરસિંહને ત્યાં આવ્યા ત્યારે આજે તે અહીં આવવાના છે કે કેમ, તે માટે મેં તેમને પૂછ્યું ત્યારે તેમણે હા કહી હતી. છતાં હંજુસુધી તે કેમ નહિ આવ્યા હોય ? ” એટલું એલીને કુમળા ચોમેર દાખિએંકવા લાગી. અદ્ય સમયમાંજ કુમળા ચમકી ઉઠી. તે એક વ્યક્તિ પ્રત્યે આંગળી કરતી એલી:— “ લુણુસિંહ ! લુણુસિંહ ! જૂએ, પેદો મનુષ્ય પૂઢ્યીસિંહજ છે કે શું ? ”

“ નક્કી તહુને ભ્રમ થયો છે. ” લુણુસિંહ સિમત કરતો એલ્યો: “ વાહ ! વાહ ! તું મનુષ્યને સારી રીતે ઓળાખી શકે છે હોં ? ”

પોતાની દાખિએ જ પોતાને ભૂલથાપ ખવડાવી એ જોઈને કુમળા શરમાઇ ગઈ. તે મૈન રહી.

અમરસિંહ વિચારમગનવસ્થામાં લીન થયો હતો.

કુમળા અને જીર્ખસિંહના સંવાદથી તેને સહજ કંટાળો આવ્યો. પૃથ્વીસિંહ માટે કુમળાની કાગળ જોઈને તે પોતાના મનમાં ચીઢાયો. પૃથ્વીસિંહને તે પોતાના પ્રિયપાત્રના પ્રતિસ્પદિશ તરીકે માનવા લાગ્યો. પૃથ્વીસિંહ કોણું ? દરખારમાં તેનું આઠલું ખધું વજન શાથી ? તે ક્યાં રહે છે ? પોતાના નિવાસસ્થાન સંખ્યીના માહિતી તે કોઈને કેમ આપતો નથી ? વગેરે બાખતોના વિચારોની ચળવિચળ તેના મનમાં અત્યારે ચાલી રહી હતી.

આ વખતે મેદાનમાં ખીજ વૃક્ષ નીચે કાળ પોતાના એક માણુસ સાથે ઉલ્લો હતો. તેણે પોતાના હૃથમાંની માળા ફેરવતાં એકવાર ચેમેર દિશિપાત કરીને પોતાના સાથીદારને કહ્યું :—“ગાંડ કાદે રાત્રિએ જુલેખાં અને ઝાજલ લોંયરામાંથી પદાર્થન કરી ગયાં છે. માટે હવે આપણો પડહો ખુલે તે પહેલાં કંઈક કરવું જ જોઈએ ? ”

“ પણ તે છોકરી ખુદ્દાને લઈને કેવી રીતે નહાસી ગઈ ? ”

“ તે ગમે તેમ હોય ! ” પોતાના સાથીદારના પ્રેરને વિશેષ મહુત્વ નહિ આપતાં કાળ બોલ્યો : “ આજે અકબરને આપણે હૃથ બતાવવો જ જોઈએ. કારણ કે તેઓ અવશ્ય આપણું કારસ્થાન ઉધાડું પાડ્યા વગર રહેશો નહિ એવી મુને ભીતિ લાગવા માંડી છે. ગાંદુર તહારે મુાડું આઠલું કાર્ય કરવું જ જોઈએ. ”

“ પણ....ખુદ બાદશાહને....અદ્દાના અંશરૂપ અકબરને ! ” ગાંદુર પોતાના હૃથમાંની કટારી પ્રત્યે તાકી રહેતો ધીમે સ્વરે બોલ્યો. તેનું સર્વાંગ કંપી ઉઠ્યું.

“ શું કહે છે ? બાદશાહ અદ્દાનો અંશરૂપ છે ! ” કાળ આવેશપૂર્ણ સ્વરે બોલ્યો : “ સ્વધર્મનો નાશ કરવા ઉદ્યુક્ત થયેલા અકબરને તું અદ્દાનો અંશ માને છે કે ? નહિ, બીલમુલ નહિ. અદ્દાએ જ મુને આ આજા કરી છે. ” એટલું બોલીને પોતાના બોલવાની અસર ગાંદુરના મનપર કેવી અધ છે તે

જેવા માટે કાળ તેના પ્રત્યે લેદકદિથી જેવા લાગ્યો. કાળને પોતાનો પ્રયત્ન સર્કુળ થવા લાગ્યો; તે ખોલ્યો: “ સત્ત્વર કર, હુવે જાંઝો વખત રહ્યો નથી. ”

“ હું તમારી છચ્છાને આધીન છું. ” ગાંઠુર ખોલ્યો.
“ શાણાશ ! અહ્વા તુને યશ આપો ! કામ સંભાળીને કરજે.
હું હુવે જાંઝું છું. ”

આ પ્રમાણે ગાંઠુરને આશીર્વાદ આપીને કાળ પોતાના મનમાં ભલકાતો ત્યાંથી ચાલ્યો ગયો અને અદ્વય સમયમાંજ મેદનીમાં ભળી ગયો.

કાળ અને ગાંઠુરને જ્યૂદાં પહ્યાં જાંજીવાર થઈ નહોતી એટલામાં “ શાનશાહુની સ્વારી આવી પહોંચી ” એવી ખુમો સંભળાવવા લાગી. પ્રત્યેક મનુષ્યની દૃષ્ટિ બાદશાહ પ્રત્યે એક સરખી લાગી રહી હતી..

અદ્વય સમયમાંજ અકૃષ્ણ પોતાને માટે નિર્ણિત કરેલા ઉચ્ચાસને જઈને એઠો. શાહુનહો સર્વીમ, ખીરખલ, માનસિંહ, અખુલફાલ વગેરે તમામ અમીર ઉમરાવો પોતપોતાને સ્થાને ગોઠવાઈ ગયા. એટલે બાદશાહે સર્વ પ્રત્યે એકવાર પ્રેમલરી દૃષ્ટિ દેંકી. ત્યારપણી અકૃષ્ણરે પોતાના એક સરહારને ચાર ઘોડેસ્વારોને શા માટે સન્ન કરવામાં આવનાર હતી તે સંખ્યે લોકોને સહમજણું પાડવા સૂચયણું. તે સ્વારોએ સિકિના ગરીબ રાજ્યપૂત રાધોળને જે ત્રાસ આપ્યો હતો તે હુકીકત લોકોને સંક્ષિપ્તમાં કહું સંભળાવી અને ત્યારપણી પેલા ચારે ઘોડેસ્વારોને મેદાનની વચ્ચેાવન્ય બાદશાહુની સંમુખ ઉભા કરવામાં આવ્યા. સર્વ લોકો આ દશ્ય પ્રત્યે એકીટસે તાકી રહ્યા હતા.

તરતજ કુટકા મારનારો કાઢ્યર પોતાના હુથમાં ચાખુક લઇને હુજર થયો; પરંતુ જેવો તે પોતાનો હુથ ઉગામીને પેલા ઘોડેસ્વારોમાંના એકના શરીરપર ચાખુકનો પ્રહાર કરવા જાય છે, તેવોજ મેદનીમાંથી એક લટુપટુ શરીરવાળો મનુષ્ય

ત્યાં હોડતે પરો આવી પહોંચ્યો અને એલ્યો “ ખબરહાર ! તહારો હાથ પાછો એંચી લે. ! ”

આ અનપેક્ષિત પ્રકાર જોઇને સર્વ મનુષ્યો આશ્ર્યચક્કિત થયા. રાજ વિરુદ્ધ આવું ઉદ્ઘત વર્તન ચલાવનાર આ મનુષ્ય કોણું હશે, તત્ત્વાંધી પ્રત્યેક મનુષ્યો પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. ખુદ અકૃષ્ણ પણ આશ્ર્યચક્કિત થયો; પરંતુ આ મનુષ્યના વર્તનને અંકુશમાં સુકવા વિચાર થાય તે પૂર્વે વીજળીના જડપે પેલો મનુષ્ય ત્યાંથી બાદશાહના સિંહાસન તરફ હોડ્યો અને પોતાના હાથમાંના ખંજરવડે અકૃષ્ણને ધા કરવા હાથ ઉચ્કયો; પરંતુ આ ચક્કિત ખંજર અકૃષ્ણની છાતી સુધી પહોંચે તે પૂર્વે એક બીજુજ વ્યક્તિ મેદનીમાંથી હોડતે પરો અકૃષ્ણના સિંહાસન પાસે આવી પહોંચી અને તેણે પેલા મનુષ્યના હાથ પર મજબુત જડપ મારી કે તરતજ તેના હાથમાંનું ખંજર છુટીને ફૂર થઈ પડ્યું. આ પ્રસંગેજ અકૃષ્ણના સિંહાસનની પછવાડેથી એક સ્વી મદ્દ માટે હોડી આવતી હતી, જે સિંહાસન પાસે આવીને મૂચ્છાંગત થઈ જતાં ખંજર તે તલણીના પેષમાં લોંકાયું.

આ સર્વ ઘટના એટલી તો જડપથી બની ગઈ કે પોતે સ્વમ્મમાં તો નથી, એવો મેદનીમાંની પ્રત્યેક વ્યક્તિને ભાસ થયો.

અદ્ય સમયમાંજ અકૃષ્ણના પ્રાણું હરવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિને કેદ કરવામાં આવી અને અકૃષ્ણ-પેલી ધાયલ થયેલી સ્વી પાસે ગયો. તેનું મહોં જેતાંની સાથે જ તે સહજ ચમક્યો. તેના નેત્રોમાં અશ્રુ ભરાઈ આવ્યાં. તે સ્વીને એક પાલખીમાં બેસાડીને જનાનખાનામાં મોકલવાની આજા આપી. પોતાના પ્રાણું હરવા તૈયાર થયેલી વ્યક્તિની હાથમાંથી ખંજર પાડી નાંખનાર વ્યક્તિ પાસે અકૃષ્ણ આવ્યો અને તેના ચરણોમાં પોતાનું શિર જુકાવીને ઉલો રહ્યો.

તે વ્યક્તિએ અકૃષ્ણના શિર પર હાથ મૂક્યો અને કહ્યું:

“ સર્વ ધર્મ પ્રત્યે સમતા દર્શાવનાર ધર્મો રાજુનું ! ચિરાચુ હો ! ”

જનસમુહમાંથી “ શાખાશ ! શાખાશ ! ” ના પોકારો સંભળાવા લાગ્યા. ત્યારપછી આકારે પોતાનો પ્રાણું બચાવનાર વ્યક્તિને માટે એક સુવર્ણાસન મંગાંયું, પરંતુ તે વ્યક્તિએ તે આસનપર બેસવાની અનીચ્છા દર્શાવવાથી તેઓ અન્ને લાંજ ઉભા રહ્યા.

અદ્વિતીયમાંજ પેલા ઘોડેસ્વારોને ફૂટકા મારવાનું કાર્ય પૂર્ણ થયા બાદ મેદની વીખરાઈ. માર્ગમાં જતાં જતાં આજે અનેલા બનાવેની ચર્ચા સર્વત્ર થવા લાગી.

સર્વ મેદની વીખરાઈ ગઈ, પરંતુ બાદશાહ અને તેના અમીર ઉમરાવો આકાશના પ્રાણું બચાવનારનો યોગ્ય સત્કાર અને પરિચય કરવા લાંજ રોકાયા હતા.

પ્રકૃતાણ ૧૬ મું.

મહાત્માનો મેળાપ.

મેદાનમાં મળેલો સમૂહ વિખરાઈ ગયો એટલે પોતાની સંમુખ ઉલેલી વ્યક્તિ પ્રત્યે એકીટસે તાકી રહેલો આકાશ કૃતજ્ઞતાપૂર્ણ સ્વરે બોલ્યો : “ મહારા પ્રાણું બચાવીને આપે મહુને આજે પુનર્જન્મ આપ્યો છે. બોલો, બોલો, હું આપના માટે શું કરું ? ”

આકાશની સ્થાને ઉલેલી વ્યક્તિએ સાહાં અને શ્વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. તેમના મહેંપર વધેલા શ્વેત બાળો તેમનું ગાંભિર્ય વધારતા હતા. વૃદ્ધાવસ્થા હેવા છતાં પણ તે વ્યક્તિનાં નેત્રો પાણીદાર અને તેજપૂર્ણ જણ્ણાતાં હતાં. તેના વિશાળ ભાલ પ્રદેશપરથી તેમજ તેના શરીરપરના વસ્ત્રોપરથી તે કોઈ સંસારવિરક્ત વિભૂતિ હોય એમ સ્પષ્ટ જણ્ણાઈ આ-

હતું હતું. આકાશ પ્રત્યે ગ્રેમલ્લરી દણિ કેંકતાં તે વ્યક્તિ બોલી: “ રાજની ! મહારે કંઈપણ જોઈતું નથી. કંઈપણ ઈનામ મેળવવાની લાલસાથી મહેં આ કાર્ય કર્યું નથી; કેમકે પ્રાણુરક્ષા એ અમારે કર્તાવ્ય ધર્મ જ છે.”

“ આપના જેવી દ્વારા વિલૂટિનો પરિચય મળશે તો તુહારાપર મહદુષ્પગાર થશે ” આકાશે વિવેક દર્શાવ્યે.

“ ધર્મરસિક શહેનશાહ ! આપે કોઈ જૈનધર્મી આચાર્યને આમન્ત્રણ મોકદ્યું હતું કે ? ” તે વ્યક્તિ સ્થિત કરતાં બોલી.

આકાશ સહજ વિચારમાં પડ્યો. તેની મુખમુદ્રાપરથી તે કંઈ યાદ કરતો હોય તેમ જણાતું હતું. થોડા જ સમયમાં આકાશને કંઈક યાદ આવ્યું હોય તેમ સામે ઉલેલી વ્યક્તિ પ્રત્યે તાકીને જોતાં બોલ્યો: “ કેટલાક મહિના પૂર્વે મહેં ગુજરાતમાં નિવાસ કરતા જૈનાચાર્ય હીરવિજયસુરિલુને અત્રે આવવાનું નિમન્ત્રણ મોકદ્યું હતું ખરં.”

“ ત્યારે તમારા નિમન્ત્રણને માન આપીને હું આજેજ અહિં આવી પહોંચ્યો છું. ”

“ ત્યારે શું આપ પોતેજ સમર્થ જૈનાચાર્ય હીરવિજયસુરિલુ ? ”

“ હા; આ સ્થળ દેહને લોકો એજ નામથી પીઠાણે છે. ”

“ એં, દ્વારામય મૂર્તિ ! આપે જ આજે મહને જીવિતદાન દીધું છે. આપના પુનિત પગલાં મહારે આંગણે થતાં જ તુને આપે પ્રાણુદાન દીધું તે કંઈ મહારા ઓછા સહભાગ્યની વાત નથી ! ” એટલું બોલીને આકાશે પોતાનું શિર આચાર્યના ચરણે ઝુકાવ્યું. આચાર્યે તેને ઉસો કર્યો અને આશિર્વાદ આપ્યો. પોતાના બન્ને હાથ જોડીને આકાશ બોલ્યો: “ કૃપાનિધાન ! આ આસ્તન સ્વીકારે. ”

“ નહિં, નહિં; શહેનશાહ, કોઈપણ જાતની ધાતુનું

આસન અમારા માટે સાધુધર્મને નિષેધકર્તા છે. ” એટલું કહીને આચાર્યે પોતાની પાસે રહેલી કામળ જમીનપર પાથરી અને પોતાની એઠક લીધી.

અહ્વ સમયમાંજ અકખર અને તેના સરહારો પોતપોતાની જગાએ બેસી ગયા. અકખર પણ આચાર્યની સામેની એઠકપર એઠા પછી હોલ્યો. “ મહારાજ ! આપ કયાંથી અને કેવી રીતે પ્રવાસ કરતા અતે આવી પહોંચ્યા ? ”

“ .આપનું આમન્ત્રણું સ્વીકારીને હું ગુજરાતના ગાંધાર બંદરથી પેદલ જ ચાલ્યો. આવું છું. ” આચાર્યશ્રી હોલ્યા.

આ સાંસળીને અકખરતો હિંજ થઈ ગયો. તે હોલ્યો. “ કૃપાનિધાન ! કેવળ મહારાજ માટે આવી વૃદ્ધાવસ્થામાં પણ અનેક કષ્ટ ઉડાવીને આપે આટલો બધો શ્રમ લીધો છે. શું મહારા અમદાવાદના સૂણાએ આપને વાહન માટે પાલખી વગેરેનો પણ કંઈ બંદોબસ્ત ન કરી આપ્યો ? ”

“ નહિ, નહિ, શહેનશાહ ! તે તો બધું આપવાને તૈયાર જ હતા; પરંતુ મહેં ભુશીથીજ તેમની વિનંતીનો અનાદર કર્યો છે. કારણું કે તેવી વસ્તુઓનો સ્વીકાર અમારા ધર્મના કુરમાન સુજગ અમારાથી થઈ શકતો નથી. ”

અકખર આ સાંસળીને વિસ્તિત થયો. અને તે થાનસિંહ પ્રત્યે દાખિપાત કરતો હોલ્યો. “ થાનસિંહ ! હું તો આ મહાત્માના નિર્દોષ બ્યવહાર અને અતિકિલિન જીવનથી અજ્ઞાત હતો; પરંતુ તુંતો તેથી સારી રીતે પરિચિત હતો. સૂરજને મહેં આમન્ત્રણ મોકદ્યું લારે જ તેં મહને બધી હકીકત જણ્ણાવી હોત તો આટલે હૂર આવવાનું આમન્ત્રણ કરીને હું તેમને કણ આપત નહિ. અને તેમની આત્મસમાધિમાં અવરોધ આણવાનું પાતક પણ મહારા શિરપર ચઢત નહીં.

થાનસિંહ અકખર પ્રત્યે એકીટસે તાકી રહ્યો. બાદશાહને શો પ્રત્યુત્તર આપવો તે સંબંધી તે વિચારવા લાગ્યો. એટલામાં પુનઃ અકખર હોલ્યો: “ હું, તહારી બનીયા બાળ હું સહમજ

ગયો છું. પોતાનો સ્વાર્થ સાધવાના ઉદ્દેશથીજ તે ભુને તે વાત જણાવી નહિ હોય ! કારણ કે આજદિન સુધીમાં સુરિમહારાજ અહિં આવ્યા નહિ હોવાથી જે તેઓ અહિં આવે તો તેમની સેવા—સુશ્રુતા કરવાનો લાભ તુને પ્રાપ્ત થાય. મહારા આમન્ત્રણુને લીધે તુને તેમજ તહારા જાતિલાઈએને વિશેષ લાભ થાય તો તેથી હું ધર્મોજ આનંદિત થાઉં છું.”

ભાદ્રશાહના ઉપરોક્તા વચ્ચનો સાંભળીને સૌ મોટેથી હુસવા લાગ્યા.

“ આપની સાથેનાં અન્ય માણુસો ક્યાં છે ? ” અકૃષણે આચાર્ય તરફ ઝરીને પુછ્યું.

“ અમો બધાંએ અહિંથી એ કોશપર સ્થીરતા કરી છે. હું સહેજ કરતો કરતો આઠલે સુધી આવી પહોંચ્યો એટલામાં અચાનક રીતે મહેં અહિં માણુસોની મેહની જોઇ. જો કે આવા તમાસામાં રોકાવું તે અમારા આચારથી વિરુદ્ધ છે; પરંતુ આપના પ્રાણુ હુરવાનું કારસ્થાન અનાયાસે મહારા જાણવામાં આવ્યું અને તેથીજ હું પણ મેહનીમાં દાખલ થયો ને ત્યાર પછીની હુકીકત તો આપ જણો જ છો. ”

“ મહારાજ ! મહારા પ્રાણુ હુરવાનું કાવતું આપના જાણવામાં શી રીતે આવ્યું અને કાવત્રાખોરો કોણુ કોણુ છે, તે વિષે આપ કંઈપણ ખુલાસો કરશો ? ”

“ ભાદ્રશાહ ! એ હુકીકત હું સ્પષ્ટ કરવા ધર્યાંતો નથી.”

આચાર્યશ્રીની અનીચા જાણીને અકૃષણે તે માટે વિશેષ કંઈપણ પૂછપરછ કરી નહિ. થોડીવાર મૈન રહ્યા પછી અકૃષણ થાનસિહુને ઉદ્દેશને એલ્યોા: “ થાનસિહ ! આચાર્યશ્રીની સાથેના તમામ માણુસોને માનપૂર્વક ધામધુમથી આવતી કાલે સિક્કિમાં લઈ આવો અને આચાર્યશ્રી માટે શહેરમાં મુકામની વ્યવસ્થા કરો. ”

“ ભાદ્રશાહ ! આજે અહિંથી હું મહારા સુકામ તરફજ જઈશ. આવતી કાલે અમો બધાં શહેરમાં સાથે આવશું.

અમારા સત્કાર માટે કોઈ પણ જીતની ખાસ વ્યવસ્થા કરવાની જરૂર નથી.” એમ કહી આચાર્યો પોતાના સુકામ તરફ પ્રયાણ કર્યું અને બાદશાહે આચાર્યશ્રીની ધામધુમ સહિત પધરામણી કરવાની વ્યવસ્થા કરવા થાનસિંહને લલામણ કરી સૈંધુરા પડ્યા.



પ્રકુરણું ૧૭ મું.

અક્ષેત્રનું કૃમાન.

અક્ષેત્રનો મેળાપ થયા પછી આચાર્યશ્રી પોતાના સુકામ તરફ વળતાં આ બનાવને માટે તેમને દેશપણ વિચાર આવ્યો નહિ. ઇક્તા બાદશાહ અક્ષેત્રના અદ્ય સહુવાસમાં તેનો ધર્મ માટે શુદ્ધ, સરળ અને સત્ય પ્રેમ જેવાથી સતત વિહારનો શ્રમ પણ તેઓ વિસરી ગયા.

સંવત ૧૬૭૮ના માગશર વહી ૭ ના સૂરિલુણે ગાંધારથી સીકી આવવા વિહાર શરૂ કર્યો હતો તે આપણે જાણી ગયા છીએ. વિહાર સમયે જગમાલ કે જેમણે આચાર્ય વિરુદ્ધ ખટપટ કરી હતી તેણે માર્ગી માગવાથી તેને મિથ્યાહુદુકૃત આપી ઉદારતાથી ગચ્છમાં લીધો ને પોતાની સાથે આવવાની રજ આપી. ગાંધાર અંદરથી અમદાવાદ આવતાં લાંના સૂખા શાહુદુદ્દિને ભારે ધામધુમથી તેમનો સત્કાર કર્યો અને હીરા માણિક્ય, મોતી, પાલખી, હાથી, ઘોડા, વળોરે ને કંદ જોઈએ તે સર્વ આપવાને બાદશાહનું કૃમાન છે તેમ જણાવી સર્વ સામની રણુ કરી; પરંતુ સૂરિલુણે જણાવ્યું કે “અમે સંસાર-વિરક્ત લિક્ષુકોને આવી વસ્તુઓ મોહ અને પ્રમાદ વધારી પાપમાં પાડનારી છે માટે તેનો ઉપયોગ કરતા નથી.” આ પ્રમાણે તેઓ પોતાના શિષ્ય સમુદ્દરને સાથે લઈ તેડવા આવનાર કુમાલ અને મૈંદી સાથે વિહાર શરૂ રાખ્યો હતો. માર્ગમાં આવતા

પાટણમાં સુરિજીના સહાય્યાયી પંડિતજી ધર્મસાગરજી તથા શ્રીવિજયસેન સુરીજીએ આ પ્રસંગે ભારે ઉત્સવ કર્યો. આ પ્રસંગે કેટલીક નૈન પ્રજનામાના આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠામહેાત્સવ કરાવવા પછી સિદ્ધપુર આવતાં “કૃપારસ ડેખ” ના કર્તા શાન્તિચન્દ્રજી સાથે આચાર્યશ્રીના મેળાપ થયો. શાન્તિચન્દ્રજીની વિક્રતાથી આચાર્યશ્રી અતિ પ્રસન્ન થયા અને તેમણે તેમને પોતાના સાથે પ્રવાસમાં લઈ લીધા. સિદ્ધપુરથી આચાર્યશ્રીએ સરેરતરા તરફ ગમન કર્યું અને ત્યાંના ઢાકોર સાહેબ અનુર્ધુનસિંહને ધર્મધોધ કરી તેના હુંદ્યસને છોડાવી દીધાં. ત્યારપછી આખુની યાત્રા કરી સાદ્ગી, રાણુકપુરનું ધરણુવિહાર નામનું ભવ્ય જીનોલય આદિ પંચતીર્થિનો લાભ લઈ મેડતા પધાર્યો. અહીનાગોર અને બિકાનેરના સંધ દર્શનાર્થે આ વ્યા હતા. ત્યાંથી સ્વાંગાનેર થઈને આચાર્યશ્રી સિક્કિના નજીક લગભગ દોઢ વર્ષ અને સાત દિવસના પ્રવાસ પછી સં. ૧૬૭૬ના જ્યેષ્ઠ વહી ૧૩ને શુક્રવારના રોજ આવી પહોંચ્યા હતા. પોતાના દોઢ વર્ષના પ્રવાસ દરમ્યાન પોતાનો સરસામાન તેચ્યો. અન્ય મનુષ્યને ઉચ્ચકવા આપતા જ નહિ. તેમજ પોતાની સાથે આલતા સૈદ્ધાંતિક શિરોમણી મહા મહોપાદ્યાય શ્રી વિમલહર્ષ ગણી, અટોટર શતાવધાન વિધાયક શ્રીશાન્તિચન્દ્રગણી, પંડિત સહુજ સાગરગણી, “હીર સૈભાગ્ય” કાબ્યના કર્તાશ્રી સિંહ વિમલગણી, વક્તવ્ય અને કવિત્વ કળા નિપૂણ તેમજ “વિજય પ્રશસ્તિ” કાબ્ય ના કર્તાશ્રી હેમવિજયગણી, વૈયાકરણ ચુડામણિ પંડિત લાભવિજયગણી, શ્રી ધનવિજયગણી આદિ વિક્રાન્ત શિષ્ય સમુદ્ધાય પણ તેવીજ ખંત અને આત્મદમનથી સાથે વિચરી રહ્યો હતો. તેચ્યોએ પણ જ્યારે ખાદ્યાહનો ધર્મપ્રેમ જાહ્યો, ત્યારે બહુ ખુશી થયા.

ધીજે દિવસે સુરોદ્ય થતાં શહેનશાહ અકબર ભારે ઢાકમાઠથી યતિજીને સિક્કિમાં લઈ જવા સાર્દ તેમના મુકામે આવી પહોંચ્યો. યતિજીને બેસવા સાર્દ ખાસ હાથી શાણુગારીને

તૈથાર કરાવ્યો હતો તેણે આચાર્ય શ્રીને બેસવાને માટે વિનંતી કરી; પરંતુ આચાર્ય શ્રીએ તે ધર્માચાર વિરુદ્ધ છે તેમ જણુંબું. શહેનશાહ પણ તેમના આ નિયંત્રણ ખુશી થયો.

ધીમે ધીમે સવારી રાજમહાલય પાસે આવી પહોંચ્યી એટલે લશકર વિગેરે પોતપોતાને સ્થાને ગોડવાઈ ગયા. બાદશાહ અકૃત આચાર્ય શ્રીને લઇને પોતાના ખાસ દિવાનભાનાના માર્ગે વજ્યો.

આ દિવાનખાનાને આજે ખાસ શાળગારવામાં આવ્યું હતું. દિવાનખાનાની જમીન પર સોનેરી જલજલ પાથરવામાં આવી હતી. આચાર્ય શ્રીને બેસવા સારુ એક સુંદર ઐઠક બનાવવામાં આવી હતી અને નજીકમાં તેમના શિષ્યવર્ગ તેમજ અન્ય અધિકારીઓને બેસવા માટે ચઢતા ઉત્તરતા દરજાની ઐઠકો ગોડવવામાં આવી હતી. અકૃત આચાર્ય શ્રીને લઇને દિવાનખાનાના દ્વાર પાસે આવી પહોંચ્યો કે તરતજ છીડારોએ “અદલા હો અકૃત” એવી નેકી પોકારી. છીડારોની નેકીનો ધ્વનિ સાંભળતાંની સાથે જ સર્વ ગૃહસ્થો ઉભા થઈ ગયા અને નમન કરવા લાગ્યા.

દ્વાર પાસે આવી પહોંચ્યા પછી દીવાનખાનામાં પાથરેદો ગાલીઓ જેઠીને આચાર્ય શ્રી ઉભા રહ્યા. તરતજ શાળો શાહ કુહમજી ગયો કે સૂરીજી ગાલીઓ પર થઈને ચાલવા ઈચ્છતા નથી. તેણે તરતજ ગાલીઓ ઉપાડી લેવા નોકરોને નેત્રસંકેત કર્યો એટલે તે ઉચ્ચકતાંજ દ્વારની નજીકમાં કેટલીક કીડીઓની હારી દર્શયમાન થઈ. અકૃતને આ દર્શયથી મહૂત્મા ઉપર સહસ્ર ગણી શ્રદ્ધા વધી. બાદ સૂરીજી અને શાહ નિયત સ્થળે પહોંચવા માટે આગળ વધ્યા અને નિર્દેષ સ્થળે પહોંચ્યા પછી આચાર્ય અને શિષ્યોએ ખગલમાંથી એક ઉનતું બનાવેલું આસન જમીન પર ભીછાવીને તે ઉપર બેઠા. અકૃત અને અમીર ઉમરાવોએ પણ પોતપોતાની ઐઠક લીધી.

અકૃત અત્યારે આચાર્ય શ્રીનો ધર્મોપદેશ સાંભળવાને

આતુર હતો તેથી વિશેષ વખત નિરથી ન જવા હેતાં જગ્યાંયું મહાત્માશ્રી ! મહારા અમલ નીચેની પ્રજાના હું સુખ્ય બેનિ-ભાગ પાડું છું. એક હિં-હુ પ્રજા અને બીજી ઈસ્લામી પ્રજા. આ બન્ને પ્રજાઓને હું મહારા નેત્રો સમાન ગણું છું. મહારી એ નેત્ર રૂપ બન્ને પ્રજામાંની એક પણું પ્રજાનું દિલ ન હુખ્યાય તેવી રીતે વર્તવા માટે હું ખાસ કાગળ ધરાવું છું. હું ઈસ્લામધર્મી રાજી છું; પરંતુ હું ઈસ્લામીઓના લાલની ખાતર હિં-હુપ્રજાને રંઝડવાનું પસંદ કરતો નથી. તેમજ હિં-હુ પ્રજાને પ્રસન્ન રાખવાના ઉદ્દેશથી ઈસ્લામી પ્રજાને હુઃખ થાય તેમ વર્તવાની પણ મહારી ઈચ્છા નથી; છતાં કેટલાક તે વાત ન સમજવાથી મારા તરફ ઉતાવળા થઈ આક્ષેપ કરેંછે. ગઈ કાલનો બનાવ તેવી ઉતાવળી સમજનું પરીખ્યામ હોય તેમ હું માનું છું. એટલે તે સંબંધે અત્યારે વધુન કહેતાં મારા પ્રાણુરક્ષણ માટે આપ ખુદાના હૃત તરીકે આવ્યા હો તેમ જાણી આપનો અહેસાન માનું છું અને આપના તરફથી ધર્મના ધ્લામની નવાજેશ મેળવવા ઉમેદ રાખું છું.

અકૃપારની શાંતિ અને પ્રજા પર સમાન પ્રેમ જોઈ સૂરિજીને આનંદ થયો. તેમણે બાદશાહને ધર્મ સંભળાવવાને આ પ્રસંગ ઠીક જોઈને પ્રતિબોધ કરતાં પહેલાં પોતાના કાર્યની લખુતા ખતાવી અને પછી જગ્યાંયું કે “નામવર બાદશાહ ! તમારી હિં-હુ-મુસ્લીમ પ્રજા માટે એક સરખી લાગણી જાણી મને બહુ આનંદ થાય છે. રાજસત્તા પ્રાપ્ત થવી એ પુન્યનો મહા ચોગ છે. કેમકે તે સ્થાનમાં ખુદાનો અંશ છે. એટલે નેકી તથા દિનસાકુની હાજરી લ્યાં હુમેશાં જરૂરનો છે. જોકે કેટલીક વખતે રાજપિતા સત્તાના ઘેનમાં પોતાની આ જવાબદારી ચુકી જાય છે અને તેથી અધિકારીઓની સ્વચ્છંદતા જોર કરી જતાં રાજ-ધર્મનો લોાપ થાય છે. ને પ્રજા હુઃખ્યથી કંટાળી સામે થાય છે. પરંતુ આપના અમલમાં સત્તાનું ઘેન જોવાતું નથો એજ પુણ્યના બળથી આપનું રક્ષણ થયું છે. એટલે તેમાં હું તો નિભિત માત્ર છું.

ધર્મનો દુંડો અર્થ જ પ્રાણી માત્ર ઉપર દ્યા રાખવી તે છે. કુરાને શરીરમાં પણ કેાઠ પ્રાણીને હુઃખ ન થાય તેવું સાહું અને પવિત્ર જીવન ગાળવાને ફરમાન છે. જે પ્રાણી કે જીવને બનાવવાની આપણી શક્તિ નથી તેનો નાશ કરવાનો અધિકાર આપણે લોગવી શકીએ નહિં. આ એક સાદી વાત છે, પણ ધર્મ તો ત્યારે જ ગણ્યાય કે ભીજા જીવોના હુઃખો ફર કરવા અને તેને મહદ કરવામાં આપણી શક્તિને રેકી શકીએ. ગાઠ કાલે આપના ઉપરથી પસાર થયેલ આકૃત અને તેમાં મારી હુલ્લરી એ આ ધર્મ સમજાવવાને ખુદાઈ સંદેશા જેવી ઘટના છે. એટલે આપને પ્રાણુરક્ષણુથી જેવો આનંદ થયો છે તેવો આનંદ ભીજા પ્રાણીને બચાવીને આપ આપી શકો તો તે મને મોટામાં મોટું હનામ મળ્યું તેમ હું સમજુશ.”

સ્ત્રીના આ દુંડા ઉપરેશની બાદશાહના હુદ્ય ઉપર ઉંડી અસર થઈ. તેમણે તેજ વળતે અખુલફાલને ઓલાવી પોતાની અને પોતાના તાખાના રાજ્યોની હુદમાં પર્યુધણુ પર્વમાં કેાઠ જીવહિંસા ન કરી શકે તેવું ફરમાન લખી ફરમાયું અને આચાર્ય શ્રી ઉતારે જવા રવાના પણ પૂછી સૌ છુટા પડ્યા.



પ્રકરણ ૧૮ મું.

પૃથ્વીસિંહ કે અકુભર ?

જ્યારે કુમળા શુદ્ધિમાં આવી ત્યારે તેણે જેણું કે પોતે એક રાજમહાલયમાં હતી. તેને જે ઓરડામાં રાખવામાં આવી હતી તે ઓરડો અદ્દ્રોગકાશિત હતો. ઓરડામાંની સર્વ ભારીઓ પર પડ્યા નાંખવામાં આવ્યા હતા. જમીન પર સુંદર ગાલીઓ પાથરવામાં આવ્યો હતો. ને છુટાં છલાયાં સુગંધી

પુષ્પોના કુંડાં ગોડવી દેવામાં આવ્યાં હતાં. ઓરડાનાં મધ્ય લાગમાં કુમળાની શથ્યા હતી. કુમળાને તેની સેવામાં જાગ્રત થયેલી જોઈ ત્યાં રોકાયેલી દાસીએ પુછ્યું. “આપને શાંતિ છે કે ?”

કુમળાએ પોતાના કપાળપર હાથ ફેરવ્યો અને આશ્ર્યથી બોલી: “આ શું ? હું અહિં ક્યાંથી ?.....હં, હં; જહાંપનાહ તો સુખરૂપ છે ને ? ”

“હા; નામવર બાદશાહ સુખરૂપ છે. આપને શાંતિથી નિદ્રા લેવા હડીમની સલાહ છે.”

કુમળાએ પુનઃ પોતાના નેત્રો મીંચ્યાં. પણ તે વિચારવેગને રોકી શકી નહિં. પોતે અકુભરના પ્રાણ બચ્યાવતાં ધાયલ થખ એ સર્વ ઘટના કુમળાની દણિ સન્મુખ પુનઃ ખડી થએ. “મહેંજે કર્યું તે ઠીકજ કર્યું” તે સ્વગત વિચારવા લાગી. જે આજે બાદશાહનો નાશ થયો હોત તો તેનો આરોપ જિચારા સિક્કિના ગરીબ રાજપૂતોના શિરપર આવી પડત અને અમારી નાહક ફૂજેતી થાત ! અમરસિંહ, જીર્ણસિંહ કે હું અથવા તો પૃથ્વીસિંહ પરજ તે આરોપ મૂકવામાં આવત ! ”

પૃથ્વીસિંહનું નામ યાદ આવતાંની સાથેજ કુમળા ચમકી. ગધ કાલે પૃથ્વીસિંહ મેદાનમાં કેમ નહિ આવ્યા હોય ? પૃથ્વીસિંહ કોણું હુશે ? તે રહે છે કયાં ? પોતાની હડીકત કહેવાનો પ્રસંગ આવતાં તેના પર તે ઢાંકપીછોડો કેમ કરે છે ? વગેરે પ્રશ્નોનો વિચાર કરવામાં કુમળા લીન થઈ ગઈ.

વિચાર કરવા જેટલી પોતાની શક્કિન નહિ હોવાથી કુમળાએ વિચારશ્રેણીને અટકાવવાનો યત્ન કરવા માંડયો. પોતાના કપાળપરનો પ્રસ્વેદ તેણે લૂધી નાંખ્યો. ને પોતાનાં વખો સમાર્યા. ઓટલામાં ઓરડાનું દ્વાર ઉધયું. કુમળાએ ચમકીને જોયું તો દ્વારમાં ખુદ બાદશાહ અકુભર ઉલો હતો. કુમળાએ આમતેમ જોયું તો તેણે દાસીને ત્યાં જોઈ નહિ. પોતાના ભાલ પ્રદેશપર ઉડી રહેલી વટો સમારતી કુમળા પોતાની શથ્યામાં બુઠી થઈ ગઈ. તેના નેત્રયુગલમાંથી એક પ્રકારનું અપૂર્વ તેજ પ્રકાશવા લાગ્યું. તે નિશ્ચલપણે અકુભર પ્રત્યે જોઈ રહી.

અકબર કુમળાની સ્વાસ્થ્યતા જોઈ ખુશી થયો. તેણે ધીમા સાહે કુમળાને પુછ્યું. “ કેમ કુમળા ! તથીયત ઠીક છે કે ? મારા જીવેલા ઘાનો વ્યાધિ એછો થયો છે કે ? કુમળા, તો મુહારા પ્રાણુના રક્ષણ માટે પ્રેરાઈ મુહારા પર મહાન ઉપકાર કર્યો છે.

“ નહિ, નહિ; જહાંપનાહ ! એમાં ઉપકાર શાનો ? આટલી રાજસેવા કરવાની મહને તક મળી એજ મહારાં સહભાગ્ય છે ! ” કુમળા વર્ચ્યેજ બોલી ઉઠી.

“ નહિ. ” અકબર ડોકું ધુણાવતો બોલ્યો. “ સિડિના જે રાજપૂતો અકબરને ઠાર કરવાના યત્નો કરી રહ્યા છે, તેજ રાજપૂતોની ટોળીમાં રહેલી કુમળા મુહારા પ્રાણ બચાવવા તત્પર થાય એથી વિશોષ આહલાદજનક મુહારા માટે શું હોઈ શકે ? ”

“ નહિ, જહાંપનાહ ! એ વાત તદ્દન જીહું છે. ” કુમળા આવેશપૂર્ણ સ્વરે બોલી.

અમે સિડિના રાજપૂતો રાજહુત્યાનો વિચાર પણ કરીયે નહીં. આમારી ટોળી કેવળ ન્યાય મેળવવા માટેજ છે. હવે અમને ન્યાય મળવા લાગ્યો છે. અમે સુખી છીએ. આપના પ્રાણ હરવાનો યત્ન કરેનાર માનવરાક્ષસ રાજપૂત હોવાનું આપનું માનવું ભુલાવો ખવરાવનારું છે. ”

“ કદાચ તેમ પણ હોય ” અકબર શાંતિથી બોલ્યો; પરંતુ એટલામાં કુમળાને પુનઃ મુચ્છી આવવા લાગ્યી. અકબર એકદમ કુમળાનો હાથ પકડીને તેને શાખામાં સૂવાડતાં સૂવાડતાં બોલ્યો “કુમળા ! તુને જાણ સખ્ત લાગ્યો છે. તહારાથી બેસી શકાશો નહિ. સ્વર્ધ જા ! ”

અકબર પ્રત્યે કૃતજ્ઞતાપૂર્ણ દષ્ટિ ફેંકતાં કુમળા મનમાજ બોલી “ અરે ગ્રલુ, આવા કરણું બાદશાહનો વધ કરવા માટે શું રાજપુતમંડળી અટપટ કરે ? ”

“ એલ, ત્યારે હું તહારો ઉપકારનો બદલો કઈ રીતે વાળું ? ” અકખરે કુમળાને શાંતિથી પુછ્યું.

“ બદલો ? ” કુમળા વિસ્મય પામતી બોલી. “ હું તો એક પામર સ્વી છું. દ્વયનો મહુને મોહ નથી. સોનું, માણિક્ય, મેતી આદિને હું ભૂતિકા સમાન લેખું છું. છતાં આપ નામવરને જે બદલો આપવોજ હોય તો મહારી માત્ર એટલીજ માગણી છે કે સિડિના ગરીબ રાજ્યપૂતોનું હુઃખ દ્વષ કરેલા. ”

એટલું બોલીને કુમળા શાંત રહી. તેની દશ્ચિ હજ પણ અકખર પ્રત્યે એક સરળી લાગી રહી હતી. તેં થોડીવાર રહીને પુનઃ બોલી. “ અને આપના પ્રાણું બચાવ્યા તે કંઈ આપને કેવળ બાદશાહ ધારીને જ નહિ ! ”

“ એટલે ? ” અકખર વિસ્મય પામતો બોલ્યો. “ શું ? કેવળ ભૂત દ્વયાના તત્ત્વનો અર્થ સહમળનોજ. તહેં મહારા પ્રાણું બચાવ્યા હતા કે ? ”

“ ના; ? ”

“ ત્યારે ? ”

કુમળા મૈનજ, રહી.

“ પણ ત્યારે મહારા પ્રાણું બચાવવાનું એવું તે કયું કારણ છે ? શું મહુને તે કહી શકાય તેવું નથી ? ” અકખરે આતુરતાથી પુછ્યું.

“ નહિ; એમ તો કંઈજ નથી. જહાંપનાહના પ્રાણું બચાવવા માટે હું દોડતી આવી હતી તેનું એક કારણ એ હતું કે મહારા પ્રાણું કરતાં પણ અધિક પ્રિય પ્રથ્વીસિંહના જેવુંજ જહાંપનાહનું સ્વરૂપ છે. ”

એટલું બોલીને કુમળા શાંત રહી. ભયમિશ્રિત પશ્ચાત્તાપની એક લાવના કુમળાના હૃદયમાં ઉદલવી. નહી બોલવાની વાત અકખર સમક્ષ બોલાઈ જવાથી તેને પશ્ચાતાપ થતો હોય એવું તેની સુખમુદ્રાપર આભાસ થવા લાગ્યો. ખુદ પ્રથ્વીસિંહ

સમક્ષ પણ જે પ્રેમ વ્યક્ત થયો નહોતો, તે આજ અકબર સમક્ષ વ્યક્ત થઈ ગયો એ કુમળાને ગમ્યું નહિ.

અકબરના આશ્રીયનો પણ અવધિજ થયો. કુમળાના નેત્રોમાંની અસ્થિરતા, અને તેના વદનમંડળપર દંગોચર થઈ રહેલું અત્યંત કેમળ પરંતુ અવ્યક્ત કાર્યાલય જોઈને તેનું હૃદય ભરાઈ આવ્યું. તે પોતાની લાગણી હવે છુપાવી શક્યો નહિ, કુમળાને વિચારમાં પડેલી જોઈ તે તેની પથારી નજુક ગયો અને કુમળાનો હુથ પકડી તેના ગાલ પર એક મધુર ચુંખન કર્યું.

કુમળા ચમકી. તેણે એક દીર્ઘ નિશાસ મૂક્યો અને અકબર પ્રત્યે તિરસ્કારયુક્ત દાખિ ઝેંકતાં કુદ્દ સ્વરે ખોલ્યો: “ નામવર આ શું ? ”

અકબર કંઈપણ ખોલ્યા સિવાય કુમળા પ્રત્યે તાકી રહ્યો અને સિમત કરતાં ખોલ્યો: “ કુમળા, હવેથી મહુને બાદશાહ તરીકે ન જોઈશ. હું જ તહારો પૃથ્વીસિંહ છું. ”

“ હું ? ” કુમળાના આશ્રીયનો અવધિજ થયો.

“ ગલરા નહિ ! ભય ન પામ ! ” અકબર આશ્વાસન સૂચક સ્વરે ખોલ્યો: “ કુમળા, પૃથ્વીસિંહના સાન્નિધ્યમાં તહારે લયલીત થવાની જરૂર નથી ! હું અત્યારે તહારો રાજ બાદશાહ-અકબર નથી ! અત્યારસુધી તું જે પૃથ્વીસિંહના ગુણું કરી રહી હુતી તેજ પૃથ્વીસિંહ-હું-અકબર તહારી. સન્મુખ ઉલો છું. મહારા સામું જો ! ”

કુમળા અકબર પ્રત્યે તાકી રહી. ઉલયની દાખિ એક થઈ. પોતાની દાખિ સન્મુખ પોતાના પ્રિય પૃથ્વીસિંહની મૂર્તી ખડી થએલી જોઈને કુમળાએ રોમાંચ અનુભૂત્યો. તેના મુખ-માંથી આશ્રીયોદ્ગાર બહાર પડ્યા. “ પૃથ્વીસિંહ કે અકબર ? ”



પ્રકરણ ૧૮ મું.

પદમાની પ્રતિજ્ઞા.

જુદેખાના ભેણાથી કાળના કારસ્થાનની હુકીકત જણું
વામાં આવી તેજ ક્ષણે અકખરે પોતાના મનમાં ઠરાવ્યું કે હવે
કાળની ખરાખર અખર લેવી પડશેજ. આજે તેણે કાળને કેવી
રીતે શાસન કરવું તત્ત્વાંધી વિચારો કરવામાં ઘણેં સમય
વીતાડ્યો. ત્યારપછી અકખરના મનમાં એક નવીન કદ્વયના
ઉદ્ભવી. તે ઉલો થયો અને અનાનખાનાના પ્રવેશક્રાર તરફ
જવા લાગ્યો.

જેવો બાદશાહ અનાનખાનાના પ્રવેશક્રારમાં પગ મૂકુવા
નાય છે કે તરતજ પદમાનો અને અકખરનો લ્યાં લેટો થયો.
અકખર ચમકીને ઉલો રહ્યો. પદમા પણ લ્યાં પાપાણ મૂર્ત્તિવત
સ્થિર ઉલ્લી થઈ રહી. થાડીવાર સુધી કોઈ કંઈ બોલ્યું નહિ.
અકખરના મનમાં પદમા માટે અલાવ આવી ગયો હોવાથી
તેનાથી તો બોલવાની શરૂઆતજ થઈ શકે તેમ નહોતું; અને
રાણી પદમાએ પણ પોતાના મનમાં દઢ નિશ્ચય કર્યો હતો કે
અકખર દિલ્લીએ પડતાંની સાથેજ તેના ચરણુદ્ધ્રય પકડીને તેની
ક્ષમા માગવી. પરંતુ કેણું જણે શુંયે થઈ ગયું. અકખર પ્રત્યક્ષ
પોતાની સન્મુખ આવીને ઉલો હતો છતાં પણ પદમા અલારે
વિચારશૂન્યજ બની ગઈ ! તેનો નિશ્ચય ડગમગી ગયો. ક્ષમા
માગવાની હૃદયમાં પ્રથળ દિચ્છા હોવા છતાં પણ તેના મુખ-
માંથી એક શરૂદેસ્યાર સુદ્ધાં થઈ શક્યો નહિ. અકખરના
ચરણુદ્ધ્રય પકડવાની અંતરમાં ઉત્કટ દિચ્છા હોવા છતાં તેનું
શરીર નીચું નમતું નહોતું. પદમાની વાચાશક્તિ છેકજ અદૃશ્ય
થઈ ગઈ. તેનાં નથનો અશ્રુપૂર્વ થઈ ગયાં. તેણે એક દીર્ઘ
નિશ્વાસ મૂક્યો.

અકખર હજુ સ્વસ્થ ઉલો હતો. તેણે પદમા પ્રતિ દિલ્લી

સુદ્ધાં કરી નહિ, એ મહિના પૂર્વે જે અકબર પદ્માના મનતું સમાધાન કરવાના ઉપાયો ચોજવા તૈથાર હતો તેજ અત્યારે પદ્માના જરૂરી સ્વભાવને લીધે તેના પ્રત્યે એદરકાર બન્યો. પદ્મા માટેનો પ્રેમજ અકબરનું હૃદય દંધ કરતો હતો. વળી કુમળા પ્રતિનું આકર્ષણું વધવાથી હવે પદ્મા તેને શાખ્યરૂપ ભાસવા લાગી હતી. પદ્માના જે સૌનંદ્યે અકબરને પ્રેમઘેલો બનાવી દીધો હતો એ સૌનંદ્ય-માંની મોહિની અત્યારે નષ્ટ થઈ ચુકી હતી, પ્રેમરૂપી લોહચુંખ જડ સૌનંદ્યરૂપી શરીરમાં નહિ હોવાથી તેમાં આકર્ષણું શક્તિ રહી નહોંતી. એ અંતઃકરણને પરસ્પર એંચનારી શક્તિ પ્રેમજ છે. શરીરકાન્તિ નહિ. ભવભૂતિ જેવા કવિ પણ કહે છે કે, હૃદય બંધનતું ખર કારણ, ‘અંતરઃકોડપિ હેતુઃ’ જ છે. એ સિવાય રમણીના ગુલાણી ગાલની લાદી કિંવા વઃલભના પાણીદાર નેત્રોની કંઈ જ કારી ફ્રાવતી નથી. અકબરના હૃદયમાં અત્યારે બિલકુલ પ્રેમભાવના રહી જ નહોંતી અને તેથી જ તે અત્યરે સ્વસ્થ ઉલો હતો.

પરંતુ પદ્માનો દીર્ઘ નિઃશ્વાસ સાંલળતાંની સાથે જ અકબરનું હ્યાણુ અંતર દ્વયું. તેની કઠોર વૃત્તિમાં કરણું ઉલરાઈ આવી એટલે તે પદ્માને સંઓધીને ઓલ્યોઃ “ હેવિ ! આ શું ? ”

આ આશ્વાસનસૂચક શરીર સાંલળનીને પદ્માનું હૃદય વધારે લારાઈ આવ્યું અને તે ડસ્કે ને ડસ્કે રોવા લાગી.

પણ “મહુને રડવાનું કારણ તો કહેવું જોઈએ. આટલું ખાંડું શા માટે ? ” અકબર પદ્માની નાલુકમાં આવતાં કરણું સ્વરે ઓલ્યો.

“ હું પાપી છું. ” પદ્મા દુસ્કાં ભરતાં ઓલીઃ “ આજ સુધીમાં મહું આપનો ધણો અપરાધ કર્યો છે, પરંતુ હવે મહુને આપના પવિત્ર ચરણમાં લઈને પાવન કરો ! હું આપને શરણ આવી છું. ” આટલું ઓલીને પદ્માએ બાદશાહના ચરણમાં પોતાનું માથું નમાવ્યું અને તેના પગનો ચરણસ્પરણ કર્યો.

પ્રિયે ! શાંત થા ! આમ ગાંડાઈ ન કર ! ” અકૃષ્ણ
પદ્માને ઉડાડવા લાગ્યો.

“ મહુને ક્ષમા નહિ મળે ત્યાંસુધી હું આપના પગ
છોડવાની નથી ! ” પદ્માએ અકૃષ્ણના બન્ને પગ અશુદ્ધી
લીજવી નાંખ્યા.

અકૃષ્ણરે દીર્ઘ નિઃખાસ મૂક્યો અને ક્ષમા આપી!

“ નાથ ! મહારી ભૂલ થતી હતીતે હું હવે સહમજ શકી
છું . ” પદ્મા કરુણાજનક સ્વરે બોલી.

“ એમાં તહારે બિલકુલ દોષ નથી ! ” એટલું બોલીને
અકૃષ્ણ એકવાર ચોમેર દસ્તિપાત કરી “ અત્યારે હું જાઉં છું ”
એટલું બોલીને તે ત્યાંથી અપાઠાંધ નીકળી પડ્યો.

પદ્મા તો પાણણુ મૂર્ત્તિવતુ સ્થિર જ ઉલ્લી હતી. બાદશા-
હના વર્તનમાં કુરકુર પડેલો જોઈને તે આશ્ર્ય પામી. હવે
પ્રિયતમનું મન કેવી રીતે સંપાદન કરવું એ સુંખાંધી વિચાર
કરતી તે અકૃષ્ણ ને માર્ગ થઈને ચાલ્યો ગયો તે માર્ગ જોઈ
રહી. “ મહેં પોતેજ મહારા નાથને અસંતોષ આપ્યો હોવાથી
મહુની ક્ષમા કેવી રીતે મળે ” એમ તે વિચારવા લાગી. શાડી
વાર મૈન રહ્યા પછી પદ્મા સ્વગત બોલવા લાગી: “ હું જ
મહા હુષ છું ! હવે મહુને ક્ષમા કર્યાંથી મળે ? મહારા
પ્રાણનાથને મહારા મુખનું દર્શન સુદ્ધાં કરવું ગમતું નથી.
પદ્મા ! તહારા પાપનું પ્રક્ષાલન કર્યા સિવાય તું કેવી રીતે
પવિત્ર બનવાની ? સ્વપતિના સ્નેહાંલિગનની આશા હવે તહારા
માટે રહી નથી. પતિ સેવાનો અદાય લાલ તહુને મળનાર
નથી ! હા, પણ એક માર્ગ છે ! જો પ્રત્યક્ષ પતિ સેવા કરવાનો
સુયોગ ગ્રામ ન થાય તો પરોક્ષ સેવા કરીને મારે સંતોષ
માનવો જોઈએ. પતિની માનસિક પૂજા કરવાથી પણ સતીતું
અંતર પવિત્ર થાય છે. પતિના સફગુણેનું સમરણ કરવાથી.
અંતઃકરણમાં પવિત્ર લાવનાઓનો જન્મ થશે. હું પ્રાણનાથને
હવે આંખના કણ્ણા જેવી લાગું છું; તોપણ તેમની મરજ વિરુદ્ધ

વર્તવાથી હું શું પૂછ્યગ્રાહિ કરી શકવાની છું ? બસ, હવે તો તેમની દસ્તિઓ પણ ન પડવું, તેમની મૂર્તિનું નિરંતર ધ્યાન ધરવું, તેમના શુણ્ણોનું ચિન્તન કર્યો કરવું, અને તેમના ભય અની જવું એજ મુહારા માટે કર્તાવ્ય ધર્મ છે. ”

આટલું બોલીને પદ્મા ને માર્ગ થઈને આવી હતી તે માર્ગ થઈને અનાનખાનામાં ચાલી ગઈ.



પ્રકુરણ ર૦ મું.

કાળનો કાળ

બાદશાહ અકબરનો વિનાશ કરવા માટે ઉદ્ઘૃત થયેતા ગફુરને કારાગૃહમાં પૂરવામાં આવ્યો હતો. જ્યારે તેને કેદ કરવામાં આવ્યો, ત્યારે તેણે નહારી છુટવાનો કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યો નહોતો. તેને ધણા ધણા પ્રક્ષો પૂછવામાં આવ્યા, પરંતુ તેણે એક પણ પ્રક્ષનો સંતોષકારક ઉત્તર આપ્યો નહિ. ‘બાદશાહને મારવા માટે તું કેના હુકમથી ગયો હતો ?’ એ પ્રક્ષ અધિકારીએ તેને કર્યો લારે તેણે મૈનજ ધારણ કર્યું. સામદામ લેદ અને અંતે દંડનો ઉપયોગ પણ અધિકારીએ કરી ચુક્યા. પરંતુ તેમાં તેમને નિરાશા સિવાય ભીજું કંઈજ પ્રાપ્ત થયું નહિ. તેણે કારાગૃહમાં આનંદથી પ્રવેશ કર્યો એટલું જ નહિ પરંતુ જ્યારે દરોગા તેને ખાવાનું આપી ગયો, લારે તેણે આનંદિત મુખમુદ્રાથી ખાંધું અને પાણી પીને લાંબો થઈને સ્કૂતો, ત્યારપછી તે ધસધસાટ નિદ્રા લેવા લાગ્યો.

જેમ જેમ સમય વ્યતીત થવા લાગ્યો. તેમ તેમ ગફુરનું ચિત્ત અસ્વસ્થ બનવા લાગ્યું. તેને પોતાની ખરી સ્થિતિનું ભાન થવા લાગ્યું. પોતાને શિક્ષા થવાનો વખત સમીપ આવી લાગ્યો. હોવાથી જેમ જેમ વખત વીતવા લાગ્યો. તેમ તેમ ગફુરનું અંતઃકરણ ભયભીત થવા લાગ્યું તે સ્વગત બોલવા લાગ્યો.

“ આરે ખુદા ! મહારાપર રહુમ કર ! તહારી ખાતરજ હું આ કાર્ય કરવા માટે તૈયાર થયો હતો; પૈસાના લોકથી નહિજ. ધર્મસ્વામી ધર્મનું રક્ષણુ કરવા જતાં ઉલટો હું કાળના મુખમાં ફેસાઈ પડ્યો છું. યા અહ્વા ! તહારી ખાતર મહેં આઠલું સાહસ કર્યું તેનો બદલો મહને આવોજ મળશો કે ? મહારો જાન જશો કે ! મહારાપર દ્વયા કર ! ગહારા પ્રાણ બચાવ ! મહારી નહારે ધા ! ”

આજો દિવસ ગાડુરે ચિન્તામાંજ પસાર કર્યો. રાત્રિના પ્રથમ પ્રહુરનો પ્રારંભ થયો. બાદશાહના પ્રાણ બચાવા પાભ્યા હોવાથી રાજ્યધાનીમાં આજે સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો. જેમ જેમ રાત્રિ વીતવા લાગી તેમ તેમ આનંદોત્સવનો ધ્વનિ કર્મી થવા લાગ્યો. ગાડુર પેતાની શય્યામાં પડ્યો પડ્યો તરફડીઓ માર્યાં કરતો હતો. તેને નિદ્રા ન આવે એ સ્વાલાબિક હતું. અલ્લાને વિનવણી ઉપર વિનવણી કરીને હવે તે છેક જ કંટાળી ગયો હતો એટલામાં તેની ઓરડીનું દ્વાર ઉઘડયું અને એક વ્યક્તિ અંદર દાખલ થઈ. ખુદ અદ્દાચે જ તેની નહારે ધાવાની કૃપા કરી હોય તેમ વિચારતો ગાડુર ઓરડીના દ્વાર ભણી દશ્ટિ ઝેંકે છે તો તેણે કાળુને જોયો. કાળુને જોતાંની સાથે જ ગાડુર અશ્રુપૂર્ણ નેત્રે બોલ્યો: “કાળ, મહને બચાવો ! તમારા જ હુકમથી ગહેં આ કાર્ય કર્યું છે, જતાં મહને મરવા દેશો કે ? ”

“ ધીમે બોલ ! ” કાળ ગાડુરની નળુકમાં આવીને બોલ્યો: “ ગાડુર, શુદ્ધિમાં આવ ! સાંલળ ! એકાદ મૂર્ખ માણસની માડુક બડાદાટ ન કર ! બાદશાહનું ખુન કરવાનું કામ તહારા હાથે પાર પડયું નથી, પરંતુ હળ પણ તું અદ્દાની સેવા કરી શકશો. બોલ છે મરળ ? ”

કાળને જે અંતરેચુાથી નાટકી સંલાખણુની શરૂઆત કરી હતી તેવું ધ્યાચિત પરિણામ આવ્યું. થોડાજ સમય પૂર્વે નિરાશ થયેલો ગાડુર આ સંલાખણ સંશળીને ઉત્સાહિત દેખાવા

લાગ્યો. તેના નેત્રો આશાથી ચમકવા લાગ્યાં. ઉત્સાહથી બોલ્યો:
“ હા; ખુદા વાસ્તો હું કોઈ પણ કાર્ય કરવાને તૈયાર છું. ”

સાંભળ ત્યારે ! જે અદ્દલાને સંતુષ્ટ કરવાની દૃઢા તહારા
મનમાં હોય તો આવતી કાલે તહુને ઇન્સાક્રૂની અદાલતમાં ઉલો
કરવામાં આવે અને તને બાદશાહનો ઘાત કરવાનું કોણે શી-
ખબ્યું તેમ પુછવામાં આવે, ત્યારે તારે સીકીના રજપૂતોનું નામ
આપવું ! સમજયો કે ! ”

“ પણ હું બોલું કેમ બોલું ? ”

“ બોલું બોલવામાં શી હુરકત છે ? ધર્મસેવા માટે, અ-
દ્વાના એકાંક્ષિકીરને બચાવવા માટે થાડું ધણું જ્ઞાનું બોલવું
પડે તો પણ લાલ છે. ”

ગાંધુર નિધાસ મૂકીને બોલ્યો: “ પણ કાળસાહેબ મહા-
રાથી આમ જ્ઞાનું બોલીને શું કલ્યાણ થઈ શકવાનું છે ? ”

“ એહા ! એમ કરવાથી મોઢું કલ્યાણ થશે. ” કાળ
ગાંલીર સ્વરે બોલ્યો: “ તહારા જ્ઞાનું બોલવાથી હું જીવતો
રહીશ અને બાદશાહને ઇસ્લામપ્રેમી કરીશ. આ સધગી ધર્મ-
સેવાનું ઇણ તહુને જ મળશે કે નહિ ? બોલ, આ ધર્મસેવા
અનુભવવા માટે તું તૈયાર છે કે નહિ ? ”

નહુમજયો. ગાંધુર લયલીત સ્વરે બોલ્યો: “ વારુ,
ધર્મસેવા અથે પણ જ્ઞાનું બોલવા તૈયાર ન થાડું તો ? ”

“ તો મૃત્યુ સિવાય તહારા માટે બીજે ઉપાય જ નથી ? ”
કાળએ રોકડો જવાણ પરખાવ્યો અને અત્યાર સુધી છુપાવી
રાખેલી કટારી બહાર કાઢી.

ગાંધુર એ ડગલાં પાછો હઠયો અને એક લયંકર ચીસ
પાડી ઉઠ્યો.

“ બોલ ! ” નિર્દ્દીય કાળ ગાંધુરના અંગ પ્રતિ ધસ્યો.
અને શાસ્ત્ર ઉગામીને બોલ્યો: “ કસમ લે; નહિતર ભરવા માટે
તૈયાર થા ! ”


કાળના છેહ્યા શાળ્યો પૂરા થયા પણ નહિ હોય એટલામાં

કારાગૃહનું પ્રવેશકાર ઉઘડયું અને હૃથીયારણંધ દ્રોક લશક-
રીની ટુકડી ઓરડીમાં ધર્સી આવી. તેમણે કાળને કેદ કર્યો.
સૌની પાછળ એક પ્રતાપી વ્યક્તિએ ઓરડીમાં પ્રવેશ કર્યો.
એ વ્યક્તિને જોતાંની સાથેજ કાળ ચમકયો અને તેના મણાં-
માંથી ઉદ્ગાર નીકળી પડ્યા: “ કોણ બાદશાહ ? ”

“ હા; બાદશાહ ! ” અકુભર દમામપૂર્ણ સ્વરે ડેણા
કાળને બોલ્યો અને કાળ પ્રત્યે તિરસ્કારસૂચ્યક દષ્ટિ ફેંકી રહ્યો.
લ્યારપણી તે પુનઃ બોલવા લાગ્યો: “ કાળ, ઈન્સાક્રની અદા-
લતમાં અંસત્ય બોલાવવા માટે ગુકુર પર જ્યોતિ ગુનારવાનો
ગુન્હોજ અત્યારે તને કેદી બનાવે છે. તમારા જેવા પાપાત્માએ
ધર્મગુરુના લેખાસમાં રહી ખુદાના જ્યારા નામને વગોવે
છે. અને ઈસ્લામના ઈદમને જાઓ કરે છે એટલે તમારા
પાપને વધારે વખત ચલાવવા હેવાં એ ઈન્શા—અદ્વાનો દ્રોહ
કરવા જેવું છે. જાઓ અત્યારે તેને બંદીખાનામાં લઈ જાઓ.
અદાલત તેનો ઈન્સાક્ર કરશો. ”

કાળને સિપાઈએ લઈ જય તેટલામાં તેણે હીમત
કરીને બાદશાહને કહું—ખ્યાલ કરો કે અદ્વાના ઇકીર કદાપિ
ઈન્સાક્રની અદાલતમાં ઉલા રહીને મૃત્યુની શિક્ષા સાંલળતા
નથી. ઈસ્લામ ધર્મને કલંકિત કરનાર હું નથી; પરંતુ આપેજ
ઈસ્લામ ધર્મનું અલિમાન છાડી અન્ય ધર્મને આશ્રય આપેલ
છે. ઈન્સાક્રની દોરી તો પૂર્વસે હુમારા કાળએના હુથમાં હતી
તો ઈન્સાક્રની અદાલતમાં જવા કરતાં હું ખુદાના દરખારમાં
જવાનું પસંદ કરે છું. આટલું બોલતા તેણે પોતાની પાસે
રાખેલી કટારી પોતાની છાતીમાં વોંચી દીખી અને તરતજ તેની
છાતીમાંથી રૂધિરપ્રવાહ વહેવા માંડ્યો. અને ક્ષણુમાત્રમાં કા-
ળએ આ લોકનો ત્યાગ કર્યો.

અન્ય લોકોની માર્ક અકુભર પણ સ્તરધ, નિશ્ચલ, અને
આશ્ર્યચકિત સ્થિતિમાં ઉલો હતો. તેણે પોતાનાં નેત્રદ્વય બંધ
કર્યો અને બોલ્યો: “ યા—અદ્વા ! ”



પ્રકૃતાણ ૨૧ મું .

કુમળાની કસોટી.

કુમળાનો ઘા રૂબાતાં તે અમરસિંહના મડાને આવી હતી. પરંતુ તે અકખરના મહાત્મયમાં રહી તે દરમિયાન તેને અકખરની નીતિ, પ્રજા પ્રેમ અને સહૃદયતાનો સારો પરીચય થવાથી તે તેને પૂર્ણ પ્રેમથી ચાહુવા લાગી હતી. અકખરના સમાજમામાં જ્યારે જ્યારે આવવું થતું લારે તે અનેક ચર્ચાઓ કરતી. પ્રેમલારી દૃષ્ટિથી તેની સાથે કલાકો ગાળવાને આતુર રહેતી અને, વખત ખજ્યે ભીડી વાતોથી-યુદ્ધિવાદથી અને રાજતંત્રની અવનવી વાતોથી તેને રીજવતી. પરંતુ પોતે એક સામાન્ય રજગતી આગા તરીકે પોતાની યોગ્યતા ન સમજુને પોતાનું અંતર ઝુલ્હું કરી શકી નહોતી.

જો કે તેને રાજમહાત્મય છોડી આરામ થતાં અમરસિંહ પાસે વસવા જતાં અકખરનો વિયોગ થવાથી હુંખ થયું. પરંતુ અકખર લ્યાં પૃથ્વીસિંહના ઉપનામથી નિયમીત આવનાર હતો. તે વાતથી તેણે સંતોષ માન્યો હતો.

તેણે અમરસિંહના મડાને આવવા પછી પૃથ્વીસિંહનું ઓળણાણું કરાયું નહોતું. પરંતુ જ્યારે તે નિયમીત વખતે મંડળીમાં આવતો ત્યારે તેનું પ્રેમાળ હૃદય છલોછલ ઉભરાઈ જતું અને જ્યારે મંડળમાં અકખરના માટે અસંતોષ દર્શાવવાનીવાત થતી ત્યારે તે હુમેશાં તેનો પક્ષ કર્યા વિના રહી શકતી નહોતી.

અમરસિંહ તેની આ દીતલાતથી કચવાવા લાગ્યો. તે કુમળાનો પાળક પિતા હતો, પરંતુ હવે તેની ઈચ્છા તેની સાથે લગ્ન સંખ્યા જોડવાની હતી. તેણે પોતાની આ ઈચ્છા કુમળાને જણ્ણાવવાને પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ કુમળાએ તેમાં મન આપ્યું નહોતું. કુમળાનો જો કે અમરસિંહ તરફ પ્રેમ હતો

પરંતુ તે પ્રેમ પિતા તરીકેનો હતો. અમરસિંહમાં પુત્રી પ્રેમને સ્થાનેં પતિની પ્રેમ વ્યક્તા થતો જય છે તેમ તે સમજી ગઈ હતી, પરંતુ તેમના પ્રાથમિક ઉપકારની યાદથી તેણે અમરસિંહનો ઉતાવળે ખુલ્લો પ્રતિકાર કર્યો નહોતો.

અમરસિંહ માની લીધું કે કુમળા રાજમહાલયમાં વસી આવ્યા પછી તે મારા સત્તાહિન જીવનસાથે જોડાવામાં અપૂર્ણતા જોતી હશે આં કદ્યનાચે અમરસિંહમાં સત્તાની આકંક્ષા જગૃત કરી. તેણે વિચાર્યું કે જે બાદશાહ અકખરને ઉડાવી દેવામાં આવે તે પોતે સત્તાધિશ થઈ શકે. આ ઉપરથી તેણે પોતાના મંદળના કેટલાકને અકખરનું કાસળ કાઢવાના લાલ સમજવી પોતાના પક્ષમાં લીધા અને પછી એ વાતને અમલમાં મૂકવાના હેતુથી મંદળમાં રજુ કરવા નિર્ણય કર્યો.

ચતુર્થીના દિવસે નિયમિત મંડળી મળી જેમાં સર્વે સભાજનો હાજર થઈ જવા પછી અમરસિંહે પોતાની વાત છેડાં કહ્યું—“ આપણે ધણ્ણા વખતથી ગરીબ રાજપુતોના હુઃખ ટાળવાને પરિશ્રમ કરી રહ્યા છીયે, પરંતુ હજી તેમાં સફ્રળ થયા નથી. અકખરની આપણ્ણા પ્રત્યે લાગણી છે તેથી આપણુને દાદ મળશે તેવી આશામાં આટલો વખત આપણે ખોઝ નાંખ્યો છે અને હજી પણ આમને આમ વિચારમાં એસી રહેશું તો જુંદળી ચાલી જશે. માટે જે તમને સિક્કિના રાજપુત કુટુંબોના હુઃખ માટે અંતઃકરણુથી લાગી આવતું હોય તો આપણે કાર્યનું સુકાન બદલવા જરૂર છે. ”

“ તે ખર્દ છે. પરંતુ આપણે ખીનો કર્યો માર્ગ લેવો તે કહેશો કે ? ” જર્ણસિંહે પૂછ્યું.

“ વાત કરવી છોડીને કાર્ય કરવું તેજ હિતકર માર્ગ છે. અકખર હિંદુ પ્રજાને ધર્મની વાતો કરી લક્ષ્યાવી શકેલ છે, એટલે આપણે આપણું બળ વધારી શકતા નથી. પરંતુ જે તેને ઠાર કરવામાં આવે તો આપણે તર્ણત હાથમાં લઈને રાજપુત પ્રજાનો ઉદ્ધાર કરી શકીયે ” અમરસિંહે માર્ગ દર્શાવ્યો.

કુમળાથી હું રહેવાઈ શક્યું નહિ. તેથી વર્ચ્યે આત્મી ઉઠી.
 “ વાર્દ ! પણ અમરસિંહજી, અકખરનો ઘાત કરવાથી રાજ-
 સત્તા તમારા હાથમાં આવી જશે તેની કંઈ આત્મી કરી છે ?
 શાહુનાના સંકીર્ણ પોતાનો વારસા હુક્ક તમને સહેલાઈથી આપી
 દેશે તેમ શું તમો માનો છો ? શાહુનશાહના સરદારો, લશકરી
 બળ અને રાજવહૃદીવટને તેમના નાશથી ચાપગીમાં પકડી
 દેવાશે તેમ તમે શા હિસાએ કહી શકો છો ? લક્ષે અકખર
 હિંદુ ધર્મ પ્રત્યે માન આપવાનો ડેણ કરતો હોય, પણ અત્યારે
 તેના તે ડેણથી રંઝન ઓછા થતી જય છે. આચાર્યશ્રી હૃદ-
 વિજ્ઞયસૂર્યના ઉપરેશથી જજીઆવેરો બંધ કરીને તેમણે
 વર્ષોના વર્ષોથી પડતી હાડમારી ફર કરી છે અને તેથી વિના
 કારણું અધિકારીએનો થતો ત્રાસ અટક્યો છે. તેણે સિક્કિમાં
 રંઝનાર સ્વારેને મેદની વર્ચ્યે સંજ કરીને જુદ્ધ ઉપર દાખ
 એસાંજ્યો છે. એ સર્વે વાત તમે ધ્યાનમાં લીધી છે ? માનો કે
 આપણું અકખરનો નાશ કરીએ, તો આ ત્રાસ વર્તાવી રહેલા
 અધિકારીએ પાછા એના એ થવાથી ઉલટું બકડું કાઢતાં ઊંટ
 નહિ પેસે તેની આત્મી શું ? ”

અમરસિંહ આ લાંખાણું સાખણુથી ગુંચવાયો. તેને લાંખું
 કે શાનશાહી તખ્ત લેવું તે છોકરાની રમત નથી. તેમ અકખરનો
 નાશ કરવાથી બીજી સત્તા ન પ્રગટે તેમ પણ કહી શકાય નહિ.
 પરંતુ અત્યારે તેનો હેતુ વાસ્તવિક રક્ષણ શોધવાનો નહોતો.
 એક વખત રાજપુત પ્રભના રક્ષણ માટે સુખ-સંપત્તિ અને
 પ્રાણનું પણ બળીદાન આપવાને તૈયાર થયેલ અમરસિંહ
 અત્યારે કુમળાને મેળવવાને ઘેલો થયો હતો. એટલે કુમળાના
 હૃથે પોતાની આશાનો કિલ્લો પડી જતો જેઠ તેને બહુ હુંખા
 થયું. કુમળાની દલીલ વિચારવા જતાં પોતે બાળજ હારી
 જાય છે તેમ લાંખું, તેથી તેણે આવેશથી જણાંયું કે
 “ કુમળાના વિચારમાં હેખાતી નિર્મણતા ક્ષાત્રતેજને પાલવી
 શકે નહિ, કુમળા થોડા વખત અકખરના રાજભવનમાં રહી

આવી છે તેથી કહાય ઉપકારની લાગણીથી પક્ષ કરતી હોય, પરંતુ જ્યાં જાતિ કર્યાણુની વાત આવે છે ત્યાં આવો પક્ષ નભાવી શકાય નહિ. અકૃથરનું સૈનિક બળ મોટું છે એ ખરું છે, પરંતુ તેની ગેરહુજરીમાં એ સૈન્ય જરૂર આપણા પક્ષમાં ઉભુ રહેશે. તેમજ જે રાજપુત રાજાઓ તેના તાખામાં પહ્યા છે, તે પોતાના જાતિ લાધુઓ માટે ઉછળી ઉઠશે. એમ મારું હૃદય સાક્ષી પુરે છે. માટે હવે આપણે નામર્દ થઈને એસી રહેવું તે મને હીડ લાગતું નથી. ”

અમરસિંહના દ્રેપપૂર્ણ વિચારોથી ભાનસિંહ અને ધીરખલનું દોઢી ઉછળી આવ્યું. તેણે કોધના આવેશમાં પોતાનો હુાથ પોતાની તરવારની મુઠ તરફ ફેરફાયો. પણ પૃથ્વી-સિંહે તેમની આ ઉતાવળી હીલચાલ તરફ કટાક્ષ કરી તેને શાંત રહેવા આજા કરી અને અમરસિંહ તરફ કરી કહું—“ રાજપુત પ્રભના કર્યાણુ માટે તમારા હૃદયમાં ઉંડી દાઝ છે તે જોઈને મને આનંદ થાય છે. જે કે અકૃથરનું અંતઃકરણ જાણવાને આપણે વધુ પ્રયત્ન કર્યો નથી, છતાં તમે કહો છો તે વાત સાચી માનીયે તોપણ આપણે તેમના સામે ચુદ્ધ જહેર કરીને જીતી શકીશું નહિ. તો પછી તેનો નાશ કેવી રીતે કરવો તે માટે વિચાર કરવાની જરૂર છે. ”

“ ધાર્ણિંજ સહેલાધથો ” અમરસિંહે પોતાનો પક્ષ સબળ થતો જોઈ હુદ્ધથી કહું—“ અકૃથર વખતો વખત એકલો લટકવા નીકળી પડે છે, તેવા વખતે તક જોઈને તેનો શિરચ્છેદ કરી નાંખવો તે કંઈ સુશકેલ સ્વાલ નથી. ”

“ ખુન ! સુતા સિંહને જગાડીનેજ શિકાર કરનાર રાજપુતના મેંચે ખુનની વાત મને ખહુ શરમાવનારી લાગે છે; જે બાદશાહ શાંતિથી સુતા વિના પ્રભના સુખ-હુઃખ જાતે જોવાને કરતો હરે છે, જે નવા નવા લોજન જમવામાં મશહૂર ન થતાં પ્રભના રક્ષણુ માટે પરિસહેલ સહન કરવામાં આનંદ માને છે. તેને તુચ્છ સ્વાર્થને ખાતર મારી નાંખવા છુપી રીતે જવું તેજ

નામર્દીછ છે. તમને રાજ્યપુતોના માટે જો લાગણી છે તો તેને મુસ્લીમ પ્રણ માટે લાગણી હોવીજ જોઈએ; છતાં તે પોતાની હિંદુ મુસ્લીમ પ્રણને એક સરખી ગણે છે. બનેને સરખું માન આપે છે. કોઈપણ ધર્મને સાંભળવાને ખંત રાખે છે એ તેની ઉદારતાને તમે કેમ ભૂલો છો ? જો શાનશાહુ પોતે જાતિલેદ રાખતો નથી તો તમે જાતિલેદનો દ્વેષ કેમ રાખી શકો ? જ્યાં ધૃતસાકુ છે; જ્યાં લાગણી છે; જ્યાં ધર્મ છે ત્યાં હિંદું હો કે મુસ્લીમ હો પણ એઉ લાઈઓંજ છે. એ મહામંત્રથીજ અક-અર સારી આલમનો પ્રેમ જીતી શક્યો છે. આખાહીલયો અમલ ચલાવી શક્યો છે. તેનું ખુન કરવા પહેલાં તમેજ કહો કે તમે રાજ્યપુતોને સુખી કરવા જતાં મુસ્લીમ પ્રણને સંતોષ આપી શકશો ? એક માતાતું સ્તનપાન કરનારા એ ભાઈએ માહોમાંહે કપાછ મરશો તો પરીણામે એઉનો નાશ થશે ને કોઈ ત્રીજુજ વ્યંતર પેઢા થશે. માટે રાજ્યપુત ધર્મને ન છાજે તેવી વાત આપણી મંડગીમાં ન થવી જોઈએ.” કુમળા ખુનની વાત સાંભળી ધગધગી ઉડી અને કોથથી તે વાતનો પ્રતિકાર કર્યો. કુમળાની લાઘામાં ઉછગી આવેલ જોર, અને વિચાર-ગાંભિરથી સૈં. સ્તન્ધ થઈ ગયા. અમરસિંહ કુમળાના આવત્સનથી બહુ નારાજ થયો. તેને પોતાની બાળ ધુળમાં મળી જતી જોઈ કોધ જારાઈ આવ્યો.

પૃથ્વીસિંહ જેયું કે નિરર્થક કલેશ વધી પડશે. અને કદાચ તુર્તવેળા કુમળાની જંદગી જોખમમાં આવી પડશે.. તેથી તે વચ્ચેજ જોલી ઉઠ્યો—“ કુમળા, અત્યારે આપણે રાજ્ય ચલાવવું નથી, પણ રાજ્યપુત પ્રજાનું હિત વિચારતું છે. એટલે લાંખી ટુંકી ચર્ચામાં ન ઉત્તરતાં અકથરનો શિરન્છેદ કરવાનો યશ કેને આપવો તે નકી કરવું જોઈએ.

“ સાખાશ, હોસ્ત પૃથ્વીસિંહ, રાજ્યપુતો પ્રત્યેની તમારી લાગણી પ્રસંશાપાત્ર છે. ” અમરસિંહ પોતાની વાત ડેકાણે આવતી જોઈ ઉત્સાહથી કહ્યું. “રાજ્યપુતોના હિત માટે આ સેવા

કરવા સૌકોઈને ઇચ્છા થાય માટે આપણે સૌ પોતપોતાની તલ
વાર હારખંધ ગોડવીયે અને એક જણુ આંખે પાટા બાંધી ને
તલવારને ઉચ્ચકે તેના માલેકને આ સૌભાગ્યનો લાલ આપવો.”

આ વાત સૌને પસંદ પડી. પણ તલવાર ઉચ્ચકી આપ-
વાનું કામ કરવાને કુમળાએ ચોખી ના પાડી, તેથી અંતે તે કામ
જીર્ણસિંહને સોંપવામાં આવ્યું. સૌ સોગન લઈને પોતાની
તલવાર એરડાની વચે હારદોર ટેકવીને ઉલા રહ્યા. જીર્ણસિં-
હની આંખે પાટા બાંધવામાં આવ્યા અને તે કેની સમશેર પર
હાથ મૂકે છે તે તરફજ સૌના ડેળા તાકી રહ્યા. કુમળા પણ
જીર્ણસિંહના હાથ તરફ તાકી રહી હતી. થીરખર અને માન-
સિંહના મનમાં એવો વિચાર ઉદ્ભબન્યો કે પોતાની સમશેરેથી
આ સઘળા રાજપૂતોને યમસદનમાં પહોંચાડી દઈએ; પરંતુ
પૃથ્વીસિંહની ઇચ્છા સિવાય તેમનાથી કંઈજ બની શકે તેમ
નહોતું.

જીર્ણસિંહે એકલીંગજાનું સ્મરણુ કરીને પોતાનો જ-
મણો હાથ લાંબો કર્યો, તે હાથ અમરસિંહની સમશેર પાસે
આવ્યો ત્યારે સૌને “એમજ થઈ રહ્યું કે, ‘નક્કી જીર્ણસિંહ
અમરસિંહનીજ સમશેર ઉપાડશો.’ પરંતુ તરતજ જીર્ણસિંહનો
હાથ સહજ આગળ લાંબાયો અને ‘જથએકલિંગજા!
કરીને
તેણે પૃથ્વીસિંહની સમશેરપર હાથ મૂક્યો.

તરતજ કુમળાએ કિકિઆરી પાડી. પૃથ્વીસિંહ તદ્દન
શાન્તતજ હતો. થીરખર અને માનસિંહ ચમક્યા.

“ સાખાશ ! પૃથ્વીસિંહાલ ! ” અમરસિંહ ઓછ્યોઃ
“ ઇશ્વરની તમારા પ્રત્યે ધણીજ કૃપા જણ્યા છે. ”

પૃથ્વીસિંહે પોતાની સમશેર ઉચ્ચકી તેને પ્રણામ કર્યા અને
નાનું સમશેર હાથમાં ધરી રાખીને તે ઓછ્યોઃ “ મિત્રો, અક-
ભરનો નાશ નજ કરવો એવી રહ્યારી પોતાની ઇચ્છા હતી,
પરંતુ આપણા મત પ્રમાણે અકારનો વિનાશ કર્યો સિવાય
આપણુને દૂતોહ મળવાની નથી, તેથીજ હું આ કાર્ય કર્યો

સિવાય રહીશ નહિ. તમે સૌચે આ કાર્યમાં મહુને સહાય આ-
પવાના સોગન પણ લીધા છે. વારુ પણ તમે સૌ મહુને તમારે
મિત્ર તો ગણોજ છો ને ? ”

“ એમાં શાંસય શો ? ” સૌ એકદમ બોલી ઉઠ્યા.

“ પૃથ્વીસિંહા, તમારા પ્રત્યેની અમારી પ્રેમભાવના
માત્ર શબ્દથીજ વણ્ણવી શકાય તેવી નથી. તમે અમને એવી તો
કિંમતી સહાય આપી છે કે તમારા માટે અમે પ્રાણપણું કર-
વામાં પણ પાછી પાની કદાપિ કરનાર નથી ! ” અમરસિંહ .
ઉમેર્યું.

પૃથ્વીસિંહે સ્વિત કર્યું અને તે સૈને ઉદ્દેશીને બોલ્યો:
“ મહારા પ્રત્યે તમારો આવી પ્રેમભાવના જોઈને મહુને બહુ
આનંદ થાય છે. હું હું મહારાં કામ એટલી ઝડપથી કરીશ કે
તેથી તમને સૈને સંતોષ જ થશે. “ એટલામાં પૃથ્વીસિંહની
દાઢ પોતાના ઉલય મિત્રો તરફ ગઈ એટલે તે સ્વિત કરતો
પુન: બોલવા લાગ્યો: “ મહારા ઉલય મિત્રોને તમે તમારા
કખબામાં રાખો. કારણું તેઓ ક્યારનાયે અસ્વસ્થ બની ગયેલા
જણ્ણાય છે. આ કાર્ય મહુને સોંપાયું છે તે તેમને પસંદ પડ્યું
હોય એમ લાગતું નથી ! તેમને આ લાલ ન મળ્યો તેથી તેઓ
બન્ને નિરાશ થઈ ગયા જણ્ણાય છે !

પૃથ્વીસિંહની આ વિનોદાત્મક ટકોરથી સૌ હુસી પડ્યા.
થીરખલ અને માનસિંહ પણ શાંત થઈ ગયા. એટલે પૃથ્વી-
સિંહ આગળ બોલવા લાગ્યો:

“ અકખરના મૃત્યુથી રાજપુત અને ઈતર પ્રભાતું કલ્યાણ
થશે, તેમ જ્યારે આપણે માની ચુક્યા છીયે અને તે કાર્ય મનેજ
સોંપાયું છે ત્યારે હું મારે તમને તે કાર્ય માટે વધારે આતુર
ન રાખવા જોઈએ. કેમકે હું પૃથ્વીસિંહ નહિ પણ અકખર છું
અને મારથી મારી પ્રભાતે સંતોષ નથી તેમ હું જાણું તો
તેમને શાંતિ આપવા માટે મારે પ્રાણનું પણ ખંડીદાન આ-

પવું જ નેઇએ.” એમ કહીને તેણે પોતાની ખુલ્લી સમશેર પોતાની તરફ વળી પરંતુ તેનો આ ખુલાસો થતામાં તો સલાજનો આશ્ર્યમુગ્ધ થઈ ગયા હતા. ખુદ બાદશાહ દિવસોથી પોતાના હુદ્દો સાંલળી રહ્યો છે અને તે હુર કરવાને પ્રયત્ન કરી રહેલ છે તે નેઇને સૌ. પોતાની લુલને માટે શરમીદા થઈ ગયા હતા અને જેવી તેણે સમશેર ઉચ્ચકી કે તેનો હાથ પડકી સૌ. પગે પડ્યા. અને પોતાની લુલ માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. અમરસિંહ પણ તેમાં લેળાયો, પરંતુ પોતાની ખાળ છેક અણીના વખતે ભાંધી વળી જવાથી તે નિરાશ થઈ ગયો.



પ્રકુરણ રૂ રૂ મું.

અકૃબરની અંતરેચળા.

અકૃબર રાજપુતોના એકાંત બ્રહ્મથી પોતાને આવાસે આવવા પછી પ્રજાકિય અસંતોષમાં રહેલી રીણુગારીએ કેમ હુર કરવી તે વિચારવા લાગ્યો. તેણે સ્વયં વિચાર્યુ કે જે જુસ્કીય સત્તા અસ્થીર હુતી તે હું સમાનતાથી દઢ કરી શક્યો છું, મારા જેંકડો શરૂઆને સ્નેહી બનાવી રહ્યો છું, ગીજનીના નાનાશા મુલનો અધિકાર પ્રાણિત કરી હિંદના મોટા લાગમાં મેં જે હુકુમત જમાવી છે તે શું મારી આવી સહુનરીળતાથી નભી શક્યો? તેમ તેને થઈ આવ્યું. અને આવી અવિચારી પ્રવૃત્તિને અંકુશમાં કેમ લાવવી તે વિચારવા લાગ્યો.

અકૃબર વિચારમાં એટલો ભખ થઈ ગયો હતો કે ત્યાં એટલો વખત પસાર થઈ ગયો તે તેને પણ ખખર રહી નહિ, છતાં હળુ તે કંઈપણ નિર્ણય કરી શક્યો નહોતો. એરલામાં શોખ અખુલક્જલ ત્યાં આવી પહોંચ્યો. અને “અદ્વાહુ અકૃબર” નો અવાજ કર્યો, ત્યારે એકાએક ચમકીને અકૃબરે તેમના સામે નોયું. અને ‘જહુનજલા હું’ કહીને તેમને ઐસવાને નેત્ર જાં કેત કર્યો.

અખુલકુજલે પોતાના શાન્ત સ્વભાવ, નિષ્કપટતા અને નિમકહ્લાલીથી ખાદ્યાહુનો એટલો તો પ્રેમ જીતી લીધો હતો. કે તેને ખાદ્યાહ પોતાનું અંગ સમજતો. ધાર્મિક ચર્ચા-ઓમાં કે રાજકિય સંકલનામાં તે વિશ્વાસુ સલાહકાર હોવાથી તેને ગમે તે સમયે તેના મહેલમાં જવાને પરવાનગીની જરૂર નહોણી. એટલે તેના આવવાથી અકુભરને આશ્ર્ય થાય, તેમ નહોણું. પરંતુ પોતાના વિચારની શુંચવાએલી શ્રુંખલા ઉકેલવામાં તેમની સલાહ લેવી ઢીક પડશે તેમ માની અખુલકુજલના આવવાથી તે ખુશી થયો.

અકુભર પોતાની જીણી-મોટી ગુઝી વાતો પણ કેટલીક વખત અખુલકુજલને કહી સંભળી વાતો અને તેની સલાહ પણ લેતો. પરંતુ અત્યાર સુધી તેણે આ રાજપુત ટોળીના પરી-ચયથી તેને વાકેદ કર્યો નહુંતો. અને અત્યારે પણ તે વાત તેને કેટલી હુદે જણાવવી તે માટે તેણે કણુવાર વિચાર કર્યો. અંતે પોતાને થતી રહેલી શુંચવણુ માટે સલાહ તો અવશ્ય લેવી તેમ નિશ્ચય કરી, વાતની વિનોદાત્મક શરૂઆત કરતાં પૂછ્યું “શોખ સરદારની સ્વારી આજકાલ કેમ હેખાતી નથી ? ”

“ છેહ્વા એ દિવસ હું આવ્યો ત્યારે જહાપનાહનો સુકામ મહાલયમાં નહોતો. રાત્રીના તો પેલા અણણ્યા ખુનના અનાવ પછી હું બહાર નોકળવા ને બદલે લખવામાંજ વધારે વખત રોકું છું એટલે આપ હન્જુરની કુરનસનો લાલ લઈ શક્યો નથી ” અખુલકુજલે વિવેકથી ખુલાસો કર્યો.

“ તમારે ત્યાં પથારીમાં અણણ્યો માણુસ કોણુ અને કેવી રીતે આવી પડ્યો. અને તેનું ખુન તમારા આવાસમાં આવીને કોણુ કરી શક્યું ? તે કંઈ સમજાઈ શકતું નથી. આજકાલ રાજના તેમજ રાજના અંગત જનોના છુપા શત્રુઓ ઉભરાઈ પડ્યા હોય તેમ મને લાગે છે અને તેથી હું તેવા-ઓની શોધમાં તથા આ છુપી હીલચાલ તપાસવાને મારો ધણ્ણો.

વખત દોકું છું. તમે છેદ્ધા એ દિવસ મને મહેલમાં મળી શક્યા નહિ એતું પણ તેજ કારણ છે. આપણે આવા ખુની અને તોકાનીયોને પકડી પાડવાજ જોઈએ. ” અકૃતિ આટલું આલતાં લાલચોળ થઈ ગયો. તેનું શોર્ય ચમકવા લાગ્યું અને પોતાનો હાથ ખલે પોરવેલી સમશોરની મુઠ તરફ વષ્યો.

અખુલક્જલ એકાએક બાદશાહને તપી ગયેલો જોઈને આશ્ર્યમુંઘ થયો. પોતાને લોંધરામાં પકડી જવા પછી ત્યાં તેણે ને દર્શય અનુભવ્યો હતો. તેથી તેણે માન્યું હતું કે તેને ધરે થયેલ ખુન અને આ તોકાનમાં કાળનો મુખ્ય હાથ હોવો જોઈએ, પરંતુ તે તો અત્યાર અગાઉ ખુદાના દરખારમાં જવાખ દેવાને પહોંચી ગયેલ છે. એટલે હું તે વાતને સ્પષ્ટ કરવી તે નક્કામી છે. તોપણું બાદશાહના પ્રકોપને શાંત કરવા વિના તેની હુંમેશની ચિંતાથી અગત્યના કાર્યને અડયણું પડશે તેવા ભયથી શાંત્વન આપતાં જણ્ણાયું —

“ ને વાતમાં કંઈ મહતા નથી તેમાં આપ હળુરને આટલી ચીંતા કરવી તે મને ઢીક લાગતું નથી. ખગીચાની બારીએ ખુલી રહી જવાથી મારી ગેરહુઅરીનો લાલ લઈ કદાચ કોઈ અનાણયો. તોકાની પોતાના શત્રુના હાથથી ત્યાં ધવાયો હુશે. પરંતુ તેમાં આપણે બહુ વિચારવા જેવું નથી. વણી જહાંપનાહે પહેરાનો વિશેષ બંદોખસ્ત કરેલ છે તો હું તે માટે લયનું કારણ રહેતું નથી. તેમ સાઓટની વિશાળ સત્તા સામે માથું ઉચ્ચકવાને પણ કોઈ હીમત કરે તેમ નથી, તો પછી છુપા શત્રુનો સંકદ્ય પણ આપના માંચેથી સાંલળીને મને આશ્ર્ય થાય છે.”

“ નહિ, અખુલક્જલ, હું જોટો સંકદ્ય કરતો નથી. તેમ તેવા કારણથી ભય દર્શાવતો નથી. પરંતુ આવા જેરેને કેમ સુધારવાં તે માટે હું તમારી સલાહ લેવા છુંછું છું. મેં અનુભવ્યું છે કે મારી ધાર્મિક જ્ઞાનાનો ધષ્ણા લોકો અવણો અર્થ કરી કાવા દાવા કરે

છે. હિંદુ પ્રજામાં કેટલાક મને પ્રપંચી માનતા હોય તેમ લાગે છે અને મુસલમાનો ધર્મ દેખી માનવાની ભુલ કરી રહ્યા છે. કહો, શું મારે આવી સ્થીતિમાં થતા કાવા દાવા માટે બેદરકાર રહેવું ? ” અકખરે શાંકા રૂપે પ્રસ્તાવ કરતાં પ્રક્ષે કર્યો.

“ આપ હુનુર ધારો છો તેવી સ્થીતિ મને સંભવતી નથી. હા, કદાચ કોઈ અહેપજ આપની અગાધ સત્તાનો ખ્યાલ ન મળી શકવાથી અથવા આપની અગમ્ય ઉત્તમ ભાવના ન સમજી શકવાથી નારાજ હોય, પરંતુ વખત જતાં તે પોતાની ભુલ આપના ઉદાર અમલના અનુભવથી જરૂર સુધારશે. આપના હન્જરો હાથી, છાલાખ લશકર અને તેનો લશકરી અસખાખ આવા ક્ષુદ્ર વિચારવાળાને આંણ નાખે તેમ છે. ચિત્તોડ, કુંભલમેર, અજમેર, સમાણુ, જેધપુર, જેસલમેર, જ્યૂનાગઢ, સુરત, ભરૂચ, માંડવગઢ, રણથંલોર, સ્યાલકેટ, રોહીતાસ વગેરે અલોધ કિલ્લાના આપ સરદાર છો, ગૌડદેશ અને ઉત્તરે કાયુલથી દક્ષીણે સેંકડો કોશ સુધી આપની સત્તા પથરાયેલી છે. રોમી, શ્રીરંગી, હિંદુ, મુસ્લીમ, પઠાણુ એ સર્વ જાતિ આપની આજા નીચે છે, સમર્થ જહાંગીરદારો આપના નામ માત્રથી ધ્રુવે છે, સેંકડોનું જવેરાત આપના લંડારમાં હાજર છે, એ અખૂટ સમૃદ્ધિ અને સત્તાના સામે આવા નિર્માણ કાવાદાવાની વાત તો મને સૂર્ય પાસે પંતગીયા જેવી લાગે છે. ” અખુલક્જલે ખાદશાહને તેની શક્તિનું સમરણુ કરાવતાં કહ્યું.

“ તમારી ગણુત્ત્રી છેક ખોટી છે તેમ હું કહેતો નથી. પરંતુ તેવા મહમાં ણેદરકાર થવું તે મને પસંદ નથી. મૈં આવા છણ-પ્રપંચ કરનારાઓ મારી હુકુમતમાં છે તેમ જાતે અનુભંગું છે અને તેથી હું તેવાઓનો નાશ કરવા માગું છું. ” અકખરે દફ્તાથી પોતાનો સંકદ્વપ જહેર કર્યો.

“ જહાંપનાહુ, આવી ખાણતમાં આપ જે નિર્ણય કરવા ધારો છો તે કીડીના સામે કુંજરની ચઢાઈજેવું છે. આપ

કુનિયાના મોટા ભાગ ઉપર બાહુભળથી સત્તા વધારી શક્યા છે। તે ખરું છે, પરંતુ તે વીર યુદ્ધ હતું. શત્રુ પણ સમોવડીયો હોય તેમાં મોટાઈ છે. ચાંચડને તો છેકરાં પણ ચોણી નાંખી શકે તેથી તેમાં કંઈ માન કે શોભા નથી. તે દિવસે શ્રી હીરસ્કૃતિ મહારાજ પાસે આપે હિંસાનો તિરસ્કાર કરતાં શું કહ્યું હતું તે યાદ કરવાથી આપનો નિર્ણય જરૂર ફેરવાશે. આપે ચિતોડ જીતતાં ચલાવેલ સમશોર અને ગ્રાસનું વર્ણન કરતાં ફુઃખી થતા હતા તે સ્મરણુમાં લ્યો. એ પવિત્ર ફરીના સહૃવાસથી આપે શીકાર કરવાનું અને છમાસ માંસ સાક્ષણું કરવાનું પણ છોડી દીધું છે. આપના જાહુણીરદારોમાં અને સંઘાળી હુકુમતમાં જીવહુંસા અટકાવવાને હુકમો કાઢ્યા છે અને રાજ્યાભિષેકના દિવસની પવિત્રતા જણવવા તે દિવસે ડેઈપણ માણુસ માંસાં હાર ન કરે તેમ ફરમાવી દ્યાનો ડંકો વગાડ્યો છે. તે પછી જ્યારે આપજ રંક પ્રભાજનનો આવી શાંકાથી નાશ કરવાનો નિશ્ચય કરશો. ત્યારે દોકો શું કહેશો? એ બધી વાતનો વિચાર કરીને આપ નિર્ણય કરશો તો વધારે ટીક થશો.” અખુલફળે બાદશાહુને શાંત કરવાનો પ્રયોગ અજમાયે.

અખુલફળનો આ પ્રયોગ આણાદ નીવડ્યો. હીરસ્કૃતિનું નામ સાંભળી તેમના પાસે પોતે ઉચ્ચારેલાં વચનનું સ્મરણું તાન્દુથી આઠ્યું. પરંતુ બીજું તરફ પોતે અનુસવેલ અસંતોષને છેક વિસારી સુકવા જેટલું ધૈર્ય રહી શક્યું નહિ, વિચારમાં શોડો સમય વિતાવવા પછી પુઃન અકૃત્યર બોલી ઉદ્યો— “વારુ—અખુલફળ, કોધથી આડેમાબે” વહી જતા મારા વિચારને તમે રોક્યો છે તે ટીક કર્યું છે. ગુરુશ્રી હીરજીસ્કૃતી મોટા ફરી છે. તેની વાતમાં મને બહુ રહ્યું લાગે છે, માટે જરૂર આ વાતમાં વિચાર કરવા જેવું છે. આપણે તેમની સલાહ લઈએ તો કેવું સારું?

“મને પણ લાગે છે કે તેમની સલાહથી ટીક પડે ખરું. કેમકે તેચો સાચા ફરી અને નિઃસ્વાર્થ ગુરુ છે. પરંતુ અત્યારે

તેઓ આસપાસના મુલ્કમાં ઉપદેશ કરવાને તથા આ તરફના પવિત્ર તિર્થોમાં દર્શાન કરવાને ગયેલા છે. એટલે તેમની સાંભળો હાલ લાલ મળી શકે તેમનથી” અખુલકુજલે ખુલાસો કર્યો.

“ તેમને બહાર જવાને તો ધણુા દિવસો વીતી ગયા છે, છતાં હજુ તેઓ અહીં હાલ આવવાના નથી ? તેમના સમાગમથી મારા વિચારમાં જે શાંતિ અને દ્યાનું પરીવર્તન થયું હતું, તેમાં આટલા દિવસના વિચોગથી આજ જરા વિચાર ફેર થયો છે, તો તેમનાથી હવે વધારે દિવસો હુર રહેવું એ મને ઢીક લાગતું નથી. માટે હવે તેમને વેળાસર અહીં પધારવાને જણુાવો અને અહીં પધારતાંજ મને ખખર આપને.”

આટલેથી વાત બંધ થતાં અખુલકુજલ સમજ્યો કે બાંધશાહુનું મન શાંત થઈ ગયું છે, તેથી બીજુ કેટલીક વાતો કરી તેણે રજ લીધી.

અકુમરને પુનઃ એકાંત પ્રાસ થતાં પાછું તેનું ચિત્ત તેજ વિચારમાં પરોવાયું. તેણે વિચાર્યું કે-મેં ભારતના મોટા ભાગમાં મારી સત્તા ચુદ્ધકળા અને બાહુભળથી વિસ્તારી છે તે ખર્દું છે, પરંતુ તેને ટકાવવામાં મારી માયાળું અને ન્યાયી રાજનીતિ વધારે અસરકારક નીવડી છે. લલે હું સુસલમાન હોઉં, પરંતુ જે પ્રણ ઉપર મારી હકુમત છે તે સમગ્ર પ્રણ મારે મન પુત્રવત હોવી જોઈએ; તેમાં હિંદુ અને સુસલમાનના લેદ રાખવાથી અલ્યાર સુધીમાં મારા વડીલો અખુટ બળ-સંપત્તિ છતાં ભારતમાં સ્થિરવાસ કરી શક્યા નથી તેને બદલે મને હિંદુ પ્રણમાંથી ધણુા શુરાઓએ પણ પોતાની કંન્યા આપી સંબંધ વધાર્યો છે અને માર્દાં તખ્ખ સ્થિર થવા પામ્યું છે. અરી રીતે હિંદુ અને સુસલમાન એ એ મારી પાંખો છે, એટલે તેમાંથી એક પણ પાંખને કાપી નાખું, તો હું શાંતિથી ઉડી શકુંજ નહિં, હિંદુઓ પણ શુરવીર અને ટેકીલા છે. પ્રતાપ જેવા ટેકી રજા અને તેવા અનેક અડગ લડવૈયા

હિંદુ જ છે. આવી બળખાન અને ટેકી પ્રણનો નાશ કરવાનું ખુદા પસંદ કરેજ નહિ. ખુદાનું ઇરમાન તો પાડોશી ઉપર પ્રેમ રાખવાનું છે, ત્યારે પછી જો હું ભારતને મારે દેશ ગણું તો હિંદુ પ્રણ મારા પાડોશી નહિ પણ કુદુંબી છે એટલે મારે તેમના પ્રત્યે માયાજ રાખવી જોઈએ.

જળ્યાવેરાની રૂઢીથી અધિકારીઓને સ્વતંત્ર રીતે ન્રાસ આપતા હતાં તે મેં નજરે જોયું છે અને આવા બનાવથી અમરસિંહને હુઃખ થાય તે બનવા જોગ છે. પરંતુ અલાના સાચા ઇકીર હીરજીસુરિના કહેવાથી જળ્યાવેરા તો મેં કાઢી નાંખ્યો છે, છતાં તેને મારા પ્રત્યે અવિશ્વાસ અને અસંતોષ કેમ રહ્યો હશે ? શું લોહીના તરસ્યા અધિકારીઓ હજી પણ આવો જુદ્દમ કરતા હશે ? ઐર, તે વાત હું હવે જોઈ લધ્યશ. અધિકારીઓના ઝોટા જુદ્દમથી પ્રણ હુલાય તે મારી શાનશાહુતનેજ કલંકડ્રૂપ છે. માટે મારે તો અમરસિંહજી અને રજ્યપુત ટોળીના દરેક સભ્યેને જુદા જુદા ‘ખાતામાં ગોઠવી દેવા જોઈએ અને કમગાદેવીને જીવન નિર્વાહ માટે અલાહેરી વ્યવસ્થા કરી આપી સ્વતંત્ર કરવી જોઈએ. અને તે ખુશી હોય તો તેને રાજમહાત્મયની અધિકારી બનાવવી જોઈએ. તેણે મારા બચાવને માટે ધા સહેલ છે. માંદગીમાં પણ તે મને મમતા ભરી દશ્ચિથી જેતી અને માયા દર્શાવતી હતી. શુંત સ્થાનની સભામાં પણ તેણે મારા માટે સારા શુકન ઉચ્ચાર્યાં હતાં અને અમરસિંહની દરડાર કર્યા વિના સામે થઈ હતી. તેની આ મમતામાં પ્રેમ છુપાયો હોય તો તે મારે શોધી લઈ શરીરે ચઢાવવો જોઈએ. બસ, એજ મારે ન્યાય છે. શયુનું પણ લખું કરવું તેમાં સહ્યનતા છે. તો પછી આ ટોળીને તો મેં ભીત્ર કરેલ છે એટલે તેનું લખું કરવું તે મારી કરજ છે. ”

અકૃષ્ણનું આ નિશ્ચયથી સમાધાન થતાં તે ઉક્ષ્યો અને તુર્ત તેનો અમલ પણ કર્યો. જે રજ્યપુત ટોળી અકૃષ્ણના પ્રકટ પરિચયથી ગલરાઈ ગઈ હતી, અને સવારે શું મોં બતા-

વધું તે ચિંતામાં હતી, તેને પોતાને ઉલટો સત્કાર થતો જેઈ અકખરના માટે મોટું માન ઉત્પન્ન થયું અને સૌ અકખરના વક્રાદાર સેવક અની ગયા. અમરસિંહને આ ઉદારતાથી સંતોષ થયો. કે કેમ તે અમે કહી શકતાનથી. કેમકે તેનું હૃદય કમળાના ઘારની ઉમેદવારી કરી રહ્યું હતું, ત્યારે નવી ઉદારતામાં કમળાને જુહીજ વ્યવસ્થા કરી સ્વતંત્ર કરવામાં આવી હતી અને તેના નિવાસ માટે પણ ખાસ જુહીજ મકાન આપવામાં આગયું હતું. એટલે અમરસિંહને કમળાની નજીક રહેવા કે ઉપકાર નીચે દ્વારાવાને તક જતી રહેવાથી તેના પ્રેમણીજને પાણી કેવી રીતે પાવું તેની ચિંતા તેને વધી પડી હોય તેમ જોવાતું હતું.



પ્રકૃતાણુ ૨૩ મું.

—
પ્રેમ-અંથી.

કમળાને રહેવાને માટે જે મકાન આપવામાં આગયું હતું તે આપણી પ્રથમ પરિચિત ચંપાદેવીના નિવાસ સ્થાનની નજીકજ હતું. કેમકે ચંપા વૃતની કસોટીમાંથી પસાર થવાથી આદશાહને તેના માટે બહુ માન હતું. એટલુંજ નહિ પણ ચંપાના લંન તેણે પસંદ કરેલ ચુવક વિજ્ય સાથે તેમના પિતા થાનસિંહને કહીને કરાવી આપ્યાં હતાં; અને તેને પુત્રી તરીકે સારો દાયજે કરી અકખર તેની વખતો વખત સંભાળ કેતો હતો.

ચંપાના સદગુણુથી જેમ અકખર સંતુષ્ટ થયો હતો. તેમ રાણી પદ્મા પણ તેની મુલાકાતથી ચંપા પ્રત્યે પ્રેમ રાખતાં શીખી હતી અને વખતો વખત તેમને મલ્લા કરતી હતી.

પદ્માના હૃદયમાંથી અકખર પ્રત્યેનો તિરસ્કાર દુર અસી- ગયો. અને તેનું હૃદય અકખરને રહાવા લાગ્યું તે વખતે અકખર તેના પ્રત્યેનો પ્રેમ સંકેલી નાંખ્યો હતો, તે આપણે જાણી

ચુક્યા છીયે. પ્રેમના પ્રવાહેણે પરસ્પર એક સરખા વેગથી અથડાય તો લરતી ચઢી જાય તેવા જાયથી, કે પછી ગમે તેમ પણ જગતમાં ઘણું ભાગે એવીજ ઘટના બને છે કે એક ભીજાને ચાહે છે ત્યારે ભીજું પહેલાને ધિક્કારે છે અને ભીજું પહેલા તરફ દળે છે ત્યારે પહેલું ભીજાથી કંટાળે છે. પદ્માને માટે તો આ વાત આખાઈ ખરી પડી. ન્યારે અકુભર પદ્માના પ્રેમનો ભીખારી હતો, તેના પાછળ ઘેલો હતો ત્યારે પદ્મા અકુભર પ્રત્યે તિરસ્કારથી જેઠ વેગળી રહેવાને મથન કરતી. અત્યારે પદ્મા અકુભરને મળવા આતુર બની છે, ત્યારે અકુભર તેને મચક દેતો નથી.

ગમે તેમ પણ સ્વી હૃદય કોમળ અને પ્રેમાતુર હોય છે. તેથી જેમ અકુભર પદ્માનો તિરસ્કાર ગળી ગયો. તેમ પદ્મા તેની આર્દ્ધચીને સહન કરી શકી નહિ. હવે તેને અકુભરને પોતાનો કેમ કરવો તેજ વિચાર થવા લાગ્યો. તેનું કાર્ય તેજ થઈ પડ્યું.

ચંપા પ્રત્યે અકુભરને સારું માન છે અને તે ત્યાં કોઈ વખત આવે પણ છે, એ વાત પદ્માની જાણુતી હતી; તેથી કદાચ પોતાનું દર્દ ચંપા પાસે કહેવાથી તે વૈધનું કામ કરશે તેમ ખારી એક વખત પદ્મા-ચંપાને આવાસે ગઈ. આ વખતે કમળા પણ ત્યાં એકી હતી. ચંપા-કમળા અને એગમ પદ્મા વખતો વખતના મીલનથી પરસ્પર ગોડણો થઈ ગઈ હતી. એટલે કોઈને જુદાઈ નહોંતી. ત્રણે સખીયો વિનોદાત્મક વાતે ચઢતાં ચંપાએ કહ્યું—“ હેને પદ્મા, ગમે તેમ તો તમો ભારતના માલેકનાં રાણી છો. લખે તેમના જનાનામાં સેંકડો રાણી છે ‘પરંતુ તમે પટરાણી હોવાથી તમારા ઉપર પ્રભના હિતનો મોટો આધાર રહે છે તેમાં તો તમે ના કહી શકો નહિ. કેમકે સ્વી એ પુરૂષનું અંગ છે. મહાલયનો મંત્રી, જનાનાનું આલુપણ અને જીવિષ્યની પ્રભનો શિક્ષક સ્વીજ છે. આ સધળી જવાખદારીને ધ્યાનમાં લઈ તમે શાનશાહુ દ્વારા ઘણું કામ કરી શકો તેમ છો.

જતાં તમે હાથમાં આવેલી તક યુમાવીને સહા ઉદાસ કેમ રહો છો ? તે સમજાતું નથી. ”

“ બહેન ચંપા, તારું કહેવું ખરું છું એક શાનશાહુના પટરાણી તરીકે હું જનકલયાણુ કરી શકું તૈમાં ના નથી. પણ જનાનામાં વસવા અને સુંદર શાષુગારથી શોભવા સિવાય પટરાણી તરીકે મારી શું સ્થિતિ છે તે મારું અંતરજ સમજે છે. બહેન, તમે મારા પોતાનાં છો, મને ચાહો છો, તમારામાં ડહાપણ છે એટલે મારે કેઢો ઠલવી નાખવાને હૃદય ઉલ્લાય જય છે. ખરું કહું છું કે બહેન હું પટરાણી નહિ પણ પસ્તાણી છું.—”

આટલું બોલતાં પડ્યા રડી પડી. તેનાથી વધુ ન બોલાઈ શકાયું. હૃદયનો ઉલરેણી ખાલી કરવા જતાં વાર્ષ શક્કિત ગળામાં દૃધાઈ ગઈ અને પાણી દૂપે થઇને ચક્ષુવાટે બહાર વહેવા લાગી.

ચંપા અને કમળા આ દૃષ્ય જોઈને હેઠાતાઈ ગયાં. જનાનામાં વસનારી શહેનશાહુની માનીતી બેગમ સુધી પણ હુંઘ પહોંચી શકે છે તે જોઈને ચંપાના આશ્ર્યનો પાર રહ્યો નહિ. પોતાની તપક્ષીર્યાની એકાંત કસોટીના સમયે બેગમે બાદશાહુની ધર્મલુઝાસુ વૃત્તિ તરફ શક લાર્યા શાહે. ઉચ્ચાર્યા હતા તેનું સમરણ થઈ આવ્યું. આ ઉપરથી તેણે માની લીધું કે પદ્માનું શંકાશીલ હૃદય બાદશાહુના પ્રેમમાં ઉણુપ સમજે છે અને તેથી તેનું હૃદય દુખાતું હશે. આ ઉપરથી બેગમ પડ્યાને આશ્વાસન આપતાં ચંપાએ કહ્યું—“ બહેન, તમારી આ નબળાઈ તમારા ઐશ્વર્યયુક્ત સ્થાનને લજવાવેછે. મને લાગે છે કે બાદશાહુની ધર્મ લુઝાસુ વૃત્તિથી તમો તેમના તરફ શંકાની નજરે જુઓછો, અને તે શંકાજ તમારા પ્રેમના સંધિ વચે મજબુત દીવાલ દૂપે નડતાં હશે. તમે ક્ષત્રી પુત્રી છો, આર્ય ભહિલાનું દોહી તમારી નસોમાં છે. એટલે તમારે આર્ય ભહિલાના આદર્શ ધર્મને બુદ્ધી જવો જોઈએ નહિં. શાંત થાઓ. બહેન શાંત થાઓ. ખાલી મનને દુલાવવાથી તમે તમારા ડિતનેજ નુકશાન કરો છો. ”

“તમારી માન્યતા ખરી છે, પણ અત્યારે હું તે પડ્જા નથી. તમે મને તે વખતે જે વાત કરી હતી ત્યારથીજ મેં મારી શાંકાઓને કાઢી નાંખી છે. હવે હું તેમને પ્રેમથી ચાહુંછું, પરંતુ તેઓજ મારાથી દુર નાસે છે. બહેન ચંપા, આ હૃદયના ઉંડા હું: ખની કહાણી મહારે કેને કહેવી ? તમેજ કહો કે અનેક વૈભવ, અખુટ સંપત્તિ અને દાસ દાસીઓના ટોળાં છતાં, એમની ધીતરાળ હોય તો પછી મને એ સર્વ શું કામનાં ? ” પડ્જાએ અશ્વ લુતાં પોતાના હું: ખને વધારે સ્પષ્ટ કર્યું.

“ અહીંજ પ્રેમની પરીક્ષા છે, શુદ્ધ પ્રેમના પાઠ શિખવા વિના પ્રેમની પરીક્ષામાં ઐસવાથી નાઉમેદજ થવાય. સમુદ્રને પ્રેમ આપી તેમાં સમાઈ જતી નહીંઓ જ્યારે પુર બહારમાં (એ કાઢામાં) છલકાઈને તેના પતિ (સસુર) ને મળવા જાય છે ત્યારે સમુદ્ર કંઈ પોતાની મર્યાદા છાંડી ઉલ્લરાઈ જતો નથી, તેનું કારણું તમે વિચાર્યું છે ? જે આ વાત તમે જાણુશો તો જરૂર તમારી નિરાશા દુર થશે. કારણુંકે પુરથ એ સમુદ્ર છે જ્યારે સ્વી એ નહીં છે. ” ચંપાએ બેગમને વાતે ચઢાવી શાંત કરવાના ઉદ્દેશથી કહ્યું.

“ ચંપાખેન, તમે પુરથને જ્ઞાનની અને સ્વીને નહીની ઉપમા આપેવાની વાત કરી તે ઠીક છે. પરંતુ તે દ્ધાંતથી તો મને ઐવડું હું: ખ થાય છે. છલકાઈ જતી નહીને સમુદ્ર પોતાના હૃદયમાં સ્થાન આપી, એક રૂપે કરી નાખે છે. નહી અને સમુદ્ર બે લિઙ્ગ મરી એક રૂપે થઈ જાય છે, અને મહમાતી નહી સમુદ્રના પ્રેમદાનથી શાંત બને છે. આવી પ્રેમની ઉચ્ચ્યકોટીની કદર મારા જીવનમાં હોય તો પછી મારે રડવાનું શા માટે રહે ? બહેન ચંપા, મને એમની (બાદશાહીની) ધર્મલુણાસા માટે લેશ પણ શાંકા નથી. હું તેમને અંતઃકરણુથી ચાહું છું, મળવાને આતુર છું, હમેશાં તેમની પાછળ ઘેલીની માઝુક કરું છું; પરંતુ તેમના દર્શનજ થતાં નથી. તો પછી મારે મારા મહેલે તેમના પદ્ધારવાની કે પ્રેમ

ભર્યાં એ વચ્ચનો સાંભળવાની તે। આશાજ કયાં રહી ? જે સમુદ્ર, નહીને હૃદયમાં ચાંપી પ્રેમતું આલિંગન આપે છે તેનું દ્ધ્યાંત આપી બહેન ચંપા, તું શું બળતામાં ધી હોવમા માગે છે ? ” પદ્માચો હૃદયનો ઉલરો કાઢતાં પોતાની લાગણીનું ભાન કરાયું.

“ બહેન, સ્વાર્થમાં મોટાચો પણ લીટ લુકે છે તે વાત હુવે મને અરાખર લાગે છે. સમુદ્ર નહીને હૃદય સરસી ચાંપે છે તે સમજવામાં તમારી ભુલ થાય છે. નહીના પ્રેમમાં મમ થયેલો સમુદ્ર જ્યારે ઉનહુણામાં તં દેખાતી નથી ત્યારે વિડુવળ થઈ પોતેજ બળી જવા લાગે છે, ને સૂર્યમાં તપ તપતાં તેના કિરણો દ્વારા પોતાની પ્રિયાની શોધમાં ઉચ્ચે ચઢે છે. આ રીતે આકાશો ચઢેલો સમુદ્ર શ્યામ મુખે ચોતરદ્વારા દોડદોડ કરી મુકે છે અને પોતાની સાથેની વિધુત રોશની પ્રકટાવી નહીના માર્ગને જોતાં ત્યાં આંઝો મીંચીને ઉતરી પડે છે. નહીં, સમુદ્રનો અગાધ પ્રેમ જોઈને એકદમ ગતિમાન થાય છે અને પ્રેમના પ્રાસાદીથી મુગધ બનીને ઘેલી થઈ ગયેલી દેખાય છે. પરંતુ પતિઅહે જતાં સુકાદી હુર્ણણ થઈ ગયેલ સમુદ્ર, તેની આ ઘેલાંછામાં કરી ન લોભાતાં તેના સામે થાય છે; ધુધવાઈ છે, પછાડા મારી પાણી ધકેલે છે. અને જ્યારે તેના શુદ્ધ પ્રેમની ખાત્રી થાય છે ત્યારેજ તેને હૃદયમાં સ્થાન આપી પોતે શાંત બને છે. એગમ સાહેબા, તમે અહુંયાજ ભુલ્યાં છો.* જે સમયે બાદશાહું તમારા ડિપ-ગુણું ઉપર મુગધ હુતા, તમારા માટે દ્વિવસ કે રાત્રીની દરકાર ન કરતાં, તમારો સ્નેહ મેળવવા આતુર હતા, તમારા શાંદને ઉચ્કી લેવામાં આનંદ માનતા હતા, ત્યારે તમારા હૃદયમાં પેઠેલા શાંકાના શર્યથી તમે દુર નાસતાં રહી તેમના પ્રેમને શુષ્ક બનાવી મુક્યો હતો. તે વાતનું સમરણું કરો. અને તમેજ કહો કે, જ્યાં સુધીં તેમની હૃદય વાટીકામાંથી.

* વૈશાખ માસમાં સમુદ્ર પોતાની સપાઠીથી નીચે જાય છે. અને વર્ષાની શરતાતમાં તોકાને ચઢવા પણી આવણું માસની અંતે શાંત અને છે.

સુકાઈ ગયેલ પ્રેમવૃક્ષને પુન નવપદ્વિવિત કરવાને માટે તમે રાત્રી દિવસ શ્રમ કરીને તમારા શંકાતાપનું પ્રાયશ્ચિત પુરું ન કરો ત્યાં સુધી તમો તેવોજ પવિત્ર પ્રેમ-કયાંથી મેળવી શકો ? અત્યારે તમારે નિરાશ થઈ અશ્રુ સારવાનો સમય નથી, પરંતુ પતિના હૃદયમાં સુકાઈ ગયેલ પ્રેમ બગીચાને તમારા અખુટ પ્રેમ પ્રવાહુથી પાણી પાઈ પાછો કેળવવાનો છે. આ કાર્ય તમે સતત અંત-શ્રદ્ધા અને લાગણીથી કરતા રહો તો પછી જેશો કે તમે કેટલાં સુખી અને સર્વોત્કૃષ્ટ સ્થાને છો. ” ચંપાએ સમજલવટથી માર્ગ દર્શાવ્યો.

પદ્મા આ વાત સાંભળી પોતાની અશ્રદ્ધા અને અધિરાઈ માટે પસ્તાવા લાગી. પોતે જેઠ શકી કે બાદશાહનો અપૂર્વ પ્રેમ ગુમાવવામાં પોતાનીજ બુલ હતી અને તે માટે તેણે સહન કરવુંજ જેઠાંએ. અત્યારથી તેણે બાદશાહના સુખમાંજ પોતાનું સુખ, તેમના આરામમાંજ પોતાનો આરામ માનવાને ધાર્યું; તેમના પ્રેમને પુન: પ્રાપ્ત કરવાનો મહુન તપ શરૂ કરવા નિશ્ચય કર્યો અને, ચંપાની આ શીખામણુમાટે ઉપકાર માની રાજમહાલય તરફ વિદ્યાય થઈ ગઈ.

કુમળા આ વાતચિત પ્રસંગે ત્યાં એઠી હતી. પરંતુ તે વચ્ચે કંઈ બોલી શકીજ નહિ, પોતે અકખરનો માંદળીમાં પરીચય કર્યો હતો. ત્યારે તે તેને પ્રેમમૂર્તિ તરીકે જેઠ શકી હતી, પૃથ્વીસિંહના ઝેપે એકાંત કુટીરમાં સત્યપ્રેમી અને કાર્યદક્ષ તરીકે પીછાએયો હતો, પરંતુ તેમાંએ પ્રબળપ્રેમની ગંધ હતી. ત્યારે શું તેજ અકખર પોતાની ધર્મપત્નિ પ્રત્યે આટલો નિષ્કુર હશે ? એ વિચારે તેને દિગ્નભુદ કરી મુક્કી હતી. તે પદ્મા અને ચંપા વચ્ચેનો વાર્તાવાપ જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ તેને નવા નવા વિચાર થવા લાગ્યા. વાતની શરૂઆતમાં અકખર નિષ્કુર હોવાનો જે તેને ભાર્યાથ્યે હતો તે અંતમાં એછો થયો. પરંતુ તેને એમતો જથ્યાયું કે અનેક સ્થાનોમાં પ્રેમ વહેંચી રહેલો અકખર એક સ્થાને પ્રેમનું પુરું પ્રદર્શન

ભરી શકે એ મિથ્યા છે. ક્રી પ્રેમવસ્તુનો તાણો છે અને પુરુષ વાણો છે. એટલે તાણુના દોરમાં એક સરળી વાણુની વણુટ ગુંથાય-ઠસોડસ થાય તોજ સુંદર વખ્ય બની શકે-એક-તાર થઈ શકે. આવી સુંદર વણુટ થવામાં તાણુવાણુના પ્રેમ-તંતુ (સુતર) કાચાં નહિ જોઈએ અને વણુકરનું દીલ તેમાં રસબસ થઈ ગયેલું જોઈએ. અકખરનું ચિત સેંકડો સાળો ઉપર વણુટ કરવા લાગી રહ્યું હોય ત્યાં તેનાથી એક સુંદર પ્રેમાંખર વગુઠ જવાની આશા શા કામની ?

અકખર મને ચાહે છે, મારા પ્રત્યે પ્રેમ ફર્શાવે છે એ પણ ત્યારે શું આવો વહેંચાએલોજ પ્રેમ હશે કે ? હા, તેમજ. જે પોતાની એક વખતની પટરાણીને પાછી યાદજ કરતો નથી તે હું રંકની શું સાર કરે ? અમરસિંહ મને ચાહે છે. પરંતુ હું તેમના પ્રત્યે પતિ તરફિનો પ્રેમ આખી શકતી નથી. મારે હુદ્ધય અકખરની પ્રેમ ચેષ્ટાએ ચાટયું છે પરંતુ તેમાં શ્વાષતા છે. ત્યારે મારે શું કરવું ? જન્મથીજ નીરાધાર થયેલી આળાના કર્મમાં રાજપતિનું સુખ માનવાની કદ્વપના કરવી તે મારી ભુલ છે. મારે અકખરની આશા છોડીજ દેવી જોઈએ.

ચંપા અને પદ્માની વાતચિત દરમિયાન કુમળા આમ નવી નવી કદ્વપના સુધિના તરંગોમાં ગોથાં ખાતી બેડી હતી. તે વિચાર નિદ્રામાં એટલી તો રેકાઈ ગઈ હતી કે, પદ્માના જવાની પણ તેને ખબર રહી નહિં. પરંતુ તુર્ત ચંપાએ “કેમ કુમળા બહેન, તમે અમસ્થાં તો પ્રેમ સુત્રની બહુએ આંદીએ ઉકેલવામાં રસ દ્યો છો ને આજે તદ્દન મૌન કેમ બેસી રહ્યાં ? ” એવો પ્રશ્ન કર્યો, ત્યારેજ કુમળાએ ચમકીને ચંપા સામે જોયું. તેની વિચારસ્થિત હવામાં ઉડી ગઈ ને ઠાવકી બની જઈ ખુલાસો કરવા લાગી. “ચંપા બહેન, હું શું બોલું. તમે તો રેજ મારા પાસે વૈરાગ્યની વાતો કરો છો, અને જાણો સંસારની માયાબળણે બેદીને કોઈ સાધવી શિરોમણી સ્વર્ગમાંથી ઉત્તરી આવ્યાં હોય

તેમ હેખાએ છો, ત્યારે આજનું તમારું પ્રેમ શાસ્ત્ર સાંલળીને હું તો ઠરીજ ગઈ છું. વૈરાગ્ય શાસ્ત્રમાં આવી રાગની વાતો પણ રહેલી હુશે તે તો મેં આજેજ જાણ્યું. હું તો એજ વિચાર કર્તી હતી કે આ સધળા પ્રેમ પાડો વિજ્ય કુમારે તમને ક્યારે શીખવ્યા હુશે ? ”

“ ઘેલી કમળા, હું તો મને પણ ટાંપી જથ્ય તેવી છો છો ! ” ચંપાએ કમળાના ગાલે ચીટકી લરી હૃદ્ય કરતાં કહ્યું - “ એતો અવસરના ગીત કહેવાય; બહેન, તુંજ કહે કે રાગનો પાઠ ભણ્યા વિના વિરાગ તે શેનો હોય ? અને વળી અમારી તો પ્રેમ શાસ્ત્રની વાત હતી. એ પ્રેમના પાઠ તો બધે એ હોય છે. કાયાનો અને માયાનો પ્રેમ કહેવાય છે, તેતો ભિથ્યા પ્રેમના આંખવાં છે. ત્યારે વૈરાગીના પ્રેમ પાઠમાં તો પ્રભુ પ્રત્યેના પ્રેમથી જોડાવાનું હોય છે એટલે તેમાં માયાવી જથ્યજ નથી. અકૃતરનો પ્રેમ પ્રકટાયો અને સુકાયો, પદ્માનો પ્રેમ શાંકાયો અને પાછો કોષ્યો. એમ વિરાગીના પ્રેમની દિશા ચળ વિચળ નથી હોતી. તે તોઃ ગાભમાં કે વનમાં, વસ્તીમાં કે એકાંતમાં, દિવસુના કે રૂતન્ય, બાગૃતિમાં કે નિદ્રામાં એક જરાએ રહે છે. એજ પ્રેમની નિશાળ તો અંતિમ વર્ગ છે ને તેમાં પાસ થવા પછી જન્મ મરણુના ઝેરા ટળી મોકાની જયો. તેમાં આ ભટકતા આત્માની જયોત મળી જથ્ય છે. ”

“ ચંપા બહેન, તમે તો નહુગરી લાગો છો, ક્યાં ઘડી પહેલાનાં સંસાર પ્રેમના ચિત્રામણુને, ક્યાં ઘડીમાં ર્વર્ગ મોકાની સફ્ર ? તમે આ શુદ્ધ સાવિત્ક પ્રેમનાં પૂજારી છો, છતાં પદ્મા બહેનને સંસાર પ્રેમનો પાઠ કેમ લખ્યાંયો ? તે તો કહે. ” કમળાએ નવી શાંકા ઉમજી કરી પૂછ્યું.

“ દાહરનાં અએક પગથીયાં ચઢાય તોજ માળ ઉપર ચઢી શકાય. એગમ સાહેબા પહેલા પગથિયેથી લપસી પડ્યાં છે. તેને સીધાં ઉપર લઈ જઈ તો ત્યાં સ્થિર ટકી શકે કેમ ? તે મને શાંકા છે. સ્વીએને સ્વર્ગિય પ્રેમના

પગથિયે ચદવા પહેલાં પતિ પ્રેમને જીતવો જોઈએ. સ્ત્રી એ પતિની છાયા છે—ચહુચરી છે. ન જુકના નાથને રીજવવાની જો તેનામાં શક્તિ ન હોય તો હુરના નાથને તે કેમ પસંદ કરી શકે ? પ્રલુભાં શુદ્ધ પ્રેમ પ્રકટવો તે કંઈ બાળ ચેષ્ટા નથી તેથીજ લ્યાગીઓના જીવન શિરસાવંઘ છે. એ પવિત્ર લૂભિકામાં પગ મુકવાનો અધિકાર ત્યારેજ મેળવી શકાય, કે જ્યારે હૃદયને ખુણો—ખાંચરેથી પણ મિથ્યા રાગ લુસાઈ ગયો હોય. સંસારની ક્ષણીક મોહનીમાં ઈન્દ્રજાળનું શુદ્ધ દર્શન થઈ ચુક્કું હોય, તેની જાળમાંથી મમત્વ છુટી ગયું હોય. આલી ઉદર લરવાને મુંડમુંડાવવી કે કંથા ધરવી તે તો પ્રલુના દરખારને છેતરવાની શતરંજ છે. મારી સવાહ શોધવા આવેલી યજ્ઞા પહેલને હું આગળ એંચી જઈને ઉલ્લય ભાષ્ટ સ્થિતિમાં કેમ મુકી શકું ? મેં તો કયારનોયે સંસાર રાગને રગદોળી નાખ્યો છે, છતાં હળુ મારા પતિ દેવ મારા પ્રલુ પ્રેમને અ પક્વ કહે છે, ને તેથી હું હળુ ત્યાગ નથી સ્વીકારી શકી, ત્યાં શાહુનશાહુમાં ચક્કુર થયેલી પજ્ઞાને હું તે પવિત્ર ક્ષેત્રમાં કેમ ધકેલી શકું ? ”

વાર્તાલાપમાં છેક ખપોર ઢળી ગયો. તેની અખર રહી નહિ અને જો વિજય ત્યાં ન આવી ચદત તો વાતોની ધારા કયાં સુધી લંબાત તે કંપના કરવી નકામી છે. ચંપા અને કમળા પ્રેમચર્ચા કરી રહ્યાં હતાં તેવામાં વિજય ત્યાં આવી ચદયો ને તેણે ચાલતી વાતોમાં ટાપશી પુરતાં કહ્યું “ દેવી, તમે ગેરહાજર વ્યક્તિ ઉપર આરોપ મુકો છો તે શું વ્યાજખી છે ? જો પ્રલુની આજ્ઞાને ચરણે તમાડું જીવન મુકવા માગો છો, તે આજ્ઞા ઉડાવવાને તમારે પહેલાં તૈયાર થવું જોઈએ. કહો જોઈએ, એ ઘડી દિવસ છતાં તમે લોજન કરી શકો એ માટે રસોધમાં જોડાવાનો સમય તમે નથી ચુક્યાં ? વાતોના રસમાં કર્તવ્ય ધર્મ ચુકી જવા છતાં તમે તમારા પ્રલુ પ્રેમને પક્વ થયેલો માનો. એટદે શું મારે તમારી હામાં હા લેણવી હેવી ? ”

વિજય કુમારના આવવાથી કુમળા શરમાઈને ચાલી ગઈ અને ચંપા તેમને વળાવવાનો વિવેક ભુલી, વિજયના આહુમાં ઢળી પડી.



પ્રકુરણ ર૪ મું.

આહુતિ.

આજે કુમળા સવારના ખડુ મોડી ઉઠી હતી. કેમકે આગલા દિવસે ચંપાને નિવાસેથી આવવા પછી તેને શાંતિ થઈ નહેતી, અને તેજ વિચારમાં મોડી રાત્રી સુધી નિદ્રા પણ આવી નહેતી. એટલે અસુરે ઉઠવા છતાં નિદ્રાનું જેર ગયું ન હોવાથી આંખો લાલ થઈ ગઈ હતી. પોતાના મકાનમાં તે એકલીજ રહેતી હોવાથી પથારી ઉપર જ્યારે સૂર્યના કિરણો આંબ્યાં ત્યારે તે બોખાકળી ઉઠીને નિત્ય કાર્યમાં શુંથાઈ, પણ તેમાં તેનું ચિત ચોંટયું નહિ, ચંપાના સહવાસથી પોતે હુમેશાં સવેગા ઉઠીને ઘર કામથી પરવારી એક સામાયિક કરી કેવાને ટેવાયલી હતી. આજે આટલા કાર્યોથી ફૂરેગ થવા જેટલો સમય ઉંઘમાંજ ખોવા માટે તે કચવાઈ, અને પોતાનું કાર્ય પોતાને આટોએજ છુટકો છે તેમ સમજ તેણે લથડતે હાથે પણ સાઝસુર અને પાણી ગળવું વગેરે નિત્ય કાર્યોને ઉકેલી મૂડુની સામાયકમાં બેસ્વાને વિચાર કર્યો. પરંતુ પોતાના ચિત્તને શાંતિ ન હતી, અને જ્યાં ચોકસ સમયનું એકય કરવા તથા સમ્યક્ ભાવ ધરવાનો છે તેવા સામાયકના કાર્ય માટે જરૂરની સમતા-શાંતિ ન હોવાથી ચંપાને આવાસે જવાને તૈયાર થઈ અને જેવી પ્રવેશ દ્વારા પાસે પહોંચી, ત્યાં શરેણશાહુ અક્ષરને પોતાને આંગણે આવતા જેયા એટલે વિવેકથી કુરનસ બળવી તેમના સાથે મકાનમાં પાછી કુરી.

બાદશાહ કોઈ વખત આ તરફ નીકળી જતાં ચંપા અને કુમળાના ખણર કેતો હતો એટલે તેમણે એક બેઠકનો ખંડ

આગળના ભાગમાં રાજ્યો હતો. અને ત્યાં સ્વર્ચ બેઠક રાખ-
વામાં આવી હતી. એટલે વિશેષ માર્ગતિતિક્ષાની રાહ ન
લેતાં બાદશાહ બેઠકના ખંડ તરફ વણ્ણો, ને ત્યાં જઈ ગોઠવી
રાજેલ ગાઢી ઉપર બેઠો. અને કુમળા વિવેકથી નીચું મેં
કરી આજા ઉઠાવવા સામે ઉલ્લી રહી.

કુમળાએ પોતાની આંતરગતાનિ છુપાવવાને ખાગુ
કાળજી રાખી હતી, પરંતુ તેની લાલ આંખો અને ચહેરાની
શ્રીકાશ બાદશાહ તુર્ત કળી ગયો હોય તેમ પૂછયું—“કેમ !
કુમળા, આજે જ્યારે હું ચાહુંને તમને અમૂલ્ય લેટ આપવા
માટે આવ્યો છું ત્યારે તમારા ચહેરા ઉપર ઉદ્વેગ કેમ દેખાય
છે ! આમ ઉદાસ છતાં અત્યારમાં બહુાર જવાની તૈયારી
કેમ કરી રહ્યાં છો ? ”

“ મહારાજ, ગઈ રાત્રે સહેજ મોડે સુવાથી આપને તેમ
જણાયું હશે. બાકી શહેનશાહના પગલાં થાય, ત્યારે ઉદ્વેગ તે
શાનો હોય ? આપ દ્વારાનુએ હું અનાથને અનેક લેટ આપી
છે, અને વખતોવખત મારી ખખર દ્વોછો. તો પછી એવી કંઈ
લેટની મને ન્યૂનતા રહી છે કે જે મેળવવાને હું કલ્પના કરી
શકું ? મારે તો આપની મીઠી દાદી અને પવિત્ર દર્શનનો
લાલ છે તે અમૂલ્ય લેટ છે. કૃપાળુ, મને અહીં એકાંતમાં ન
ગોડે, ત્યારે ચંપાણહેન પાસે જઉ છું; એટલે વિશેષ આનંદ
રહે છે. અને અત્યારે પણ નિવૃત્તિ હોવાથી ત્યાંજ જતી હતી.
તેવામાં આપના દર્શન થવાથી હું મને ભાગ્યશાલીની સમજું-
છું. આજા હોય તો ચંપાણહેનને આપ હુન્નુરના દર્શનનો
લાલ લેવા અહીં જોતાવું.” કુમળાએ લંઘાણુથી ઝુલાસે
કરતાં ચંપાને તેડી લાવવાને રણ માગી.

કુમળા અહીં એકદી રહેવા આવવા પછી મોટો ભાગ
ચંપા સાથે ગાળતી હતી અને વિશેષતઃ બાદશાહની સુલાકા-
તમાં ચંપા સાથેજ રહેતી. એટલે અત્યારે અનાયાસે ઉપસ્થિત

થયેલ એકાંતનો પ્રસંગ હુર કરવાને તેણે આ વિવેકલરી યુક્તિની હતી, પરંતુ અકુમરને તે વાત ન રૂચી હોય તેમ ઓદ્યો—“ નહિ, કમળા ! ચંપાને જોલાવવાને તમારે તસ્થી લેવાની જરૂર નથી. તમારા અત્યારસુધીના પરિચયથી હું બેઠ શક્યોછું, કે તમે એક નિરાધાર ખાળા છતાં ઉચ્ચકુળની જોલાદનાં છો. કુળ અને જલિની પરીક્ષા વચ્ચે—પંચે અને પડોશે થાય છે. તમે જ્યારથી મને બચાવવા જતાં આડા ધા જીવ્યા હતા ત્યારથીજ હું તમારી ઉત્તમતા પારખી ગયો છું, અને તમારી માંદગીમાં તથા એકાંત કુટીરમાં રાજ્યપુત્રોળી સાથે થયેલા સમાગમથી મારી ખાત્રી થઈ છે કે તમે સફુણું-સમજુ અને શાંત ખીરતન છો. તમે મેદાનમાં આડા ધા જીવીને મારા ઉપર ઉપકાર કર્યો છે, એટલુંજ નહિ પણ આપણી છેલી સભામાં તમે જીવના જેખમે મારો પક્ષ કરવામાં જે અહાહરી અને લાગણી ખતાવી છે, તે સધળું હું જીવી જઉં તેટલો એકદર નથી. તમારા મારા પ્રત્યેના આ સધળા ઉપકારનો શું બદલો આપવો તેજ હું વિચાર કરતો રહ્યોછું, અને આજે તમારા પાસે આટલો વહેલો આવવાનું પણ તેજ કારણું છે, અત્યારે તમારી અહીં એકાંત હાજરી છે તેથી આ ખાખતમાં હું તમારી ઈચ્છા જાણવા માણું છું. કહો, કમળા ! તમારા ઉપકારના બદલામાં હું તમારી કર્દી સેવા ઉઠાવું ? ”

“ પ્રભુ, આમ ઘેલાં કાઢી મને શરમીંદી ન કરો. મૈં આપના ઉપર કંઈ પણ ઉપકાર કર્યોજ નથી. છતાં આપ તેમ માનો છો તે આપનીજ મોટાઈ છે. ખરું કહું તો આપેજ મારા પ્રભુ ધર્મના બદલામાં મને પૂરા ઉપકાર નીચે દખાવી નાખી છે. મારી માંદગી વખતે સુશ્રૂષામાં આપે જે કાળજ અને ખંત દર્શાવ્યાં છે તેનો બદલો હું મારી જાંદગીભરની સેવાથી પણ વાળી શકું તેમ નથી. આપના શરૂદોમાં અત્યારે દેખાયેલો ભાર અને માન મારી ચોઅયતાની હુદ ઓળંગી ગયાં છે, ને મને ઉલટાં શરમાવે છે. રંકની કોટે રત્ન ન શોલે, માટે—”

આટલું બોલતામાં કમળાનું હૃદય ભરાઈ આવ્યું. તે અકુભરના માનવાચક શાસ્ત્રોમાં આશાંકા થતાં થરથરવા લાગી, પોતાની માંદગીમાં તેનો બાદશાહ પ્રત્યે પ્રેમ જગૃત થયો હતો, એકાંત કુટીરના સમાગમમાં તે પોષાયો હતો અને અહીં ના વસવાટ પછીની મુલાકાતોમાં તે નવપ્રદ્વાવિત થયો હતો; છતાં આગલા દિવસની પગાની કહાણીના આતાપથી તે છેક સુકાઈ ગયો હતો, તે બાદશાહ કયાંથી સમજુ શકે! કમળાના વર્તનમાં આટલું ન ધારેલ પરિવર્તન જોઈ અકુભર આક્ષર્ય પામ્યો. તેના થરથરાટમાં કંઇ હૈવી ખળ જોયું. તેના ખરતાં આશ્રૂઓ જણે મોતી ઠળી પડતાં હોય તેમ બહેમાયો. અને જો કમળાના પાછળ હડવાથી ખડખડાટ ન થયો હોત તો, પોતાની પાસેનો રૂમાલ પાથરીને ખરતાં મોતી જીલી દેવા અને તેના ચરણે ઠળી પડવાની ઉતાવળ પણ કદાય તે કરી નાખત, પરંતુ કમળાના પાદસ્પર્શથી થયેલા અવાજે તેને સાવચેત કર્યો. કમળાની પ્રેમ દાખિમાં આ જાહુઈ ફેરફાર કેમ થઈ ગયો હશે? તે સમજુ શક્યો નહિ. તેણે મોતી જીલવાના ભ્રમમાં ખીસામાંથી એંચી કાઢેલ રૂમાલ કમળા તરફ ઝેંકતાં કહ્યું. “કમળા, આ તું શું કરી રહી છે? કે, રૂમાલથી તારું મોં દુષી નાંખ. રાજપુતોની મંડળીને તલવારની ધારે નથાવતી, અને નેક તથા ટેકને માટે અડગ ઘેર્ય-ખળ અને ખુદ્ધિ આપનારી કમળા, કદી પણ રહી શકેજ નહિ. કમળા, હમેશાની તારી મીઠી વાણી, હસમુખો ચેહારો, અમૃત વર્ષાવતાં પ્રેમ નથનો અને શલભલા રાજકુશળને પણ હંકાવે તેવી વાતોને સ્થાને આ હું શું જોઉં છું? રાજમહાલયમાં માંદગીના ખીછાને તે અપોલ હૃદય, સમય આવ્યે કયાં છુપાઈ ગયું? પૃથ્વીસિંહ તરીકેના મારા તરફના હૃદયોદાનને સ્થાને અત્યારે અશુ અને અધૈર્ય કેમ હેખાય છે? તારી આ લાગણીઓને માન આપવા, તારા ઉપકારના બદલામાં તને સર્વદા મારીજ કરી કેવાને આજે હું તારે આંગણે આવ્યો છું, ત્યારે તારામાં આ

આજથી ફેરફાર હું કેમ જોઉં છું ? કમળા, સાવધ થા. આજથી તું મહારા હૃદયની અધિષ્ઠાત્રી થઈ ચુકી છે. મહારા સધળા વિચારો અને કૃતિનું કેન્દ્રસ્થાન હવે તુંજ છે. કમળા, મહારી સાથે એક પ્રેમ લર્યો શણ્દોચ્ચાર તો કર. ”

કમળાએ ઉંચું જોયું અને અકૃપર પ્રત્યે કરણુાલરી દાખિ ઝેંકી. તેના નેત્રમાં હવે અશ્રુનું બુંદ પણ નહોતું.

“ મહારાજ ! ” કમળા ગાંલિર સ્વરે બોલવા લાગી. “ આપ નામવર અમારા શહેનશાહ છો એ વિસરી ગયા કે ? ”

“ હું શહેનશાહ છું એટલે શું માર્દ પ્રયણ ક્ષેત્રજ ન હોએ શકે ? કુદુંબ, લી, સ્નેહી અને આપ્તજનમાં પણ શું મારે શહેનશાહના સ્થાને રહેવું જોઈએ ? જરા વિચાર કર, મહારાજ હવે તહારા હૃદયની સાથે જડાઈ ગયું છે. તું મહને ચાહે છે, છતાં મહારી પત્ની થવામાં તહને કષ આકયણું જણ્યાય છે તે કહી હે. ” અકૃપરની અધીરાજ બધી જતાં તેણે પોતાનું હૃદય ઠલવી નાખ્યું.

કમળાએ પોતાની છાતી ઉપર હાથ સુકયો. મનમાંનો વિચાર બહાર નહિ દર્શાવવાની તેની છચ્છા હતી. પરંતુ અંતે તેના મ્હેંમાંથી ઉફ્ગાર નીકળી પડ્યા “ પણ-પણ-પણા ”

સર્પદંશ થયો હોય તેમ ચમકીને અકૃપરે પ્રતિધ્વનિ કર્યો. “ પણા ! પણા ! તેનું શું ? ”

“ હા ; ” કમળા પુનઃ બોલી “ પણા આપની પણરાણી છે. એટલે મારા પ્રત્યેનો પ્રેમ પ્રવાહુ તેમના તરફ વાળવાને હું ગ્રાર્થના કર્દું છું આપના પ્રત્યેનો મહારો પ્રેમ અમર્યાદિત છે એ ખર્દું. પરંતુ આપની અને મહારી પરિસ્થિતિ વચ્ચે આકાશ જમીનનું જે અંતર રહેલું છે તે હું પૂર્ણપણે જાણું છું. આપ સાર્વભૌમ ભૂપાલ છો, અને હું એક લિખારિણી છું. મહુરાં માત પિતા કોણું છે તે પણ અધારિ હું જાણી શકી નથી. આપની પત્ની બનવાથી હું સુખી થઈશ, પરંતુ મહારી ખાતર હું આપને ઉચ્ચ સ્થાનેથી ભ્રષ્ટ થયેલા જોઈ શકીશ નહિ. કમ-

જા નામની એક અજ્ઞાત જ્ઞાતિની છોકરીના પ્રાણુનાથ સાટ
આકથર ! ના, ના ! કાલત્રયે પણ એમ બની શકનાર નથી !
તમારા મુખ દર્શનથી મારી અલિલાખા પૂર્ણ થઈ છે.
હવે તમારી સાથે લગ્ન કરીને હું આપને કલાંકિત નહિ
કરું. આપના ઉચ્ચસ્થાને આપ અચલ વિરાળ રહો ! આપ
ભાઈ ન થાઓ જેજ મહારા પ્રેમની આધુતિ છે. જે મહારાથી
આટલે અંશો આત્મસંયમ ન થઈ શકે તોપણી મહારા પ્રેમ
સાત્ત્વિક નજ ગણ્યાય ! ”

બાદશાહ કમળાની આ વેગભરી વાણી સાંસળી સ્તરથી
બની ગયો, તેનાથી વધારે બોલી શકાયું નહિ, તેણે ખિન્ન વદને
મુશ્કેલીથી કમળાને પૂછ્યું.

“ કમળા ! તું મહને સહા આમ હુરજ રાખીશ કે ? ”

“ હા ; તેમજ. પરંતુ હું નિરંતર આપની નજીકમાં
રહીશ. શરીરથી નેટલી હૂર તેટલીજ અંતરથી નિકટ રહીશ.
જે કે આપ મહારાથી વિલક્ત હુશો તથાપિ આપના વિચાર,
આપનાં મનોભાવ, આકંશા અને આપના આત્માની સાથે રહે-
નાડું મહાડું ઐકય નિરંતર અલંગ રહેશો. ઈશ્વરપર શ્રદ્ધા
રાણીને આપણે નિરંતર આપણું જીવન પવિત્ર રાખવું જોઈએ.
આપણા પ્રેમને કલાંકિત ન થવા હેવો જોઈએ. બાદશાહનામવ-
રના જનાનખાનામાં સેંકડો સ્વીચ્છો છે, તેજ પ્રમાણે હું એક
વધારે થધશ તેથી વિશેષ શું છે ? આપનો પ્રેમ જે નિર્મણ
લાગણીવાળો હોય, તો આ વાત પુનઃ નહિ છેડવા હું વિનંતી
કરું છું.” કમળાના મુખમાંથી આ શાફો નીકળતા હતા, ત્યારે
તેના નેત્રોમાં અભિ જરતો હોય તેમ દેખાતું હતું.

બાદશાહ આ દૃશ્ય જોઈને વિચારમાં પડી ગયો, કમળા
ના સતીત્વની પ્રલાભમાં તે અંનક્ષ ગયો હોય, તેમ તે સ્તરથી
થઈ ગયો. અને અહીંથી નીકળી જવાનો નિક્ષેપ કરી ઉલ્લે
થતાં બોલ્યો. “ કમળા, મારો ઉહેશ તને સુખી કરવાનો છે.
એટલે જ્યારે તું મારા સાથે સ્નેહુલભની ગાંડ ધાંધવા ખુશી

નથી, તો તે માટે મારે હઠ કરવાની જરૂર નથી. તું નિરાધાર છે, ધતાં તાર્દું ચારિગ્રય ઉદ્ઘાટન છે; એટલે તારી જાતિ માટે મને ફુલડો પડવાનો લય નથી. જો તું મારી પ્રતિષ્ઠાના રક્ષણું માટેજ આત્મસંયમ આદરી રહી હો, તો તે લીતિ કાઢી નાંખજો. અને જો હળું પણ તાર્દું હૃદય મારા પ્રત્યે એંચાય, તો વિના સંકેર્યે યાદ કરજો. તું બાળા છે, એટલે એકાંત જીવનનો લય હુર કરવા, તારા સ્વી જીવનને સંરક્ષિત કરવા તથા સંસાર ચાત્રાનો સાથી શોધવાની તને જરૂર પહેલોજ. આ પ્રસંગે નારા મનને ફરી પુછી જોજો. અને જો તે સ્થાન માટે અકુભર રને વિશ્વાસ પાત્ર જણ્યાય તો જોવાવજો. હાલ તો જઉં છું.” આટલું કહી અકુભર ત્યાંથી રવાના થઇ ગયો.

* * *

અકુભર બહાર ગયો. ત્યાં સુધી કમળા તેના પાછા જોઈ રહી, પરંતુ તે દર્શિથી હુર થયો એટલે તેનો આવેગ ખર્ચી ગયો. તેનું હૃદય ભરાઈ આંદ્યું. આપોમાં અશ્વધારા વહેવા લાગી અને કપાળે હુથદર્ઢ શૂન્ય અવસ્થામાં એસી ગઈ.

પવનની કેટલીક લહેરીઓ પસાર થઈ જવા પછી જ્યારે તે સચેત થઈ, ત્યારે લગભગ દિવસનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો. અસ્વસ્થતામાં વિખરાઈ ગયેલા વાળ સમા કરી તે ડી, અને ગઈ ચુજરી લુલી જઈ રસોઈમાં જોડાવા ધાર્યું. પરંતુ તેની લુખ મરી ગઈ હતી. ઉત્સાહ મંદ પછ્યો હતો અને ચિત્ત વ્યા અન્યું હતું; તેથી રસોઈ કરવાનું માંડીવાળી એરડામાંજ એસી રહી.

અકુભર આટલો ઉતાવળો તેના શણદને માન આપી ચાલ્યો ગયો. તેથી તેને આશ્ર્મ્ય સાથે માન ઉત્પત્ત થયું. તેણે વિચાર્યું કે—“ ભારતનો સરદાર ધારે, તો મને ક્ષણ માત્રમાં પોતાને આધીન થવાને ફરજ પાડી શકે તેમ હતું. વાસ્તી અત્યારે તો તેની મહદ અને સહાનુમૂતિ ઉપરજ માર્દું જીવા છતાં કેવાળ મારી લાગણ્યિને માન આપીને

તે ગયા, ને મારા છોધ લર્યા શણ્હો સામે સહેજ પણ રોશ ન દર્શાવતાં જતાંએ મને મારી રિથિતિનું ભાન કરાવી, વિચાર કરવાની તક આપી, એ તેમની સહેજનતા જેતાં પદ્મા તરફની તેની અર્દચિ માટે તેને હોષિત સમજવામાં શું બુલ થતી નહી હોય ? અકખરનો પ્રેમ વહેંચાએલો છે તે ખરું, પરંતુ તેથી તેના મારા પ્રત્યેના સફળાવમાં કંઈ ઉણુપ હેખાંતી નથી. પદ્મા કહેતીજ હતી કે એક વખત જ્યારે અકખર મારા પાછળ દિવાનો હુતો લારે હું તેનાથી દૂર નાસતી હતી. તેમ હું પણ તેના પ્રેમને ઠેકર મારી પદ્માની સ્થિતિમાં મુકાઇ છું. પરંતુ હવે શોચ શું કામનો ? પદ્મા અંતે અકખરના પ્રેમને શોધે છે, તેના પાછળ જુરે છે, પોતાની બુલને માટે પસ્તાય છે, છતાં તેવી બુલ મેં કરી. કદાચ હવે તે બુલ માટે હું પસ્તાઉં, તો પણ લાલ શો ? એક પરિણિતા સ્વી તરીકે પદ્માને હજી પણ શહેનશાહને રીઅવવાનો અવકાશ છે, ત્યારે મારે તે અવકાશજ કર્યાં છે ! તે જતાં જતાં પણ વિચારવા અને બોલાવવાથી આવવાને વચ્ચેન આપી ગયેલ છે; પરંતુ તેમ કહેવરાવવાને મારો અધિકાર શો ! કંઈ નહિ. હું વિરાગી જીવનમાંજ સંતોષ માનીશ. સંસારના માયાખંધનોમાં મારે મોહ શામાટે રાખવો જેઠાંએ ? માયાવી પ્રેમના શાખુંક સુખોને માટે મારું જીવન હું પરતંત્ર નહિજ થવા દઉ.”


આટલી વિચારમાળના અંતે તેનામાં કંઈ નવું ખળ આવ્યું હોય તેમ બેઠી થાડ ગઈ. પણ તે નવું ખગ ક્ષણુમાત્ર પણ ટકી શક્યું નહિ, ઘડી ઘડી એકાકી જીવનમાં લોગવવી પડતી મુશ્કેલીએ. અને નિરાશા તેની આંખ સામે તરી આવ્યાં. અકખરના છેલા શણ્હો તેની સામે ખડા થાડ ગયા, ને તે અણે વાંચતી હોય તેમ બોલી—“તું ખાળા છે, એણે એકાંત જીવનનો ભય હુર કરવા, તારા સ્વી જીવનને સંરક્ષિત કરવા તથા સંસારયાત્રાનો સાથી શોધવાની તને જરૂર પડશેજ” આદશાહના જતી વખતના આ શણ્હો તે કરી કરીને બડાબડવા લાગી. વળી પાછેં વિચારનો વેગ વધી ગયો. હવે તેને

એક નવો પ્રશ્ન ઉભો થયો કે શું ખીચોથી સાથી વિના સંસાર રથ નહીં ચલાવી શકતો હોય ? શું ખીચોનું એકાંત જીવન ભયમાં છે ? અને તેને રક્ષણું જરૂર છે ? બાદશાહની આ વાત જરૂર વિચારવા જેવી છે. જે મને પતિનું છત્ર હોતાતો બાદશાહ મારા પ્રેમની યાચના નજ કરી શકત. જે હું નિરાધાર ન હોત તો અમરસિંહના ઉપકાર નીચે મારે ન દખાવું પડત. ”

કુમળાને પોતાની નિરાધાર અવસ્થા અને કુમારી લંદગીને ભય ખુલ્લો દેખાતાં મગજ ભરવા લાગ્યું. અમરસિંહનું નામ-સમરણ થતાં તેના રોમેરોમ કંપી ઉઠ્યાં. તેના પ્રેમમાં રહેલી સ્વાર્થની ગંધ અને તેના અંગે પાથરેલી જાળનું સમરણ થતાં તેનું ચિત્ત સ્થિર રહ્યું નહિ. જણે તે અમરસિંહને ત્યાં ઉલેલો જોતી હોય તેમ ઘેલાં કાઢવા લાગ્યી. અને અમરસિંહને પોતાની સામેથી હુંકી કાઢતી હોય તેમ કોધથી જોલી— “ જા-જા અમરસિંહ, મારા ઉપરના તારા ઉપકારને ભુલી જઈને હું તને વધારે કહી શકતી નથી, પરંતુ કુમળા કહી પણ પ્રપંચી પ્રેમને તાબે થાય તે આશા છોડી હે. અકૃષ્ણરે તારી નીચ ચુક્લિયો જાણવા છતાં તે ભુલી જઈ વેરનો બદલો ઉપકારથી વાહ્યો છે તે ચાહ કર. ; કુમળા નિરાધાર છતાં તારા જેવી કૃતિદિન કે વિષયાંધ નથી. જે અકૃષ્ણરના પ્રેમનું ખલીદાન આપી શકે છે તેના સામે તારો આ પ્રયત્ન શું કામનો છે ? — ”

આટલું જોલીને મૈન રહી. તેની આંખો લાલચોળ થઈ ગઈ હતી. પોતાની સ્થીતિ કે શરીરનું ભાન ભુલી ગઈ હતી. તે અમરસિંહને અહીંથી કાઢી મુકવા જતી હોય તેમ સિંહણુની ચેઠ ઉછળીને સામે ઢોડી અને સામેની દીવાલ સાથે અથડાઈ એલાન ધરણી ઉપર ટળી પડી.

કુમળા પડી તે પડીજ. તે પણી તેનો એકપણ અવંજ કે ચેષ્ટા જોવાયાં નહિ. પણ આજે કુમળાને ન જોવાથી ચંપા ઝપોર પણી જ્યારે તેને જોવાવવા આવી ત્યારે કુમળાનો નિર્જીવ ઢેઢ જોઈ તે હેઠતાઈ ગઈ.



મુકુરણુ ૨૫ મું.

અકુભરની જીવદ્યા.

કમળાના મરણુના ખખર બાદશાહને, આચ્યા ત્યારે તેના હૃદયને સંપત્ત આધાત થયો. તે કમળાની ટેક અને મનોનિશ્ચહની પ્રશંસા કરતાં જીવનની ક્ષણિક ઘટનાના વિચારમાં ઉત્તરી ગયો. સવારના વાતો કરતી કમળા સાંજ પહેલાં ખુદાના દરારમાં ચાલી ગઈ, એ ઘટનાએ તેના હૃદયને જીવનની ક્ષણિકાંગુરતાનું ભાન કરાયું. અત્યારે તેને રાજમહાલયના વૈભવોમાં આનંદ જોવાયો નહિ. જીવને કંઈ ચેન પડયું નહિ. તેથી ધાર્મિક ચર્ચા કરવાને તે અખુલક્જલ પાસે જવા નીકળ્યો.

જ્યારે અકુભર અખુલક્જલના આવાસે ગયો. ત્યારે અખુલક્જલ શ્રી હૃરવિજયસૂરિ સાથે જાનગોષ્ઠિ કરી રહ્યો હતો. બાદશાહને આવતાં જેઈ અખુલક્જલ બારણું સુધી સામે ગયો, ને માનપૂર્વક આવકાર આપ્યો. બાદશાહ એકાએક આચાર્યશ્રીને ત્યાં આવેલા જેઈ બહુ ખુશી થયો, અને પોતાના હૃદેગમાં જે આચાસનની તે આશા રાખી રહ્યો હતો; તેવે વખતે સૂરજિના અનાણ્યા સમાગમથી તેમને ષેવડી શાંતિ મળતાં મન ઉપરનો લાર ઓછો થઈ ગયો. હોય તેમ ઉચિત આસને એસતાંજ કહ્યું. “ અખુલક્જલ, સૂરજિ મહારાજ અંહી પધારવા છતાં તમે મને ખખર કેમ કર્યો નથી ? ”

“ જહાંપનાહુ, મહારાજશ્રી આજેજ આગ્રેથી પધાર્યો છે. આ ખખર હું આપને જતેજ કહેવા આવવાનો હતો, પરંતુ જાનગોષ્ઠિમાં ઉડી શકાયું નહીં, તેટલામાં આપ હજુરના સુધારક કદમ અહીંજ થવાથી હું ઠપકાને પાત્ર હર્ઝ છું. અને તે ભુજ માટે મારી ચાહું છું ” અખુલક્જલે ખખર નહિ અપાયાનું કારણ જણ્યાવતાં કહ્યું.

“ મહારાજ, આપ અહીંથી અ ચા તરફ પધારવા પછી આપના કિમતી ષોધ માટે મારું મન ધાણી વખત આતુર

અન્યું છે. મારા જીવનક્ષેત્રમાં અનેક પ્રસંગે ધર્મઓધ માટે આપના જેવા નેક ફૂકીરની અહુ જરૂર જણાય છે. માટે આપઅહુંજ હુમેશાં રહો તેમ ચાહું છું. શું આપને અહીં વસ્તવામાં કંઈ અગવડ જણાય છે ? કુપા કરી આપને જે કંઈ અહુંથોપડતી હોય તે જણાવશો, તો હું તેને દુર કરવાને પ્રયત્ન કરીશ” અકૃષણે હીરવિજયસૂરિને વિનય ભાવે પૂછ્યું.

“ નહિ, ખાદ્યાહ અમારે સાધુને જગતની કોઈ જંગળ આડે આવી શકતી નથી. તો પછી તમારા પાસે રહેવામાં કંઈ અગવડો નહતી હુશે તેમ આપે માનવાને કે ચિંતા કરવાને જરૂર નથી. પરંતુ અમારે એકજ સ્થળે સ્થિરવાસ કરવાની અમારા ધર્મમાં મના છે# અમારે ધરણાર કે સગં સંબંધીનો સ્નેહ કણિક અને માયાવી જાણીને ત્યાગવા છતાં દીતર વસ્તુમાં મમત્વ શા માટે જેઠો ? અમારું કામ તો ઝૂતમાત્રથી નિરાળા રહ્યો આત્મકલ્યાણ સાધવાનું છે, ને તેમ કરતાં અની શકે તેણું જનકલ્યાણ કરવાનું છે. તો પછી અહીં સ્થિર રહેવું, તે અમારા આચાર અહારની વાત છે. આપજ વિચાર કરો, કે મારા અહીં નિત્યના વસ્તવાટથી તમારા સાથે રાગ વધે, તમારા અહુ માનથી મદને અવકાશ રહે અને સ્થિર શાંતિથી પ્રમાદ ધર કરે; એટલે અમે જે જે શત્રુઓનો નાશ કરવાને સાધુ થયા છીએ તેજ બદાએને અમે હુથે કરીને નોતરું કેમ આપી શકીયે ?

અમારે તો હિંસા, મુખ્યાવાદ, ચોરી, અધ્યક્ષ અને પરિથહી દુર રહેવાનું છે. રાત્રીલોજન ન કરવું, પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ, અને ત્રસ જીવોને તકલીફ ન પડે એ અમારે જેવાનું છે. રાજ્યાંડ અમારે ન કહે, તો રાજનો પ્રેમતો ક્યાંથીજ કહ્યા શકે ? કંસા કે ધાતુપાત્ર, પદંગ એવા મોહના કે આરામના સાધનો અમારે શું કામનાં ? ગૃહસ્થના ધરે પણ

* આ આખતમાં ઋપલદાસ ડવિએ લખ્યું છે :—

સ્રી પહીયર વર સાસરધ સંબિમયા સહિગાસ;
એ ત્રિષે અલથામણું, જે મંડિ ચિરવાસ.

નિવાસ કરવાનો અમારે માટે નિષેધ છે, ત્યાં માયા જ્ઞાનમાં ચુપડાવાની વાતજ કયાં રહી? સ્નાન શાષ્ટુગાર પણ અમને હો નિરશ્રીક છે. પ્રલુના દરખારમાં બાદશાહ અને ઝડીર, અમીર અને શરીબ સૌના માટે એકજ ઈન્સાઇ છે. ત્યાં સંસારની સાહેબી કે સત્તાને માન અપાતું નથી, પરંતુ કર્મનો ઈન્સાઇ થાય છે. એ નેક અદાલત પાસે જવાબ આપવા માટે આત્માને ચેતતો રાખવો એ અમારી ઝર્ઝ છે. ધીન લડંસાહાર લુંદળીના એશ આરામમાં ઝેસાઈ જનારાઓને જગાડવા એજ અમારો ધર્મ છે, એટલે અહું મારાથી સ્થીરવાસ કરી શકાય નહિ. ” શ્રી હીરવિન્યસ્તુરિએ પોતાને અહીંથી વિહાર કરવાનું કારણું સમજાયું.

“ મહારાજ, લુંદળીનો લરોસો નથી, એ વાત મને ખરોખર સમજાઈ છે. પરંતુ અત્યારે એક પાલખીમાં એસે અને એને પાલખી ઉપાડે તેમ જે જગતમાં જેવાય છે, તેવા અમીર અને ગરીબનો એકજ ઈન્સાઇ ખુદાના દરખારમાં કેમ હોએ શકે? ” બાદશાહે શાંકા કરી.

“ રાજનું, અહુંજ સંસારમાં ભુલાવો છે. ભૂત માત્રની પીછાથું કરનારા યોગીઓની સ્થિતિજ તે વાત સમજુ શકે છે. તમે ધર્મના લુઝાસુ છો, તેથી આ વાત વધારે સ્પષ્ટ કરવા જેવી છે. જગતમાં લોકો દરેક સારા કાર્યો કરતાં નથી. એટલે જે જેવાં કાર્ય કરે છે, તેને જેવાં ઝુણ લોગવવાં પડે છે. બાજરો વાવનાર મકાઈ મેળવી શકે નહિ. તેમ દુઃખ આપનાર સુખની આશા રાખી શકે નહિ. આ વહેવારનો ન્યાય છતાં લોકો આ વાત સમજતા નથી. અમીરો આગલા સત્કાર્યના બદલામાં પાલખીએ એસે છે, તે પોતાના કાર્યનો બદલો મેળવે છે. પરંતુ તે સત્કાર્યનો બદલો મેળવવામાં આનંદમાની જે નવું વાવેતર સારું ન કરે તો પણી તેને નવો પાક કર્યાંથી મળી શકે? જગતના મ્રાણીમાત્રમાં એક સરખી પંક્તિના લુવો કર્મનું ઝુણ લોગવી રહ્યાં છે. પણી તે મનુષ્ય રૂપે રહીને લોમવતા હોય, કે હરીણું, રોજ અથવા કીડી, મકોડીના સ્થળ ઢેહમાં

વસતા હોય. એટલા માટે સર્વ પ્રાણી માત્ર ઉપર ગ્રેમ રાખવો એ દ્યાર્થર્મનું પહેલું કુરમાન છે. ” શ્રી હીરવિજયસૂરિએ ખુલાસો કર્યો.

“ શું હરીણ, રોજ જેવા પ્રાણીનાં પણ એકજ પ્રકારના જીવન હુશે ? ” બાદથાડે આશ્રી પામતાં પૂછ્યું. “ યા અદ્ભુત, આ વાત જણુતાં મને ખસું હુઃખ થાય છે. જગતની સર્વે લીલા એ ખુદાની નવાજેશા છે, એમ તો મને પણ થતું હતું. પરંતુ તેમાં મારાપણું કે બુતદ્યા વિના મેં અનંત જીવોને આ હાથથી મારી નાખ્યા છે. શોભાને ખાતર સેંકડો પ્રાણીનો પ્રાણ લીધો છે. એના માટે ખુદાના દરખારમાં હું શું જવાબ દઈશ ? ”

“ રાજન, પશ્ચાતાપ એ ભુલનું પ્રાયશ્ચિત છે. તમારા માટે હણું વખત ગયો નથી. તમે સેંકડો પ્રાણીને જીવત દાન આપી તમારી ભુલનો બદલો વાળી શકો તેમ છો. આચાના મારા સંદેશાને માન આપી તમે ત્યાં અમારા ગયા પણસદુના દિવસોમાં જીવહિસા બંધ કરવાને કુરમાન કર્યું હતું, તેથી સેંકડો પ્રાણી બંધી ગયાં હતાં. એ રીતે તમારી એક આજા લાખો પ્રાણુને જીવાડી શકે તેમ છે. ડાખરના તળાવમાં થતી હિસા તમે ક્ષણું માત્રમાં અટકાવી, લાખો જીવોનું રક્ષણું કરી શકો તેમ છે. તમારી વિશ્વાળ હુકુમતમાં હિસા અટકાવીને ભુતદ્યા ફેલાવી શકો તેમ છે. માટે શોચ ન કરતાં ભુત સુધારવામાંજ જીવનની ચાર્યકર્તા છે. ” આચાર્યો દ્યાનો માર્ગ દર્શાવ્યો.

“ અખુલકુજલ, સૂરિજીના આ બોધથી મને મારા પાપ ધોધ નાખવાનું સુખ્યું છે. આ દ્યાળુ ફરીરના ઉપકારનો બદલો આપણે કેમ વાળી શકીશું, તે સમજાતું નથી. ખરેખર સેચો જગદ્ગુરુ છે. લોકો તેમને તેવી રીતે ઓળખે, માટે હું તેમને બહેરમાં ‘ જગતગુરુ ’ નું બિર્ડ* આપવા કર્યું છું.

* ધર્મકાય.

વળી ડાખરના તળાવની હિંસા બંધ થાય તથા મારી હુકુમતમાં લોકો જીવહિંસા ન કરે તેવા ફરમાનો અત્યારેજ કાઢવાની જરૂર લાગે છે. માટે પહેલાં તે કામ તમે હાથમાં હ્યો. મારી પ્રણને અનાજની એટ નથી. એક રૂપીયામાં અગ્નીયાર હુલર તોલા બાજરી અને સાડા આઠસો તોલા ધી મળે છે. દુધ તો એક દોકડામાં એક શેર વેચાય છે; તોપણી જીબની લાલચ, કે મનના શોખને ખાતર ખીજનો પ્રાણુ હરી લેવાય તે મને ધીનજરૂરી લાગે છે. માટે તેવી હિંસા સત્વર બંધ થવી જોઈએ ” અકૃપરે અખુલ-કુલને ફરમાયું.

અખુલકુલે ત્યાંજ અહિંસાનું ફરમાન બાદશાહની આજા પ્રમાણે લખવું શરૂ કર્યું. તેમાં હાલના અને લવિષ્યના હુકેમો, જગીરદારો, કરોડી અને સુખા. તથા મુસદીઓને અનુલક્ષીને ગાય, લોંસ, આખલા તથા પાડાને ધીલકુલ ન મારવા તથા વર્ષના લગભગ ધણ્ણા દિવસો સુધી હિંસા બંધ કરવાને ફરમાન લખી તેના ઉપર મહોરણાપ નાખી. અને તેની પાંચ નકલો કરાવી એક ગુજરાત અને સોરઠમાં, ધીજી દીલહી ઝોટેહપુર જીવા માટે, ત્રીજી અજમેર નાગપુર, ચોથી માળવા અને દક્ષિણ તથા પાંચમી લાહોર અને મુલતાન તરફ મોકલવા ફરમાયું. તથા મુળ લેખ થાનસિંહ મારક્રત સૂરીજીને માન પૂર્વક પહેંચાડવા જણાયું.

હું બાદશાહે હીરવિજયજી સૂરીને ઉહેશીને નામ ભાવે કહ્યું:— “ મહારાજ, આપના બોધથી મારા હૃદયનો ભાર ઓછો થઈ ગયો છે. આપના આવા અનેક ઉપકારના બદલામાં હું આપને માટે કંઈ કરી શકતો નથી. મારું અજ્ઞ પણ આપ સ્વીકારી શકતા નથી, પરંતુ આપ જ્ઞાનના સાગર છો અને જ્ઞાન એ આપનો સાથી છે, તો મારા પાસે પરસુંદર નામના એક યતિ પાસેથી મળેલો જ્ઞાનલંડાર સાચવી રાખેલ છે તે આપ સ્વીકારશો, તો મારા મનને આનંદ થશો.”

“રાજનૂ, અમારાથી ઉચ્ચકી શક્તાય તે કરતાં વધારે પુસ્તક કે કંઈ ઉપાધિ અમે રાખી શકતા નથી. પુસ્તકો એ જ્ઞાન છે તે ખરું, પરંતુ તેમાંએ અમારો મોહુ સ્થાપવો તે ત્યાગને બળવનારું છે. માટે એ સંઘર્ષ હું લેવાનો લાભ લઈશ પરંતુ મારે તે રાખી લેવાની જરૂર નથી.” સૂરીલુચે આચાર સમજાઓયો.

સૂરીલુના આ જવાખથી બાદશાહને સંતોષ વખ્યો નથી તેમ અખુલકુજલ સમજુ ગયો, તેથી તે વચ્ચે એલી ઉઠ્યો. “સૂરી મહારાજ, આવા ઉત્તમ જ્ઞાનના થંથેને ચોઝ્ય પાત્ર વિના ખીજને ખતાવવા તે પણ નકામા છે. એટલે જે આપ તેને નહિ સ્વીકારો, તો આટલા વખતથી ભંડારમાં પડી રહેલા થંથો પણી શું કામના ? આપ જેવા પાત્રના હુથમાં તે વસ્તુ મુક્તવાથી જરૂર લાભનું કારણ થશે; અને નામવર બાદશાહની એક માગણી સ્વીકારવાથી તેમને પણ બહુ સંતોષ થશે. માટે કૃપા કરી આ વાતમાં આનાકાની છોડી દેવા મારી નામ પ્રાર્થના છે.”

શ્રી હૃદવિજ્યસ્તુરિએ અંતે તે બંથ ભંડાર એવી રીતે સ્વીકારવાને જણુંયું કે—“લદે, એ ભંડાર હું સ્વીકારીને થાનસિંહને વ્યવસ્થા માટે સોંપીશ અને તે આચામાં શહેનશાહ અકૃષ્ણના નામથીજ તેનો લાભ સર્વ કોઈ લઈ શકે તેમ ખુલો મુક્તવામાં આવશે.”

આ ચોજનાથી બાદશાહને એવડો સંતોષ થયો અને સૂરિ મહારાજની નિઃસ્વાર્થવૃત્તિ માટે પ્રશંસા કરતાં સૌ છુટા પડ્યા.



પ્રકુરણુ રદ્દ મું.

સ્નેહ સંધાન.

કમળાના અચાનક ભરણ થવાના ખણર પદ્માને પણુ મહ્યા હતા. તેને એ ખણર નહોટી કે આગલા દિવસની હડીકિત જાળીને કમળાએ પદ્માના પ્રેમને પુનઃજીવન આપવાની ચાચના સાથે પોતાના પ્રેમની આહુતિ આપી છે. તે નહોટી જાણુતી કે આ ભરણ એ પદ્માના પ્રેમયજ્ઞમાં કમળાનું થયેલું ખલીદાન છે. તો પણ એક સખી તરીકે આ ખણરથી તેને હુઃખ થયું. બાદશાહની ઈતરાળ વચ્ચે આશ્વાસનનું એક બારણું ખંધ થયું તેટલું તો તેને જરૂર લાગ્યી આવ્યું. અને તેના ગુણું સમરણની ધૂનમાં નિદ્રા પણ આવી નહિ. લગભગ અર્ધરાત્રિ પસાર થવા છતાં તેની આંખો ન મળવાથી તે એઠી થઈ, ને દાસીને ખુમ ભારતાં કહ્યું “ જુલેખાં ! ”

દાસીઃ જુલેખાં ત્યાં પદ્માની પથારી નજીકજ ઐસી રહી હતી, તે ઓલી ઉડી. “ જી, એગમસાહેબા ! કેમ આપની નીંદ ઉડી ગઈ છે ? કંધ આજા હોય તો ફરમાવો. ”

“ બાદશાહ હજુરની સ્વારી મહેલમાં છે કે ? ” પદ્માએ પૂછ્યું.

“ નહિ, હુમણાંજ પહેરેળીરથી મેં જાણ્યું છે કે નામવર બાદશાહ હજુ મહેલમાં પધાર્યા નથી. ” દાસીએ ખુલાસો કર્યો.

પદ્મા પુનઃ પથારીમાં પડી-પડી વિચાર કરવા લાગ્યી. અનંત સત્તા અને વૈલબ્ય છતાં બાદશાહ જરૂર આજકાલ જીજ રહે છે. તેએ હમેશાં મારી રાત્રી સુધી, કે તેએ વાર આખી રાત્રી મહેલમાં પધારતા નથી, તો પણ મને નહિ મળી શકવામાં તેમને હોષ હેવો એ મારી ભુલ છે. મારે જેમ તેના સુખ વૈલબ્યમાં લાગ છે, તેમ તેમના હુઃખ કે ચિંતામાં પણ મારે લોગ આપવો

એ મારી કર્જ છે. તેઓ રાત્રી દિવસ ચિંતા વેઠીને સુખે નિદ્રા પણ ન હ્યે, અને હું શાંતિથી બેસી રહું, તો પછી મારો સ્વીધર્મ ચુકું છું. હું તેમની સહયરી સેવિકા કે અર્ધાંગના ત્યારેજ હોઈ શકું, કે તેમના સુખે સુખી, ને તેમના હુઃખે હુઃખી થતી હોડું. આજથી મારે તેમના આરામ વિનાનો આરામ નજીમો છે. હું તેમને પણ પડીને પણ તેમની ચિંતા જાણી લઈ, તેમનો ભાર ઓછો કરવામાં મારો પ્રાણ આપીશ, ત્યારેજ મને શાંતિ થશે.” આટલો વિચાર થતાં તે ઉઠીને કપડાં સમાં કરવા લાગી.

રાણીને એકાએક આમ તૈયારી કરતાં જોઈ જુલેખાં આશ્રમ પામી. અને ધુટણીએ પડી અરજ કરવા લાગી—“નામવર મહારાણી, અત્યારે અર્ધાંગનિઃ આ શી તૈયારી કરો છો ? આપ આરામ હ્યો. નહિતો સવારના તથીયત બગડી જશે. આપનું શરીર આટલું બધું ચિંતામાં સુકાઈ ગયું છે, તેમાં ઉનાગરા કરવાથી વધારે નુકશાન થવાનો લય રહે છે. માટે આપ સુઈ જાઓ, હું આપની ચરણુચંપી કરું છું.”

પદ્માએ કંઈ જવાબ આપ્યો નહિ, પરંતુ અત્યારે કૃયાં જવું, તેનહિ સુભવાથી પાછી પથારીમાં પડી. એટલે જુલેખાં તેની સારવાર કરવા લાગી; અને પંખો લઈને વાયુ ઢોળવા લાગી. શારીરિક અને માનસિક નિર્ભળતાને લીધે થોડીવારે રાણીની આંખો મિચાઈ, એટલે જુલેખાંએ તેના અંગપર એક શાલ ઓઢાડી દીધી.

પદ્માની આવી સ્થિતિ શાથી થવા પામી હતી તે ચતુર જુલેખાં જાણુતી હતી. તેથી તેણે પદ્માને સુવાડીને ખાદશાહુ આવી પહોંચ્યા છે કે કેમ તે બદ્લ પુનઃ એકવાર ખાત્રી કરી આવવાનો પોતાના મનમાં વિચાર કર્યો. કદાચ દૈવયોગ ખાદશાહુનો મેળાપ થાય તો પદ્માની પરિસ્થિતિ તેને સ્પષ્ટ કહી સંભગાવવાનો વિચાર પણ જુલેખાંએ કર્યો અને તેમ કરતાં ખાદશાહુ ગુસ્સે થાય તો સહુન કરવાનો નિશ્ચય કરીને, તેણી અકખરના ખાનગી દિવાનખાના તરફ જવા માટે નીકળી પડી.

ભરાખર આજ સમયે મહાલયના પ્રથમ દરવાજાપરની ચોકીપર કોઈ બોધ્યું. “ દ્વાર ઉધાડ. ”

“ કોણ ! ” પહેરેગીરે પુછ્યું.

“ હું, અકુખર ” ઉત્તર મળ્યો.

તરતજ દ્વાર ઉધાડવામાં આવ્યું. આ પ્રમાણે સધળી ચોકી વટાવીને બાદશાહ પોતાના ખાનગી ઓરડામાં આવી પહોંચ્યો. તેણે કપડાં ઉતારતાં પોતાના ઓરડા સામેના ઉધાનમાંના એક ઉંચા વૃક્ષ ઉપરથી કંઈ આકૃતિ સરીજતી જોઈ, પરંતુ આ મોડી રાત્રીને મિથ્યા ભ્રમ હુશે એમ માનીને અકુખરે તેને વિશેષ મહત્વ આપ્યું નહિ. અને કપડાં ફેરવીને પલંગપર જઈને બેઠો. તેવામાં તેની દૃષ્ટિ સ્વાભાવિકરીતે દ્વાર તરફ ગઈ, એટલે ત્યાં તેણે જુલેખાંને ઉલેલી જોઈને પુછ્યું “ કોણ ! જુલેખાં ? ”

“ લુ હુઝૂર ! ”

“ અત્યારે કેમ ? ”

“ નામવર, અમારાં હેગમસાહેખાની પ્રકૃતિ અસ્વસ્થ છે. અને તેઓ આપને મળવા આતુર છે. ”

“ હું આવતી કાલે સહુવારે આવીશ. ” બાદશાહે કુંકમાં પતાવ્યું.

“ પણ—” જુલેખાંએ કરી દલીલ કરવાનો પ્રયત્ન કર્યો.

“ અત્યારે મુને વિશ્રાન્તિની જરૂર છે. ” એટલું બોલીને બાદશાહે પોતાની દૃષ્ટિ તેના તરફથી ફેરવી. જુલેખાં વધારે બોલી શકી નહિ, પરંતુ બાદશાહ અત્યારે મહાલયમાં છે તે બાખતની પદ્ધાને સત્વર ખખર પહોંચાડવા ઝડપથી પાણી કરી. દરવાજ પાસે આવી પહોંચતાં તે એકાએક ચમકી. કાળા વસ્ત્રમાં લપેટાઓદી આકૃતિ તેણે મહેલના તરફ તાકી રહેલી જોઈ. પણ તે કદાચ ભુત હુશે એવી કદમ્પના કરીને તે ભયભીત થતી પડ્યાના ઓરડા તરફ ઢોડી ગઈ.

અકૃબર પલંગપર જઈને સૂતો તો ખરો; પરંતુ કુમણાના શરૂદો તેના સામે તરી આવ્યા. “ મહારા પ્રત્યેનો પ્રેમ-પ્રવાહુ પદ્મા તરફ વાળવાને હું પ્રાર્થના કરું છું ” એ કુમળાના વચનોનું સ્મરણું થતાં પદ્માની માંદગીના જુલેખાં અખર આપી ગઈ હુતી તે વાત તરફ ધ્યાન જેંચાયું; પણ પ્રેમના વિવિધ પ્રવાહમાં તણુંધુંને અનેક પ્રેમવ્યાપારમાં અકૃબરને આજદિન સુધીમાં જે નિરાશા થઈ હુતી તેથી તેની યાચનાને તેતુર્ત આદર આપવા જેટલો ઉત્સાહી થઈ શક્યો નહિ. વળી તેના મનમાં વિચાર આવ્યો કે:—“ જ્યારે હું પદ્મા પાસે પ્રેમ યાચના કરુંતો હતો, લારે તેણે દરકાર ન કરી. પરંતુ તે પછી તેના વર્તનમાં ફેરફાર તો થયોજ છે. તો પછી મારે તેની ભુલને શું વળગી રહેલું? નહિજ. તે સ્વી છે, તેથી અદ્યપજ ગણાય, એટલે મારે તેની કસુર માટે ક્ષમા આપવી જોઈએ. હજુ પણ હું તેને નિરાશ કરું તો કહાય તેની સ્વી બુદ્ધિની મુખ્યાંધમાં બીજી સ્વીહૃત્યાનું પાતક મહારા શિરપર રહ્યોછે. ‘‘ અહ્વા હો અકૃબર ! ’’ પદ્માના અપરાધ વિસરી જઈને તેને સુખી કરવી એવીજ અહ્વાની ધૂઢ્છા છે ! ત્યારે હું અત્યારેજ તેની પાસે જઈ; પરંતુ અત્યારે મધ્યરાત્રિ વીતી ગઈ છે. એ ત્રણ કલાકમાં તો પ્રાતઃકાલ થશે. માટે સહવારે જ જઈશ. ” આ પ્રમાણે વિચાર કરતાં આદશાહુને નિદ્રા આવી ગઈ.

જુલેખાંએ પદ્મા પાસે આવીને તેને જાયત કરી. અને આદશાહ મહાલયમાં પધાર્યાની બાતમી આપી. એટલે તે ડૂઢીને આદશાહના દિવાનખાના તરફ જવાને તૈયાર થઈ. જુલેખાંએ તેને તૈયાર થયેલી જોઈ કંપીત સ્વરે કહ્યું. “ બાઈ સાહેબ, તમે આ સમયે ન જાઓ તો ઠીક ”

“ કેમ ? ” જુલેખાં તરફ તાકી રહીને પદ્માએ આશ્વર્ય પામતાં પૂછ્યું.

“ મહુને એમજ લાગે છે કે તમે અત્યારે ત્યાં ન જાઓ
તો ઢીક. મહારા મનમાં અલદ્ર કદ્વપનાઓ થાય છે.”

“ પણ તું શું કહેવા માગે છે ? ”

“ હું જયારે આવતી હતી ત્યારે એક કાળા વસ્ત્રમાં
લપેટાએલી આકૃતિ મહેલ તરફ તાકી રહેલી મહેં જોઈ હતી.
હું તમને પગે લાગું છું કે તમે અત્યારે ત્યાં ન જાઓ. ભૂત-
પિશાચ—

“ પણ ગાંડી, અત્યારે હું નહિ જાઉ તો કરીને કયારે
મેળાપ થશો તે કંઈ નિશ્ચય છે ! આવી મળેલી તક ગુમાવવી
એ એક પ્રકારની મૂર્ખાઈ નહિ તો બીજું શું ? જુલેખાં, હું
પોતેજ અત્યારે ભૂત બની ગઈ છું તો પછી ભૂત મહુને શું કરી
શકનાર છે ”

આપણું ખોલતાં પદ્માનો કંઠ ઝંઘાઈ ગયો. જુલેખાં પણ
રડવા લાગી. જુલેખાંના ઉત્તરની રાહ નહિ જોતાં પદ્મા બાદ-
શાહુ પાસે જવા નીકળી પડી.

બાદશાહના એરડા પાસે પહોંચતાં તેણે કાળા વસ્ત્રમાં
છુપાએલ આકૃતિને બાદશાહના એરડામાં દાખલ થતાં જોઈ.
જુલેખાંએ ભૂતની કહેલી હકીકત તેને પુનઃ સાંભરી આવી.
તેનું ધૈર્ય ડગમગી ગયું. પરંતુ તે આકૃતિ ભૂતની હોય કે ગમે
તેની હોય, તો પણ તેને અર્ધ રાત્રિએ બાદશાહના એરડામાં
જવાનો શો હેતુ છે, તે જાણવાને દંડ નિશ્ચય કરી આગળ
ચાલી. મધ્યરાત્રિ વીતી ગઈ હોવાથી મહાલયમાંના ધણું ખરા
દીપકો ખૂજાઈ ગયા હતા. છતાં હિમતથી તે આગળ જતી હતી
તેવામાં તૈના પગમાં કંઈ અથડાયું. માર્ગમાં આ શું છે ?
તેની તેણે નીચી વળીને ખાત્રી કરી તો ત્યાં એક પહેરેગીરનું શાખ
પડયું હતું. પદ્માને આ કંઈ મહાન સંકટનો ચોગ છે તેમ
જણાયું. તુર્ત તેણે પહેરેગીર પઃસે પહેલી સમશેર પોતાના
હુથમાં લીધી, અને ધીમે પગલે તે ચુપકીદીથી બાદશાહના
શયનમંદિરના દ્વાર પાસે આવીને અંદર જોવા લાગી.

તેણે જોયું કે આ અંધારપીછેડીમાં છુપાએલ વ્યક્તિ ખાદશાહુ તરફ તાકીને જોઈ રહી હતી. અને ખાદશાહુ શાંત નિદ્રામાં પડ્યા હતા.

પદ્માચે સાવધથઈને પોતાના હાથમાંની સમશેર મજબુત પકડી. એટલામાં “મહારી નહાલી પદ્મા ! ઉલ્લી રહે ! આ હું આવ્યો ! ” એટલા શર્ષદો નિદ્રાધીન અકૃપરના મુખમાંથી નીકળી પડ્યા. આ શર્ષદો સાંલળીને પેલી છુપાએલી વ્યક્તિ ચમકી, પરંતુ પદ્માને તો તેથી બેવડું જોર મજયું. ખાદશાહુ સ્વસુષે પોતાના નામનો ઉચ્ચાર કર્યો એ તેને દૃષ્ટિભ્રમ સુમાન લાગ્યું. પોતાનું લાગ્ય આજે કંઈ ઓરજ જણાતું હતું એવી તેની ખાત્રી થઈ. પરંતુ પદ્મા આ પ્રમાણે વિચારે કરતી હતી એટલામાં તે વ્યક્તિએ પોતાનો જમણો હાથ ઉંચ્યા કર્યો. તેના જમણુા હાથમાં કટારી જોઈને પદ્મા કંઈ ઉઠી, પરંતુ તુર્ત સાવધાન થઈ પેલી વ્યક્તિ પોતાના હાથમાંની કટારી અકૃપરની છાતી તરફ લઈ જાય છે તે પહેલાં પાછળથી પદ્માચે તેના હાથ ઉપર પોતાની સમશેરનો ફૂટકો એવો તો સક્રાઇથી લગાવ્યો કે તે વ્યક્તિનો હાથ કટાર સાથે દુર જઈને પડ્યો. અને તેનો ખણુણણુટ થતાં ખાદશાહુ ચમકી ઉડ્યો. છુપાએલી વ્યક્તિને અણુને વખતે આ અણણ્યો ધા આવવાથી તે ગભરાઈ જવા છતાં કપાએલા હાથની વેદના ન ગણુકારતાં પાછું વાળી જોયું. એટલામાં તો પદ્માચે બીજુવાર પોતાની સમશેર ફૂરવીને તેના ખલા ઉપર એવો તો મજબુત ફૂટકો લગાવ્યો કે ‘હાય’ ના છીતકાર સાથે તે જમીનપર ફળી પડ્યો. અને તેજ ક્ષણે પદ્મા પણ લોહી તપી જવાથી એક ચીસ પાડીને મુર્છિત થઈ ગઈ.

અકૃપરે એકદમ ઉઠીને જોયું તો ત્યાં પદ્મા અને એક કાળાં વસ્ત્રમાં લપેટાએલ ઢેઢુને બેશુદ્ધ અવસ્થામાં જમીનપર પડેલાં જોયાં. અકૃપર આ દસ્ય જોઈને ગભરાયો. આનો મર્મ તેકળી શક્યો નહિ. પદ્માની પ્રકૃતિ અસ્વસ્થ ડેવાનું જુલેખાં એ

જણુંયું હતું, અને તે અત્યારે અહિં કયાંથી ? એવો પ્રેરન અકબરના મનમાં ઉદ્ભવ્યો. તે હમણાંજ આવી હાવી જોઈએ અને એશુદ્ધ થઈ પડેકી વ્યક્તિ સાથે તેણે અપાણ્ણી કરી હાવી જોઈએ, એવી તેના હૃથમાંની સમશેર પરથી ખાત્રી થઈ. એશુદ્ધ થઈ પડેકી વ્યક્તિ ઉંધી પડી હાવાથી તે ડેણુ હતી તે ઓળખી શકાય તેમ નહોટું. પરંતુ પોતે રાજમહાલયમાં પ્રવેશ કર્યો લ્યારે ને આકૃતિ ઉપરથી સરકતી તેણે જોઈ હતી તેજ આ હતી એવી અકબરની ખાત્રી થઈ.

અત્યારે વિચાર કરીને એસી રહેવાનો સમય નહોતો. હુર્ત તેણે પદ્મા પાસે જઈને તેને કયાં છન્ન થઈ હતી તે જેવા માંડયું. પદ્મા ચર્ચી પડી હતી. અકબરે તેના હૃથમાંની સમશેર લઈને ફૂર મૂકી અને તેના ભાલપ્રહેશપર ઝૂરકી રહેલો તેનો કેશકલાપ સમારીને વાયુ ઢોળવા લાગ્યો.

પદ્માની કાન ફોડી નાંએ તેથી ચીસ સાંભળીને રાજમહાલયમાંના કેટલાક માણુસો અકબરના ઓરડા પાસે ત્વરિત ગતિમાં આવી પહોંચ્યા. રાજ માનસીંગ અને બીરખલ પણ આ રાજમહાલયમાં જ રહેતા હતા. તેઓ બંને પણ પોતપોતાની સમશેરે હૃથમાં લઈને ઢોડી આવ્યા. તેમણે જોયું કે અકબરના ઓરડાના પ્રવેશદ્વાર પાસેનો ચોકીદાર શબ્દવત્ત પડેલો હતો. ઓરડામાં અકબર એશુદ્ધ અવસ્થામાં પડેકી પદ્માને વાયુ ઢોળતો હતો. અને અકબરના પલંગની નજીકમાં એક મૃતક દેહ પડ્યો હતો. બીરખલ આ દેહને સીધો કરતાં ચમકીને બોલ્યો, “ અમસીંહ ! ”

“ ણરાખર ! આતો અમરસિંહજ ! ” રાજ માનસીંગ પણ અમરસિંહ પડેલો હતો ત્યાં જઈને તેને ઓળખી કાઢતાં બોલ્યો.

અમરસિંહનું નામ સાંભળતાંની સાથેજ અકબરે પાછુ વાળીને જોયું અને આશ્ર્ય પામતાં પૂછ્યું.

“ ઓહો ! અમરસિંહ ? અજાન દ્વેષનો લોણ થઈ પડ્યો. જો પદ્મા ન હોત તો આજે હું તો કયારનોયે ખુદાના

દરખારમાં પહોંચી ગયો હોત. વાર્ડ, બીરખલ, અત્યારે તમે અમરસિંહના શબને અહિંથી ઉપડાવી ચોકીમાં રાખો. મુને અત્યારે થોડી વિશ્રાન્તિની જરૂર છે. ”

તરત જ માનસીંહ અને બીરખલ અમરસિંહના શબને ત્યાંથી ઉપડાવીને લઈ ગયા. લારપઢી બાદશાહ પદ્માના મુખપર ગુલાખજળનો છંટકાવ કરવા લાગ્યો. ગુલાખજળના સિંચનથી પદ્માને સહજ શાન્તિ વળી હોય એમ જણાયું. જો કે હજુ સુધી તેણે પોતાનાં નેત્રો ઉઘાડયાં નહોતાં તથાપિ તેના કપાળમાં કરચલીએ. પડી અને તેણે એક મંદ નિઃશાસ મૂક્યો.

“ પદ્મા, ન ગલરા. ” અકબર બોલ્યો.

પરંતુ પદ્માના મુખમાંથી ઉત્તર નજ મળ્યો. તેની મૂર્ચ્છા ગાઠ હોય તેમ તેને લાખ્યું. એટલે કુરીથી અકબર પવન ઢાળવા લાગ્યો. થોડીવાર પછી પદ્માના કપાળમાં પુનઃ કરચલીએ. પડી; કેટલીકવાર પછી તેણે નેત્રો ઉઘાડયાં અને તે અકબર પ્રત્યે તાકી રહી. પરંતુ હજુ તેણી શુદ્ધિમાં તો નહોતી જ. તેની દૃષ્ટિ અકબરને ઓળખી શકી હોય તેમ જણાયું નહિ.

“ હેવિ ! મુને ઓળખ્યો કે ? ” અકબરે પદ્માના કપાળ પર હાથ ફેરવતાં પૂછ્યું.

પદ્મા હવે શુદ્ધિમાં આવતી જતી હતી. અકબરના શાખદો સાંલળીને તે સહજ ચમકી અને તેના તરફ સૂક્ષમદસ્તિથી જોવા લાગી. પતિને ઓળખતાંની સાથેજ તેની આંખમાં ઝળળળીઓં ભરાઈ આવ્યાં. પરંતુ તેનામાં બોલવાની શક્તિ નહોતી.

“ હેવિ ! સ્વસ્થપણે ઉંધી જાઓ ! ” અકબર પદ્માનાં આશ્રુ લૂછતો બોલ્યો. પદ્માએ પોતાનાં નેત્રો મીચ્યાં.

કેટલીક વાર પછી પદ્માએ પુનઃ નેત્રો ઉઘાડતાં બાદશાહ તરફ જોઈને બોલી: “ નાથ ! હવે હું જીવવાની નથી ! ”

“ આવું હૃદયવેધક ન બોલ. તુને જખમ થયો નથી. મૂર્ચ્છા વળતાંજ આરામ જણાશો. ” અકબરે આખાસન આપ્યું.

“ જો આરામ આવશે તો હું છવીશ ત્યાં સુધી આપની સેવા કરીશ. પણ નાથ, મહુને લાગે છે કે હું મરણ પામીશ. મૃત્યુ પામતાં પહેલાં મહુને મહારા અપરાધ બદલ ક્ષમા મળે તો હું સુખેથી મરીશ. કદાચ આપને મહારા પર કંટાળો આવ્યો હશે, આપ મહુને ધિક્કરતા—”

“ આવું ઐલીને મહારા હૃદયને વધારે હું ખિત ન કર ! ” અકુભર વચેજ ઐલી ઉઠ્યો. “ ઓહાલી ભૂત કાળને વિસરી જા ! હવે તહારા અને મહારા હૃદયનું એકુય થાય એવો ધ્યાન આદેશજ છે. હેવિ, આજે તો મહુને પ્રાણુદાન આપીને તહેં મારી આંખો ઐલી નાંખી છે. એટલું જ નહિ, પરંતુ તહેં મારા પર અનંત ઉપકાર કર્યો છે. હવેથી આપણે લિન્ન રહી શકીશું નહિ. ”

એટલું ઐલીને બાદશાહ શાન્ત રહ્યો એટલે પદમા સંતોષપૂર્ણ સ્વરે ઐલી. “ હાશ ! હવે મહુને નિરાંત વળી. હવે હું સુખેથી મરીશ. આપની સેવા કરવાની મહારા અંતરમાં રહેલી ઈચ્છા આજે પાર પડી છે. આપના પ્રાણ અચ્યાવવાની ઉત્તમ તક મહુને ધર્શિવરે જ આપી ! ”

પદમાથી આગળ ઐલાયું નહિ. તેના ચક્ષુ અશુદ્ધી ભરાઈ આવ્યાં.

અકુભરે તેને સ્નેહાલિંગન આપીને કહ્યું “ પદમા ! તું અત્યારે નિદ્રા લે ! તારા મન અને શરીરને જે આધાત થયો છે તેને શાંત નિદ્રાના આશ્યાસનની જરૂર છે. ”

“ એ ખર્દું છે, નાથ ! પણ આપને અત્યાર સુધી આરામજ મળ્યો નથી. દિવસ રાત્રીના સતત પરિશ્રમથી આપને પણ આરામની તેટલીજ જરૂર છે. માટે આપ પદંગે પધારો, હું આપની સેવા કરી પાવન થાઉં ” એમ પદ્માએ પ્રાર્થના કરી.

“ નહિ, અત્યારે તેને આરામની જરૂર છે.” એમ કહી અકુભરે તેને પદંગમાં સુવાડી અને પોતે પણ નિદ્રામાં પડ્યો—



પ્રકૃતરણુ ૨૭ મું.

ચંપાની દીક્ષા.

પ્રાતઃકાળે અકૃબર પથારીમાંથી ઉઠ્યા પછી, પદ્મા તેમની આજ્ઞા લઈ પોતાના નિવાસસ્થાને ગઈ, તે પછી અકૃબરે બહાર આવી અમરસિંહના શખને દહુનક્કિયા કરવાને ફરમાયું. માનસિંહ અને ધીરખલ વગેરે અંગત અધિકારી વર્ગ ત્યાં હાજર હતો. અકૃબરે અમરસિંહનું શખ જોયું કે તુર્ત તેના મગજમાં ગઈ રાત્રિની ઘટના તાણ થઈ આવતાં તેણે બહાર જવાનું બંધ રાખ્યું, અને પોતાના એકાંતભુવન તરફ પાછા ફરતાં માનસિંહ તથા ધીરખલને ઉદેશીને કહ્યું. “આ શખની વ્યવસ્થા થઈ જવા પછી તમે અન્ને અખુલફરજલને યોલાવી મારી પાસે આવી જનો. હું તમારી સૈની રાહ જેતો એકાંતભુવનમાં એડો છું.”

અકૃબર આટલી આજ્ઞા કરીને એકાંતભુવનમાં આવી એડો એટલે તેની વિચારમાળા પુનઃ શરૂ થઈ. એકતરફથી તેને પદ્માની સેવા જેતાં આ તેમના સ્વલાવના અણુધાર્યાં ફેરફાર માટે બહુ આશ્ર્ય થયું, અને ધીણું તરફથી અમરસિંહના દોષ ન ગણુકારતાં બદલામાં સારી બંગાર અને માન આપવા છતાં તે આ રીતે પોતાનું જ ખુન કરવા આવ્યો, તેમાં કાંઈ લોડ લેદ હોવો જોઈએ, તેમ તેને લાગ્યું. અમરસિંહના આ વર્તનથી તેને એમ પણ થઈ આવ્યું કે કુમળાનો ગ્રેમ સંકુચિત થવામાં અને તેનું અચાનક મરણ થવામાં અમરસિંહનો કુમળાને થયેલો કરદો અનુભવ કારણબુલુત હોવો જોઈએ. આ કદમ્બનાથી તેને અમરસિંહ તરફ વિશેષ તિરસ્કાર છૂટ્યો. તે વિચાર કરવા મૂલ્યો કે—“ખુદાના દરખારમાં અદલ ઈન્સાર છે તે વાતની મનાવથી પુરેપુરી ખાત્રી થાય છે. અમરસિંહ ખુરે હાલ

મરણ પામ્યો તે તેની ખુરાઈની બદલેજ હોય તેમ ખુલું જણ્ણાય છે. સારી જહાનપર અધિકાર જમાવવામાં એજ ખુદાની કામત અને મહેરનોજ અહેસાન માનવો જોઈએ. જો એ અજબ શક્તિની મહેર ન હોત તો પણ તરફ મારી ધીત-રાળ છતાં તેને અત્રે મોડી રાત્રિએ પણ મારા મહેરે આવવાની ખુદ્ગિજ કેમ સુભત ? હીરળું મહારાજે કહું હતું કે ‘ કર અને જો ’ એજ કર્મનો ધન્સાક્ર છે, તે વાતમાં હવે મને લેશ પણ સંદેહ રહ્યો નથી. મેં પ્રાણુહિંસા બંધ કરવાનું કરમાંયું તેના બદલમાં મારા પ્રાણુનું રક્ષણ થયું તેમ માનવું શું એદું છે ! તેમની નેક સલાહનું આટળું ઝળ જોવા પછી મારે તેમને લુલી જવા જોઈએ નહિ. ”

અકુભર ગાઈ રાત્રિના બનાવ ઉપર આ પ્રમાણે અવનવા વિચાર કરી રહ્યો હતો તેટલામાં અખુલકુજલ, રાજ માનસિંહ અને ખીરખલ ત્યાં દાખલ થયા. તેઓએ ‘ અહ્વા હો અકુભર ’ કહીને કુરનસ બળવી. અકુભર, આ શરૂદો ડાને અથડાતાં સચેત થયો : અને તેમને સામેના : આસને એસવાને ધસારત કરતાં એલયો : —

“ અખુલકુજલ, આજે રાત્રીના મારા ઉધરથી ને આકૃત પણાર થધ છે એ વાત તમે રાજ માનસિંહ અને ખીરખલથી સાંલળી હશો. આ બનાવથી મને લેશ માત્ર પણ એદ થતો નથી. પરંતુ ખુદાની અજબ શક્તિ અને નેક ધન્સાક્રને માટે માન થાય છે. હીરળુસૂરિએ લાલાં કામો કરવાનું તેટલા માટે કહું હતું. તેમના કહેવા પ્રમાણે ખીજાના પ્રાણો બચાવતાં મારો પ્રાણ બચ્યો છે એમ મને લાગે છે. તેથી મારી ધચ્છા તેમને મળીને વધારે એધ સાંલળવાની અને તેમના ઉપકારના સમરણુમાં કંઈ સેવા ઉઠાવવાની થાય છે. આટલા માટે વિચાર કરવાને અત્યારે તમોને એલાયા છે તો કહે, તમારો તે સંબંધમાં શું અભિમાય છે ? ”



“ જહાંપનાહનું માનવું સુનાસિઅ છે ” અણુલક્ષજલે સહાતુભૂતિ દર્શાવતાં કહ્યું. “હેરવિજ્યસૂરીએ સાથેના મારા બહેણા સહવાસથી તેમની વાણીમાં પરોપદાર અને પવિત્રતાજ હું જોઈ રહ્યો છે. આવા મહાત્માની મુલાકાત અને સેવામાં પણ લાલજ છે. કમનસિએ આવો લ ભ હવે આપણને વધારે વખત નહિ મળે તેમ મને જણાયું છે. એટલે તે ખબર પણ—“શું ! સૂરિએના સમાગમનો લાલ વધારે વખત નહિ મળવાતું કંઈ કરશું છે ? ” અકુમરે અધિરાઠી વચેજ પુછયું.

“ અ, હા, હું આપનામવરને એજ વાત કહું છું કે સૂરિએ ગુજરાતમાંથી આ તરફ આવ્યાં લગભગ ત્રણ વર્ષ થવાથી તે તરફના લોકો તેમના દર્શન માટે તલસી રહ્યા છે. અને વખતો વખત ત્યાં પધારવાને કહેણું આવ્યા કરે છે, વળી સૂરિએ પણ એક વખત કહેતા હતા કે મારી ઉમર લગભગ વન વટાવી જવા આવી છે એટલે ગુજરાતમાં રહેલા મારા બહેણા સંમુદ્ધાયને ધર્મજ્ઞોત્ત્રનો ભાર સાંપવાને મારે વેળાસર જવું જોઈએ. ગાઈકાલનો તેમના વિદ્ધાન શિષ્ય વિજ્યસેનસૂરિનો સંદેશો આવતાં તેમણે તુર્તિમાં ગુજરાત તરફ જવાનો નિર્ણય મને વાતવાતમાં સંભાવી દીધેં હતો, એટલે આ વાત આપ નામવરની હજુરમાં હું આજે રોશન કરવાનો હતોજ. તેમકે આપે સૂરિ મહારાજને ‘ જગતગુરુનું પદ આપવા માટે જહેર દરભાર લરવા ઈચ્છા બતાવી હતી તે કામ તુર્તજ અમલમાં મુકવાને અનુકૂળ દિવસ મુકરર કરવાની આપની આજા લેવાની છે. જહાંપનાહની ઈચ્છા વિશેષ સત્કારની છે તો તે પણ આ પ્રસંગે અમલમાં મુકી શકાશે. તો આપનામવર જે આજા ઝરમાવશો તે પ્રમાણે વ્યવસ્થા કરીશ ” અણુલક્ષજલે ખુલાસે કર્યો.

“ આઠલી પક્વ ઉમરે સૂરિએ ગુજરાતમાં જવાની તસ્વી મૂર્ખાવે તે માટે આપણે નમૃતાથી સમજાવવાની જરૂર છે.

કેમકે તેમના સહવાસથી આપણી ધર્મસલામાં પણ બહુ તાત્ત્વિક લાલ થાય છે. ” બીરખલે જણુંયું.

“ તેઓશ્રી નિઃસ્પૃહિ હોવાથી આપણી માગણી સ્વીકારશે રોમ દઢતાથી માની શકાય નહિ. એટલે આપણે તેમની પકવ ઉમરે સેંકડો કેશ જવામાં તકલીફ ન પડે તે માટે પુરતી રથાસત અને આરામના સાધનો પુરાં પાડવાને છેવટનો વિચાર પણ કરી રાખવો જોઈએ. ” રાજ માનસિંહે પોતાનો વિચાર દશાંયો.

અકુખર, અખુલકુભલની વાત સાંભળી વિચારમાં પડી ગયો હતો. દરમિયાન બીરખલ અને માનસિંહના અભિપ્રાય જાણુતા તેણે કહ્યું. “ માનસિંહજી, તમને સ્ફુરણુના આચાર-વિચારનો શું અનુભવ નથી થયો કે, તેઓ શરીરના જતનના માટે આરામનું એક પણ સાધન વાપરવાની વિદ્ધ છે. હું એજ વિચાર કરી રહ્યો છું કે આટલી ઉમરે તેઓશ્રી ગુજરાત સુધી કેવી રીતે પહોંચી શકશે ? માટે આપણે એક વખત મુલાકાત લઈ આચાર્યશ્રીને અહીંના રોકાવા આગ્રહ કરવા જરૂર છે. તમે આવતી કાલેજ મુલાકાત કરવાનો વખત મુકરર કરી મને જણાવશો. અને પરમ દિવસ ‘ જગત શુરૂ ’ નું પછ આપવાનો જોહેર દરખાર કરવાને તમે સાથે મળીનેજ ગોડવણું કરશો. ” અકુખરે હુકમો કર્યાના વિચારમાં કહ્યું.

“ જેવી આજા ” ત્રણે એક સામટાં એલી ઉઠયા.

અકુખરે તેમને સોંપેલ કાર્યની વ્યવસ્થા કરીને અખર આપવાનું જણાવી રજા આપી, પરંતુ હીરજીસૂરિ ગુજરાત તરફ જવાના છે, તે અખરથી તેને રોકી રાખવાના વિચારમાંજ તે વિચાર કરતો એસી રહ્યો.

*

*

*

*

પદ્મા જો કે સવારના ઉઠીને પોતાના આવાસે ગઈ હતી પરંતુ તેનું મન ત્યાં સ્થિર થઇ શક્યું નહિ. રે

અણુલકુગલ વગેરે મુસહી વર્ગ અકબર પાસેથી ખહાર નીકળ્યો. એટલે તુર્ત તે અકબરના એકાંતભૂવનમાં દ્વાપર થઈ અને નામ ભાવે બોલી—“ નાથ, આવી રીતે આપ ઉદાસ ઐજી રહ્યા છો તે જેઠ મેં આપની પાસે વગર પરવાનગીએ આવવાનો અવિવેક કર્યો છે તે માટે ક્ષમા માશુ છું. ગાંધ રાત્રીના ખનાવરાં કંઈ ઉદાસ બની બેસવા જેવું નથી. ઉલટો ખુદાની મહેર માટે આજે આનંદમહેતસવમાં હિવસ પસાર કરવો જેઠાં. તેને બદલે આપ ઉદાસ ઐસી રહીને શું ચિંતા કરી રહ્યા છો, તે જાણવાને હું આતુર છું.”

“ હુલી તારાં અહેસાન અને અંતઃકરણની લાગણી જેતાં રાજમહાલયના ડોાં લાગમાં મારી સુલાકાત કરવાને તારે રજાનો. વિવેક દર્શાવવાની જરૂર નથી. ગાંધ રાત્રીએ તેં બતાવેલી શક્તિ અને હિભેત ક્ષત્રી તેજનું બરાબર લાન કરાવી શક્યાં છે. તારા એ ઉપકારના સમરણુમાં આજનો હિવસ મહેતસવ તરીકે ઉજવાય તે માટે હું જરૂર હુમણુજ હુકમ કાઢીશ. એજાં અગત્યના કાર્યમાં હું અત્યારસુધી તારી ખબર કાઢી શક્યો નથી, તે માટે હીલગીર છું. કહે પદમા, તારી તથીયત તો હુવે સ્વર્ણ છે ને ? ” અકબરે એટલોં ખુલાસો કરતાં લાગણીભર્યો પ્રશ્ન કર્યો.

“ પ્રભુ, મને તો લેશ માત્ર ઈજા થઈ નહોતી એટલે મારા આરામ માટે આપને ચિંતા કરવા જેવું રહેતું નથી. પરંતુ આપ ઉદાસ હેખાએ છો તેની મને ચિંતા થાય છે તો મારી એ ચિંતા ફર કરવાને આપની ઉદાસિનતાનું કારણ જણ્યાવશો તો કૃપા થશો..” પદમાએ પુનઃ એજ પ્રશ્ન કર્યો.

“ પદ્મા, તારા જેવી સફગુણી ઐગમના સહવાસમાં મને ચિંતાનું કશું કારણ હોયજ નહિ. હું તો ઇકત્ત સ્વીરજુસ્સુરિ ગુજરાતમાં પાછા ચાલ્યા જવાના છે તેવા ખબર મળવાથી તેમના વિશેગની કહેપના થતાં ઉદાસ થઈ રહ્યો છું. માટે તમે ચિંતા ન કરતાં સુખેથી આરામ હોયો.” અકબરે મૂલ્યસો કર્યો.

“ નાથ, મારો આરામ આપના આરામમાંજ રહેલો છે. હીરળસુરિ ગુજરાત તરફ જવાના છે એ ખખરથી એવા સંત પુરુષનો લાભ ઓવા માટે ઉદાહરીન થવાય તે સ્વાભાવિક છે. જોકે એવા વિરાગીઓને આપણે હુમેશાં રોકી શકીયે તે અસંભવિત છે પરંતુ હશુ અહીં થાડો વધારે વખત રોકી રાખીને આપની હચ્છા વિશેષ લાભ મેળવવાની હોય તો તેમ હું કરી શકીશ, એમ મારું માનવું છે.” પદ્માએ હિમત આપી.

“ વાહ, પંજા, તું ખરેખર કોઈ અજબ દેવાંગના છે. પરંતુ આ મહાપુરુષ પાસે તારી શક્તિ નક્કામી છે. જે મહાતમા જગતની કોઈ પણ મોહળાઈથી ક્રસાયા નથી કે કોઈ પણ લાલચમાં લપટાયા નથી તેમજ કંચન-કામનિથી તો તદ્દૂન વિરક્ત છે, તેના પાસે તારી બુદ્ધિ શું કામની ? ” અકાગરે નિરાશાનું કારણું હર્ષાંયું.

“ નાથ, સૂરિજુના સહાયણે અને આચારધર્મને હું જાણું છું, છતાં તેમને થાડો વખત રોકી શકાય તેવી મારી પાસે ચાવી છે તેમ આપ હુકીકત જાણુશો લારે કખુલજ કરશો. ” પદ્માએ પિષ્ટપેષણું કરી વાતમાં આકંક્ષા ઉત્પજ્ઞ કરી.

“ પદ્મા, જે તારી પાસે એવી ચાવી હોય તો જલદી મને બતાવ, તારી બુદ્ધિમાં મને શ્રદ્ધા છે. એલ જલદી કહી હે. ” અકાગરે અધિરાઇથી પુછ્યું.

“ જહાંપનાહ, વાત સાહી અને આપની દિલ્લિ મર્યાદામાં હોવાં છતાં આમ અધિરાઇ કેમ બતાવો છો ? આપે માની લીધેલી પુત્રી ચંપાહેવી સંસાર છોકી આર્યો થવા માગે છે તે શું આપ જાણુત્તા નથી ? ” પદ્માએ ખુલાસો કર્યો.

“ હા, ચંપાહેવી પહેલેથી કોઈ યોગીની જેવી હતી. નાનપણુંજ તેણે છ મહીના સુધી એક સામટાં રાત્રી દિવસનાં રોજ (ઉપનાસ) કર્યા હતા. અને લગ્ન કરવા પછી પણ ઝુદાની બંદગીમાં ઘણો વખત કાઢે છે. તેવામાં વળી કમળાનું અચાનક મરણ થતાં તેને બહુ દુઃખ થઈ ગયું. ”

હુમેશાં ઉદાસ રહેછે અને આ સંસારની સગાઈ-સંખંધને છોડી દેવાને હુઠ કરી રહી છે. તે વાત હું જાણું છું પણ તે વાતનું અત્યારે શું કામ છે ? સુરિજીને રોકી રાખવાની ચાવીને બદલે ચંપાની વાતને શું સખંધ છે.” અકુભરે મધુર ટકોર કરી.

“ જ્હાલા, આટલી વાત કરવા છતાં આપ હજુ ચાવી જોઈ શક્યા નથી તે કેવું આશ્ર્ય ! જુઓ, ચંપા રહેનને સંસારથી છુટા થવાનું છે અને આચાર્યશ્રી સંસારથી છુટી જે માર્ગ ઉલા છે તે માર્ગ જવું છે એટલે જે આચાર્યશ્રીને ચંપા ઐનના ગુરુ થવાને આશ્રહ કરીએ તો તેમનાથી એક ધર્મને માર્ગ ચાલતા આત્માને રજુણો રહેવા દઈ ચાલ્યું જવાય નહિ. કહો, આ વાતમાં આપનો શું ભત છે ? ” પદ્માએ પૂછ્યું. “ વાહ, એગમ સાહેણા તમે તે ખુણ ચાતુરી દર્શાવી, થોડા દિવસ પહેલાં ચંપાહેવીનો પીતા થાનસિંહજી મને કહેતો હતો કે ચંપા પેઠે મારા દરખારમાં રહેલા જૈતાશાહ પણ સંસારના રાગથી છુટીને સાધુ થવા માર્ગ છે. તો આ કાર્ય માટે આચાર્યશ્રીને જરૂર રોકી શકાશે. ધર્મના લાભના કારણે રોકાવામાં તેમનાથી ના કહી શકાશે નહિ તે વાત બરાબર છે.” અકુભરે આનંદ દર્શાવતાં કહ્યું. એટલું જ નહિ પરંતુ તુહુર્ જૈતાશાહ, થાનસિંહ અને ચંપાને બોલાવવાને માણુસો મોકદી દીધાં.

* * * * *

જૈતાશાહ, થાનસિંહ તથા ચંપા રાજમહાલયમાં આવ્યાં ત્યારે પણ અકુભર એકાંતલૂષનમાં ઐસી પદ્મા સાથે વાતો કરી રહ્યો હતો. પેતાની આવી સુલાકાતના પ્રસંગે જનાનાને હાજર રહેવાનો અત્યાર સુધી પ્રસંગ અન્યો નહોતો, પરંતુ આજે તે પદ્માની લાગણી—શૈર્ય અને ખુદ્ધિના પ્રસંગમાં એટલો તો આપ્રીન ખની ગયો હતો, કે તેણે પદ્માને રજા મૂર્ચપવાનું ફરસ્તા ધાર્યું નહિ.

ચોપહાર દ્વારા રજા મેળવીને સધળા અંદર દાખલ થયાં અને કુરનસ બનવી ઉભાં એટલે અકખરે તેમને એસવાને ઇસારત કરી. ચંપાએ ત્યાં પેસતાંજ પડ્ગાને અકખર પાસે ઉલેલી જોઈ, એટલે તેને આશ્રી થયું, અને જાણે પડ્ગાની લુત માટે તેને મુખારકબાદી હેતી હોય તેમ નેત્રસંકેતથી હું જાહેર કરી નાંખ્યો, અને પડ્ગાએ પણ તે હુંના સંદેશાને મંદ હુસ્ય કરતાં વધાવી લીધો.

સધળાએ પોતાની બેઠક લીધા બાદ અકખરે વાતની શરૂઆત કરતા કહ્યું “જૈતાશાહ, રાજસભામાં તમારું સારું માન છે. અને સર્વ વાતે સુઅ૰ી છો, છતાં તમે સંસારથી છુટા પડી ઝડીરી લેવા માગો છો તેમ થાનસિંહ કહેતા હતા, એ વાત શું સત્ય છે ? ”

“ જહાંપનાહ, આપની હંજુરમાં ખોટા ખખર કોણું આપી શકે ? થાનસિંહ શેઠે આપને જે કહ્યું છે તે ખરું છે.” જૈતાશાહ દુંકમાં ઝુલાસો કર્યો.

“ પણ એમ કરવાનું કંઈ કારણું ? તમને એવું શું હુઃણ છે કે જેથી તમે આટલો અધિકાર છોડીને ઝડીર થવા ચાહો છો ? ” અકખરે ઉડા ઉત્તરતાં પૂછ્યું.

“ સારા ભારતના સરદારની કૃપા છે ત્યાં મને કોઈ વાતની જથુપ છે તેમ કહેવાયજ નહિ. પરંતુ હું આ સધળું છોડવા માગું છું,” તેનું કારણ એજ છે કે હું સરદારના પણ સરદારની નોકરીમાં જોડાવા માગું છું. જૈતાશાહ જણાયું.

“ જૈતાશાહ, તમે વધારે લાલચથી અકખરનો પણ સરદાર શોધવામાં લુચ્યા હો તેમ મને લાગે છે. થાનસિંહે તો તમે ઝડીરી દેખાના છો તેમ કહ્યું હતું. પણ જે તમારે સારી નોકરી માટેજ છુટા થવું હોયતો તમારા કામથી હું, પસંદ છું માટે કહેશો તો સરદારી, સુષેદારી, કે જમીનદારી, કે જે તમને ધ્યાચા હુશે તે આપીશ. કહો શું જોઈએ છે ? ” અકખરે સુઅશાંકા આપતાં કહ્યું.

“ ખુદાવિંદ, હું જે નોકરી કરવા ઈચ્છું છું તે કોઈ દેશના બાદશાહની નહિ, પણ તે સારી જહાનમનો માલેક છે. જેને આપ ખુદા કહેણો, કોઈ પ્રભુ કહે છે અને હું તેમને ‘આરિહંત’ ના નામથી ઓળખું છું. આ નોકરીમાં જમીન, પૈસો કે સત્તા મેળવવાની નથો, પરંતુ તેને છોડીને આત્માને સ્વતંત્ર કરવાના છે. કેમકે જમીન, પૈસો વા સત્તા એ સર્વે માયા બધન છે; એટલે તે બધનમાંથી મુક્ત થવું એજ સાધુ સ્થિતિ છે. ” જૈતાશાહે ખુલાસો કર્યો.

“ હું, કહોને કે હીરળુસૂરિના જેવા તમે પણ ક્રક્કીર થવા માગો છો; વાર્ષ, તેતો ઠીક, પરંતુ હીરળુસૂરિ મહારાજ તો ગુજરાતમાં જવાના છે, ત્યારે તમે ક્રક્કીરી કેાના પાસેથી શીખશો ? ” અકબરે નવો પ્રશ્ન કર્યો.

“ આપે એ વાત કરી મને ઠીક સાવચેત કર્યો છે. મારે સાધુ થવાના સમયને હળુ ત્રણુ માસનો વિલંબ થશે તો તેટલો વખત તેઓશ્રીને અહીં રોકાઈ જવા હું વિનંતી કરીશ. કેમકે મારી સાથે ચંપા બહેન પણ આર્યા થવાના છે. ” જૈતાશાહે જણાવ્યું.

“ ચંપા બહેન, કેમ તમે પણ સંસારથી છુટા પડી જવા માગો છો ! લારે વિજયનું શું થશે ? તે તમને રજ આપશે કે ! ” અકબરે ચંપાને આતુરતાથી પૂછ્યું.

“ ખુદાવિંદ, કમળા બહેન એકાએક શુજરી ગયા તે જેવા છતાં ખોટા મોહમાં હવે હું ક્રસી રહેવા રાજ નથી. મારા પતિહેવ પણ આ જનાવથી સંસારની અસારતા સમજ ગયા છે અને તેથી તેઓ પણ સંસારથી વિરક્ત થવા ધારે છે.” ચંપાએ નીચું લેઇ નમ્રતાથી ખુલાસો કર્યો. ●

“ આક્રીન ! બેટી ચંપા, તારા ધર્મગ્રેમને માટે મને બહુ આનંદ થાય છે. તારા જેવડી ખાળકી ખુદાને આટલી હુદે આપ્યી જય અને પોતાના પતિને પણ તે માર્ગ ગ્રેમથી સાથે મૂક્યું.

લઈ જાય તે કંઈ ઓછી તાંજુખી નથી. ચંપા, તું ખરેખરી દેવી છે. ” અકખરે ચંપા પ્રત્યે લાગણી દર્શાવી.

આચાર્યશ્રીને થોડો વધારે વખત રોકી રાખવાનો ભાર હુવે જૈતાશાહુ તથા થાનસિંહને સોંપી દેવાનું અકખરે ટીક ધાર્યું રાને તેથી હુમણુજ આચાર્યશ્રી પાસે જઈને તે નિશ્ચય કરી દેવાનું જણાવી સૈને રજ આપી.

પદ્મા, ચંપાને દરવાજા સુધી વળાવવા ગઈ, ને ત્યાં ગઈ રાત્રીને ઈતિહાસ કુંકમાં કહીને એ સર્વ સાતુકુળતા માટે પરસ્પર હર્ષિત થઈ છુટા પડ્યા.



ગુરુરાજ ૨૮ મું.

સૂર્ય-સેવા.

અખુલકુજલ, અકુખરની આજા પ્રમાણે ખપોરના આચાર્ય શ્રી પાસે ગયો, ત્યારે જૈતાશાહુ તથા થાનસિંહ લાં આવી પહોંચ્યા હતા. અને સૂરિલુને રોકવાને અરજ કરતા હતા. એટલે અખુલકુજલ આ વાત સાંભળીને ખુશી થયો. તેને લાગ્યું કે નામવર બાદશાહ સૂરિલુને રોકવાને અરજ કરવા ચાહે છે, એ હેતુ પાર પાડવામાં આ પ્રસંગ ખરાખર અનુકૂળ થઈ પડશે તેમ ધારી ચાલતી વાતમાં તેણે દ્વખલળીરી કરતાં કહ્યું. “ મહારાજ, જૈતાશાહુ તથા ચંપાહેવી અને તેના પતિ જયારે આપના ચરણે આવવા માગે છે, ત્યારે આપે તેમને આદર આપવો એ પહેલી કુરજ છે. આપને ગુજરાતમાં જઈને પણ ધર્મની સેવા કરવાની છે, તો તેવાં સેવાના કાર્ય માટે સેવકોની વૃદ્ધિ થ● તેમાં આપે ખુશીથી રોકવું જોઈએ. નામવર શાનશાહુ આપને રોકવાને આતુર છે અને તેફલા માટે આપને મળવાનો સમય નકી કરવા હું આવ્યો છું. તો કુપા કરી જૈતાશાહના ઉત્સાહને માન આપી થોડો વખત રોકાઈ જવ નિર્ણય કરશો તેમ મારી પણ વિનંતી છે.”

અત્યાર સુધીમાં આ વાત ઉપર બહુ ચર્ચા થઈ ચુકી હતી. અને વિચાર કરતાં આ નવા ભાવીકોને દીક્ષા આપવા રોકાવું તેમાં વધારે લાભ છે તેમ આચાર્યશ્રી નેહ શક્યા હતા. તેથી વધારે ચર્ચામાં ન ઉત્તરતાં તેમણે દીક્ષામહોત્સવ સુધી રોકાવાને પોતાનો નિર્ણય જહેર કર્યો. અને તે માટે મુહૂર્તો નજી કરી આપ્યા.

અખુલક્ષ્યલે તે પછી બાદશાહને મળવાનો અવકાશ જાણવા માટે પુનઃ પુછતાં સૂરિજીએ : હું—“ શાનશાહ અકૃતિનો ધર્મપ્રેમ નેહ મને બહુ આનંદ થયો છે. તેમના ક્રેવા નિર્મણ હૃદયના બાદશાહને ધર્મ—ઉપદેશ સંભળાવવો તે મોટા લાભનું કારણ છે. માટે કાલે સવારમાં આપણે તેમના મહાલયેજ જઈશું.”

અખુલક્ષ્યલે આ ખખર બાદશાહને સાંજના પહેંચાડી દીધાં અને ભીજે દિવસે સવારના અખુલક્ષ્યલ, સૂરિજીને બોલાવીને રાજમહાલયે પહેંચ્યો. તે સમયે અકૃતિ તેમની રાહુ બેઇને અંથાલયમાં એઠા હુતો. પહેરેગીરે તેમને સૂરિજી તથા અખુલક્ષ્યલ આવી પહેંચવાના ખખર આપતાં તે દરવાજા સુધી સામે ગયો. અને માનપૂર્વક અંથાલયમાં પધારવા કહું. સૂરિજી તથા તેની સાથે આવેલ એ શિષ્યો પોત પોતાની ચાદર પાથરી એડા અને બાદશાહ તથા અખુલક્ષ્યલ સામેના સાદા આસને એસી ગયાં. એટાં અખુલ—ક્ષ્યલે વાતની શરૂઆત કરતાં કહું. “ જહાંપનાહ, આપણા શહેરમાં જૈતાશાહ, વિજયકુમાર તથા ચંપાદેવી, સૂરિજી મહારાજ પાસે દિક્ષા ક્રેવાનાં છે, તેથી આચાર્યશ્રી હાત ત્રણ માસ અહોજ સ્થિરવાસ કરવા કણુલ થયા છે. એ ખખર આપની સેવામાં રોશન કરવા રજા લઈ છું. ”

“ વાહ, વાહ, બહુ ખુશ ખખર. આચાર્યશ્રીના વિશેષ રહેવાથી આપણને બહુ લાભ થશે. ” અકૃતિ અખુલક્ષ્યલના ખખરને વધાવી લેતાં કહું, અને પછી આચાર્યશ્રી તરફ ક્રીને ઝૂયું. “ સૂરિમહારાજ, ત્રણ માસ પછી શું આપ ગુજરાત જવા ધારે છો? ”

“ રાજન, મને આ તરફ આપવાને ત્રણુ વર્ષ થવા આવ્યાં છે; એટલે મારે હવે અહીં રોકાઈ રહેવું નહિ જોઈએ; પરંતુ અખુલકુંડાને જણાયું તેમ દીક્ષામહેઠાત્સવના કારણે હજુ ત્રણેક માસ અહીં સ્થિરતા થશે. ” સૂરિનું ખુલાસો થડ્યે.

“ પરંતુ આપન આટલી ઉમમરે ગુજરાત સુધી પહેં. ચવામાં બહુ તકલીફ પડશે; માટે અહીંજ રોકાઈને ત્યાં ભીજા ક્રેદિને મોકલી આપો તો કેમ? ” અકબરે આતુરતાથી પૂછ્યું.

“ નહિ, રાજન, અમારાથી એક સ્થળે વધારે સ્થિરવાસ કરી શકાય નહિ. વળી અમને ક્ષણુભાગ શરીરની આળ પંપાણની જરૂર નહિ હોબાથી વિહારમાં તકલીફ રહેતી નથી.” દુરવિજયજીસૂરિને ખુલાસો કર્યો.

“ મહારાજ આપને તકલીફનો ભય નહોય, પરંતુ અમેને તો ચિંતાજ રહે. તેમજ આપ અહીંથી પધારો એટલે મને જે ધર્મનો ખોધ મળે છે તે પણ બંધ પડી જય; માટે આપને અહીંજ રોકાઈ રહેવા મારી વિનંતિ છે. ”

આચાર્યશ્રી બાદશાહને જવાબ આપે તે પહેલાં વચ્ચે અખુલકુંડાન ઓલી ઉઠ્યો—“ સૂરિનું મહારાજ, આજકાલ આપના સમાગમથી નામવર હજુરને બહુ આનંદ મળે છે. તેમજ તેમના વિચાર દ્વારા ધર્મ તરફ વધતા જાય છે. કેટલાક દોકો તો નામવર શાનશાહને ‘નૈન’ સિદ્ધાંતના અનુયાયી * રીકે ઓળખે છે તો પછી આપને અતે રોકાવું વધારે લાલકારક છે. ”

“ શેખ મહાશય, તમારું કથન સત્ય છે, પરંતુ હું તો જગતમાં જ્યાં દ્વારા, સત્ય, પ્રમાણિકતા, અધ્રાહ અને મનોનિશ્ચિહ્ન જોઉં છું, ત્યાં જૈનત્વજ સમજુ છું. છતાં

* ડે. રમીથકૃત ‘અકબર’ માં પોર્ટર્ગીજ પાદરી ‘પિનહરો’ નો પત્ર પ્રકટ થયો છે. તેમાં લખ્યું છે કે ‘He Follows the seat of the jains અર્થાત અકબર નૈન સિદ્ધાંતનો અનુયાયી

સાઓટના ધર્મપ્રેમને પોષવાને મારા શિષ્ય શાંતિચંદ્રજીને અહોં સુકૃતો જઈશ, ને બનતાસુધી ગુજરાતમાં જવા પછી મારા ખટધર શિષ્ય વિજ્યસેનસૂરિને પણ બનશે તો આ તરફ મોકલવાનું કરીશ ” આટલો ખુલાસો અખુલકુલને કરવા પછી આચાર્યશ્રીએ અકૃષ્ણને કહ્યું. “ રાજન, આ વાતથી આપને પણ સંતોષ થશે અને હોલ ત્રણ માસ જેટલો વખત અત્રે રહેવાનું બનશે તે દરમિયાન વિશેષ ધર્મ-ચર્ચા થશે; એટલે હવે આપ વિશેષ આથડુ છોડી દેશો તેમ હુચ્છુ ‘છું.’ ”

અકૃષ્ણરે આ ગોઠવણુથી સંતોષ પામતાં અખુલકુલને પૂછ્યું. “ પણ વાર્દ અખુલકુલ, આવતી કાલે સૂરિ મહારાજને ‘જગદ ગુરુ’ નું પદ આપવાનો દરખાર ભરવા માટે સધળી તૈયારી થઈ છે કે ? ”

“ અ, હા. ગધ રાત્રે રાજ માનસિંહ તેમજ ખીરખલ મને મહ્યા હતા ત્યારે તેઓ તે માટે તૈયારીમાંજ છે તેમ કહેતા હતા.” અખુલકુલે ખુલાસો કર્યો.

“ મહારાજ, આવતી કાલે સવારના આગાના અનેક શુણુનો પ્રભને પરીચય કરાવવા દરખાર ભરવાનો છે, તેમાં આપના શિષ્યનું દંડ સાથે વેળાસર પદારવા કૂપા કરશો.” અકૃષ્ણરે સૂરિનું આમંગણુ કરતાં કહ્યું.

“ રાજન, તમે મારા પ્રત્યેના પ્રેમથી મને જે માન આપવા ધારો છો તે માટે હું લાયક નથી. જગત પ્રત્યે મૈત્રી-ભાવના રાખીને પ્રાણી માત્રનું હિત દિનિંદ્રાનું તે અમારો કર્તાંબ ધર્મ છે; પણ તેથી આપ જે માન આપવાની વાત કરો છો તે અમારી કુરજમાં અલિમાનનું ખીજ રોપજનેવું છે. આવા માનથી મોહ, ભમત્વ અને હું પદ વધવાનો સંભવ રહ્યે છે; માટે આ વિચારને બંધ રાખવા મારો આથડુ છે.”

વિજ્યસૂરિએ દરખાર ભરવાની હકીકિત જાણી કહ્યું.

“મહારાજ, આપનું માનવું સામાન્ય પ્રાણી માટે સાચું માની શકાય, પરંતુ આપ જેવા સમતાના સાગર માટે એવી અનેક નહીંયો આવી મળે તો પણ આવી લીતિનો સંભવ રહેતો નથી. એટલે તે બાબતમાં આપને આચ્છા કરવા જેવું લાગતું નથી. આ પ્રસંગે આપને તસ્વી આપવાનો મારો હેતુ તો જુદોજ છે.” અકખરે જવાબ આપતાં નવી વાત ઉપાડી.

“કહો ખુશીથી કહો, જીનગોષ્ઠી કરવી એ અમારું કર્તવ્ય છે.” સૂરિન્ધરે જણાવ્યું.

“મહારાજ, આપને તસ્વી આપવાનો મારો હેતુ આપને અતે હુમેશના માટે રોકી રાખવાને આચ્છા કરવાનો હતો, પરંતુ તે માટે આપે ખુલાસો કરી નાખ્યો છે; તો હવે મારી એક અભિલાષા તૃપ્ત કરશો તો મને સંતોષ થશો.” અકખરે નવી માગણી કરવાની ઈચ્છા દર્શાવી.

“રાજન, અમારા આચારને ખાંધ ન આવે તેવું કોઈ પણ સેવાનું કાર્ય કરવાને હું સહા તમરજ છું; આપને માટે તેમાં શાંકા ન લાવતા ખુશીથી કહો.” સૂરિનું જણાવ્યું.

“સૂરિ મહારાજ, આપે મને ધર્મબોધ આપીને અનેક ઉપકારો કર્યો છે. હવે જ્યારે આપ ગુજરાત તરફ જવાનો નિશ્ચય ફેરવી શકતા નથી, તો મને કંઈ એવી સેવા કર્મભાવો કે જેથી મારી ઈચ્છા તૃપ્ત થાય અને આપના સમાગમનું હુમેશાં સ્મરણ રહી શકે.” અકખરે માગણી કરી.

“રાજન, તમે પ્રાણીરક્ષાનાં તથા મનુષ્ય પ્રત્યેની સુરક્ષા વધારનારાં ને જે કાર્યો કરી રહ્યા છો તેથી મને સંતોષ થાય છે. તમારી આ સેવા કંઈ એવી નથી કે જેથી હવે મને કંઈ વિશેષ ઉહેવાનું રહેતું હોય. છતાં તમારી ઈચ્છાને વધારે આદર મળે તે માટે બને તો તિર્થોનું રક્ષણ કરવા હું બલામણ કરું છું.” આચાર્યશ્રીએ માર્ગ દર્શાવ્યો.

“ મહારાજ, આપની ભલામણુને હું શીરે ચઢાવું છું. હવે જો આપ મારી હકુમતમાં જૈન ધર્મનાં એવાં કયા કયા તિર્થી આવેલા છે તે જણાવશો તો ઉપકાર થશે” અકબરે પૂછ્યું.

“ રાજન, તમારી હકુમતમાં જૈન ધર્મના ઘણું તિર્થી છે. તેમાં પુંડરીક (સિદ્ધાચળ), તારંગા, આખૂ, કેસરીયાળ, રાજગૃહીના પણડો અને સમ્મેતશિખર વગેરે વધારે પ્રસિદ્ધ છે.” હિરવિજયલસૂરિએ ખુલાસો કર્યો.

સૂરિમહારાજ, આ તિર્થીના રક્ષણુ માટે હું જરૂર મારાથી અનતું કરીથ, પરંતુ મને હજી એક વાત જણાવાની હિચળ છે કે આવાં તિર્થીમાં ચાત્રાચે જનાર લોકોને રાજ તરફથી કંઈ ખાસ મુશ્કેલી તો પડતી નથી કે ? ” અકબરે વધારે હુકીકત જણાવા માણી.

“ રાજન, ચાત્રિકોની મુશ્કેલીને અનુભવ અમને પુરે કયાંથી હોય ? પરંતુ કોઈ કોઈ સ્થળે ચાત્રિકોને કરના નામે ત્રાસ લોગવવો પડે છે, તેમ મેં જાણ્યું છે.”

“ ઓહ ! પ્રલુના દરખારમાં જનાર પાસેથી કર લેવો તે તો જળ્યાવેરા કરતાં પણ વધારે જુદમની વાત છે. આ વાતથી આપે મને વાકેક કર્યો તે બહુ ટીક થયું છે.” અકબરે સૂરિનું ઉહેશીને આટલું કહ્યા પછી અખુલકુલને જણાયું. “ અખુલકુલ, કાલે દરખાર પ્રસંગે આ તિર્થીના રક્ષણુનો ખરીતો પણ સાથે સાથે આપવા અને સુંડકાનો કર કોઈ સ્થળે લેવાતો હોય તો બંધ કરવા હું જરૂર ધારું છું; માટે તમે બપોરના આવજો. અત્યારેતો બહુ મોડું થયું છે, માટે આચાર્યશ્રીને તેમના ઉતારે મુકી આવો. અને કાલે સવારના દરખારમાં સાથે તેડી લાવવાનો લાર તમારા શીરે છે તે લુકી જશો નહિં.”

ધીજે દીવસે ખાસ દરખારમાં આચાર્ય શ્રી હિરવિજયસૂરુ ‘ જગદુર્ગુરુ ’ નું બિદ્રુદ આપવા પછી તિર્થરક્ષણુનો

* ખરીતો સેંપવામાં આવ્યો અને તે પ્રસંગે અકુભરે એ પણ જણ્ણાંયું કે—“ આવી પવિત્ર ભૂમિને હુમેશાં સ્વતંત્ર રાખી લેની પવિત્રતાને માન આપવામાં મારા સરદારો—જહાણીરદારો અને દરખારીઓ ખરાખર કાળજી રાખશે તેમ મારો વિશ્વાસ છે. છતાં તે ઉપર ખરાખર હેખરેખ રહી શકે તે માટે મારા મંત્રી કર્મચંદ કે જેઓ જૈન છે તેમને આ હુકમનું પાલન તપાસવાની ખાસ સત્તા આપું છું.”

* આ ખરીતો એ પુટ કાંબા અને લગભગ ટોટ કુંટ પહોળા સરેરેત કપડા ઉપર સોનેરી હર્ષેણી લખાએલો છે, અને તે બાદશાહી મહોર-સીક્કા—સહી સાથેનું અમદાવાદમાં રોડ આણંદજ કલાણુણી પેઢીમાં અત્યારે મોજુદ છે, આ ખરીતો ઉર્દુમાં છે, તેનું અક્ષરસઃ ભાષાંતર નીચે મુજબ થાય છે.

જલાલુદીન મોહમ્મદ અકુભર બાદશાહ ગાળનું ફરમાન.

સુધે માળવા, શાહજહાનાખાદ, લાહોર, મુલતાન, અહમદાવાદ, અજમેર, મેરટ, ગુજરાત, બંગાળ તથા મારા તાખાના બીજાઓ મુલકો કરેાઉયો અને જહાણીરદારોને સૂચના કરવામાં આવે છે કે—

અમારો મુખ્ય ઉદ્દેશ અમારી પ્રજનને ખુશી કરવાનો તથા તેના દીલને સંતોષ આપવાનો છે, તેમજ અમારું અંતઃકરણ, પવિત્ર હૃદય-વાળા તથા દ્યુત્તરભક્ત સન્જનોની રોધ કરવામાં હુમેશાં રોકાધ રહે છે તેથી અમારા રાન્યમાં રહેનારા એવા સાંધુ પુરુષનું જ્યારે પણ અમે નામ સાંભળીએ છીએ લારે તુર્ત તેમને માનપૂર્વક અમારી પાસે બોલા-વવામાં આવે છે અને તેમનો સત્ત-સમાગમ કરી આનંદ પ્રાપ્ત કરવામાં આવે છે.

ગુજરાતમાં રહેલા જૈન શૈવેતાંખર સંપ્રદાયના આચાર્ય હીરવિજયસ્સર અને તેમના શિષ્યોના સંખ્યામાં અમે ધણી વખત સાંભળ્યું હતું કે તેઓ ધણા પવિત્ર મનવાળા સાંધુ પુરુષ છે, તેથી અમે તેમને અમારા દરખારમાં આવવાને આમંત્રણ કર્યું, ને તેમના દર્શનથી અમે ખુલ્લ ખુશી થયાં. જ્યારે તેમને પાછું ગુજરાતમાં જવાનું ઠર્યું ત્યારે અર્જ કરી કે “ ગરીબ નવાજ તરફથી એક એવો ખાસ હુકમ થવો જોઈએ કે સિદ્ધાંખલજ, ગિરનારજ, તારંગાળ, કેશરીયાનાથજ અને આણુણનાં તીર્થ જે ગુજરાતમાં છે તથા રાજગૃહજના પાંચ પહાડ તથા સમેતશિખરજ ઉર્દ્દે પાર્થીનાથ પહાડ ને બંગાળમાં છે એ સંખળા પહાડોની નીચે બ્યા

આચાર્ય શ્રી હીરવિજયસૂરિ તે પછી ગ્રણુ માસ અહીં રોકાંયા દરમિયાન મોટા આડંબરથી જૈતાશાહુ, વિજયકુમાર તથા ચંપાદેવીને દીક્ષા આપવામાં આવી. દીક્ષામહેાત્સવને અંગે અકાદમે પણ દ્રવ્ય તથા જાતિથી ઉત્સાહલર્યો ભાગ લીધો. અને જૈતાશાહુનું નામ અજીતવિજયજી, વિજયકુમારનું નામ વિમાગવિજયજી અને ચંપાનું નામ ચંપાશ્રીજી રાખવામાં આવ્યું. એ પછી આચાર્યશ્રીએ લાંથી વિહૂાર કરી સું ૧૬૪૨ નું ચાતુર્માસ અભિરામાભાદમાં કર્યું હતું.

મહિરોની ડોડીએની પાસે તથા બધી લક્ષી કરવાની જર્યો, જે શ્વેતાંધ્ર ધર્મની છે, તેની આરે તરફ ડોઢ્યપણું થખસ ડોઢ્યપણું જાનવરને ન મારે” તેએશ્રી દુર્દેશથી આવ્યા છે, તેમની અર્જુ વ્યાજખી છે, તેમની ભાગણી મુસલમાન ધર્મથી પણ વિર્દ્ધ નથી, કેમકે મોટા પુરુષોને નિયમ હોય છે કે તે ડોઢ્યધર્મમાં પોતાની દુલગીરી ન કરે; તેથી અમારા માનવા પ્રમાણે એ અરજુ વ્યાજખી લાગે છે. તપાસ કરવાથી પણ માલુમ પડે છે કે બધા સ્થળો ભાંખા કાળથી જૈન શ્વેતાંધ્ર ધર્મના છે તેથી તેમની એ અરજુ મંજુર કરવામાં આવી છે અને સિદ્ધાયળ, ગિરનાર, તારંગા, ડેશરીયા આખું, અને સુમ્ભેત શિખર ઊર્ઝે પાર્થનાથ પહાડ જે બંગાળામાં છે, તથા બીજા પણ જૈન શ્વેતાંધ્ર સંપ્રદાયના ધર્મસ્થાનો જે અમારા તાથાનાં મુલકમાં છે તે સંધળા જૈન શ્વેતાંધ્ર સંપ્રદાયના આચાર્ય હીરવિજયસૂરિને સ્વાધીન કરવામાં આવે છે કે જેથી શાંતિપૂર્વક તે પવિત્ર સ્થાનોમાં પોતાના ધર્મશરીરી લક્ષી કરી શકે.

જે કે આ પ્રસંગે એ સ્થળો હીરવિજયસૂરિને સ્વાધીન કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક તો એ સંધળા જૈન શ્વેતાંધ્ર ધર્મવાળાઓના અને તેમની માલેકીના છે.

જ્યાંસુંધી સૂર્ય અને ચંદ્ર તપે સાંસુંધી આ શાશ્વત ઇરમાન જૈન શ્વેતાંધ્ર પાસે કાયમ રહે. ડોઢ પણ મનુષ્ય આ ઇરમાનમાં દુલ ન કરે, આ પર્વતોની જગાની નીચે-ઉપર-આસપાસ સંધળાં યાત્રાના સ્થળોમાં અને પૂજા કરવાની જગ્યાએમાં ડોઢ પણ ડોઢ પ્રકારી જીવહિસા ન કરે. આ હુકમનો ધ્યાન પૂર્વક અમલ કરે, ડોઢ તેનાથી વિર્દ્ધ વર્તન ન કરે તથા બીજી નવી સનંદ ન માગો.. લખી. મૂર્ખી મો માહે ઉદ્દિષ્ટેસ્ત મુતાબિક રવીજિલાયવલ સન ઉજ જુલસી.

મૂર્ખી

આ વાતને દશ વર્ષ વીતી ગયાં. દરમિયાન સૂરિએ અનેક નાના મોટા જહાંગીરદારોને ધર્મ પમાડ્યો હતો. અને મારવાડમાં થઈને ગુજરાત, કાઢિયાવાડમાં વિચરતાં છેલ્લા જીના-માં પધાર્યો. ત્યાં સં. ૧૬૫૨ના લાદરવા શુદ્ધી. ૧૧ના રોજ કાળ-ધર્મ પામ્યા. તેમને જ્યાં અભિસંસ્કાર કર્યો, ત્યાં તે રાત્રીમાં વૃદ્ધો નવપદ્લવિત થઈ ગયાં અને આંખાને કેરીએ આવી હુતી તેમ પણ ઉલ્લેખ છે. અહીં તેમની ગાહી તથા પગલાં વગેરે સ્મરણ-ચિનહેણ અત્યારે પણ છે.

આચાર્ય શ્રી હીરવિજયસૂરિના સ્વર્ગવાસના અખર અકખરને મહ્યા ત્યારે તે તથા અખુલ-કુઝલ વગેરે પરિચિત જનો પણ અહુ ખેદ પામ્યા. તેમનો અભિસંસ્કાર થયો તે વાડી બાદશાહે પવિત્ર લુભિ તરીકે જાળવી રાખવા જૈન શંધને અર્પણ કરતાં કહું કે:—

ધન જીયું જગત શુરૂનું કર્યો જગ ઉપગારદે.

x x x x

અસ્યા કુકીર નવિ રહ્યા કાલે, ખીણ કુણ નર નામરે.

આ ઉપરાંત ખીણ ખરીતા જીવદ્યા અને તિર્થરક્ષણુના છે તેમાં એક ઇકરો નીચે પ્રમાણે છે. “આ ઉપરથી યોગાભ્યાસ કરનારાઓમાં એષ હીરવિજયસૂરિ સેવડા અને તેમના ધર્મને પાળનારા, કે જેમણે અંમારી હજુરમાં હાજર થવાનું માન મેળવ્યું છે; અને જેએ અમારા દરખારના ખરા હિતેચ્છુએ છે, તેઅના યોગાભ્યાસનું ખરાપણું, વધારો અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયો કે—તે શહેરના રહેવાસીઓમાંથી કોઈઓ એમને હરકત કરવી નહિ, અને એમનાં મંદિરો તથા ઉપાશ્રોમાં ઉતારો કરવો નહિ, તેમ તેમને તુચ્છારવા પણ નહિ. વળી જો તેમાંનું કંઈ પડી ગયું કે ઉજાડ થઈ ગયું હોય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારવા કે તેનો પાયો નાંખવા ધર્યે તો તેનો કોઈ ઉપલક શાનવાળાએ કે ધર્માંધે અટકાવ પણ કરવો—નહિ” વગેરે—

ત્યારપણી અકૃષ્ણ નવ વર્ષે ગુજરી ગયો. તેનો પાછળનો સમય હ્યાં અને સરલતાથી ભરપૂર પસાર થયો હતો. અને તેણે છેવટ સુધી જૈન યતિઓનો સમાગમ રાજ્યો હતો. જ્યારે સંવત. ૧૯૫૮ માં, અખુલકુલ યુદ્ધમાં દુગાથી ભરવાના ખર્બર અકૃષ્ણને પડ્યા ત્યારે તેને સહ્ય આધાત થયો. તેમના પુત્ર સલીમની નીતિ-રીતિ માટે તેના મનને અસંતોષ હતો, પરંતુ અંત્યે સલીમ, અકૃષ્ણને ચરણે જયો. એટલે તેને સમશોર-મુકુટ અને સત્તા સોંપી તેને પ્રણ રક્ષણુની લલામણ કરતાં દેહસુક્તા થયો.



जैन बन्धुओंने सूचना.

अमारे त्यांथी खास जैन मंदीरोंमां वापरवा
लायक केसर, बरास भीमसेनी, दशांगी धुप, सुगंधी
अगरबती, सोना चांदीना पाना, मलबारी सुखिड, अगर
उंचो मावरधी ते सीवाय कस्तुरी नेपाळी, अम्बर जंगबारी,
शुद्ध शेलारस, शुद्ध चंदननुं तेल, मोम्माइ, गोरुचंदन,
शीलाजीत, हरडे, धी जहांगीर बाम, धातु पौष्ट्रीक टोनीक
पील्स, वीगेरे वीगेरे माल जथ्थाबंध तेमज छुट्क
कीफायत भावे मळशे. भावने माटे प्राइसलीष्ट मंगावो.

शा. फुलचंद गोपाळजी—हेरीसरोड—भावनगर.

जैन बन्धुओंने सूचना.

अमारे त्यांथी खास जैन मंदीरोंमां वापरवा लायक केसर,
भरास भीमसेनी, दशांगी धुप, सुगंधी अगरबती, सोना चांदीना पानां,
मलबारी सुखिड, अगर उंचो मावरधी, ते सीवाय कस्तुरी नेपाळी, अम्बर जंगबारी,
शुद्ध शेलारस, शुद्ध चंदननुं तेल, मोम्माइ, गोरुचंदन,
शीलाजीत, हरडे, धी जहांगीर बाम, धातु पौष्ट्रीक टोनीक पील्स,
वीगेरे वीगेरे माल जथ्थाबंध तेमज छुट्क कीफायत भावे मळशे. भावने
माटे प्राइसलीष्ट मंगावो.

शा. फुलचंद गोपाळजी—हेरीसरोड—भावनगर.

ADVERTISEMENT TO JAINS:-

Saffron, Baras Bhimseni, Dashangi Incense,
Incense sticks, Gold and Silver leaves, sandal-
wood Malbari used in Jain Temples, Musk Nep-
alese Amber Jangbari, Pure shelaras, Pure chan-
dan-oil, Mummis, Gooruchandan Shilajit, Myro-
bolams, The Jahangir Balm Tonic Pills etc., etc.,
can be had from us at moderate rates Call
For Price-list.

SHRI FULCHAND GOPALI
Haris road—BHAVNAG

ઉત્તમ સંગ્રહ.

—૦૦૦—

કેસર, કસ્તુરી, અમર, બરાસ, કપુર ઉંચી અગરખટી
અગર, દશાંગધૂપ, સોના ચાંદીના પાના, સુખડ, અતર,
હીંગ, હરડે, ખાપરીથું, મોમાછ, સીલાળત, મોતીનો
સુરમો વિગેરે ખાત્રીદાર માલ કીર્ણાયતથી વેચનાર ખાસ
એકજ ફુકાન.

ડિ. શાન્તિલાલ કાન્તિલાલની કું.

જુમામસીદ, નં. ૧૨૭

મુખ્ય.

વીસમી સદીની નવીન શોધ.

સંગ્રહણી (ગળતી)

માટે અમૃતમય ઉપાય.

પ્રતિષ્ઠિત અને વિદ્યાન વદ્ય દાક્તરોની દ્વાં ખાઈ કંદળેલા
સંગ્રહણી (ગળતી), મુખ્યધના ઝાડા, અતિસાર અને આંતરડાના
ક્ષયથી પીડાતા નિરાશાજનક દર્દને આશીર્વાદ થએ પડેલી ત્રીસ
વરસના અનુભવની રામભાણુ દ્વાં માટે ઇન્દ્ર મળો યા સવાલ-
પત્ર મંગાવો. પત્રબ્યવહાર નીચેના સીરનામે કરવો.

મેળાપ દર રવીવારે અમદાવાદ.	માસ્તર કે. ને. પટેલ
કાલુપુર ડાંગરાની પોળ-તંબુ-	
રાગરાની ઘડકીમાં ધર નંબર-૩૫૬	એન્ડ સન્સ, સ્પ્રેશીઆલીસ્ટસ; (મહીકાંડા) માણુસા.
અમારી ખાલાનંદ બચ્ચાંએને ઇષ્ટ્ખુષ્ટ, આનંદી અને: ધંદર બનાવે છે.	

श्री र
द
पुस्तक